

ઝાઢુસસાલેહીન

- : પ્રકાશક : -

હાજી નાજી મેમોરીયલ ટ્રસ્ટ

માળી ટેકરા, આંબાચોક, ભાવનગર

ફોનનંબર : (૦૨૭૮) ૨૫૧૦૦૫૬ / ૨૪૨૩૭૪૬

... Kitab Downloaded from ...

www.hajinaji.com

● [LIKE US ON FACEBOOK](#) ●

નોંધ.....

→ વધુ કિતાબો ડાઉનલોડ કરવા માટે www.hajinaji.com પર લોગ ઓન કરો.

→ કિતાબમાં કોઈ ભૂલચૂક જણાય તો જણ કરવા વિનંતી.

hajinajitrust@yahoo.com

અનુક્રમણિકા

ક્રમ	વિષય	પેજ
૦૧	દર મહિનાની પહેલી તારીખની નમાઝ	13
૦૨	'સુહાગરાત'ની દુઆ તથા નમાઝ	17
૦૩	માહે રમઝાન	19
૦૪	માહે રમઝાનના આ'માલ	19
૦૫	માહે રમઝાનના ફઝાએલ, રોઝા રાખવાનો સવાબ, કુરઆન શરીફ પઢવાનો સવાબ	22
૦૬	રોઝાના પ્રકાર	36

૦૭	રોઝો તોડનાર બાબતો	39
૦૮	માહે રમઝાનનો ચાંદ જોઈને પઢવાની દુઆ, પહેલી રાતના આ'માલ	41
૦૯	ઝિયારતે વારેસા	45
૧૦	ઝિયારતે જનાબે અલી અકબર (અ.સ.)	53
૧૧	ઝિયારત શોહદાએ કરબલા	55
૧૨	ઝિયારતે હઝરતે અબ્બાસ (અ.સ.)	57
૧૩	નમાઝ પછી પઢવાની કેટલીક આયતો	60
૧૪	આયતુલ કુરસી	61
૧૫	આયએ શહાદત	63

૧૬	આયએ મુલ્ક	65
૧૭	આમનર રસૂલોની આયાત	66
૧૮	સૂરએ નાસ	68
૧૯	સૂરએ ફલક	69
૨૦	સૂરએ કાફરૂન	70
૨૧	સૂરએ નસ્ર	71
૨૨	સૂરએ તકાસૂર	72
૨૩	સૂરએ ઇન્શીરાહ	73
૨૪	સૂરએ કદ્ર	74
૨૫	માહે રમઝાનની પહેલી તારીખના આ'માલ	76
૨૬	માહે રમઝાનમાં હંમેશા પઢવાની દુઆ	79
૨૭	અઝીમ સવાબની દુઆ	81

૨૮	માહે રમઝાનની ઈબાદતોમાં ખામી રહે, તે પૂરી થવાની દુઆ	83
૨૯	સેહરીની મોટી દુઆ	84
૩૦	સેહરીની નાની દુઆ	92
૩૧	ઇફ્તારના આદાબ તથા દુઆઓ	94
૩૨	હંમેશા રાત્રે પઢવાની આલીશાન દુઆ	97
૩૩	હંમેશા રાત્રે પઢવાની ઉમદા દુઆ	98
૩૪	પંદરમી તારીખથી શબ્દે કદ્ર સુધીના આ'માલ	101
૩૫	શબ્દેકદ્રના આ'માલ	114

35	માહે રમઝાનમાં દરરોજ રાત્રે અને દિવસે પઢવાની દુઆ અને નમાઝ	131
39	નમાઝે વહશત	164
3૮	માહે શવ્વાલ	165
3૯	ઈદની રાત તથા દિવસની ફઝીલત તથા દુઆ અને નમાઝ	167
૪૦	ઈદની નમાઝનું બયાન	180
૪૧	ફિત્રાનું વર્ણન	187
૪૨	ઝીલ્કાદ મહિનાના આ'માલ	193
૪૩	માહે ઝીલ્હજ	204
૪૪	ઝીલ્હજની દસમી તારીખ સુધીના આ'માલ	208

૪૫	ઇદે ગદીરની ફઝીલત તથા આ'માલ	245
૪૬	માહે મોહરમ	272
૪૭	આશૂરાનો અહવાલ	277
૪૮	ઝિયારતે આશૂરા	281
૪૯	માહે સફર	324
૫૦	સફર મહિનાના આ'માલ	324
૫૧	ઝિયારતે અરબઈન	325
૫૨	જનાબે ઝયનબ (સ.અ.)કી ઝિયારત	335
૫૩	સફર મહિનાના આ'માલ	341
૫૪	માહે રબીઉલ અવ્વલ	345
૫૫	રબીઉલ અવ્વલ મહિનાના આ'માલ	347

૫૬	માહે રબીઉલ આખર	348
૫૭	માહે જમાદીઉલ અવ્વલની જાણવા જેવી બાબતો	349
૫૮	માહે જમાદીઉલ આખર	350
૫૯	રોઝી માટેની નમાઝ	366
૬૦	માહે રજબ	367
૬૧	માહે રજબની ફઝીલત અને આ'માલ	367
૬૨	રોઝા રાખી ન શકે તેઓ વિશે હુકમ	372
૬૩	માહે રજબના આ'માલ	375
૬૪	માહે રજબની પહેલી તારીખના આ'માલ	388
૬૫	દરેક મહિનાની ૧૩મી, ૧૪મી	406

	અને ૧૫મી રાત	
૬૬	માહે રજબની ૧૬ થી ૩૦ તારીખ સુધીના આ'માલ	413
૬૭	રજબ મહિનામાં હંમેશા પઢવાની નમાઝ	420
૬૮	માહે શાઅબાનની ફઝીલત	427
૬૯	માહે શાઅબાનના આ'માલ	433
૭૦	પંદરમી શાઅબાનના આ'માલ	437
૭૧	દુઆએ કુમૈલ	452
૭૨	બલા અને આફતોથી બચવાનો અમલ	476
૭૩	અમલની રીત	477
૭૪	માહે શાઅબાનની છેલ્લી	478

	તારીખોના આ'માલ	
૭૫	દરેક મહિનામાં કરવાના આ'માલ	488
૭૬	ઘર બેઠા પઢવાની ઝિયારત અને અહદનામુ	492
૭૭	હઝરત ઈમામે ઝમાના (અ.સ.)ની ઝિયારત	505
૭૮	આબે નયસાન	508
૭૯	અકીકાનું બયાન	509
૮૦	ખત્તા કરવાનું બયાન	513
૮૧	નવરોઝની તારીખ, ફઝીલત	515
૮૨	નમાઝે આયાત	525
૮૩	જવશને કબીર	526
૮૪	દુઆ-એ-નુદબા (લીપીયાંતર)	656

૮૫	દુઆ-એ-નુદબા (તરજૂમો)	685
૮૬	દુઆ-એ-ફરજ	715
૮૭	ઝિયારતે હઝરત ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.)	720

બિસ્મિલ્લાહિરે રહુમાનિરે રહીમ

દર મહિનાની પહેલી તારીખની નમાઝ

તે બે રકઅત છે, પહેલી રકઅતમાં સૂરે અલ્હમ્ પછી ત્રીસ વખત સૂરે ફુલ્હોવલ્લાહો અહદ પઢે અને બીજી રકઅતમાં સૂરે અલ્હમ્ પછી ત્રીસ વખત સૂરે ઇન્ના અન્નાહો પઢે. નમાઝ પૂરી કર્યા બાદ આ આયતોને પઢે.

બિસ્મિલ્લાહિરે રહુમાનિરે રહીમ

વ મા મિને દાબ્બતિને ફિલ અઝ્ ઇલ્લા
અંલલ્લાહે રિઝ્કોહા, વ યઅંલમો
મુસ્તકરેરહા વ મુસ્તવદઅંહા, ફુલ્લુને ફી
કિતાબિમ્ મોબીન.

(સૂરએ હુદ : ૬)

બિસ્મિલ્લાહિરે રહુમાનિરે રહીમ

વ ઇંયે યમ્સસકલ્લાહો બે ઝુરેરીન ફ
લા કાશેફ લહૂ ઇલ્લા હૂ વ ઇંયે યોરિદક
બે ખંયેરિને ફ લા રાદ્ લે ફઝલેહી, યોસીબો
બેહી મંયે યશાઓ મિને ઐબાદેહી, વ હોવલે
ગંફુરે રહીમ.

(સૂરએ યુનુસ : ૧૦૭)

બિસ્મિલ્લાહિરે રહુમાનિરે રહીમ

સયજઅંલુલ્લાહો બઅંદ ઉંસિરંયુસ્રા

(સૂરએ તલાક : ૭)

બિસ્મિલ્લાહિરે રહુમાનિરે રહીમ

મા શાઅલ્લાહો લા ફુવ્વત ઇલ્લા

બિલ્લાહે હુંસ્બોનલ્લાહો વ નેઅંમલે વકીલ,

(સૂરએ આલે ઈમરાન : ૧૭૨)

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીંમ

વ ઓફવ્વેઝો અમરી એલલ્લાહે
ઇન્નલ્લાહ બસીરૂમ બિલે એબાદ.

(સૂરએ મોઅમીન : ૪૪)

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીંમ

લા એલાહ ઇલ્લા અન્ત સુબ્હાંનક ઇન્ની
કુન્તો મેનઝો ઝાંલેમીન.

(સૂરએ અમ્બીયા : ૮૭)

બિસ્મિલ્લાહિરે રહુમાનિરે રહીમ
રબ્બે ઇન્ની લે મા અન્નલ્લે અલય્ય
મિને ખંયરિને ફકીર.

(સૂરએ કસસ : ૨૪)

બિસ્મિલ્લાહિરે રહુમાનિરે રહીમ
રબ્બે લા તઝની ફદવ વ અન્ત ખંયરુલ્લે
વારેસીન.

(સૂરએ અમ્બીયા : ૮૯)

ત્યાર બાદ થોડો સદકો આપે. ઇન્શાઅલ્લાહ તમાલા
તે મહિનાની સલામતી તેણે ખરીદી લીધી. અગર પહેલી
તારીખે ન પટ્ટી શકે તો બીજા દિવસે અથવા જ્યારે પણ
શક્ય હોય ત્યારે પટે.

‘સુહાગ રાત’ની દુઆ તથા નમાઝ

ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ફરમાવે છે:

જ્યારે તમારી દુલ્હનને તમારી પાસે પ્રથમ રાત્રે લાવવામાં આવે, ત્યારે તેને કહો કે પહેલાં વઝુ કરે, અને તમે પણ વઝુ કરો. પછી બે (૨) રકઅત નમાઝ પઢો. તેને પણ કહો કે, બે (૨) રકઅત નમાઝ પઢે. પછી અલ્લાહનો હમ્દ બજાવી લાવો. મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (સ.અ.વ.) પર સલવાત મોકલો, પછી દુઆ કરો અને જે ઔરતો દુલ્હનની સાથે તેને મુકવા આવી હોય, તેણીઓને આમીન કહેવા કહો. પછી આ દુઆ પઢો.

અલ્લાહુમ્મરરુકુંની ઈલ્ફિહા વ વુદહા
વ રેઝાહા વ અરેઝેની બેહા વજેમઅં બયેનના
બે અહુસને ઇજતેમાઈવ્વે આનસીતેલાફિને

ફ ઇન્નક તોહિબ્બુલ હુલાલ વ તકરહુલ
હુરામ.

ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

જ્યારે તમે 'ઝફાફની રાત્રે' (લગ્નની પહેલી રાત્રે)
દુલ્હન પાસે જાવ, તો તેની પેશાનીના બાલને પકડીને તેને
કિબ્લાની તરફ કરી દો અને આ મુજબ કહો..

અલ્લાહુમ બે અમાનતેક અખંઝંતોહા
વ બે કલેમાતેકસે તહુલ્લતોહા ફ ઇને કંઝયેત
લી મિન્હા વલદને ફજઅલ્હો મોબારકને
તકીયમ મિને શીઅંતે આલે મોહુંમદિવે
વલા તજઅલે લિશે શયતાંને ફીહે શિરેકવે
વ લા નસીબને.

માહે રમઝાન

માહે રમઝાનના આ'માલ

હદીસોમાં છે કે વર્ષનો પહેલો મહિનો માહે રમઝાન છે અને ખુદાએ તઆલાએ કુરઆને શરીફ માહે રમઝાનમાં નાઝિલ કરવાનું શરૂ કર્યું, તેથી અમોએ આ'માલ માહે રમઝાનથી લખવાના શરૂ કર્યા છે.

આ કિતાબમાં દરેક મહિનાના જાણવા જેવા બનાવો અને મઅસૂમીન (અ.મુ.સ.)ની વિલાદત અને શહાદતની તારીખો તથા તે મહિનાના આ'માલ વગેરે બયાન કરવામાં આવેલ છે. શહાદત વિલાદતની મશહૂર તારીખોનું કોષ્ટક કિતાબના અંતે આપવામાં આવેલ છે.

ઈમામ અલી (અ.સ.)ની રિવાયત મુજબ માહે રમઝાનની ત્રીજી અને ૨૦મી તારીખ તથા ઈમામે જઅફરે સાદિક (અ.સ.)ની રિવાયત મુજબ ૨૪મી તારીખ ઘણી જ ખરાબ છે.

- ૧લી રાત્રે હજરત ઇબ્રાહીમ (અ.સ.) ઉપર ‘સહીફા’ નાઝિલ થયા છે.
- ૩જી અથવા બાઅઝ (અમુક લોકો) લખે છે કે ૬ઠ્ઠી રાત્રે ‘તવરેત’ નાઝિલ થઈ છે.
- ૧૦મી તારીખે જનાબે ખદીજતુલ કુબરા (સ.અ.)ની વફાત છે.
- ૧૩મી રાત્રે ‘ઇન્જીલ’ નાઝિલ થઈ છે.
- ૧૫મી તારીખે ઇમામ હસન (અ.સ.)ની વિલાદત છે,
- ૧૬મી તારીખે મુખ્તાર (અ.ર.)ની શહાદત છે,
- ૧૭મી તારીખે બદ્રની લડાઈ થઈ હતી.
- ૧૮મી તારીખે ‘ઝબૂર’ નાઝિલ થઈ છે.
- ૧૯મી તારીખે સુબ્હની નમાઝમાં હજરત ઇમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને ઇબ્ને મુલ્જુમ મલઉને તલવાર મારી,
- ૨૦મી તારીખે ‘મક્કા’ ઉપર વિજય મેળવ્યો, અને હજરત રસૂલે ખુદા (સ.અ.વ.)ના ફરમાનથી

- હઝરત અલી (અ.સ.)એ આપના ખભા મુબારક ઉપર પગ રાખીને કાઅબાના બુતો તોડ્યા છે,
- ૨૧મી રાત્રે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ને મેઅરાજ પર જવાની પણ હદીસ છે. ૨૧મી તારીખે ઘસા (અ.સ.) આસમાન ઉપર ગયા,
- ૨૧મી તારીખે મૂસા (અ.સ.) તથા યુશોઅ (અ.સ.)ની વફાત છે.
- ૨૧મી તારીખે હઝરત અલી (અ.સ.) શહીદ થયા. કુરઆને શરીફ શબે કદ્રમાં નાઝિલ થવું શરૂ થયું, આયત-આયત, સૂરો-સૂરો એ રીતે ૨૩ વર્ષની મુદતમાં સંપૂર્ણ કુરઆને શરીફ નાઝિલ થયું છે.

માહે રમઝાનના ફઝાએલ, રોઝા રાખવાનો સવાબ, ફુરયાન શરીફ પઢવાનો સવાબ

માહે રમઝાન ખુદાનો મહિનો છે, અને તમામ મહિનામાં
એ મહિનો ખુઝુર્ગ છે,

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

દર વર્ષેમાહે રમઝાન આવવા પહેલાં ‘બેહિશ્ત’ને
શણગારવામાં આવે છે અને જ્યારે માહે રમઝાનની
પહેલી રાત થાય છે ત્યારે અર્શની નીચે એવી હવા ચાલે
છે કે, જેને ‘મસીરા’ કહે છે અને તેથી ઝાડ અને
બેહિશ્તના દરવાજામાંથી એવા ખુશનુમા અને મધુર અવાજ
નીકળે છે કે એવો દિલ પસંદ અવાજ કોઈએ સાંભળ્યો
નહીં હોય અને તે વખતે હૂરો બેહિશ્તના ગુરફા
(ઓરડા)માંથી બહાર આવે છે, અને નીદા કરે (અવાજ
આપે) છે કે એવું કોઈ છે જે નેક કાર્યો કરીને ખુદા પાસે
અમારી માંગણી કરે? પછી હૂરો બેહિશ્તના ખઝાનેદાર

રિઝવાનને પૂછે છે કે આજે કઈ રાત છે? તો રિઝવાન જવાબ આપે છે કે અય નેક સુરત અને નેક અમલવાળી આજે માહે રમઝાનની પહેલી રાત છે. મોહમ્મદ (સ.અ.વ.)ની ઉમ્મતના રોઝેદારો માટે બેહિશ્તના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. પછી ખુદા ફરમાવે છે અય રિઝવાન! બેહિશ્તના દરવાજા ખોલી નાખ અને મોહમ્મદ (સ.અ.વ.)ની ઉમ્મતના રોઝેદાર માટે જહન્નમના દરવાજા બંધ કરી દે, અને અય જિબ્રિલ! જમીન ઉપર જઈ શયતાનોને પકડીને સાંકળમાં જકડી અને તેમના ગળામાં તોક નાખી દે કે જેથી તેઓ મારા હબીબ મોહમ્મદ (સ.અ.વ.)ની ઉમ્મતના રોઝેદારોના રોઝાને ખરાબ કરી ન નાખે.

ભરોસાપાત્ર સનદ સાથે હઝરતે ઇમામે અલી રઝા (અ.સ.)થી રિવાયત છે કે હઝરતે રસૂલે ખુદા (સ.અ.વ.)એ શાબાન મહિનાની છેલ્લી તારીખે ખુલ્લો પઠીને ફરમાવ્યું:

અય લોકો! તમારી સામે ખુદાનો મહિનો આવ્યો છે.

તે એ મહિનો છે કે જેમાં તમો ખુદાના મહેમાન તરીકે
 બોલાવવામાં આવ્યા છો, એ મહિનામાં શ્વાસ લેવો તસ્ખીહનો
 સવાબ છે, સુવું ઇબાદત છે. એ મહિનામાં તમારા આ'માલ
 કબૂલ છે, તમારી દુઆઓ સ્વીકાર્ય છે, માટે પરવરદિગારે
 આલમ પાસે ગુનાહથી પાકીઝા દિલ અને ખરી નિચ્ચતથી
 સવાલ કરો કે અય માલિક! તુ અમોને રોઝા રાખવાની
 અને ફુરઆને શરીફ પઢવાની તવફીક અતા ફરમાવ,
 ખરેખર શકી અને બદઆકેબત એ શખ્સ છે કે આ અઝીમ
 મહિનામાં ખુદાની બખ્શીશથી મહેરૂમ રહે, અને તમો આ
 ભૂખ અને તરસથી કયામતની ભૂખ અને તરસને યાદ
 કરો, અને મિસ્કીનો તથા ફકીરોને સદકો આપો, વડીલોને
 માન આપો અને નાનાઓ ઉપર રહમ કરો અને
 સગાઘાલાઓ ઉપર મહેરબાની રાખો, અને જે કંઈ બોલવું
 યોગ્ય ન હોય તેનાથી જીભ બંધ રાખો. જેના ઉપર નજર
 કરવી હલાલ નથી તે જોવાથી આંખ બંધ રાખો, અને જે
 કંઈ સાંભળવું હલાલ નથી તે સાંભળશો નહીં, યતીમો
 ઉપર મહેરબાની કરજો કે જેથી તમારી પાછળ તમારા

યતીમો ઉપર મહેરબાની કરવામાં આવે, પોતાના ગુનાહોથી ખુદા પાસે માફી માંગો, નમાઝના સમયે દુઆ માંગવા માટે ખુદા સમક્ષ હાથ ઊંચા કરો કારણકે તે સૌથી શ્રેષ્ઠ સમય છે, એ સમયે ખુદાએ તઆલા પોતાના બંદાઓને રહેમતની નજરથી જુએ છે, બંદા મુનાજાત કરે ત્યારે તેઓને જવાબ આપે છે અને તેને પુકારે ત્યારે તે લખ્બૈક કહે છે અને દુઆ કબૂલ કરે છે.

અય લોકો! તમારી જાન તમારા કૃત્યોમાં ગીરવી છે, બખ્શીશ (માફી)ની દુઆ માંગી તમારી જાનને છોડાવી લો. તમારી પીઠ ગુનાહોથી ભારે થઇ ગઇ છે, માટે આ મહિનામાં સજદામાં વધારે વાર લગાડીને ગુનાહના ભારથી પીઠ હલકી કરો, જાણી લેજો કે ખુદાએ પોતાની ઇઝ્ઝત અને જલાલની કસમ ખાધી છે કે આ મહિનામાં નમાઝ પઢનારા અને સજદો કરનારાઓને અઝાબ નહીં કરે, એટલું જ નહીં પણ કયામતના દિવસે તેઓને જહન્નમની આગથી ડરાવશે પણ નહિ.

અય લોકો! તમારામાંથી જે કોઈ પણ આ મહિનામાં

મોઅમીનને રોઝો ખોલાવશે, તેને બંદો આઝાદ કરવાનો સવાબ મળશે, તેના ગુનાહ માફ થઈ જશે.

આ સાંભળી ક્રોધ સહાબીએ અર્ઝ કરી: યા રસૂલુલ્લાહ (સ.અ.વ.)! અમો સર્વે એટલી શક્તિ નથી ધરાવતા.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું: એટલી શક્તિ ન હોય, તો ખજૂરની અરધી પેશીથી અથવા પાણીના ઘૂંટથી રોઝો ખોલાવી જહન્નમથી બચો, કારણકે જેની એથી વધારે શક્તિ ન હોય તેને આટલી જ બાબતમાં સવાબ અતા ફરમાવે છે.

અય લોકો! જે ક્રોધ આ મહિનામાં નમ્ર સ્વભાવ રાખશે, તે સિરાત ઉપરથી એ દિવસે આસાનીથી પસાર થઈ જશે, જે દિવસે તેના ઉપરથી પગ લપસી જતા હશે. જે ક્રોધ આ મહિનામાં ગુલામ (નોકર) અને લોંડીથી આસાનીથી ખિદમત લીએ, તેનો હિસાબ ક્યામતમાં ખુદા આસાનીથી લેશે, અને જે ક્રોધ આ મહિનામાં લોકોને સતાવે નહીં, તેને ક્યામતમાં ખુદા પોતાના (ક્રોધ) ગઝબથી બચાવશે. જે ક્રોધ આ મહિનામાં યતીમને સારી હાલતથી રાખશે, તેને

ક્યામતમાં ખુદા સારી હાલતથી રાખશે, જે કોઈ આ મહિનામાં પોતાના સગાઓ સાથે નેકી તથા એહસાન કરશે, ક્યામતમાં ખુદા તેને પોતાની રહેમત સાથે મેળવશે અને જે કોઈ સગા-સંબંધીઓ અને કુટુંબીજનો સાથે ‘કત્થે રહમ’ કરશે એટલેકે સંબંધ તોડશે, તો ક્યામતમાં ખુદા તેનાથી પોતાની રહેમતથી દૂર રાખશે.

આ મહિનામાં સુન્નત નમાઝ પઢે, તો ખુદાએ તઆલા તેના માટે જહન્નમની આગથી મુક્તિનો પરવાનો આપે, જે કોઈ આ મહિનામાં વાજિબ નમાઝ અદા કરે, તો ખુદાએ તઆલા તેને બીજા મહિનામાં સીતેર નમાઝ પઢે એટલો સવાબ આપે, જે કોઈ આ મહિનામાં મારી અને મારી આલ ઉપર સલવાત પઢે, તો ખુદા તેના નેકીના ત્રાજવાને એ દિવસે ભારે કરશે કે જે દિવસે નેક આ’માલના પલ્લા હળવા હશે.

અય લોકો! ખરેખર આ મહિનામાં બેહિશ્તના દરવાજા ખોલી નાખવામાં આવે છે, માટે તમે પોતાના પરવરદિગાર પાસે સવાલ કરો કે તે તમારા માટે બંધ ન કરે. જહન્નમના

દરવાજા બંધ હોય છે, માટે ખુદા પાસે સવાલ કરો કે તે તમારા માટે ખોલે નહીં, અને આ મહિનામાં શયતાનોને કૈદ કરવામાં આવે છે, માટે દુઆ કરો તે તમારા ઉપર ગાલિબ ન થાય.

ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે:

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) માહે રમઝાનમાં ખુલ્લો પઢ્યા અને ફરમાવ્યું:

અય લોકો! આ એ મહિનો છે કે તેને ખુદાએ તમામ મહિના ઉપર એવી ફઝીલત અને બુરુગી આપી છે કે જેવી અમો અહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલત તમામ લોકો ઉપર છે. આ મહિનામાં આસમાનના, બેહિશ્તના અને રહેમતના દરવાજા ખોલી નાખવામાં આવે છે, જહન્નમના દરવાજા બંધ કરવામાં આવે છે. આ મહિનામાં મોઅમીનોનો અવાજ સાંભળવામાં આવે છે તેઓની દુઆ કબૂલ થાય છે વગેરે, અને આ મહિનામાં એક એવી રાત છે કે તે રાત્રે મલાએકા આસમાનથી જમીન ઉપર આવે છે અને સવાર સુધી ખુદાના

હુકમથી રોઝેદાર મોઅમીન પુરૂષો અને મોઅમીન સ્ત્રીઓ ઉપર સલામ કરે છે. એ રાત શબે કદ્રની છે. હઝરત આદમ (અ.સ.)ના પેદા થવાની બે હજાર વર્ષ પહેલા ખુદાએ તે રાતને મારી વિલાયત અને ઇમામત મુકર્રર કરી છે, એ રાતની ઇબાદત હજાર મહિનાની ઇબાદત કરતાં બેહતર છે. તે દિવસનો રોઝો હજાર મહિનાના રોઝા કરતા બેહતર છે.

અય લોકો! માહે રમઝાનમાં સૂર્ય અને ચંદ્રનો ઉદય રોઝેદાર પુરૂષો અને સ્ત્રીઓ ઉપર રહેમતની સાથે થાય છે, આ તમારો મહિનો બીજા મહિના જેવો નથી, આ મહિનાના દિવસો અને રાત તમામ દિવસ-રાત કરતાં બેહતર છે, આ મહિનામાં શયતાન કૈદ થાય છે, ખુદાએ તઆલા રોઝી અને ઉમરમાં વધારો કરે છે, હાજુઓ મુકર્રર કરે છે, ખુદા ઇમાનદારો તરફ બખ્શીશ, ફતેહમંદી, રહેમત, રોઝી અને ખુશનુદીની સાથે નજર કરે છે.

અય રોઝેદાર! ખુદા તમોને જઝા આપે, તું તારા કામ પૂર્ણ કર, ખરેખર આ મહિનામાં તું તારા

પરવરદિગારનો મહેમાન છો, તું વિચાર અને ધ્યાન કર કે રાત-દિવસ કેવી રીતે પસાર કરીશ? અને શરીરના અવયવને પોતાના પરવરદિગારના ગુનાહથી કેવી રીતે બચાવીશ? હોંશીયાર થા રાતના સુષ્ણ નહીં અને દિવસના ખુદાની યાદથી ગાફીલ રહીશ નહીં, એવું ન થાય કે આ મહિનો પસાર થઈ જાય અને તારા ગુનાહ તારા ઉપર બાકી રહી જાય, અને જ્યારે રોઝેદારોને મજૂરી (ઈનામ) મળે, ત્યારે તું નુકસાન પામનારાઓમાંથી ન હોય. જ્યારે પોતાના આકા તરફથી ઇનામ મળે, ત્યારે તું મહેરૂમ (વંચિત) રહેનારાઓમાંથી ન હોય અને જે દિવસે પરવરદિગારના દોસ્તો નજદીકીથી ભાગ્યશાળી થાય તે દિવસે તું હાંકી મુકાએલાઓમાંથી ન થાય,

અય રોઝેદાર! તારો આકા તને પોતાના દરબારમાંથી કાઢી મૂકે, તો તું કોના દરબારમાં જઈશ? અગર પરવરદિગારે ખુરુગ તને મહેરૂમ રાખે, તો તને કોણ રોઝી આપશે? અગર તને બેઈઝત કરે, તો કોણ માન આપશે ? તે તને છોડી દઈ, તો કોણ તારી મદદ કરશે?

અગર તે ખુદા તને પોતાના બંદામાં ન ગણે, તો તું ક્યા ખુદાનો બંદો થઈશ? અગર તે તારી ખતા (ભૂલ) અને ગુનાહો માફ ન કરે, તો કોની પાસે માફ કરાવવા જઈશ? અગર તારા ઉપર મુકર્ર કરેલો વાજિબ હક માગશે, તો શું જવાબ આપીશ?

અય રોઝેદાર! આ મહિનામાં રાત્રે અને દિવસે ખુદાની કિતાબ (કુરઆન) વાંચીને તેની નજદીકી મેળવ, કારણકે ખુદાની કિતાબ શફાઅત કરવાવાળી છે અને તેની શફાઅત કબૂલ થશે. જેણે તેને વાંચેલ છે તેના માટે ક્યામતમાં તે શફાઅત કરશે. તેને વાંચનાર તેની વાંચેલી આયતોની ગણતરી પ્રમાણે બેહિશ્તના દરજ્જામાં ઉપર જશે.

અય રોઝેદાર! તને ખુશખબરી કે જેટલા શ્વાસ તું આ મહિનામાં લે છે તેનો સવાબ તારા આ'માલનામામાં તસ્બીહ તરીકે લખાય છે, આ મહિનામાં તારી ઊંઘ ઇબાદત અને બંદગીમાં ગણાય છે.

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે જે કોઈ માહે રમઝાનનો રોઝો રાખે અને જે ચીજો હરામ કરી છે

તેનાથી પોતાના નફસને બચાવે, તો તેના માટે બેહિશ્ત વાજિબ થાય છે અને જે કોઈ આ મહિનાનાં રોઝા રાખે અને કોઈ પણ હરામ ચીજથી રોઝો ન ખોલે, તો બેહિશ્તમાં દાખલ થશે.

પછી ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: મેં હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)થી સાંભળ્યું કે પયગમ્બરના વસીઓમાં જે બેહતરમાં બેહતર વસી છે તે બેહતરમાં બેહતર મહિનામાં શહીદ થશે.

મેં પૂછ્યું તે વસી અને મહિનો ક્યો છે?

ફરમાવ્યું: બેહતરમાં બેહતર મહિનો માહે રમઝાન છે અને બેહતરમાં બેહતર વસી યા અલી (અ.સ.) તમે છો,

મેં પૂછ્યું: યા રસૂલુલ્લાહ (સ.અ.વ.)! ખરેખર એ બાબત થશે?

ફરમાવ્યું હા, ખુદાની કસમ ! મારી ઉમ્મતમાંનો બહુજ બદબખ્ત હઝરત સાલેહ (અ.સ.)ની સાંઢણીને કત્લ કરનાર જેવો તમારા માથા ઉપર તલવાર મારશે

અને તેથી તમારા માથાના લોહીથી તમારી દાઢી રંગીન થશે. આ સાંભળીને બધા રડવા લાગ્યા.

ભરોસાપાત્ર સનદો સાથે હજરત રસૂલે ખુદા (સ.અ.વ.)થી મનકૂલ છે કે આપે ફરમાવ્યું:

અય લોકો! જ્યારે માહે રમઝાન આવે, ત્યારે જે કોઈ તેના દિવસો દરમ્યાન રોઝા રાખે અને રાતોમાં મુકર્રર (નક્કી) કરેલ સમય સુધી નમાઝ પઢે, ઇબાદત કરે, ફઝીલતના સમયે નમાઝ પઢે, અને જુમ્હાના દિવસે જુમ્હાની નમાઝ માટે જલ્દી કરે અને ઇદના દિવસે ઇદની નમાઝ માટે સવારના હાજર થાય, તો તે શખે કદ્ર (કદ્રની રાત)નો સવાબ પામશે, મહાન બક્ષિશો અને પુષ્કળ બદલાને પાત્ર થશે, અને ખુદાની બક્ષીશ છે, તે ઇન્સાનની બક્ષિશ જેવી સામાન્ય નથી.

રોઝાનો સવાબ અને તેની ફઝીલત અગણિત છે. અઈમ્મએ તાહેરીન (અ.મુ.સ.)ની હદીસોમાં વર્ણન છે કે રોઝા ઇબાદતોમાં અફઝલ ઇબાદત અને પાક પરવરદિગારની નજદીકીનું કારણ છે અને તેનો સવાબ ઇલ્મે ખુદામાં છે. રોઝો શરીરની ઝકાત છે અને દોઝખની

આગ સામે ઢાલ છે. તે ફૂક (તંગી), ખલા અને નફસની ખ્વાહિશોને દૂર કરે છે, પિત્તનો નાશ કરે છે, બુદ્ધિ અને મનન શક્તિને તેજ કરે છે જન્નતમાં દાખલ થવાનું અને શયતાનથી દૂરીનું કારણ છે. બલ્કે, રોઝેદારથી શયતાન પૂર્વ અને પશ્ચિમ જેટલે દૂર ભાગી જાય છે. રોઝેદાર માટે ફરિશ્તા દુઆ અને ઇસ્તિગ્ફાર કરે છે, રોઝેદારનો અમલ કબૂલ થાય છે. રોઝાદારની રૂઠ જન્નતના ખાગની સૈર કરે છે. જે કોઈ અલ્લાહની ઇતાઅત માટે રોઝો રાખે અને તેના ખદલામાં સોનાથી ભરીને જમીન આપવામાં આવે, તો પણ એનો ખદલો થઈ શકતો નથી.

“રમઝાન” અલ્લાહનું નામ પણ છે, તેથી હદીસોમાં છે કે “રમઝાન” આવ્યો “રમઝાન” ગયો એમ ન કહો, પણ કહો કે “માહે રમઝાન” આવ્યો, “માહે રમઝાન” ગયો. દરેક ચીજની મોસમ હોય છે અને કુરઆને શરીફ પઢવાની મોસમ માહે રમઝાન છે. આ મહિનામાં કુરઆન પઢવાનો સવાબ ઘણો વધારે મળે છે. એટલે સુધી કે આ મહિનામાં એક આયત પઢે, તો બીજા મહિનામાં આખું

કુરઆન ખતમ કરવા જેટલો સવાબ મળે છે.

ઈમાની ભાઈઓ! દર મહિનામાં એક વખત કુરઆન ખતમ કરવું સુન્નત છે અને થોડા થોડા દિવસમાં ખતમ કરે તો છ દિવસમાં ખતમ કરવું, અને માહે રમઝાનમાં ત્રણ દિવસે કુરઆન ખતમ કરવું સુન્નત છે અને જો હંમેશા આખું કુરઆન ખતમ કરી શકે તો સારું છે.

અલ્લામા મજલિસી (અ.ર.) લખે છે કે અગર રસૂલે ખુદા (સ.અ.વ.), જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) અને દરેક ઇમામ (અ.સ.)ની રૂહને એક-એક કુરઆન ખતમ કરીને તેનો સવાબ બક્ષી દેવામાં આવે, તો સવાબમાં વધારો થાય છે.

ઇમામે ઝયનુલ આબેદીન (અ.સ.) ફરમાવે છે:

જે શખ્સ કુરઆને શરીફનો એક અક્ષર સાંભળે, તો હક તઆલા તેને એક સવાબ આપે છે, એક ગુનાહ માફ કરે છે, અને એક દરજ્જો બુલંદ કરે છે તેમજ જો કોઈ એક અક્ષર યાદ કરે, તો દસ સવાબ આપે છે, દસ ગુનાહ માફ કરે છે અને દસ દરજ્જા બુલંદ કરે છે.

રોઝાના પ્રકાર

રોઝા ચાર પ્રકારના છે :

(૧) વાજિબ (૨) સુન્નત (૩) હરામ (૪) મકરૂહ

વાજિબ રોઝા :

૧. માહે રમઝાનના રોઝા
૨. માહે રમઝાનના કઝા રોઝા
૩. કફ્ફારાના રોઝા
૪. હજ્જે તમતોઅના બદલે (ફુરખાની તર્ક કરવાના લીધે) કફ્ફારા પ્રમાણે દસ રોઝા
૫. નઝર, માનતાના, અહદના, કસમના રોઝા,
૬. ઇજારાના રોઝા
૭. એઅતેકાફના મુકરર (નક્કી કરેલ) શરતોની સાથે
૮. મોટા દીકરા પર મરહૂમ બાપના કઝા રોઝા.

માહે મુબારકે રમઝાનના રોઝાનો સમય સુબ્હ સાદિક થી મગરિબે શરઘ સુધી છે. રોઝાની નિચ્યત મગરિબથી સુબ્હ સાદિકની પહેલા યાહે ત્યારે કરી શકાય છે. મનમાં એમ ખ્યાલ હોય કે કાલે રોઝો રાખવો છે, તો કાફી છે. જનાબતનું ગુસ્લ હોય, અને ગુસ્લ કરવાનો સમય બાકી ન હોય, તો ગુસ્લને બદલે તયમ્મુમ કરીને સુબ્હ સાદિક સુધી જાગવું (એહતિયાતની રૂએ) વાજિબ છે.

(સુબ્હે સાદિક એટલે સૂર્ય ઉદય થવાને આશરે દોઢ કલાક પહેલા પૂર્વ તરફથી આસમાનના કિનારા ઉપર નેહર જેવી સુફેદી નીકળે છે અને તે ફેલાઈને અજવાળું થઈ જાય છે. મગરિબે શરઘ એટલે સૂર્ય અસ્ત થયા પછી પૂર્વ તરફ જે રતાશ નીકળે છે તે માથા પરથી પસાર થઈ જાય તે વખત.)

સુન્નત રોઝામાં કોઈ બિરાદરે મોઅમિન કાંઈ ખવરાવે અથવા પીવરાવે, તો એ રોઝાને ઇફ્તાર કરે એથી સિત્તેર રોઝાનો સવાબ મળે છે, બલ્કે અગર રોઝો

જાહેર ન કરે, તો એક વર્ષના રોજાનો સવાબ મળશે. અગર રોજો ન ખોલે, તો એ રોજો મફરૂહ થઈ જશે. પણ માહે રમઝાનનો રોજો તોડવો હરામ છે, અને તેની કઠ્ઠા તથા કફ્ફારો (દંડ) આપવો પડશે. કફ્ફારામાં એક ગુલામ આઝાદ કરવો અથવા બે મહિના અનુક્રમે રોજા રાખવા અથવા સાંઈઠ મિસ્કીનોને ખાણું ખવરાવવું. શા માટે કઠ્ઠા કર્યો અને કેટલો કફ્ફારો આપવો તેના ઘણા મસાએલ છે. અનુક્રમે રોજા રાખવાથી મુરાદ એ છે કે પહેલા એકત્રીસ (૩૧) રોજા અનુક્રમે (સતત) બરાબર રાખવા અને પછીના ૨૯ રોજા જુદા જુદા દિવસોમાં રાખે, તો પણ જાએઝ છે. અગર કોઈ શખ્સ માહે રમઝાનના રોજા જાણી જોઈને શરૂ કરાવે વિના તોડી નાખે, તો કઠ્ઠા અને કફ્ફારો (દંડ) વાજિબ છે અને તે ગુનેહગાર પણ થાય છે, અને મઆઝલ્લાહ જો વાજિબ ન જાણીને ન રાખે, તો તે શખ્સ ઇસ્લામમાંથી નીકળી જઈ “મુરતદ” થઈ જાય છે.

રોઝો તોડનાર બાબતો

રોઝામાં મોઅતબર એ છે કે પોતાને રોઝો તોડનારી ચીજોથી સુખ્હ સાદિકથી મગરિબ સુધી અટકાવે, એટલે જાણી જોઇને રોઝાને તોડનારી બાબત અમલમાં લાવે નહીં, અને રોઝો ૧૦ ચીજોથી તૂટે છે:

૧. જાણી જોઇને ખાવું,
૨. જાણી જોઇને પીવું,
૩. જાણી જોઇને જનાબતનું ગુસ્લ ચડાવવાથી (જુનુબ થવું)
૪. જાણી જોઇને ખુદા, રસૂલ (સ.અ.વ.) અને અઇમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) ઉપર જૂઠું બોલવાથી,
૫. જાણી જોઇને પાણીમાં માથું ડુબાવવાથી,
૬. જાણી જોઇને ગુબાર અથવા ધુમાડો ગળામાં પહોંચાડવાથી,

૭. જાણી જોઇને ઉલ્ટી કરવી,

૮. ઇસ્તિમના

૯. જાણી જોઇને હુકનો કરવો (એનિમા)

(હુકનો એટલે પાયખાનાને રસ્તે પિચકારી વગેરેથી દવા પ્રવાહી ઇત્યાદિ નાખવાને કહે છે તેમજ શિયાફ (ઘન દવા)નો પણ એહતયાતન ઉપયોગ ન કરવો.)

૧૦. જનાખતની હાલતમાં જાણી જોઇને સુખ્હ સાદિક સુધી રહેવાથી નિફાસ, હયઝ અથવા ઇસ્તેહાઝાનું જાણી જોઇને સુખ્હે સાદિક સુધીમાં ગુસ્લ ન ઉતારવાથી.

આ ઉપરોક્ત દસે - દસ ચીજો રોઝાને ખાતિલ કરનારી છે.

નોંધ : વધુ જાણકારી માટે આલિમને પૂછવું અથવા “તવઝીહુલ મસાઈલ”નો અભ્યાસ કરવો.

માહે રમઝાનનો ચાંદ

જોઈને પઢવાની દુઆ, ગુસ્લનું બયાન

“ઝાદુલ મઆદ” કિતાબમાં છે કે માહે રમઝાનનો ચાંદ શોધવો સુન્નત છે.

હઝરત ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

જ્યારે માહે રમઝાનનો ચાંદ દેખાય, ત્યારે ચાંદ તરફ ઇશારો કર અને મોઢું કિબ્લા તરફ કર તથા બંને હાથ આસમાન તરફ ઊંચા કરી અને ચાંદ તરફ ધ્યાન કરી નીચે મુજબ કહે...

રબ્બી વ રબ્બો કલ્લાહો રબ્બુલ્
આલમીન, અલ્લાહુમ્મ અહિલ્લહૂ અલયના
બિલ્અમ્ને વલ્ઇમાને વસ્સલામતે વલ્
ઇસ્લામે વલ્ મૂસારઅંતે એલા માતોહિબ્બો

વતરેઝાં, અલ્લાહુમ્મ બારીકે લના
 ફીશહેરેના હાઝાં વરેઝુકેના ખંચેરહૂ વ
 અંવેનહૂ વસેરીફે અંના ઝુંરેરહૂ વ શરેહૂ
 વ બલોઅહૂ વ ફિત્તહૂ.

ઇબ્ને અકીલ ચાંદ જોઇને આ દુઆ પઢવી વાજિબ
 (બહુ જરૂરી) જાણે છે:

અહુમ્મદો લિલ્લાહિલ્લાહી ખંલકેની
 વ ખંલકેક વ કંદર મનાઝેલક વ જઅંલક
 મવાકીત લિન્નાસે અલ્લાહુમ્મ અહિલ્લાહૂ
 અંલયેના એહુલાલામ માબારકેન
 અલ્લાહુમ્મ અદખિલ્હો અંલયેના
 બિસ્સલામતે વલેઈસ્લામે વલે યકીને વલે

ઇમાને વલંબિરે વત્તકૃવા વત્તવેફીકે
લેમા તોહિંબ્બો વ તરેઝાં.

માહે રમઝાનની પહેલી રાત્રે ગુસ્લ કરવું સુન્નત છે.

○ માહે રમઝાનની પહેલી રાત્રે ગુસ્લ કરવું સુન્નત છે.

○ પ્રત્યેક એકી રાત્રે એટલે ૧લી, ૩જી, ૭મી, ૨૧મી, ૨૯મી વિગેરે રાત્રે ગુસ્લ કરવું સુન્નત છે, ખાસ કરીને ૧લી, ૧૫મી, ૧૭મી, ૧૯મી, ૨૧મી તથા ૨૩મી રાત્રે ગુસ્લ કરવું સુન્નત છે.

○ છેલ્લા દસકાની દરેક રાત્રે ગુસ્લ કરવું સુન્નત છે. એક રિવાયતમાં છે કે આખા માહે રમઝાનમાં હંમેશા રાત્રે ગુસ્લ કરવું સુન્નત છે.

○ ૨૩મી રાત્રે બે ગુસ્લ સુન્નત છે.

મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ પર બહુ જ સલવાત પઢવી તથા પુષ્કળ તૌબા કરવી. “લા એલાહા

ઘલ્લલાહ” વારંવાર પઢવું અને રાત-દિવસની નાફેલા નમાઝો છોડવી નહીં.

જ્યારે માહે રમઝાન શરૂ થતો, ત્યારે હઝરત ઇમામે જઅફરે સાદિક (અ.સ.) પોતાના ફરમંદોને વસીયત ફરમાવતા હતા કે, આ મહિનામાં ઇબાદત કરવાની કોશિશ કરો, કારણકે આ મહિનામાં રોઝી વહેંચાય છે. ઉંમર તથા મૃત્યુ લખવામાં આવે છે. હાજુઓ માટે હજ નસીબ થાય છે કે હજ કરવા જાય અને આ મહિનામાં એક રાત એવી છે, જે હજાર મહિના કરતાં બેહતર છે.

પહેલી રાત્રે ઇમામે હુસૈન (અ.સ.)ની ઝિયારત પઢવી સુન્નત છે.

હઝરત ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

જે કોઈ માહે રમઝાનની પહેલી રાત્રે અથવા પંદરમી રાત્રે અથવા છેલ્લી રાત્રે એ હઝરતની ઝિયારત કરે, તો ઝાડના પાનની જેમ તેના ગુનાહો ખરી પડશે અને પોતાની

માના પેટથી જન્મ પામ્યો હોય, એવી રીતે ગુનાહથી પાક થઈ જશે તેમજ અલ્લાહ તેને હજ તથા ઉમરાનો સવાબ અતા ફરમાવશે.

ઝિયારતે વારેસા

ઝિયારત પઢ્યા પછી સુન્નતની નિયતથી બે રકઅત નમાઝ પઢવી.

ઝિયારત પઢતા હું હઝરત ઇમામ હુસૈન (અ.સ.)કી સુન્નત કુર્બતન એલલ્લાહ.

અસ્સલામો અંલયૈક યા અબ્બા
અંબેદિલ્લાહ, અસ્સલામો અંલયૈક યબ્ન
રસૂલિલ્લાહે, અસ્સલામો અંલયૈક વ
રહૂમતુલ્લાહે વ બરકાતોહ,

અસ્સલામો અંલયૈક યા વારેસં આદમ

સંફવતિલ્લાહ, અસ્સલામો અંલયેક યા વારેસં
નૂહિંને નબિયિલ્લાહ, અસ્સલામો અંલયેક
યા વારેસં ઇબ્રાહીમ ખંલીલિલ્લાહ,
અસ્સલામો અંલયેક યા વારેસં મૂસા
કલીમિલ્લાહ, અસ્સલામો અંલયેક યા વારેસં
ઈસા રૂહિલ્લાહ, અસ્સલામો અંલયેક યા
વારેસં મોહંમદિને હુંબીબિલ્લાહ, અસ્સલામો
અંલયેક યા વારેસં અમીરિલે મોઅમેનીન
(વલીયિલ્લાહ,) અસ્સલામો અંલયેક યબ્ન
મોહંમદેનિલે મુસ્તંફા, અસ્સલામો અંલયેક
યબ્ન અંલિયોનિલે મુરેતઝાં, અસ્સલામો

અંલયેક યબ્ન ફાતેમતઝૈરો, અસ્સલામો
 અંલયેક યબ્ન ખંદીજતલે કુબેરા, અસ્સલામો
 અંલયેક યા સાંરલ્લાહે વબ્ન સાંરેહી વલે
 વિતેરલે મવતૂર, અશહદો અન્નક કંદે
 અકંમતસૈલાત વ આતયેતઝે ઝકાત વ
 અમરેત બિલે મઅંરૂફે વ નહયેત અંનિલે
 મુનેકરે વ અ તંઅંતલ્લાહ વ રસૂલહૂ હંત્તા
 અતાકલે યકીન, ફલઅંનલ્લાહો ઉમ્મતને
 કંતલત્ક, વ લઅંનલ્લાહો ઉમ્મતને ઝલમત્ક,
 વ લઅંનલ્લાહો ઉમ્મતને સમેઅંતે બે ઝાલેક
 ફરઝેયતે બેહ, યા મવલાય યા અબા
 અંબેદિલ્લાહ અશહદો અન્નક કુન્ત નૂરને

ફિલ અસંલાબિશશામેખંતે વલ અરંહાંમિલ
 મોતંહરતે લમ તોનજંજિસંકલ જાહેલિચ્યતો
 બેઅન્જાસેહા વ લમ તુલ બિસંક મિન
 મુદંલહિમ્માતે, સંયાબેહા, વ અશહદો અન્નક
 મિન દ આંએમિદીન, વ અરંકાનિલ
 મોઅંમેનીન, વ અશહદો અન્નકલ ઇમામુલ
 બરંરૂત્તકીંચ્યુરં રઝીંચ્યુઝં ઝકીંચ્યુલ હાદિલ
 મહંદિચ્યો, વ અશહદો અન્નલ અઇમ્મત
 મિવં વુલંદેક કલેમતુત્તકંવા વ અઅંલામુલ
 હોદા વલ ઉરંવતુલ વુસંકો વલ હુંજંજતો
 અંલા અહંલિદ દુનયા વ ઉશહેદુલ્લાહ વ
 મલોએકતહૂ વ અમ્બેયોઅહૂ વ રોસોલહૂ

અન્ની બેકુમ મોઅમેનુવં વ બેએયાબેકુમ
 મૂકેનુમ બે શરાયેએ દીની વ ખંવાતીમે
 અંમલી વ કંલેબી લે કંલેબેકુમ સિલેમુવં
 વ અમરી લે અમરેકુમ મુત્તબેઉને
 સંલવાતુલ્લાહે અંલયેકુમ વ અંલા અરવાહેકુમ
 વ અંલા અજસાદેકુમ વ અંલા અજસામેકુમ
 વ અલાં શાહેદેકુમ વ અંલા ગોંએબેકુમ વ
 અંલા ઝાંહેરેકુમ વ અંલા બાતૈનેકુમ.

સલામ હો આપ પર અય અબુ અબ્દિલ્લાહ,
 સલામ હો આપ પર અય ફરજંદ રસૂલે ખુદા
 (સ.અ.વ.) કે, સલામ હો આપ પર ઔર રહેમત
 અલ્લાહ કી ઔર બરકતે ઉસકી.

સલામ હો આપ પર અય વારિસ આદમ કે જો
 બુરગુઝીદહ અલ્લાહ કે હંચ, સલામ હો આપ
 પર અય વારિસ નૂહ નબીએ ખુદા કે, સલામ હો
 આપ પર અય વારિસ ઈબ્રાહીમ ખલીલે ખુદાકે,
 સલામ હો આપ પર અય વારિસ મૂસા ક્લીમે
 ખુદાકે, સલામ હો આપ પર અય વારિસ ઈસા
 રહે ખુદા કે સલામ હો આપ પર અય વારિસ
 મોહમ્મદ (સ.અ.વ.) હબીબે ખુદા કે, સલામ હો
 આપ પર અય વારિસ અમીરિલ મોઅમેનીન
 વલીએ ખુદા કે સલામ હો આપ પર અય ફરઝંદ
 મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) કે સલામ હો આપ
 પર અય ફરઝંદે અલીએ મુતુર્ઝા (અ.સ.) કે
 સલામ હો આપ પર અય ફરઝંદે ફાતેમા ઝહરા
 (સ.અ.) કે, સલામ હો આપ પર અય ફરઝંદ
 ખદીજતુલ કુબરા કે, સલામ હો આપ પર અય
 વોહ જુન્કે ખૂનકા તાલિબ ખુદા હય બેટે અયસો
 કે જિનકે ખૂનકા બદલા નહીં લિયા ગયા, મૈ

गवाही देता हूं के नमाज़ को आपने कायम किया.
 और ऋकात को अदा किया, और हुकूम किया
 नेक बातोंका, और मना किया जूरी बातों से,
 और धताअत की अल्लाह और उसके रसूल की
 आभीर तक, पस जुदा लअनत करे उस गिरोह
 पर जिस्ने आपको कत्ल किया, लअनत करे
 जुदा उस कौम पर के जिस्ने आप पर मुल्म
 किया और लअनत करे अल्लाह उस कौम पर
 के जिस्ने उसको सुना तो उससे राग़ी हुं. अय
 मेरे मौला, अय अजु अज्जिल्लाह मंय गवाही
 देता हूं के आप नूर थे जलंद सुल्पो और पाकीज़ा
 शिकमोमे, नहीं आलुदा किया आपको
 जहिलयतने अपनी नजसतोंसे और न पेहनाये
 आपको अपने तारिक कपडे, और मंय गवाही
 देता हूं तहकीक के आप दीनके सुतून हंय और
 मोअमिन के अरकानोमें से हंय, और मंय गवाही
 देता हूं आप धमाम हंय नेक परहेज़गार पसंदीदह

पाक रहनुमा और सही रास्ते के चलनेवाले,
और मंय गवाही देता हुं के एमाम आपकी
अवलाह मेंसे हंय परहेज़गारी की रह, हिदायतके
सुतून और मजबूत दोरी और हुज्जत हे दुनिया
वालो पर, और मंय गवाह करता हुं अल्लाह
और मलाअेका उसके और उसके नबी ओर
उसके रसूल को, के मंय आप पर एमान लाया
हुं और यकीन करनेवाला आपकी रजअत का,
और मेरे अमलकी एन्तेहा आपके दीनी अेहकाम
के साथे और मेरा दिल आपके दिलके साथ मिला
हुवा हय, और मेरा मामला आपके मामलेके
ताजे हय सलवात अल्लाह की आपके उपर
आपकी इहों पर, और आपके जिस्मों पर और,
आपकी लाशो पर, और आपमें से हाज़िर हो
उन पर, जे आपमें से गाअेज हो उन पर, जे
आपमें से जाहेर हो और आपमें से छुपे हो उन
पर. (जियारत की दो रकअत नमाज़ पढे.)

ઝિયારતે જનાબે અલી અકબર અ.સ.

અસ્સલામો અંલયેક યબ્ન રસૂલિલ્લાહ,
અસ્સલામો અંલયેક યબ્ન નબીયિલ્લાહ,
અસ્સલામો અંલયેક યબ્ન અમીરિલે
મોઅમેનીન, અસ્સલામો અંલયેક યબ્નલે
હુસૈનિશહીદ, અસ્સલામો અંલયેક
અય્યોહશહીદ વબ્નશહીદ, અસ્સલામો
અંલયેક અય્યોહલે મઝલૂમો વબ્નુલે
મઝલૂમ, લઅંનલ્લાહો ઉમ્મતને કંતલતક
વ લઅંનલ્લાહો ઉમ્મતને ઝંલમતક વ
લઅંનલ્લાહો ઉમ્મતને સમેઅંતે બેઝાલેક

ફર ઝેંયત બેહ.

સલામ હો આપ પર અય ફરઝંદ રસૂલે ખુદા (સ.અ.વ.) કે સલામ હો આપ પર અય ફરઝંદ, નબીએ ખુદાકે, સલામ હો આપ પર અય ફરઝંદ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) કે સલામ હો આપ પર અય ફરઝંદ હુસૈને શહીદકે, સલામ હો આપ પર અય શહીદ ઔર ફરઝંદ શહીદ કે, સલામ હો આપ પર અય મઝલૂમ ઔર ફરઝંદ મઝલૂમ કે, લાઅનત કરે ખુદા ઉસ જમાઅત પર જિસ્ને આપકો કત્લ કિયા, ઔર લાઅનત કરે ખુદા ઉસ જમાઅત પર જિસ્ને આપ પર ઝુલ્મ કિયા, ઔર લાઅનત કરે ખુદા ઉસ જમાઅત પર જુસ્ને સુના ઈસકો તો રાઝી રહી ઉસ પર.

ઝિયારતે શોહદાએ કરબલા

ઝિયારત પઢતા હું તમામ શોહદાએ કરબલાકી સુખ્નત
કુર્બતન એલલ્લાહ

અસ્સલામો અંલયકુમ્બે યા અવલેયો
અલ્લાહે વ અહિંબ્બાઅહૂ, અસ્સલામો
અંલયકુમ્બે યા અસ્કેયો અલ્લાહે વ અવિદ્દાઅહૂ
અસ્સલામો અંલયકુમ્બે યા અનૈસૌર
દીનિલ્લાહ, અસ્સલામો અંલયકુમ્બે યા
અનૈસૌર રસૂલિલ્લાહ, અસ્સલામો અંલયકુમ્બે
યા અનૈસૌર અમીરિલૈ મોઅમેનીન,
અસ્સલામો અંલયકુમ્બે યા અનૈસૌર ફાતેમત

સચ્ચેદતે નેસૌઈલ્લે આંલમીન, અસ્સલામો
 અંલયકુમ્બે યા અનૈસૌર અબી મોહુંમદેનિલ્લે
 હુંસનિબ્ને અંલિયેનિઝં ઝકીયિનૈ નાસૌહું,
 અસ્સલામો અંલયકુમ્બે યા અનૈસૌર અબી
 અંબદિલ્લાહ બે અબી અનૈતુમ્બે વ ઉમ્મી
 તિબ્તુમ્બે વ તાંબતિલ્લે અરૈઝુંલ્લતી ફીહા
 દોફિનૈતુમ્બે વ ફુઝૈતુમ્બે ફવૈઝનૈ અંઝીમા ફ
 યા લયૈતની કુન્તો મઅંકુમ્બે ફઅફૂઝ મઅંકુમ્બે.

સલામ હો આપ પર અય અવલીયાએ ખુદા ઔર
 દોસ્તાને ખુદા, સલામ હો આપ પર અય
 બુરગુઝીદાને ખુદા ઔર ઉસકે દોસ્તદારો, સલામ
 હો આપ પર અય મદદગારો દીને ખુદાકે, સલામ

હો આપ પર અય મદદગારો રસૂલુલ્લાહ
 (સ.અ.વ.) કે, સલામ હો આપ પર અય મદદગારો
 અમીરિલ મોઅમેનીન (અ.સ.) કે, સલામ હો આપ
 પર અય મદદગારો ફાતેમએ ઝહરા (સ.અ.)
 તમામ આલમો કી ઓરતોં કી સરદાર કે, સલામ
 હો આપ પર મદદગારો મોહમ્મદ કે બાપ હસન
 બીન અલી પાકીઝા ખૈરખ્વાહ બુઝુર્ગ કે, સલામ
 હો આપ પર અય મદદગારો અબુ અબ્દીલ્લાહ
 (હુસૈન) કે, મેરે માં-બાપ આપ પર ફીદા હો
 ઔર પાક હુઈ ઉસ ઝમીન જુસ્મે આપ દફન હુવે
 ઔર કામયાબ હુવે આપ બડી કામયાબી, પસ
 કાશ મંચ આપ કે સાથ હોતા તો મચંબી સાથ
 કામયાબી હાસીલ કરતા.

ઝિયારતે હઝરતે અબ્બાસ અ.સ.

ઝિયારત પઢતા હું હઝરત અબ્બાસ અ.સ. કી સુન્નત
 કુર્બતન એલલ્લાહ

અસ્સલામો અંલયક યબ્ન અમીરિલ
 મોઅમેનીન અસ્સલામો અંલયક અય્યોહલ
 અંબદુસ્સાલેહુલ મોતીઆ લિલ્લાહે વ લે
 રસૂલેહી અશહદો અન્નક કંદે જાહદત વ
 નસંહંત વ સંબરત હંત્તા અતાકલ યંકીન
 લઅંનલ્લાહુઝ્ઝં ઝાલેમીન લકુમ મેનલ
 અવ્વલીન વલ આખેરીન વ અલહંકંહુમ
 બે દરકિલ જહીમ.

સલામ થાય આપ પર અય ફરઝન્ટે અમીરલ
 મોઅમેનીન, સલામ હો આપ પર અય ખુદાના
 નેક બંદા, જેણે ઈતાઅત કરી ખુદાની અને તેના
 રસૂલની, હું ગવાહી આપું છું કે આપે જેહાદ કર્યો

નમાઝ પછી પઢવાની કેટલીક આયતો

ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

જ્યારે હક તઅલાએ આયતુલ કુરસી, આયએ શહાદત અને આયએ મુલકને જમીન ઉપર નાઝિલ થવાનો હુકમ કર્યો, તો તે આયતોએ કહ્યું

“અય ખુદાવંદા! તું અમોને ગુનેહગાર ખતાકાર લોકો તરફ મોકલો છો?”

હક તઅલાએ વહી ફરમાવી:

તમો જમીન ઉપર જાઓ, હું મારી ઇઝઝત અને જલાલની કસમ ખાઇને કહું છું કે આલે મોહમ્મદ (સ.અ.વ.) અને તેઓના શિયાઓમાંથી જે કોઇ તમોને પઢશે, તો હું મારી છુપી રહેમતોમાંથી તેની તરફ સિતેર વખત રહેમતની નજર કરીશ અને તેની તૌબા કબૂલ કરીશ, ભલે પછી તેના મોટા ગુનાહ હોય.

રિવાયતમાં છે કે ખુદાએ ફરમાવ્યું કે જે કોઇ આ (નીચે આપેલી) આયતો દરેક ફરજ (વાજિબ) નમાઝ

પછી પટે, તો હું તેને ‘હઝીરએ કુદુસ’ નામના સ્થળે રાખીશ, ભલે પછી તેણે ગમે તે પ્રકારના ગુનાહ કર્યા હોય. અગર જો એમ નહીં કરું, તો તેની તરફ પોતાની ખાસ રહેમતથી જોઈશ અને અગર જો તે પણ નહીં કરે, તો તેની સિત્તેર હાજતો પુરી કરીશ, જેમાની સૌથી નાની હાજત ગુનાહોની સજા ન કરવાની છે, અગર એમ પણ નહીં કરે, તો તેને દરેક દુશ્મનની ઇજાથી મારી પનાહ (રક્ષણ)માં રાખીશ અને દુશ્મનોના મુકાબલામાં તેની મદદ કરીશ અને તેને બેહિશ્તમાં દાખલ થવામાં મોત સિવાય બીજું કોઈ ચીજ આડે નહીં આવે. તે આયતો સૂરે અલ્હમ્દ, આયતુલ કુરસી, આયએ શહાદત અને આયએ મુલ્ક છે. અલ્હમ્દનો સૂરો સર્વે કોઈ જાણે છે અને બાકીની ચીજો નીચે મુજબ છે.

આયતુલ કુરસી

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહુંમ

અલ્લાહો લાં એલાહ ઇલ્લા હુવ, અલ્

હુંચુલ કુંચૂમ, લા તઅખૌઝૌહૂ સેનતુ
 વ્વલા નવેમ, લહૂ મા ફિસ્સમાવાતે વમા
 ફિલે અરેઝં, મને ઝંલ્લઝી યશફઓ ઈન્દહૂ
 ઇલ્લા બેઇઝનેહી, યઅંલમો મા બયને
 અયેદીહિમ વમા ખંલેફહુમ, વલા યોહીતૂન
 બેશયેઇમ મિને ઈલ્મેહી ઇલ્લા બેમા શાઅ,
 વસેઅં કુરેસીયોહુસ્સમાવાતે વલેઅરેઝં,
 વલા યઊદોહૂ હિંફેઝૌહોમા, વ હોવલે
 અંલિયૂલે અંઝીમ્ લા ઇકેરાહ ફિદીને
 કંત્તબચ્ચનરે રૂશદો મેનલેગંચે, ફમંચ્ચકફુરે
 બિત્તૌગૂંતે વ યોઅમિમ બિલ્લાહે ફકંદિસે

તમ્સક બિલેઉરેવતિલે વુસંકો, લન્ફેસોંમ
 લહા વલ્લાહો સંમીઉને અંલીમ઼ અલ્લાહો
 વલિય્યુલેલઝીન આમનૂ યુખરેજૂહુમ
 મેનઝોઝોલોમાતે એલન્નુરે, વલ્લઝીન કફરે
 અલ્લેયોઓહોમુત્તોંગૂતો યુખરેજૂનહુમ
 મેનન્નૂરે એલઝોઝોલોમાતે, ઉલોએક
 અસંહોબુનેનારે, હુમ ફીહા ખોલેદૂન઼

(સૂરએ બકરહ : ૨૫૫, ૨૫૬, ૨૫૭)

આયએ શહાદત

બિસ્મિલ્લાહિરે રહીમાનિરે રહીમ
 શહેદલ્લાહો અન્નહૂ લો એલાહ ઇલ્લા

હોવ વલે મલોએકતો વ ઓલુલે ઈંલમે
કોંએમમે બિલોકિંસ્તે, લો એલાહ ઇલ્લા
હોવલે અંઝીઝુલે હુંકીમઃ ઇન્નદીન
ઈન્દલ્લાહિલે ઇસ્લામ, વ મખ્તલફલે લઝીન
ઉતુલે કેતાબ ઇલ્લા મિમ્ બઅંદે મા
જોઅહોમુલે ઈંલમો બગ્થમ્ બયેનહુમ્, વ
મંચકફુરે બે આયાતિલ્લાહે ફઇન્નલ્લાહ
સરીઉંલે હેસાબઃ

(સૂરએ આલે ઈમરાન : ૧૮, ૧૯)

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

આ આયત (આયએ શહાદત) પઢે તે વખતે “હકીમ”

પછી “વ અના અલા ઝાલેક મેનશ્શાહેદીન” કહે તો

જેટલા અક્ષર છે તેની ગણતરી પ્રમાણે ખુદાવંદે કરીમ ફરિશ્તા પૈદા કરે અને તે ફરિશ્તા ક્યામત સુધી તેના માટે ઇસ્તિગ્ફાર કર્યા કરે અને ખુદાએ તઆલા તેના માટે બેહિશ્તના દરવાજા ખોલી આપે અને તેના માટે દોઝખના સાત દરવાજા બંધ કરે.

વળી હઝરતે ફરમાવ્યું કે જે કોઈ એ આયત (આયએ શહાદત)ને સુતી વખતે પઢે, તો ખુદાએ તઆલા સિત્તેર (૭૦) હજાર ફરિશ્તા પૈદા કરે, કે તે (દરેક) ક્યામત સુધી તેના માટે ઇસ્તિગ્ફાર કર્યા કરે.

આયએ મુલ્ક

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીંમ

કોલિલ્લાહુમ્મ માલેકલે મુલ્કે તોઅંતિલે
મુલ્ક મનૈ તશાઓ વ તન્ઝેઉંલે મુલ્ક મિમ્નૈ

તશાઓ, વ તોઈઝઝો મન તશાઓ વ
 તોઝિલ્લો મન તશાઓ, બેયદેકલ ખંચેર,
 ઇન્નક અંલા કુલ્લે શયેઈન કંદીર તૂલેજુલ
 લયેલ ફિન્નહારે વ તૂલેજુન્નહાર ફિલ્લયેલ,
 વતુખેરેજુલે હંચે મેનલે મય્યેતે વ તુખેરેજુલે
 મય્યેત મેનલે હંચે વ તરેઝોકો મન તશાઓ
 બેગંચેરે હેસાબ

(સૂરએ આલે ઈમરાન : ૨૬,૨૭)

આમનર રસૂલોની આયાત

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીમ

આમનરે રસૂલો બેમા ઉન્ઝેલ એલયેહે

મિરુંબેહી વલમોએમોનૂન. કુલ્લુન આમન
 બિલ્લાહે વ મલોએકતેહી વ કોતોબેહી
 વ રોસોલેહ, લા નોફરેકો બયેન અહંદિમ
 મિરું રોસોલેહ, વ કોલૂ સમોએના વ
 અતેએના ગુંફેરાનક રબ્બના વ એલયેકલે
 મસીરું લા યોકલેકુલ્લાહો નફેસને
 ઇલ્લા વુસ્એહા, લહા મા કસબતે વ
 એલયેહા મકતસબતે રબ્બના લા
 તોઆબિએના ઇન્સીના અવે અબંતેએના,
 રબ્બના વલા તહમિલે એલયેના ઇફેરને
 કમા હંમલેતહૂ એલલે લર્ઝીન મિને

કુંબલેના, રબ્બના વલા તોહુંમિલના માલા
 તોકુંત લના બેહ, વઅંફો અંના, વગોફિર
 લના, વરહુંમના, અન્ત મવલનાના ફન્સુંરેના
 અંલલ કુંવમિલ કાફેરીનં

(સૂરએ બકરહ : ૨૮૫,૨૮૬)

સૂરએ નાસ

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીમ

કુંલ અઉઝો બેર બોબિન્નાસે
 મલેકિન્નાસે એલાહિન્નાસે મિને શરરિલ
 વસ્વાસિલ ખંનનાસ અલ્લઝી યોવસવેસો
 ફી સૌદૂરિન્નાસે મેનલ જિન્નતે વન્નાસ

સૂરઅે ફલક

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીંમ

કુંલ અઊઊઊં બેરબંબિલે ફલકેં મિનં
શરેરે મા ખંલકેં વ મિનંશરેરે ગાંસેકિંન
એઊઊં વકુંબ, વમિનં શરેરિનં નફફાસાંતે
ફિલઓકુંદેં વ મિનં શરે હાંસેદિનં એઊઊં
હુંસદેં

ઉપરના બંને સૂરા (સૂરે ફલક અને સૂરે નાસ)ની ખાસિયત એ છે કે હંમેશા રાતના પઢે, તો જિન્નાતથી અને વસવસાથી બેખોફ રહે. અને જો બાળકના ગળામાં લખીને પહેરાવે, તો જિન અને જમીનના કીડાથી સુરક્ષિત રહેશે.

‘મઅવ્વઝતૈન’ ફુલઅઊઊં બેરબંબિનાસનો સૂરો

અને બીજો કુલઅઉઝો બેરબીલ ફલકનો સૂરો છે.

“કુલ યા અય્યોહલ કાફેરન”નો સૂરો

(સુરે કાફેરન)

બિસ્મિલ્લાહિરે રહીમાનિરે રહીમ

કુંલે યા અય્યોહલ કાફેરન
લાઅઅંબોદો મા તઅંબોદૂન વલો અન્તુમ
આંબેદૂન મા અઅંબુદ વલો અના આંબેદુમ
મા અંબત્તુમ વલો અન્તુમ આંબેદૂન મા
અઅંબુદ લકુમ દીનોકુમ વલેય દીન

અલ્લાહના રસૂલ (સ.અ.વ.) ફરમાવે છે:

જે કોઈ આ સૂરાને પઢે, તો કુરઆનનો ચોથો ભાગ
પઢવા જેટલો સવાબ મળે, શયતાન દૂર થાય, શિર્કથી

બચે.

“એઝાજઅ”નો સૂરો (સુરે નસ્ર)

બિસ્મિલ્લાહિરે રહુમાનિરે રહીમ

એઝા જાઅ નસુરુલ્લાહે વલ્ફતહો વ
રઅયતન્નાસ યદખોલૂન ફી દીનિલ્લાહે
અફવાજા ફસબ્બેહુ બેહુમ્દે રબ્બેક
વસતગોફિરેહો, ઇન્નહૂ કાન તવ્વાબા

અલ્લાહના રસૂલ (સ.અ.વ.) ફરમાવે છે:

જે કોઈ આ સૂરાને પઢે, તો એવું છે જાણે કે તે મક્કાના વિજયમાં મારી સાથે હતો.

ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

જે કોઈ ઉપરોક્ત સૂરો ફરજ (વાજિબ) અથવા સુન્નત નમાઝ પછી પઢે, તો ખુદા તેને તમામ દુશ્મનો

ઉપર મદદ આપે અને જ્યારે કબ્રમાંથી બહાર નીકળે, તો તેની સાથે એક કિતાબ હોય કે તે કિતાબમાં પુલે સેરાતથી પાર થવાની અને જહન્નમથી મુક્તિ મળવાની અને જહન્નમની આગથી રક્ષણ મળવાની પરવાનગી હોય.

“અહ્લાકો મુત્તકાસોરો”નો સૂરો

(સૂરે તકાસૂર : ૧૦૨)

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ

અહ્લાકોમુત્તકાસોરોં હંતા ઝુરતોમુલ્લ
 મકાંબિરં કલ્લા સવેફ તઅલમૂનં સુંમ
 કલ્લા સવેફ તઅલમૂનં કલ્લા લવ
 તઅલમૂન હુલ્મલે યકીનં લતરવુન્નલે
 જહીમં સુંમ લતરવુન્નહા અંયેનલેયકીનં

સુંમ્મ લતુસેઅલુન્ન યવેમએઝિંને અંનિને
નઈમ્

ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

જે કોઈ આ સૂરો ફરજ (વાજિબ) નમાઝમાં પઢે, તો તેને એકસો (૧૦૦) શહીદનો સવાબ મળે અને તેની સાથે ફરિશ્તાઓની ચાલીસ હરોળ નમાઝ પઢે, અને સુન્નત નમાઝમાં પઢે, તો પચાસ (૫૦) શહીદનો સવાબ મળે.

અલ્મ નશરહનો સૂરો **(સૂરએ ઈન્શોરાહ :૯૪)**

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ

અલમ નશરહું લક સંદરકું વ વઝંઅંના

અંન્ક વિઝરકું અલ્લાહી અન્કંઝં ઝંહરક

િ વ રફઁના લક િંકરક િ ફઁન્ન
 મઁલઉસરે યુસરા િ ઈન્ન મઁલ ઉસરે
 યુસરા િ ફઁઁઁ ફરગૈત ફનેસૈબ િ વ ઁલા
 રબ્બેક ફરગૈબ.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે :

જે કોઈ આ સૂરાને પઢે, તો મારા દુઃખને દૂર કરવા
 જેટલો સવાબ તેને મળશે.

ઇન્ના અન્નાહોનો સૂરો

(સૂરે કદ્ર : ૯૭)

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ

ઇન્ના અન્નાહો ફી લયલતિલે કંદરે

વમો અદરક મા લયલતુલ કંદરે લયલતુલ
 કંદરે ખંચરુમ મિન અલ્કે શહરે તનઝલુલ
 મલોએકતો વરેહો ફીહા બેઇઝને રબ્બેહિમ
 મિન કુલ્લે અમરિન સલામ, હેય હંત્તા
 મલ્લઈલે ફજરે

ધમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

જે કોઇ માહે રમઝાનની પહેલી રાત્રે વહેતા પાણીમાં
 ગુસ્લ કરે અને ૩૦ છાબકા પાણીના માથા ઉપર નાખે,
 તો આવતા માહે રમઝાન સુધી અંદરની તહારતથી પાક
 રહે. જે કોઇ માહે રમઝાનની પહેલી રાત્રે ગુસ્લ કરે,
 તેને તે આખુ વર્ષ ખુજલી નહીં થાય.

પહેલી તારીખે પણ સુન્નત છે કે વહેતા પાણીમાં
 ગુસ્લ કરે અને માથા ઉપર ૩૦ છાબકા પાણી નાખે.

ધમામે અલી રઝા (અ.સ.) ફરમાવે છે કે એમ કરવાથી

આખા વર્ષની આફતો અને બીમારીઓથી અમાન મળે. તેમજ પહેલી તારીખે ગુલાબના પાણીનું છાબકું મોટા ઉપર નાખે, તો બેઘઝઝતી અને પરેશાનીથી નજાત પામે અને જો હંમેશા એ મહિનામાં એમ કરે તો એ બલાઓથી બચે.

ઈમામ મોહમ્મદ તકી (અ.સ.) ફરમાવે છે:

દરેક મહિનાની પહેલી તારીખે બે રકઅત નમાઝ એવી રીતે પઢે કે પહેલી રકઅતમાં સૂરએ અહમ્દ પછી શ્રીસ (૩૦) વખત સૂરએ કુહો વલાહ અને બીજી રકઅતમાં સૂરએ અહમ્દ પછી સૂરએ ઇન્ના અન્નાલાહ પઢે અને નમાઝ ખતમ કર્યા પછી બની શકે તેટલો સદકો આપે, તો તેણે એ મહિનાની સલામતી ખરીદી લીધી.

**માહે રમઝાનની પહેલી તારીખે
આ નીચેની દુઆ પઢવી સુન્નત છે**

اللهم اني استأجره في شهره رمازم

વકેંદિકે તરઝેંત અંલયેના સેંયામહૂ વ અન્નલ્લ
 ફીહિલે કુંર આન હોદલે લિન્નાસો વ
 બય્યેનાતિમં મેનલે હોદા વલે ફુરેકોન
 અલ્લાહુમ્મ અઈન્ના અંલા સેંયામેહી વ
 તકેબ્બલેહો મિન્ના વ તસલ્લીમંહુ મિન્ના
 વ સલ્લીમહુ લના ફીહે, વસલ્લીમના મીન્હો
 વસલ્લિમહો લના ફી યુસરિમં મિન્ક વ
 આંફેયતિને ઇન્નક અંલા ફુલ્લે શયેઈને કુંદીર.

ઈમામ જઅફર સાદિક (અ.સ.) અને ઈમામ મૂસા
 કાઝિમ (અ.સ.) ફરમાવે છે :

માહે રમઝાનમાં દરેક નમાઝ પછી આ દુઆ પઢવી
 સુન્નત છે.

યા અંલિય્યો યા અંઝીમ, યાગંકૂરો યા
 રહીમ, અન્તરૃબ્બુલે અઝીમુલ્લઝી લયેસ
 કમિસ્લેહી શયેઅ, વ હોવસ્સમીઊલ બસીર,
 વ હાઝાં શહરૂને અંઝંઝંમ્તાહૂ વ કરૃમ્તાહૂ
 વ શરૃફેતહૂ વ ફઝંઝંલેતહૂ અંલશ્શોહૂરે વ
 હોવ શહરૂલ્લઝી ફરઝંત સૈયામહૂ અંલય્ય
 વ હોવ શહરો રમઝાંનલ્લઝી અન્ઝલ્ત ફીહિલે
 કુંરેઆન હોદલે લિન્નાસે વ બય્યેનાતિમ
 મેનલે હોદા વલે ફુરેકાંન વ જઅંલ્ત ફીહે
 લયેલતલે કુંદરે વ જઅંલ્તહા ખંયેર મે મિને
 અલ્ફે શહરિને ફયા ઝંલે મન્ને વલા યોમન્નો

अँलयक मुन्न अँलय भे इकाके रकँभती
भेनन्नारे, ई भनं तमुन्नो अँलयडे व
अदँभिल्लेनिले जन्नत भे रडँभतेक या
अरँडँभरं राडँभीन.

माहे रमजानमां हंमेशा पढवानी दुआ

अल्लाहना रसूल मोहम्मद मुस्तुफ़ा (स.अ.व.)
इरमावे छे :

माहे रमजानमां दरेक नमाज पछी आ दुआ पढे, तो
अल्लाह क्यामत सुधीना तेना गुनाह भक्षी आपे.

अल्लाहुम्म अदँभिल्ले अँला अडँलिले
कौभूरिस्सोडूर, अल्लाहुम्म अगँने कुल्ल
इकीर, अल्लाहुम्म अशेभेअँ कुल्ल ज़अेअँ,

અલ્લાહુમ્મ કૈસો કુલ્લ ઉર્યાન, અલ્લાહુમ્મ
 કૈઝે દયેન કુલ્લે મદીને, અલ્લાહુમ્મ ફરરિજે
 અંને કુલ્લે મકરૂબ, અલ્લાહુમ્મ રૂદ કુલ્લ
 ગૌરીબ, અલ્લાહુમ્મ ફુક્ક કુલ્લ અસીર,
 અલ્લાહુમ્મ અસંલેહું કુલ્લ ફાસેદિમ મિને
 ઓમૂરિલ મુસ્લેમીન, અલ્લાહુમ્મશફે કુલ્લ
 મરીઝે, અલ્લાહુમ્મ સુદ ફકૈરના બેગૌનાક,
 અલ્લાહુમ્મ ગૌયેયિરે સૂઅ હૌલેના બેહુંસ્ને
 હૌલેક અલ્લાહુમ્મકૈઝે અન્નદયેન વ અઘંનેના
 મેનલે ફકૈર, ઇન્નક અંલા કુલ્લે શયેઇને
 કંદીર.

અય અલ્લાહ નસીબ કર ખુશી કબરવાળાને,
 અય અલ્લાહ દરેક ગરીબને ગની કર, અય
 ખુદા દરેક ભૂખ્યાને ખાણું ખવરાવ, અય અલ્લાહ
 દરેક નિર્વસ્ત્રોને કપડાં પહેરાવ, અય અલ્લાહ
 દરેક કર્મદારનું કર્મ અદા કર, અય ખુદા દરેક
 ઉદાસની ઉદાસીને દૂર કર, અય ખુદા પહોંચાડ
 દરેક મુસાફરને વતન, અય ખુદા દરેક કૈદીને
 મુક્ત કર, અય ખુદા સુધારી આપ દરેક ખરાબ
 કામ મુસલમાનના, અય ખુદા શિફા આપ દરેક
 બીમારને, અય ખુદા અમારી ગરીબીને તવંગરીથી
 બદલ, અય ખુદા અમારી ખરાબ હાલતને સારી
 કર, અય ખુદા અમારા કર્મને અદા કરી અમારી
 ગરીબીને તવંગરીમાં બદલી નાખ, ખરેખર તું
 દરેક ચીજ પર સત્તાવાન છો.

અઝીમ સવાબની દુઆ

માહે રમઝાનમાં કોઈપણ દિવસે અથવા રાત્રે બે-બે
 રકઅત નિચ્યત કરી બાર રકાઅત નમાઝ પઢે. દરેક

રકઅતમાં સૂરએ અલ્હમ્ પછી પચ્ચીસ વખત સૂરએ કુલ હો વલ્લાહ પટે અને જ્યારે બાર રકઅત નમાઝ પુરી થાય, ત્યારે નીચે મુજબ ૭૦ (સિતેર) વખત પટે.

સુબ્હાનલ્લાહે વલે હુંમ્દો લિલ્લાહે વ
લા એલાહ ઇલ્લલ્લાહો વલ્લાહો અકબરે,
વ લા હુંવ્લ વલા કુંવ્વત ઇલ્લા બિલ્લાહિલે
અંલીયિલે અંઝીમ.

એ પછી નીચેની દુઆ સિતેર (૭૦) વખત પટે...

અસ્તગંફેરુલ્લાહલેલઝી લા એલાહ ઇલ્લા
હોવરે રહુંમાનુરે રહુંમુલે હુંચુલે કુંચૂમ
વ અતૂબો એલયેહ.

એ નમાઝનો સવાબ એ છે કે બારમી રકઅતના

છેલ્લા સજદામાંથી માથું ઉપાડે નહીં ત્યાં તેના તમામ ગુનાહ હક તઆલા માફ કરી આપે, અને સાત લાખ હજનો, સાત લાખ ઉમરાનો, સાતસો રાત જાગીને ઇબાદત કરવાનો અને સાતસો રોઝા રાખવાનો સવાબ મળે. દુનિયા અને આખેરતની આફતોથી ખુદા નજાત અતા ફરમાવે, તેના દિલમાંથી હંમેશા હિકમતની વાતો નીકળી જીભ ઉપર જારી થાય. તે જ વર્ષમાં ખુદાની રહેમતે પહોંચે, તો શહીદનો મરતબો પામે અને જ્યારે દુનિયાથી ગુજરી જાય, ત્યારે સલામતીથી જન્નતમાં દાખલ થાય.

માહે રમઝાનની ઇબાદતોમાં

ખામી રહે, તે પુરી થવાની દુઆ

ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

માહે રમઝાનમાં વાજિબ તેમજ સુન્નત નમાઝો પછી આ દુઆ પઢ્યા કરે, તો ખુદાએ તઆલા તેને બક્ષી આપે, માહે રમઝાનની ઇબાદતોમાં જે કાંઈ ખામી રહી ગઈ હોય તેને પુરી કરી આપે અને તે પછીની ઇબાદતોને દુરસ્ત

કરશે.

અલ્લાહુમ્મઅદે અંના હુંકુંકું મા મઝાં
મિન શહરે રમઝાંન વગાંફિરલના તકુંસીરના
ફીહે વ તસલ્લમહો મિન્ના મકુંબૂલન, વલા
તોઆખિંઝના બેઘસરાફેના અંલા અનફોસેના
વજઅંલેના મેનલ મરહૂંમીન વલા તજઅંલના
મેનલ મહૂંરૂમીન.

સેહરીની મોટી દુઆ

માહે રમઝાનમાં સેહરી કરવી સુન્નત છે.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

મારી ઉમ્મતે સેહરી છોડવી જોઈએ નહીં, વધારે ન
ખાય તો ખુરમાની એક પેશી ખાય, જેઓ વહેલી સવારે

ઘસ્તિગફાર અને સેહરી કરે, તેના માટે હક તઆલા તથા મલાએકા સલવાત પઢે છે. સેહરી કરવી, ભલે પછી પાણીનો એક ઘૂંટ હોય.

ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

જે કોઈ સેહરી અને ઘફતાર (રોઝો ખોલતી) વખતે “**ઘન્ના અન્નાહો**”નો સૂરો પઢે અને જો બંને સમય વચ્ચે તે વ્યક્તિ ગુજરી જાય, તો રાહે ખુદામાં શહીદ થઈને પોતાના ખૂનમાં આળોટ્યો હોય તેવો સવાબ મળે.

ઘણી મોઅતબર સનદોના આધારે વારીદ છે કે હઝરત ઈમામે અલી રઝા (અ.સ.)એ ફરમાવ્યું કે આ (નીચે આપેલી) સેહરીની દુઆ હઝરત ઈમામે મોહમ્મદે બાકિર (અ.સ.) પઢતા હતા અને ફરમાવતા હતા કે:

ખુદાની નજદીક આ દુઆની અઝમત અને તેની કબૂલિયત વિષે લોકો જાણી લે, તો એ મેળવવા માટે તલવારો કાઢી એકબીજા સાથે લડે. અગર કસમ ખાઉં કે આમાં ખુદાનું “ઘસ્મે અઅઝમ” છે, તો તે રાસ્ત (યોગ્ય) છે. જ્યારે આ દુઆ પઢવી, ત્યારે બરાબર ધ્યાન આપી નમ્રતાથી

પટવી અને નાલાએકથી છુપી રાખવી.

અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક
મિન્બહાએક બે અબ્હાહો વ કુલ્લો બહાએક
બહિયુન, અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક
બે બહાએક કુલ્લેહ, અલ્લાહુમ્મ ઈન્ની
અસ્અલોક મિને જમાલેક બેઅજમલેહી વ
કુલ્લો જમાલેક જમીલ, અલ્લાહુમ્મ ઈન્ની
અસ્અલોક બેજમાલેક કુલ્લેહ, અલ્લાહુમ્મ
ઈન્ની અસ્અલોક મિને જલાલેક બેઅજલેહી
વ કુલ્લો જલાલેક જલીલ, અલ્લાહુમ્મ ઈન્ની
અસ્અલોક બેજલાલેક કુલ્લેહ, અલ્લાહુમ્મ
ઈન્ની અસ્અલોક મિને અંઝંમતેક બે

અઐંઐંમેહા વ કુલ્લો ઐંઐંમતેક ઐંઐંમહે,
 અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બે ઐંઐંમતેક
 કુલ્લેહા, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક
 મિન્નૂરેક બેઅન્વરેહી વ કુલ્લો નૂરેક નય્યેરુન,
 અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બેનૂરેક કુલ્લેહે,
 અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક મિન્ રહૂંમતેક
 બે અવેસએહા વ કુલ્લો રહૂંમતેક વાસેએહે,
 અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બેરહૂંમતેક
 કુલ્લેહા, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક મિન્
 કલેમાતેક બે અતમ્મેહા વ કુલ્લો કલેમાતેક
 ત્તામૂહે, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક
 બેકલેમાતેક કુલ્લેહા, અલ્લાહુમ્મ ઇન્ની

અસ્અલોક મિનં કમાલેક બેઅકમલેહી વ
 કુલ્લો કમાલેક કામેલ, અલ્લાહુમ્મ ઈન્ની
 અસ્અલોક બેકમાલેક કુલ્લેહં, અલ્લાહુમ્મ
 ઈન્ની અસ્અલોક મિનં અસ્માએક બે
 અકબરેહા વ કુલ્લો અસ્માએક કબીરહં,
 અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બેઅસ્માએક
 કુલ્લેહા, અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિનં
 ઈંઝતેક બેઅઅંઝતેહા વ કુલ્લો ઈંઝતેક
 અંઝીઝહં, અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક
 બેઈંઝતેક કુલ્લેહા, અલ્લાહુમ્મ ઈન્ની
 અસ્અલોક મિનં મશિયતેક બેઅમ્ઝાહા વ
 કુલ્લો મશિયતેક માઝ્યેહં, અલ્લાહુમ્મ

ઇન્ની અસ્અલોક બેમશિયતેક કુલ્લેહા,
 અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક મિને કુંદરતેક
 બિલ્કુંદરતિલે લતિસ્ત તંલ્તબેહા અંલા કુલ્લે
 શયેઈવે વ કુલ્લો કુંદરતેક મુસ્તતીલહ,
 અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બે કુંદરતેક
 કુલ્લેહા, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક મિને
 ઈંલ્મેક બે અન્ફઝી વ કુલ્લો ઈંલ્મેક નાફીઝ,
 અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બેઈંલ્મેક
 કુલ્લેહ,
 અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક મિને
 કંવેલેક બેઅરઝાહો વ કુલ્લો કંવેલેક રઝિયે,
 અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બેકંવેલેક
 કુલ્લેહ,
 અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક

મિમ્મસાએલોક બેઅહુંબ્બેહા એલયેક વ
 કુલ્લો મસાએલોક એલયેક હુંબીબહ,
 અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બમસાએલોક
 કુલ્લેહા, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક મિને
 શરફેક બે અશરફેહી વ કુલ્લો શરફેક શરીફ,
 અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બેશરફેક
 કુલ્લેહ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક મિને
 સુલ્તાનેક બે અદવમેહી વ કુલ્લો સુલ્તાનેક
 દાએમ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક
 બેસુલ્તાનેક કુલ્લેહ, અલ્લાહુમ્મ ઇન્ની
 અસ્અલોક મિમ્મ મુલ્કેક બેઅફખરેહી વ
 કુલ્લો મુલ્કેક ફાખરે, અલ્લાહુમ્મ ઇન્ની

અસ્અલોક બેમુલ્કેક કુલ્લેહ, અલ્લાહુમ્મ
 ઇન્ની અસ્અલોક મિન ઔલુવ્વેક
 બેઅઅંલાહો વ કુલ્લો ઔલુવ્વેક ઔલ.
 અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બે ઔલુવ્વેક
 કુલ્લેહ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક
 મિનમન્નેક બેઅકંદમેહી વ કુલ્લો મન્નેક
 કંદીમ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક
 બેમન્નેક કુલ્લેહ, અલ્લાહુમ્મ ઇન્ની
 અસ્અલોક મિન આયાતેક બેઅકરમેહા વ
 કુલ્લો આયાતેક કરીમહ. અલ્લાહુમ્મ ઇન્ની
 અસ્અલોક બેઆયાતેક કુલ્લેહા, અલ્લાહુમ્મ
 ઇન્ની અસ્અલોક બેમા અન્ત ફીહે મેનશશઅને

વલજબરૂતે વ અસંઅલોક બે કુલ્લે શઅનિંવે
 વહંદહૂ વ જબરૂતિંવે વહંદહા, અલ્લાહુમ્મ
 ઇન્ની અસંઅલોક બેમા તોજબોની બેહી
 હીંન અસંઅલોક ફઅજબની યા અલ્લાહ.

જે હાજત હોય, તે ખુદા પાસે માંગો, ઇન્શાઅલ્લાહ
 પુરી થશે.

સેહરીની નાની દુઆ

યા મફ્ઝઈં ઈન્દ કુર્બતી, વ યા ગૌંસીં
 ઈન્દ શિદતી, એલયક ફઝેઅંતો વ
 બેકસ્તગૌંસ્તો, વબેક લુઝતો લા અલૂઝાં
 બેસેવાક વલા અલ્લોબુર્લફરજ ઇલ્લા મિન્ક,
 ફઅગિસ્ની વ ફરિજ અન્ની યા મયં યકુંબલુલે

યસીર, વ યઅંકુ અંનીલ કસીરે, ઇકુંબલે
 મિન્નીલે યસીર વઅંકુ અંનીલે કસીર ઇન્નક
 અન્તલે ગંકુરુરે રહીમ અલ્લાહુમ્મ ઇન્ની
 અસેઅલોક ઇમાનને તોબાશેરો બેહી કુંલ્બી
 વ યક્રીનને (સાંદેકને) હુંતા અઅંલમ અન્નહૂ
 લંયોસીબની ઇલ્લા મા કતબ્તલી વરઝેઝેની
 મેનલે અંયેશે બેમા કુંસમ્તલી યા અરહુંમરે
 રાહુંમીન યા ઉદ્દતી ફીકુરબતી વ યા સાંહુંબી
 ફી શિદતી વ યા વલિયી ફી નેઅંમતી વ
 યા ગાંયતી ફી રુંબતી અનંતસ્સાતેરો અંવેરતી
 વલ્આમેનો રવેઅંતી વલે મોકીલો અંસરતી

ફગૌંફિરેલી ખંતીંઅતી યા અરેહુંમરે રાહુંમીન.

ઇફતારના આદાબ તથા દુઆઓ

સુન્નત છે મગરિબની નમાઝ પહેલા પઢે, ત્યાર પછી ઇફતાર કરે, પણ બીજા લોકો તેની રાહ જોતા હોય અથવા ભૂખ-પ્યાસ વધારે લાગી હોય અને હુઝૂરે કલ્બ એટલે કે (નમાઝમાં) ધ્યાન ન રાખી શકે તેમ હોય, તો નમાઝની પહેલા રોઝો ખોલવો બેહતર છે.

ઇફતાર સમયે “ઇન્નાઅન્નલ્લાહ”નો સૂરો પઢવો સુન્નત છે.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

જે કોઈ રોઝો ખોલતી વખતે નીચેની દુઆ પઢે, તો પોતાની માના પેટમાંથી પૈદા થયો હોય એવી રીતે ગુનાહથી પાક થઈ જાય છે.

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીંમ

યા અંઝીંમો યા અંઝીંમો અન્ત ઇલાહી

લા એલાહ લી ગૈયેરોક ઇગૌફિરે લેયઝં
ઝંબલે અંઝીમ, ઇન્નહૂ લા યગૌફેરૂઝં ઝંબલે
અંઝીમ ઇલ્લલે અંઝીમ.

ઇમામે હસન (અ.સ.) ફરમાવે છે: રોઝેદાર માટે
ઇફતાર વખતે એક દોઆ કબૂલ થાય છે,
માટે પહેલો લુકમો લેતી વખતે કહે..

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ
યા વાસેઅલે મગૌફેરતે ઇગૌફિરેલી.

ઇમામે મૂસા કાઝિમ (અ.સ.) ફરમાવે છે:
ઇફતાર વખતે આ દુઆ પઢે, તો એટલો સવાબ મળે
કે જેટલા શખ્સોએ તે દિવસે રોઝા રાખ્યા હોય.

અલ્લાહુમ્મ લકસુંમતો વઅંલા રિઝકેક

અફતૈરતો વ અંલયેક તવકેકલેતો.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ખજૂર, પાણી અથવા રૂતુખ અને પાણીથી ઇફતાર કરતા હતા. હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) પહેલા હલવાથી ઇફતાર કરતા, તે ન મળે તો સાકર યા ખુરમાથી, તે પણ ન હોય તો ગરમ પાણીથી ઇફતાર કરતા હતા અને ફરમાવતા હતા કે ગરમ પાણી મેદા (પેટ)ને સાફ કરે છે, આંખોનું તેજ વધારે છે, ગુનાહોને ધોઈ નાખે છે અને પિત દૂર કરે છે.

હઝરત અલી (અ.સ.) દૂધથી ઇફતાર કરવાનું પસંદ કરતા હતા.

ઇમામે અલી રઝા (અ.સ.) ફરમાવે છે:

ઇફતાર વખતે એક રોટી સદકો આપે, તો અલ્લાહ તેના ગુનાહ માફ કરી. ઇસ્માઇલ (અ.સ.)ની ઔલાદમાંથી એક ગુલામ આઝાદ કરવાનો સવાબ આપે છે.

હઝરતે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે:

માહે મુબારક રમઝાનમાં દુઆ અને ઇસ્તિગ્ફાર કરો, કારણકે દુઆ તમારી બલા દૂર કરે છે તથા ઇસ્તિગ્ફાર તમારા ગુનાહ ભૂંસી નાખે છે.

હઝરત ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

જે કોઈ આ મહિનાની પહેલી રાત્રે નાફેલા નમાઝમાં “**ઇબ્ના ફતહના**”નો સૂરો પઢે, તો તે વરસે બલાઓથી હિફાઝતમાં રહેશે.

હંમેશા રાત્રે પઢવાની આલીશાન દુઆ

નીચેની દુઆ માહે મુબારકે રમઝાનની રાત્રે હંમેશા પઢે, તો તેના ચાલીસ વર્ષના ગુનાહ માફ થઈ જાય.

अल्लाहुम्म رब्بِ شَرْعِ رَمَازَانَ
اَللّٰهُمَّ اِنِّىْ اَسْئَلُكَ بِرَمَازَانَ
اَللّٰهُمَّ اِنِّىْ اَسْئَلُكَ بِرَمَازَانَ

મોહુંમદિંવે વ આલે મોહુંમદ, વર્ઝુંકેની
 હુંજ બયેતેકલે હુંરામે, ફી ઑમી હાઝા
 વફી કુલ્લે ઑમ, વગુંફિરેલી તિલ્કઝં ઝાંનૂબલે
 ઑઝામ ફઈન્નહૂ લા યગુંફેરોહા ગયેરોક
 યા રહુંમાનો યા અલ્લામ.

હંમેશા રાત્રે પઢવાની ઉમદા દુઆ

નીચેની દુઆ પઢવામાં ઘણો સવાબ છે.

અલ્લાહુમ્મ બેરહુંમતેક ફિસ્સાલેહીન
 ફઅદખિંલ્ના, વફી ઈલ્લીયીન ફરફઅંના,
 વબેકઅસિમ મિમમઈંનિમ મિનઅંયેનિન
 સલ્સબીલિન ફસ્કૈના, વ મેનલે હુંરિલેઈને

બેરહુંમતેક ફઝવ્વિજના, વ મેનલે વિલ્દાનિલે
 મોખુંલ્લદીન કઅન્નહુમ લોઅલોઉમ
 મકનૂનુને ફઅખુંદિમના, વ મિને સંમારિલે
 જન્નતે વ લોહુંમિતંયેરે ફઅતંઈમના, વ મિને
 સંયાબિસે સુન્દોસે વલુંરીરે વલેઈસ્તબરકે
 ફઅલેબિસ્ના, વ લયેલતલે કંદેરે વહુંજેજ
 બયતેકલે હુંરામે વકંત્લને ફીસબીલેક
 ફવફફિકંલના, વ સાંલેહુંદોઆએ વલેમસ્અલતે
 ફસ્તજબ્લના, વ એઝાં જમઅંતલે અવ્વલીન
 વલ્આખેરીન યવ્મલે કંયામતે ફરહુંમના
 વ બરોઅતમ મેનન્નારે ફકંતુબ્લના વફી

જહન્નમ ફલા તગુંલ્લના, વફી અંઝાબેક
 વ હવાનેક ફલા તબ્તલેના, વ મેનઝઝકુંકુંમે
 વઝરીઅે ફલા તુત્તેઈમ્ના, વ મઅંશશયાતીને
 ફલા તજેઅંલ્ના, વફિન્નારે અંલા વોજૂહેના
 ફલા તકબુબ્ના વ મિને સંયાબિન્નારે વ
 સરાબીલિલે કર્તેરાને ફલા તુલેબિસ્ના, વ
 મિને કુલ્લે સૂઈને યા લા અેલાહ ઇલ્લા
 અન્ત બેહુંકુંકું લા અેલાહ ઇલ્લા અન્ત
 ફનજેજેના.

આ મહિનામાં હમેશા રાત્રે હજાર વખત “ઇન્ના
 અન્નલ્લાહ”નો સૂરો તથા સો (૧૦૦) વખત “હા, મિમ
 દોખાન”નો સૂરો પઢવો સુન્નત છે.

પંદરમી તારીખથી શબે કદ્ર સુધીના

આ'માલ

પંદરમી રાત્રે ગુસ્લ કરવું અને હઝરત ઇમામે હુસૈન (અ.સ.)ની ઝિયારત પઢવી સુન્નત છે.

હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું:

જે કોઈ માહે રમઝાનની પંદરમી રાત્રે બે-બે રકઅત કરીને એકસો રકઅત નમાઝ પઢે. દરેક રકઅતમાં અલ્લહના સૂરા પછી દસ વખત કુલ્હોવલ્લાહનો સૂરો પઢે, તો ખુદા દસ ફરિશ્તાને મોકલે, જેઓ તેને તેના દુશ્મનો અને જિન્નાતોની ઇજાથી સુરક્ષિત રાખે. મૃત્યુ સમયે ત્રીસ ફરિશ્તા મોકલે, જેઓ તેને જન્નતની ખુશખબરી આપે, ત્રીસ ફરિશ્તા તેને જહન્નમની આગથી નિર્ભય કરે.

એજ હઝરત ફરમાવે છે કે માહે રમઝાનની પંદરમી

રાત્રે ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત કરે અને ઇશાની નમાઝ પછી એ હઝરતની કબ્ર પાસે દસ રકઅત નમાઝ એવી રીતે પઢે કે દરેક રકઅતમાં અલ્હમ્દના સૂરા પછી દસ વખત કુલ્હો વલ્લાહનો સૂરો પઢે, તો તે ત્યાં સુધી નહીં મરે, જ્યાં સુધી કેટલાક ફરિશ્તાઓને ખ્યાબમાં ન જુએ, જેઓ તેને જન્નતની ખુશખબરી આપે અને જહન્નમની આગથી બેખૌફ કરે.

માહે રમઝાનની ૧૫મી, ૧૯મી, ૨૧મી વગેરે રાત્રિઓ તેમજ માહે રજબ તથા શાઅબાનમાં પણ ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત પઢવી સુન્નત છે.

૧૭મી રાત પણ ઘણી મુબારક છે. આ રાત્રે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) તથા કાફિરોનું લશ્કર ભેગું થયું અને સવારે બદ્રની લડાઈ થઈ, જેમાં ઈસ્લામનો વિજય થયો. આ રાત્રે ગુસ્લ અને ઇબાદતની ઘણી ફઝીલત છે.

૧૯મી રાત “શબે કદ્ર”ની પહેલી રાત છે.

કેટલાક કહે છે કે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ અસ્હાબોને ખબર આપી કે બની ઇસરાઈલમાં એક આબિદ

હતો. તેણે હથિયાર બાંધી રાહે ખુદામાં એક હજાર મહિના જેહાદ કરી હતી.

સહાબીઓએ અચંબો પામીને પૂછ્યું: અમો ટૂંક મુદ્દતની ઉંમરમાં એવો સવાબ કેવી રીતે મેળવી શકીએ?

તો અલ્લાહે ઇબ્ન અન્નાહનો સૂરો નાઝિલ કર્યો, જેમકે અલ્લાહ ફરમાવે છે:

બેશક અમોએ કુરઆન “કદ્ર”ની રાત્રે નાઝિલ કર્યું છે.

(સૂરએ કદ્ર : ૧)

એટલેકે તમામ કુરઆને શરીફ લખે મહફૂઝમાંથી શરૂઆતમાં ચોથા આસમાન ઉપર “બયતુલ મઅમૂર”માં શબેકદ્રમાં નાઝિલ થયું. તે પછી જિબ્રિલ સૂરહ-સૂરહ અને આયત-આયત હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની પાસે લાવતા હતાં એટલે સુધી કે ત્રેવીસ વર્ષની મુદ્દતમાં આખુ કુરઆન આપ (સ.અ.વ.) પાસે લાવ્યા. તેને “શબે કદ્ર” કહેવામાં આવે છે કારણકે તે રાતથી બીજી કદ્રની રાત સુધીમાં એટલે કે એક વર્ષમાં જે કાંઈ થનાર છે, તે

નિર્માણ થાય છે. તે રાત કદ્ર (નિર્માણ) અને બરકતવાળી છે અને તે કદ્રનો અર્થ તંગી પણ થાય છે. આસમાન પરથી એટલા ફરિશ્તાઓ નાઝિલ થાય છે કે જમીન તેમના માટે તંગ થઈ જાય છે.

શબે કદ્રમાં મતભેદ છે. કેટલાક કહે છે કે આખા વર્ષમાં શબે કદ્ર છુપી છે, માટે દરેક રાત્રે ઇબાદત કરવી જોઈએ કે જેથી શબે કદ્રની ફઝીલત મળે. કેટલાક કહે છે કે માહે શાઅબાન અને માહે રમઝાનમાં છુપી છે. કેટલાક કહે છે કે શાઅબાનની પંદરમી રાત છે. કેટલાક કહે છે કે માહે રમઝાનની ૧, ૧૫, ૧૭, ૧૯, ૨૩, ૨૭, ૨૯મી અથવા છેલ્લી રાત છે.

આપણા આલિમો એકમત છે કે તે માહે રમઝાનની ૧૯મી અને ૨૩મી રાતમાં છે. ૨૧મી અને ૨૩મી રાત હોવાની (પણ) ઘણી રિવાયતો છે. આ ત્રણેય રાત્રિઓમાં જાગતા રહી ખુદાની ઇબાદત કરવી જોઈએ કે જેથી શબે કદ્રની ફઝીલત મેળવી શકાય. તે છુપી રાખવામાં એ હીકમત છે કે તેની આશામાં દરેક રાત્રિએ ઇબાદત કરે. જેમકે ઇસ્મે

આઝમ તમામ અસ્માએ હુસ્નામાં છુપું છે તેથી તેની આશાએ ખુદાના તમામ નામોને યાદ કરે.

પછી તે રાતની તઅઝીમ (મહાનતા)માં અલ્લાહ તઆલા ફરમાવે છે:

તું શું સમજ્યો કે શબે કદ્ર શું છે?

(સૂરએ કદ્ર : ૨)

કદ્રનો અર્થ ઇઝઝત, નિર્માણ થયેલ, ખુદાના હુકમ અને સત્તા વગેરે થાય છે.

એ રાતનો મરતબો અને તેની ઇઝઝત તું શું જાણે?

જે કોઈ એ રાત્રે ઇબાદત કરે તે અલ્લાહની પાસે માનવંતો થઈ જાય છે. તેની કદ્ર વિષે અલ્લાહ ફરમાવે છે:

“શબે કદ્ર’એ હજાર મહિનાથી શ્રેષ્ઠ છે.”

(સૂરએ કદ્ર : ૩)

જે હજાર મહિનામાં બની ઇસરાઈલના ગાઝીએ જેહાદ કરી હતી, એટલે કે કદ્રની એક રાતની ઇબાદતનો સવાબ તે શખ્સના હજાર મહિનાની જેહાદ કરતાં ઉત્તમ છે.

ઘમામે હસન (અ.સ.) ફરમાવે છે:

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)થી સાંભળ્યું છે કે મેં (હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ સ્વપ્નમાં જોયું કે મારા મિખ્બર પર વાંદરા કુદે છે! આ સ્વપ્ન જોઈ મને રંજ થયો. પછી જ્યારે જિબ્રિલ આવી ત્યારે બયાન કર્યું કે જેઓ આપના મિખ્બર પર ચડશે તેઓ બની ઉમૈયા છે. તેઓ બાદશાહી ભોગવશે.

મે પૂછ્યું: તેઓની બાદશાહી કેટલા દિવસ ટકશે?

(જિબ્રિલે) કહ્યું કે હજાર મહિના.

આથી હું ઘણો દિલગીર થયો. જિબ્રિલે મને આશ્વાસન આપ્યું અને કદ્રનો સૂરો લાવીને કહ્યું કે બની ઉમૈયાની હજાર મહિનાની બાદશાહી કરતા શબે કદ્ર (કદ્રની રાત) ઉત્તમ છે. તેઓના હજાર મહિનામાં શબે કદ્ર નહિં હોય!

ર૩મી રાત “જોહની” છે. જોહન નામના અરબે રસૂલે ખુદા (સ.અ.વ.)ની ખિદમતમાં અરબ કરી કે માઈ મકાન મદીનાથી દૂર છે, તેથી બેહતરમાં બેહતર કોઈ રાત મારા માટે મુકર્રર કરી આપો કે તે રાતે આપની ખિદમતમાં

આવ્યા કરૂં. હજરતે તેના માટે ૨૩ મી માહે રમઝાનની રાત મુકરર કરી. તેથી તે હંમેશા માહે રમઝાનની ૨૩મી રાત્રે પોતાના ઘરના માણસો (નોકરો) સહિત આવતો અને સવારના પાછો જતો.

૨૩મી રાત્રે બે ગુસ્લ કરવા સુન્નત છે. એક તો રાતની શરૂઆતમાં અને બીજું પાછલી રાતના.

હજરત ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

૨૩મી રાત “જોહની” છે. તે રાત્રે ખુદાની હિકમત મુજબ તમામ કામ નિર્માણ થાય છે. એ રાત્રે મૃત્યુ, રોઝી, બલા, અજલ, કઠા વગેરે બીજા વર્ષની શબ્દકદ્ર સુધીની તમામ થનાર બાબતો નિર્માણ થાય છે, તો ખુશહાલ એ શખ્સના કે એ રાતના જાગે અને ખુદાની ઇબાદત કરે, રૂકૂઅ અને સજ્દા કરે, પોતાના ગુનાહોને પોતાની નજર સામે લાવે, તેની ઉપર રૂદન કરે, તો જે એ મુજબ કરે, ઉમ્મીદ રાખુ છું કે ઇન્શાઅલ્લાહ શબ્દકદ્રની ફઝીલતથી મહેરમ નહીં રહે.

ફરમાવ્યું કે ખુદાએ તઆલા એક ફરિશ્તાને હુકમ કરે છે તેથી તે હંમેશા માહે રમઝાનમાં નિદા કરે છે કે અય મારા બંદાઓ ! તમારા ભૂતકાળના ગુનાહ માફ કરી આપ્યા. શબ્દકદ્રમાં તમો એકબીજાના હકમાં શફાઅત કરો, તો કબૂલ કરું. તમો એકબીજા માટે દુઆ કરો, તો કબૂલ કરું. પરંતુ જો નશાવાળી ચીજથી રોઝો ખોલે અથવા કોઈ મોઅમીન તરફ દિલમાં કીનો રાખે, તેના માટે આ ફઝીલત નથી.

ઇમામે જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

ર૩મી રાત્રે જે કોઈ “સૂરએ અનકબૂત” અને “સૂરએ રૂમ” પઢે, ખુદાની કસમ, તે બેહિશ્તી છે અને આમાં કોઈને જુદો નથી કરતો (કે ફલાણો નહીં)

એજ હઝરતે ફરમાવ્યું કે ર૩મી રાત્રે હજાર (૧૦૦૦) વખત ઇન્ના અન્જલનાહનો સૂરો પઢે, તેની સવાર ખરા અને મજબૂત ચકીન સાથે થાય. આ રાત્રે મારા માટે જે મખસૂસ કરામતો છે, તે સ્વપ્નામાં જુવે.

“હા, મીમ, દોખાન”નો સૂરો આ રાત્રે પઢવો સુન્નત

છે.

હઝરત ઇમામ મોહમ્મદ તકી (અ.સ.) ફરમાવે છે:

કોઈ આ રાત્રે ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત કરે, તો તેની સાથે એક લાખ ચોવીસ હજાર પયગમ્બરોની રૂહો મુસાફરો કરે છે, જેઓ તમામ આ રાત્રે ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત કરવા જવાની રજા લે છે.

હઝરત ઇમામ મોહમ્મદે બાકિર (અ.સ.) ફરમાવે છે:

કોઈ માહે રમઝાનની ૨૩મી રાત્રે જાગે અને એકસો રકઅત નમાઝ પઢે, તો ખુદા દુનિયામાં તેની રોઝી બહોળી કરે અને દુશ્મનોની ઇજાથી નજાત આપે અને તેને ડુબી જવાથી, દબાઈ જવાથી, ગળામાં લુકમો ફસાઈ જવાથી અને વિકરાળ પ્રાણીઓથી બચાવે, મુન્કીરો નકીરની બીક દૂર કરે અને કબરમાંથી બહાર આવશે, ત્યારે તેને એવું નૂર આપવામાં આવશે કે મહશરના લોકોને તે નૂર રોશની આપશે, તેના જમણા હાથમાં અમલનામું આપશે, તેના માટે જહન્નમની આગથી છુટકારો તેમજ પુલે સેરાતથી

આસાનીથી પાર ઉતરવાનું, જન્નતમાં દાખલ થવાનું, હિસાબ ન લેવાનું લખશે તેમજ જન્નતમાં તેને પયગમ્બરો, સિદ્દીકો અને શહીદોનો સાથી કરશે.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

જે કોઈ “કદ્ર”ની રાત્રે જાગતો રહે અને ખુદાની ઇબાદતમાં મશગૂલ રહે તો તેના સઘળા ગુનાહ બક્ષવામાં આવે.

મનકૂલ છે કે “કદ્ર”ની રાત્રિએ શયતાન બહાર નીકળતો નથી અને કોઈને ઇજા પહોંચાડી શકતો નથી.

ઇબ્ને અબ્બાસ કહે છે કે હઝરતે ફરમાવ્યું કે આ રાત્રે જિબ્રિલ સિતેર હજાર (૭૦,૦૦૦) ફરિશ્તાને સાથે લઈ “સિદરતુલ મુન્તાહા” ઉપરથી ઝમીન ઉપર આવે છે અને તે ફરિશ્તાઓની સાથે નૂરના અલમ હોય છે અને તેને ચાર જગ્યાએ ઉભા કરે છે:

૧. ખાનએ કાઅબા ઉપર

૨. રસૂલે ખુદા (સ.અ.વ.)ના રોઝા મુબારક ઉપર

૩. બયતુલ મુકદ્દસ ઉપર

૪. તુરે સીના ઉપર

પછી જિબ્રિલ ફરિશ્તાઓને કહે છે કે જમીન ઉપર જાઓ. એક પણ મોઅમીનનું ઘર એવું નથી હોતું કે જ્યાં એ ફરિશ્તા ન જતા હોય, સિવાય કે એ ઘરમાં જતા નથી, જ્યાં કુતરા, સુવ્વર, શરાબ અથવા હરામ કૃત્ય વડે નાપાક જનાબતવાળા (થયા) હોય અથવા મૂર્તિ હોય. એ સઘળા મલાએકા (ફરિશ્તા) હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઉમ્મતને સવાબ પહોંચાડવા માટે અલ્લાહની તસ્બીહ અને તેના ઝિક્રમાં મશ્ગૂલ હોય છે. જ્યારે સવાર થતાં આસમાન ઉપર રવાના થાય છે, ત્યારે પહેલા આસમાનના મલાએકા તેઓના ઇસ્તિકબાલ (આવકાર) માટે આવે છે અને પૂછે છે કે ક્યાંથી આવો છો?

કહે છે કે ઝમીન ઉપરથી, કારણકે શબે કદ્ર (કદ્રની રાત) હતી.

મોહમ્મદ (સ.અ.વ.)ની ઉમ્મતને અલ્લાહે શું આપ્યું?

કહ્યું: તેઓના નેક લોકોને નજાત આપી. ઇબાદત કરનારાઓના હકમાં તેઓની શફાઅત કબૂલ કરી.

આ સાંભળી પહેલા આસમાનના મલાએકા ખુશ થાય છે અને તસ્ખીહનો અવાજ બુલંદ કરે છે. પછી તેઓ પહેલા આસમાનના મલાએકા સહીત બીજા આસમાન પર જાય છે. ત્યાં પણ એજ સવાલ-જવાબ થાય છે. તેઓ પણ બહુ જ ખુશ થઈને તસ્ખીહનો અવાજ બુલંદ કરે છે. એવી રીતે (ક્રમશઃ) સાતમા આસમાન ઉપર “સિદરતુલ મુન્તહા” સુધી પહોંચે છે, ત્યાં પણ એજ સવાલ જવાબ થાય છે. અદનની જન્નતના લોકો તેઓના અવાજ સાંભળે છે અને રિઝવાનને પૂછે છે તેઓ કે આ કેવા અવાજ છે ? તે કહે છે કે મોહમ્મદ (સ.અ.વ.)ની ઉમ્મત માટે તસ્ખીહ કરવા લાગે છે. તો તેઓ પણ તસ્ખીહ કરે છે, અને અર્શના રહેવાસીઓ પણ તેઓના અવાજ સાંભળી તસ્ખીહ કરવા લાગે છે.

પછી ખુદાએ તઆલા ફરમાવે છે: કદ્રની રાત્રે મલાએકા અને રૂહ (પછીના આખા વર્ષ માટે નિર્માણ કરેલા દરેક કામ માટે) નાઝિલ થાય છે.

(સુરએ કદ્ર)

રૂહથી મુરાદ જિબ્રઇલ અ. છે, તેઓ મલાએકા સાથે

જમીન પર આવી મોઅમેનીન સાથે મુસાફરો કરે છે. એની નિશાની એ છે કે મોઅમેનીનના દિલમાં રીક્કત થાય છે.

પછી ખુદાએ તઆલા ફરમાવે છે:

“એ કદ્રની રાત તમામ બૂરાઇઓ, બલાઓ અને શયતાની આફતોથી સલામત છે.”

મતલબ એ કે એ સલામતી, નેકી અને બરકત સવાર સુધી છે. અથવા આ આયતનો અર્થ એ કે એ રાતમાં કોઇ બૂરાઇ પૈદા થાય અને શયતાન તેમા પોતાનો કાંઇ દખલ કરે તેનાથી સલામત છે.

સૂરએ કદ્રની ચોથી આયતમાં “બેઇઝને રબ્બેહિમ” (પોતાના પરવરદિગારના હુકમથી) શબ્દો આવ્યા, ત્યાં એ આયત અને વાક્ય પુરું થયું, એ પછી છેલ્લા શબ્દો “મિન ફુલ્લે અમરિન” (વાસ્તે હરેક કામની) શબ્દ દાખલ છે. તો એ શબ્દો પાંચમી આયતમાં મેળવતા આ પ્રમાણે અર્થ થશે કે એ રાત્રે દરેક બાબતની સલામતી છે અને તેમાં દરેક બાબતની ભલાઈ, બરકત અને ફાયદા છે,

કારણકે અલ્લાહ તઆલા ભલાઈ અને બરકતની ચીજો એ રાત્રે મુકર્રર કરે છે.

શબેકદ્રના આ'માલ

શબે કદ્રમાં જે આ'માલ કરવાના છે તે આ મુજબ છે:

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

જે કોઈ શબે કદ્રમાં બે રકઅત નમાઝ એવી રીતે પઢે કે દરેક રકઅતમાં સૂરે અલ્હમ્દ પછી સાત વખત ફુલ્હોવલ્લાહનો સૂરો પઢે અને બે રકઅત પુરી થતાં સિતેર વખત “અસ્તગંફેરૂલ્લાહ વ અતૂબો એલયહે” કહે, તો તેની બરકતથી અલ્લાહ તેને તથા તેના મા-બાપને બક્ષી આપે અને કેટલાક મલાએકા (ફરિશ્તા) મોકલે જેઓ બીજા વર્ષ સુધી તેઓ માટે નેકીઓ લખ્યા કરે. કેટલાક મલાએકાને જન્નતમાં મોકલે, જેઓ તેના માટે ઝાડ લગાડે, મકાન બનાવે અને નેહરો જારી કરે અને તે શખ્સને અલ્લાહ તઆલા મૃત્યુ પહેલાં એ તમામ ચીજો દેખાડશે.

પ્રણેય રાત્રે ગુસ્લ કરવું તાકીદ ભરી (ભારપૂર્વકની) સુન્નત છે. તે રાત્રે સૂર્ય અસ્ત થવાની નજદીક ગુસ્લ કરવું ઉત્તમ છે કે જેથી સાંજની નમાઝ તે ગુસ્લથી પઢે. (આ બાબતે મરજ-એ- તકલીદના ફતવા પ્રમાણે અમલ કરવો.)

હઝરત ઇમામે મોહમ્મદ બાકિર (અ.સ.) ફરમાવે છે:

શબે કદ્રની રાત્રે સુન્નત છે કે કુરઆને શરીફ હાથમાં લઈ ખોલી આ દુઆ પઢે...

अल्लाहुम्म ٱننى असألوك ٱو
 كةتالوكل ٱنل (اँلا ناللللكل
 ٱुरسل) वमा ٱلله व ٱللللكل अكلل,
 व असألوك ٱللسنا वमा ٱوٱللكل व
 ٱुरلل अन तللँलनी ٱلनँ अँलँके

મેનનારે (વ તકેઝેયે હુંવાએજી લિદેદુન્યા
વલે આખેરહું)

પછી ખુદા પાસે હાજતો માંગો, ઇન્શાઅલ્લાહ પુરી
થશે.

હઝરત ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે
છે:

શબે કદ્રની રાત્રે કુરઆને શરીફ માથા ઉપર રાખીને
પઢે...

અલ્લાહુમ્મ બેહુંકેકે હાઝંલે કુરઆને
વ બેહુંકેકે મને અરસલ્તહૂ બેહી વબે હુંકેકે
કુલ્લે મોઅમેનીને મદહુંતહુ ફીહે વ બેહુંકેકેક
અંલયોહિમ ફલા અહુંદ અઅરફો બેહુંકેકેક
મિન્ક.

પછી નીચે મુજબ મઝસૂમીન (અ.મુ.સ.)ના નામ
દસ-દસ વખત પઢે:

બેક યા અલ્લાહ (૧૦ વખત)

બે મોહુંમ્મદિન, (૧૦ વખત)

બે અંલીયિન, (૧૦ વખત)

બે ફાતેમત, (૧૦ વખત)

બિલ હુંસને, (૧૦ વખત)

બિલ હુંસયને, (૧૦ વખત)

બે અંલીયિબિનલ હુંસયન, (૧૦ વખત)

બે મોહુંમ્મદિબને અંલીયિન, (૧૦ વખત)

બે જ અંકરિબને મોહુંમદિન (૧૦ વખત)

બે મૂસબને જ અંકરિન, (૧૦ વખત)

બે અંલીયીબને મૂસા, (૧૦ વખત)

બે મોહુંમદિબને અંલીયીન, (૧૦ વખત)

બે અંલીયી બને મોહુંમદિન, (૧૦ વખત)

બિલ હુંસનિબને અંલીયીન, (૧૦ વખત)

બિલ હુંજજતીલ (કાંએમે અંલયહિસ્સલામ.)

(૧૦ વખત)

(પછી જે હાજત હોય તે ખુદા પાસે માંગો)

શબે કદ્રની રાત્રે બે-બે રકઅત કરીને સો રકઅત નમાઝ પઢવી સુન્નત છે, દરેક રકઅતમાં સૂરે અલ્હમ્દ પછી કુહોવલ્લાહનો સૂરો પઢે અને અમૂક રિવાયતમાં છે કે સાત વખત, યા પાંચ, યા ત્રણ કે એક વખત કુહોવલ્લાહનો સૂરો પઢે તો પણ થઈ શકે છે. આ સો રકઅતની ઘણી ફઝીલત વારીદ થઈ છે. સુસ્તી હોય તો બેસીને પણ પઢી શકે છે.

આ (ઉપરોક્ત) આ'માલ બયાન થયા તે ૧૯મી, ૨૧મી અને ૨૩મી ત્રણેય રાત્રે કરવાના છે.

૧૯મી રાતના ખાસ આ'માલ એ છે કે એકસો (૧૦૦) વખત કહે...

अस्तغفرُ اللهُ رُبُّنِي وَ اَتُوبُو
اِلَيْهِ.

અને એકસો (૧૦૦) વખત કહે...

اَللّٰهُمَّ اِنِّىْ اَسْتَعِيْزُ بِكَ مِنْ
اَلْحَرَمِ

મોઅંમેનીન.

અને આ રાત્રે નીચેની દુઆ પઢે:

અલ્લાહુ મજ્ અંલ ફીમા તકઝી
વતોકંદેરો મેનલ અમરિલ મહંતૂમે વ
ફીમા તફરોકો મેનલ અમરીલ હંકીમે, ફી
લખ્લતીલ કંદરે વફીલ કંઝાઈલ્લાઝી લા
યોરદો વ લા યોબદલો અને તકતોબની
મિન હુંજજાજે બયતેકલ હંરામિલ મબરૂરે
હુંજજોહોમુલ મશકૂરે, સઅયોહોમુલ મઁકૂરે,
ઝોનૂબોહોમુલ મોકફફરે, અંને હુમ
સય્યેઆતોહુમ વજ્ અંલ ફીમા તંકઝી વ
તોકંદેરો અન્તોતીલ ઉંમરી વ તોવસ્સેઅં

અંલય્ય ફી રિઝકીં (વ તોકુંદેરલી ફી જમીઅં
ઓમૂરી મા હોવ ખંચરૂલી ફી દુન્યાય વ
આખેરતી યા અરહુંમરે રાહુંમીન)

પછી પોતાની હાજતો ખુદાએ તઆલા પાસે માંગે.

૨૧મી રાતના આ'માલ ૧૯મી રાતના ખાસ આ'માલ
સિવાય બાકી તેજ પ્રમાણે છે અને એ રાત્રિઓમાં ઝિક્કે
ખુદા અને સલવાત બની શકે તેટલી પઢે, અને પોતાના
તથા પોતાના માં-બાપ, સગાવહાલા માટે બક્ષિશની દુઆ
માંગે, અને જવશને કબીર પણ પઢવાનો ઘણો સવાબ
છે. ૧૯મી રાત કરતાં ૨૧મી રાતની ઘણી ફઝીલત છે,
૨૧મી અને ૨૩મી રાત્રે પણ સો રકઅત નમાઝ પઢે,
દરેક રકઅતમાં અલ્હમ્દના સૂરા પછી એક અથવા દસ
વખત કુલ્હોવલ્લાહનો સૂરો પઢે.

બરોસાપાત્ર હદીસમાં છે કે ઇમામે મોહમ્મદ બાકિર
(અ.સ.) આ બંને રાતે જાગતા હતા. રાતના પહેલા

અર્ધા ભાગમાં દુઆ માંગતા હતા, અને પછીના અર્ધા ભાગમાં નમાઝ પઢતા હતા.

૨૩મી રાતના આ'માલ પણ ૧૯મી રાતના આ'માલ મુજબ કરે અને નીચેની દુઆ પઢે:

અલ્લાહુ મૈમમદુદ્દી ફી ઉંમરી વ
અવસેઅંલી ફી રિઝકી વ અસૈહૈહૈલી જુમી
વ બલ્લિગૈની અમલી વ ઇન કુન્તો મેનલ
અશકૈયાએ ફમહૈની મેનલ અશકૈયાએ,
વકૈતુબની મેનસોઅંદાએ ફ ઇન્નક કુંલ
ફી કિતાબેકલ મુન્નલે અંલા નબિય્યેકલ
મુરસલ સંલવાતોક અંલયહે વ આલેહી
યમહૂંલ્લાહો મા યશાઓ વ યુસૈબિત, વ
ઈન્દહૂ ઉમ્મુલ કિતાબ.

પછી આ મુજબ પઢે:

અલ્લાહુમ્મજે અંદની મિને અવફરે
એબાદેક નસીબને મિને કુલ્લે ખંયરિને
અનેઝલ્લહુ ફી હાઝંહિલ લયલતે અવ અન્ત
મુન્ઝેલોહુ મિન્નૂરિને તહદી બેહી અવ
રહૂમતિને તન્શેરોહા, અવ રિઝકિને
તકસેમોહુ, અવ બલ્લોઠને તદફઝોહુ, અવ
ઝુંરેરિને તકશેફોહુ, વકતુબ્લી મા કતબ્ત
લેઅવલેયાએકસંસાલેહીનલ્લઝી નસ્તવજબૂ
મિનેકસંવાબ વ આમનૂ બેરેઝાંક અંનેહુમે
મિનેકલે એકોબ યા કરીમો, અલ્લાહુમ્મ
સંલ્લે અંલા મોહુંમદિને વ આલે મોહુંમદ

વઠ્ઠિ અંબી ઝાંલો ક બેર હું મતો ક યા
અર હું મરેર હું મીન.

આ દુઆ ઉપરાંત બની શકે તેટલું કુરઆન શરીફ પઢે. દુઆએ તૌબા અને દુઆએ મકારેમુલ અખ્લાક પઢે.

ત્રેવીસમી રાતના આ'માલ વિષે ઇમામે જઅફરે સાદિક અ.મેં ફરમાવ્યું:

ત્રેવીસમી રાત્રે સૂરએ અનકબૂત, સૂરએ રૂમ અને સૂરએ દોખાન પઢે તથા એક હજાર (૧૦૦૦) વખત 'ઇન્નાઅન્નલ્લા'નો સૂરો પઢે.

શબે કદ્રથી છેલ્લી રાત સુધીના આ'માલ

ખાસ કરીને રઠમી અને રપમી રાતના પણ ગુસ્લ કરવું સુન્નત છે. રપમી રાતે ખુદાએ તઆલા રોઝેદારથી બદીઓ અને ગુનાહો દુર કરે છે. તમામ બલાઓ દુર કરે છે અને તેઓની આંખોમાં નૂર અતા ફરમાવે છે.

ર૭મી રાતે પણ ખાસ કરીને ગુસ્લ સુન્નત છે. મનકુલ

છે કે હઝરત ઇમામે ઝયનુલ આબેદીન (અ.સ.) ર૭મી
રાતે સાંજથી સવાર સુધી વારંવાર આ દુઆ પઢતા હતા:

अस्सालुम्भरुकुंनितं तज्ज्ञ इय अंनं
दारिलं गौरुरे, वलं अनाभत अला दारिलं
भाँलूढे वलं षसतेअँदाद लिलं भवते कुँब्ल
डौँलूलिलं इवते.

ર૯મી રાતે પણ ખાસ કરીને ગુસ્લ કરવું સુન્નત છે.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

માહે રમઝાનની દરેક રાત્રિએ ત્રણ અવાજ આપવામાં
આવે છે: કોઈ માંગનાર છે જે માગે તેને આપું? કોઈ
તૌબા કરનાર છે, જે તૌબા કરે, તેની તૌબા કબૂલ કરું?
કોઈ માફી ચાહનાર છે, જે માફી ચાહે તેના ગુનાહ માફ
કરી આપું? એવો કોણ છે, જે એવા ખુદાને કરજ આપે
કે જે હરગિઝ મોહતાજ થતો નથી. પોતાના વાયદા ઉપર
વફા કરનાર છે અને ઝુલ્મ કરતો નથી? ફરમાવ્યું કે

છેલ્લા દિવસોમાં હંમેશા ઇફ્તારના વખતે હજાર હજાર જણને ખુદા જહન્નમથી આઝાદ કરે છે અને જ્યારે જુમ્હાની રાત અને જુમ્હાનો દિવસ આવે છે ત્યારે હજાર હજાર જણને જહન્નમની આગથી આઝાદ કરે છે કે જેઓ અઝાબને લાયક થયા હોય. જ્યારે માહે રમઝાનની છેલ્લી રાત અને છેલ્લો દિવસ આવે છે, ત્યારે આખા મહિનામાં જેટલા આઝાદ કર્યા હોય, તેટલા લોકોને આઝાદ કરે છે.

માહે રમઝાનની છેલ્લી રાતે ગુસ્લ કરવું અને ઇમામે હુસૈન (અ.સ.)ની ઝિયારત પઢવી સુન્નત છે તેમજ માહે મુબારકે રમઝાનને વિદાય કરવો તાકીદ ભરેલી સુન્નત છે. માહે રમઝાનને એવી રીતે વિદાય કરે કે જેવી રીતે પોતાના વધારે વ્હાલા સગાને વિદાય કરીએ છીએ, અને વિદાય એ જાહેર કરવા માટે છે કે એ મહિનાના રોઝા અને ઇબાદત અમારા માટે ભાર ન હતાં, બલ્કે અમો તેને ચાહતા હતા અને હવે તેની જુદાઇથી અમે ગમગીન છીએ.

છેલ્લી રાતે વિદાયની એક નાની દુઆ લખવામાં
આવી છે :

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બેઅહુંબે
માદોઈંત બેહી વ અઝાં મા રઝીંત બેહી,
અંને મોહુંમદિને વ અને અહલેબયતે
મોહુંમદિને અંલયહે વ અંલયહે મુસ્સલામ
અને તોસંલ્લેય અંલયહે વ અંલયહેમ વલા
તજેઅંલે વદાઅં શહરી હાઝાં વદાઅં ખૌરુજી
મેનદદુન્યા વલા વદાઅં આખેરે એબાદતેક
વ વફફિકેની ફીહે લેલયલતિલ કુંદરે વજેઅંલે
હાંલી ખંયરને મિને અલ્ફે શહરિને
મઅંતઝાંઆ ફિલ્અજરે વલ્એજાબતે વલે

અંકેવે અંનિઝંઝંબે બે રઝં રબ્બે.

જાબીર બિન અબ્દુલ્લાહ અનસારી ફરમાવે છે કે હું હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની ખિદમતમાં માહે રમઝાનના છેલ્લા જુમ્હાને દિવસે ગયો. જ્યારે આપ (સ.અ.વ.)એ મને જોયો, ત્યારે ફરમાવ્યું:

આ માહે રમઝાનનો છેલ્લો જુમ્હા છે, માટે તેને વિદાય કર અને આ દુઆ પઢ:

અલ્લાહુમ્મ લા તજઅંલહો આખેરલે
અંહુદે મિન સૈયામેના, ઇય્યાહો ફઈને
જઅંલહૂ ફજઅંલની મરહૂમંવે વલા
તજઅંલની મહૂરૂમા.

પછી આપ (સ.અ.વ.) ફરમાવ્યું:

આ દુઆ પઢવાથી બે નેક ખસલતોમાંથી એક નસીબ

થશે, કાં તો બીજો માહે રમઝાન જોશે અને કાં તો ખુદા તેને બક્ષી આપશે અને ઘણી રહેમત કરશે.

માહે રમઝાનની છેલ્લી રાતે ગુલામ આઝાદ કરવા સુન્નત છે, કારણકે તે રાતે અલ્લાહ ઘણા બંદાઓને જહન્નમની આગથી આઝાદ કરે છે. તો આ અશક્ત બંદો કોઈ ગુલામને આઝાદ કરે, તો ઉમ્મીદ છે કે એ માલિક તેને જહન્નમની આગથી આઝાદ કરશે અને ગુનેહગારોના દફતરમાંથી તેનું નામ કાઢી નાખશે.

ઇમામે ઝયનુલ આબેદીન (અ.સ.) એક વરસમાં જેટલા ગુલામ મેળવતા હતાં, તેમાંથી વીસ અથવા તેથી વધારે કે ઓછા માહે રમઝાનની છેલ્લી રાતે રાહે ખુદામાં આઝાદ કરતા અને ફરમાવતા કે તમોને એ આશાએ આઝાદ કર્યા કે ખુદાવંદે રહીમ મારી ભૂલો માફ કરે અને મને જહન્નમના અઝાબથી આઝાદ કરે. જ્યારે ઇદનો દિવસ થતો હતો, ત્યારે તેઓને એટલું ઇનામ આપતા કે તેઓ લોકો પાસે માંગવાથી બેપરવા થઈ જતા હતા. આપ (અ.સ.) ફરમાવતા કે ખુદાવંદે કરીમ માહે રમઝાનની

દરેક રાતે ઇફતારના સમયે એવા હજાર હજાર (દસ લાખ) જણને આઝાદ કરે છે, જેઓ જહન્નમના અઝાબને લાયક થયા હોય અને આખા મહિનામાં જેટલા આઝાદ કર્યા હોય તેટલા છેલ્લી રાતે આઝાદ કરે છે. ઈમામ (અ.સ.) કોઈ ગુલામ અથવા કનીઝને એક વરસથી વધારે રાખતા ન હતા. આપ (અ.સ.) અરફાતના દિવસે એટલે કે માહે ઝીલહજની નવમી તારીખે અરફાતમાં પણ ગુલામોને આઝાદ કરતા હતા.

રિવાયત છે કે માહે રમઝાનની છેલ્લી રાતે સુન્નત છે કે ‘સૂરએ અન્થામ’, ‘સૂરએ કહફ’ અને ‘સૂરએ યાસીન’ પઢે અને એક સો વખત કહે...

अस्तغفرالله و اتوبو اليه.

માહે રમઝાનમાં દરરોજ રાત્રે અને દિવસે પઢવાની દુઆ અને નમાઝ.

૧લી રાત્રે ચાર રકઅત નમાઝ સુન્નત છે. બે-બે રકઅત કરીને પઢે. દરેક રકઅતમાં અલ્હમ્દના સૂરા પછી પંદર વખત ફુલ્હોવલ્લાહનો સૂરો પઢે, તો તેનો સવાબ એ છે કે ખુદા સિવાય કોઈ હિસાબ કરી શકે નહીં.

૧લી તારીખે આ નીચેની દુઆ પઢે, તો ખુદાવંદે કરીમ તેને હજાર નેકી અતા કરે, હજાર દરબજા બુલંદ કરે અને હજાર ગુનાહ માફ કરે.

બિસ્મિલ્લાહિર રહ્માનિર રહીમ

અલ્લાહુ મ્મજ્ અંલે સૈયામી ફીહ

સૈયામસૈએમીન વ કૈયામી ફીહ કૈયામલે

કાંએમીન વ નબ્બેહની ફીહે અંને નવમતિલ
 ગાંફેલીન, વ હબ્લી જુર્મી ફીહે યા એલાહલ
 આંલમીન વઅંફો અંની યા આંફેયને અંનિલ
 મુજરેમીન.

૨-જી રાત્રે ચાર રકઅત નમાઝ સુન્નત છે. બે-બે
 રકઅત કરીને પઢે. દરેક રકઅતમાં અલ્હમના
 સૂરા પછી વીસ વખત ઇન્નાઅન્નલ્લાહનો સૂરો
 પઢે, તો અલ્લાહ તેને બક્ષી આપે, રોઝીમાં
 બરકત આપે અને તે વરસમાં તેના કામો
 આસાનીથી પુરા થાય.

૨-જી તારીખે નીચે લખેલી દુઆ પઢે, તો તેણે પોતાની
 ઉમરમાં જેટલા કદમ ઉપાડ્યા છે, તેટલા
 વરસની ઇબાદતનો એવો સવાબ અતા કરે,
 જેમાં દિવસના રોઝા રાખ્યા હોય અને રાત્રે
 નમાઝ પઢી હોય.

બિસમિલ્લાહિરે રહુમાનિરે રહીમ

અલ્લાહુમ્મ કુંરેરિબ્ની ફીહે એલા
મરેઝાંતેક વ જનનિબ્ની ફીહે મિન સખંતેક
વ નકેમાતેક વ વફકિફેની ફીહે લેકેરોઅતે
આયાતેક, બેરહુમતેક યા અરહુમરહુમીન.

૩-જી રાત્રે દસ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી પચાસ (૫૦) વખત ફુલ્હોવલ્લાહનો સૂરો પઢે, તો ખુદા તરફથી જહન્નમની આગથી આઝાદ થાય છે અને તેના માટે રહેમતના દરવાજા ખોલી નાખવામાં આવે છે.

૩-જી તારીખે નીચે લખેલી દુઆ પઢે, તો હક તઆલા તેના માટે “જન્નતે ફીરદોસ”માં સફેદ મોતીનું એક મકાન બનાવે જેની ઉપર સિત્તેર હજાર

ચમકતા નૂરવાળા ગુરફા હોય, દરેક ગુરફામાં
 (ઓરડા) સિતેર હજાર તપ્ત (સિંહાસન) હોય,
 દરેક તપ્ત ઉપર એક હૂર હોય અને તેના માટે
 હંમેશા હજાર મલાએકા અલ્લાહ તરફથી હદીયો
 (ભેટ) લાવે.

બિસમિલ્લાહિરે રહીમાનિરે રહીમ

અલ્લાહુમ્મરેઝુકીની ફી હિઝ્ઝેહન વ
 તમબીહેવ બાઈંદેની ફીહે મેનસ્સફાહતે વ
 ત્તમ્બેવીહે વ જઅલ્લી નસીબન મિન કુલ્લે
 ખંયેરિન તુન્નેલો ફીહે, બેજૂદેક યા અજવદલે
 અજવદીન.

૪-થી રાત્રે આઠ રકઅત નમાઝ પઢે. દરેક રકઅતમાં
 અલહમ્દના સૂરા પછી વીસ વખત

‘ઘળ્લાઅનઝલ્લાહ’નો સૂરો પઢે, તો હકતઆલા તેના આ’માલને તે રાતે પયગમ્બરોના આ’માલની જેમ બુલંદ કરે.

૪-થી તારીખે નીચે લખેલી દુઆ પઢે, તો હક તઆલા જન્નતમાં સિતેર હજાર કુરસી અતા ફરમાવે, જે દરેક કુરસી ઉપર એક હૂર હોય.

બિસ્મિલ્લાહિર રહીમાનિર રહીમ

અલ્લાહુમ્મ કુંવેની ફીહે અંલા એકાંમતે
અમરેક વ અઝિંકુંની ફીહે હુંલાવત ઝિંકરેક
વ અવંઝેઅંની ફીહે લેઅદાએ શુકરેક
બેકરમેક વહુંફઝુંની ફીહે બે હિંફઝુંક વ
સિતરેક યા અબસંરન્નાઝુંરીન.

૫-મી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં

સૂરે અલહમ્દ પછી પચાસ વખત ફુલહોવલ્લાહનો
 સૂરો પઢે અને નમાઝ તમામ થયા પછી સો
 વખત સલવાત પઢે, તો હઝરત રસૂલે ખુદા
 (સ.અ.વ.) ફરમાવે છે કે તેનો સવાબ એ છે
 કે જન્નતમાં હું જ્યાં રહું, ત્યાં તે રહે.

પ-મી તારીખે નીચે લખેલી દુઆ પઢે, તો હક તઆલા
 જન્નતના હજાર મોટા પ્યાલા અતા ફરમાવે,
 જે દરેક પ્યાલામાં હજાર જાતનું ખાણું હોય.

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહુંમ

અલ્લાહુમ્મજ' અંદની ફીહે મેનલે

મુસ્તગૌફેરીન વજ'અંદની ફીહે મિન'

અંબાદેકસૈસૌલેહીનલે કૌનેતીન વજ'અંદની

ફીહે મિન' અવલેયાએકલે મુકૌરબીન

બેરઅફતેક યા અરહુંમરે રાહુંમીન.

૬-છી રાત્રે ચાર રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં અલહમ્દના સૂરા પછી 'તબારકલ્લાઝી'નો સૂરો એક વખત પઢે, તો તેનો સવાબ એ છે કે તેણે શબ્દે કદ્રની ફઝીલત અને ઇબાદત મેળવી હોય.

૬-છી તારીખે નીચે લખેલી દુઆ પઢે, તો હક તઆલા તેને ચાલીસ હજાર શહેર અતા કરે, જે દરેક શહેરમાં ચાલીસ હજાર "કુરસી" એટલે કે તખ્ત હોય, તે દરેક "કુરસી"ની લંબાઈ હજાર ગજની હોય, દરેક કુરસી ઉપર એક એક હૂર હોય, તે દરેક હૂરને હજાર વાળ હોય અને દરેક વાળ માટે એક-એક ખિદમત કરનારી હોય.

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ

અલ્લાહુમ્મા લા તખ્તુંની ફીહ
લેતઅરૌઝે મઅસિયતેક વલા તઝરિબ્ની

બેસીયાતોં નકેમતેક, વઝહોં ઝેહોંની (ફીહે)
 મિમ્મૂજેબાતે સખંતેક બેમન્નેક વઅયાદીક
 યા મુન્તહા રગોંબતિ રગોંબીન.

૭-મી રાત્રે ચાર રકઅત નમાઝ છે, દરેક રકઅતમાં
 અલહમ્દના સૂરા પછી તેર વખત
 ‘ઇન્નાઅનઝલ્લા’નો સૂરો પઢે, તો તેના
 બદલામાં હક તઆલા ‘જન્નતે અદન’માં
 સોનાનું એક મકાન તૈયાર કરે અને આવતા
 વર્ષ સુધી ખુદાની અમાનમાં રહે.

૭-મી તારીખે નીચેની દુઆ પઢે, તો હક તઆલા
 જન્નતમાં તેને એ નેઅમતો અતા કરે છે, જે
 શહીદો, સઘદો અને અવલિયાને આપે છે.

બિસ્મિલ્લાહિરે રહોંમાનિરે રહોંમ

અલ્લાહુમ્મ અ ઈન્ની ફીહે અંલા

સૈયામેહી વ કૈયામેહી વ જનૈનિબ્ની ફીહે
 મિનૈ હફવાતેહી વ આસાંમેહી વરેઝુકૈની
 ફીહે ઝિંકૈરક બેદવામેહી બેતવેફીકૈક યા
 હાદેયલૈ મોઝિંલ્લીન.

૮-મી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં
 અલહમ્દના સૂરા પછી દસ વખત કુલ હો
 વલ્લાહનો સૂરો પઢે. નમાઝ પછી હજાર વખત
 ‘સુબ્હાનલ્લાહ’ પઢે, તો જન્નતના આઠેય
 દરવાજા ખુલ્લા થઈ જાય. જે દરવાજેથી ચાહે
 જન્નતમાં દાખલ થાય.

૮-મી તારીખે નીચે લખેલી દુઆ પઢે, તો હક તઆલા
 તેના અમલને હજાર સિદ્દીકના અમલની
 બરાબર બુલંદ કરે.

બિસ્મિલ્લાહિરે રહુમાનિરે રહીમ

અલ્લાહુમ્મરેઝુકની ફીહે રહુમતલે
અયતામે, વ ઇતંઐમતંતંઐમો, વ
ઈફ્શાઅસ્સલામે, (વ મુજાનેબતિલ્લેઆમે,)
વ સોહુબતલકેરામે, બેતંવેલેક યા મલેજઅલે
આમેલીન.

૯-મી રાત્રે મગરિબની નમાઝ પછી અને ઇશાની
નમાઝ પહેલાં છ રકઅત નમાઝ છે. દરેક
રકઅતમાં અલહમ્દના સૂરા પછી સાત વખત
'આયતુલ કુરસી' પઢે અને નમાઝ તમામ કર્યા
પછી પચાસ વખત સલવાત પઢે. તેનો સવાબ
એ છે કે સિદ્દીકો, શહીદો અને સાલેહોના
આ'માલની જેમ તેના આ'માલને મલાએકા
બુલંદ કરે.

૯-મી તારીખે નીચેની દુઆ પઢે, તો ખુદાવંદે કરીમ તેને એ સવાબ આપે, જે બની ઇસરાઇલના પયગમ્બરોને આપ્યો છે.

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીંમ

અલ્લાહુમ્મજે અંલ્લી ફીહે નસીબમે

મિરે રહુંમતેકલે વાસેઅંતે વહદેની ફીહે

લેબરાહીનેકસ્સાતેઅંતે, વખુંઝં બેનાસેયતી

એલા મરેઝાંતેકલે જામેઅંતે બેમહુંબ્બતેક

યા અમલલે મુશ્તાકીંન.

૧૦-મી રાત્રે વીસ રકઅત નમાઝ પઢે અને દરેક રકઅતમાં સૂરે અલ્હમ્દ પછી ત્રીસ વખત સૂરએ ફુલ્હોવલ્લાહ પઢે, તો ખુદા તેની રોઝીમાં બરકત

આપે અને ફાએઝીન અને સાલેહીનમાં ગણો.

૧૦-મી તારીખે નીચેની દુઆ પઢે, તો તમામ મખ્લૂક અને દરેક ચીજ તેના માટે દુઆ કરે.

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીંમ

અલાહુમ્મજ'અંલની ફીહે મેનલે
મોતવકકેલીન અંલયેક વજ'અંલની ફીહે મેનલે
ફાએઝીન લદયેક વજ'અંલની ફીહે મેનલે
મોકર્રબીન એલયેક બેએહુસાનેક યા
ગૌયતત્તૌલેબીન.

૧૧-મી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલ્હમ્દ પછી વીસ વખત 'ઇન્નાઅન્નાહ'નો સૂરો પઢે, તો તેનો સવાબ એ છે કે તે દિવસે તેના માટે કોઈ ગુનાહ લખાય નહીં.

૧૧-મી તારીખે નીચેની દુઆ પઢે, તો હજનો સવાબ છે જે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની સાથે કરેલ હોય અને તે હજ સિતેર (૭૦) હજની ખરાબર છે તેમજ તેના માટે એ ઉમરાહ લખવામાં આવે, જે અહલેખૈત (અ.મુ.સ.)ની સાથે કર્યો હોય, તે પણ સિતેર ઉમરાહની ખરાબર છે.

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીંમ

અલ્લાહુમ્મ હુંબિબ્બે એલય્ય ફીહિલ્
 એહુંસાન, વ કરેરેહું એલય્ય ફીહીલ્ફોસૂકું
 વલેઈંસ્યાન વ હુંરિંમ અંલય્ય ફીહિસ્સખંતં
 વન્નીરાન બેઅંવનેક યા ગૈયાસંલ
 મુસ્તગીંસીન.

૧૨-મી રાત્રે આઠ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં

અલ્હમ્દના સૂરા પછી ત્રીસ વખત સૂરે ઇબ્ન
અનઝ્લાહ પઢે, તો શાકેરીનનો સવાબ તેને
મળે અને કયામતના દિવસે સાલેહીનના
દરજામાં ગણાય.

૧૨-મી તારીખે નીચેની દુઆ પઢે, તો ખુદા તેના
ભૂતકાળના અને હવે પછીના ગુનાહ માફ કરી
ગુનાહોને બદલીને નેકીઓ લખે.

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહુંમ

અલ્લાહુમ્મ ઝયેની ફીહે બિસસિતરે

વલે અંફાફે વસતુરેની ફીહે બેલેબાસિલે

કૌનૂએ વલે કફાફે વહુંમિલ્ની ફીહે અંલલે

અંદલે વલેઇન્સૌફે વ આમિન્ની ફીહે મિન

કુલ્લે મા (અહુંઝરૌ વ) અખાંફો બે ઈસ્મતેક

યા ઈસમતલે ખાંએફીન.

૧૩-મી રાત્રે ચાર રકઅત નમાઝ પઢે. દરેક રકઅતમાં અલ્હમ્દના સૂરા પછી પચીસ વખત ફુલ્હોવલ્લાહનો સૂરો પઢે, તો ઇન્શાઅલ્લાહ કયામતના દિવસે વીજળીની જેમ પુલે સેરાત પરથી પસાર થઇ જાય.

૧૩-મી તારીખે નીચેની દુઆ પઢે, તો અલ્લાહ દરેક પથ્થર અને ઢેફાની ગણતરી જેટલી નેકીઓ અતા ફરમાવે અને જન્નતમાં દરજ્જો બુલંદ કરે.

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ

અલ્લાહુમ્મ તંહુહિરેની ફીહે મેનદનસે

વલેઅકુંઝારે વ સુંબીબિરેની ફીહે અંલા

કાએનાતિલે અકુંદારે વ વફ્ફિકુંની ફીહે

લિત્તોકાં વ સૌહૃદ્ભતિલં અબ્હારે બેઅંવેનેક
યા કુર્ંત અંયેનિલં મસાકીન.

૧૪-મી રાત્રે છ રક્ષત નમાઝ છે. દરેક રક્ષતમાં સૂરએ અલ્હમ્દ પછી ત્રીસ વખત ‘એઝાઝુલ્લેલિલ અર્મે’ (સૂરે ઝિલઝાલ)નો સૂરો પઢે, તો હક તઆલા તેને સકરાતે મોત તથા મુન્કીર અને નકીરના ડરથી બચાવે.

૧૪-મી તારીખે નીચેની દુઆ પઢે, તો એવું છે કે જાણે તેણે પયગમ્બરો અને સાલેહોની સાથે રોઝા રાખ્યા હોય.

અલ્લાહુમ્મ લાતોઆખિરંની ફીહે બિલ
અંસંરાતે વઅકિંલ્ની ફીહે મેનલં ખંતાંયા
વલ્હફવાતે વલા તજ્અંલ્ની ફીહે ગંરઝંને
લિલં બલાયા વલ્ આફાતે બેઈઝ્તેક યા

ઈઝ્ઝલે મુસ્લેમીન.

૧૫-મી રાત્રે ચાર રકઅત નમાઝ છે. પહેલી બે રકઅત નમાઝ પઢે તેમાં દરેક રકઅતમાં અલ્હમ્દના સૂરા પછી સો (૧૦૦) વખત કુલ્હોવલ્લાહનો સૂરો પઢે. બીજી બે રકઅત નમાઝ પઢે, તેમાં દરેક રકઅતમાં સૂરે અલ્હમ્દ પછી પચાસ (૫૦) વખત કુલ હો વલ્લાહનો સૂરો પઢે.

૧૫-મી તારીખે નીચેની દુઆ પઢવી. કિતાબમાં સવાબ લખેલ નથી.

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ

અલ્લાહુ મ્મરઝુકની ફીહે તૌઅંતલે
ખાંશેઈન વશરહ્મા ફીહે સંદરી બેએનાબતિલે
મુખ્બોતીન બેઅમાનેક યા અમાનલે

ખાંએફીન.

૧૬-મી રાત્રે બાર રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં અલ્હમ્દના સૂરા પછી “અલ્હાકોમુતકાસોરો” (સૂરે તકાસૂર) બાર વખત પઢે. તેનો સવાબ એ છે કે કયામતના દિવસે કબ્રમાંથી બહાર નીકળશે, તે વખતે સૈરાબ (સંતૃપ્ત) હશે અને કયામતની પ્યાસની અસર તેને નહીં થાય અને બુલંદ અવાજથી કલમએ શહાદતૈન પઢતો બેહિસાબ જન્નતમાં પ્રવેશ કરશે.

૧૬-મી તારીખે નીચેની દુઆ પઢે, તો હક તઆલા તેને એક ચમકતું નૂર અતા કરે કે તે નૂરના સબબથી રસ્તો ચાલે અને બે કપડાં પહેરવા માટે કરામત ફરમાવે. જન્નતની એક સાંઢણી ઉપર બેસાડે અને જન્નતની “શરાબે તહૂરા” પીવરાવે.

બિસ્મિલ્લાહિરે રહુમાનિરે રહીમ

અલ્લાહુમ્મ વફકિ કંની ફીહ
લેમોવાફકંતિલ અશરારે વ જનનિબ્ની ફીહ
મોરાફકંતલ અશરારે વ આવેની ફીહ
બેરહુમતોક એલા દારિલ કંરારે
બેએલાહિયતેક યા એલા હલ ઔલમીન.

૧૭-મી રાત્રે બે રકઅત નમાઝ છે. પહેલી રકઅતમાં સૂરે અલ્હમ્ પછી કોઈ પણ સૂરો એક વખત પઢે. બીજી રકઅતમાં સૂરે અલ્હમ્ પછી સો વખત ફુલ્હોવલ્લાહનો સૂરો પઢે. નમાઝ પૂરી થયા પછી સો વખત 'લા એલાહ ઇલ્લલ્લાહ' પઢે, તો હક તઆલા હજાર હજ, હજાર ઉમરાહ અને હજાર જેહાદનો સવાબ અતા ફરમાવે.

૧૭-મી તારીખે નીચેની દુઆ પઢે, તો તે નુકસાન પામનારાઓમાંથી હોય તો પણ હક તઆલા બક્ષી આપશે.

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ

અલ્લાહુમ્મહુદેની ફીહેલેસાંલેહિંલે
અઅંમાલે વક્રંઝેલી ફીહિલે હંવાએજ વલે
આમાલ યા મન લા યહુતાજો એલત્તફસીરે
વસ્સોઆલે યા આંલેમમ બેમા ફી સાદૂરિલે
આંલમીન (સંલ્લે અંલા મોહમ્મદિવે વ
આલેહિત્તાંહેરીન.)

૧૮-મી રાત્રે ચાર રકઅત નમાઝ પઢે. દરેક રકઅતમાં સૂરએ અલ્હમ્દ પછી પચ્ચીસ (૨૫) વખત ‘ઇન્ના અઅતયના’ (સૂર-એ-

કવસર)નો સૂરો પઢે, તો તેનો સવાળ એ છે કે મલેકુલ મૌત જ્યારે તેની રૂહ કબ્ર કરવા આવશે, ત્યારે તેને ખુશખબરી આપશે કે હક તઆલા તારાથી રાઝી છે.

૧૮-મી તારીખે નીચેની દુઆ પઢે, તો હક તઆલા તેને હજાર પયગમ્બરોનો સવાળ અતા કરશે.

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીમ

અલ્લાહુમ્મ નબ્બેહની ફીહ લે બરકાતે
 અસ્હારેહી વ નવવિરે ફીહ કુંલ્બી બેઝ્યાએ
 અન્વારેહી વખુંઝં બે કુલ્લે અઅંઝાઈ
 એલત્તેબાઅે આસારેહી બેનૂરેક યા મોનવ્વેર
 કૌલૂબિલે આંરેફીન.

૧૯-મી રાત્રે પચાસ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં

સૂરે અલ્હમ્ પછી એક વખત ‘એઝાઝુલ ઝેલતિલ અઝ’ (સૂરે ઝિલઝાલ)નો સૂરો પઢે.

૧૯-મી તારીખે નીચેની દુઆ પઢે, તો આસમાન અને ઝમીનના મલાએકા (ફરિશ્તા) તેના માટે ઈસ્તિગ્ફાર અને દોઆએ ખૈર કરશે.

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ

અલ્લાહુમ્મ વફ્ફિરે ફીહે હુંઝુંઝી મિમ્

બરકાતેહી વ સહ્હિલે સબીલી એલા

ખંયેરાતેહી વલા તહ્હરિમ્ની કુંબૂલ હુંસનાતેહી

યા હાદેયને એલલે હુંકુંકિલ મોબીન.

૨૦-મી રાત્રે આઠ રક્અત નમાઝ પઢે, જેમાં કોઈપણ સૂરો પઢી શકાય છે. મતલબ કે સુબ્હની જેમ બે-બે રક્અત કરીને ચાર નમાઝ પઢે. હક તઆલા તેના ભૂતકાળના તથા હવે પછીના

ગુનાહ માફ કરી આપશે.

૨૦-મી તારીખે નીચેની દુઆ પઢે, તો માહે રમઝાનમાં જેટલા શખ્સોએ રોઝા રાખ્યા હોય, તેઓની ગણતરી પ્રમાણે આઠ વર્ષની કબૂલ કરવામાં આવેલી ઇબાદતનો સવાબ મળે અને તેની તરફ હજાર ફરિશ્તા મોકલે, જેઓ તેને દરેક જખ્બાર અને શયતાનની ઇજાથી બચાવે અને તેની તથા જહન્નમની વચ્ચે સિતોર ખંદકનું અંતર કરે, જે ખંદકો આસમાન તથા જમીનના અંતર જેટલી મોટી હોય.

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહુંમ

અલ્લાહુમ્મફતહુંલી ફીહુ અબ્વાબલે
જિનાને વ અગુંલીકું અન્ની ફીહુ અબ્વાબને
નીરાને વ વફૂફિકુંની ફીહુ લે તિલાવતિલે

કુંરેઆને યા મુન્ઝેલસં સકીનતે ફી કૌલૂબિલે
મોઅંમેનીન.

૨૧-મી રાત્રે પણ વીસમી રાતની જેમ આઠ રકઅત
નમાઝ છે.

૨૧-મી તારીખે નીચેની દુઆ પઢે, તો હક તઆલા
તેની કબ્ર નૂરાની કરશે, તેના ચહેરાને નૂરાની
બનાવશે અને તે પુલે સેરાત ઉપરથી વીજળીની
જેમ પસાર થઈ જશે.

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીંમ

અલ્લાહુમ્મજ' અંલ્લી ફીહે એલા

મરેઝાંતેક દલીલવે વલા તજ'અંલે લિશાયતાંને

ફીહે અંલય્ય સબીલવે વજ'અંલિલે જન્નત

લી મન'ઝેલવે વ મકીલયં યા કાઝયં

હું વાં એ જીતે તો લેખી ન.

૨૨-મી રાત્રે પણ ૨૧મી રાત મુજબ આઠ રકઅત નમાઝ પઢે. તેનો સવાબ એ છે કે કોઈપણ દરવાજામાંથી જન્નતમાં પ્રવેશ કરી શકશે.

૨૨-મી તારીખે નીચેની દુઆ પઢે, તો મૃત્યુ સમયે આસાની થાય, મુનકીરો-નકીરના સવાલ આસાન બને અને નેક તરીકા ઉપર સાબિત કદમ રહે.

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહુંમ

અલ્લાહુમફતહુંલી ફીહે અબ્વાબ ફત્તેલેક
વ અન્નિલે અંલય્ય ફીહે બરકાતેક વ વફ્ફિક્કની
ફીહે લેમૂજેબાતે મરેઝાંતેક વ અસકિન્ની
ફીહે બુહુંબૂહુંતે જન્નાતેક યા મોજબ દઅવતિલે

મુઝંતરૈન.

૨૩-મી રાત્રે પણ ૨૨મી રાત મુજબ આઠ રકઅત નમાઝ પઢે.

૨૩-મી તારીખે નીચેની દુઆ પઢે, તો હક તઆલા વીજળીની જેમ પચગમ્બરો (અ.મુ.સ.) અને નેક લોકોની સાથે પુલે સેરાત ઉપરથી પાર ઉતારે.

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીંમ

અલ્લાહુમ્માગીં સિલ્ની ફીહે
મેનઝંઝોનૂબે વ તંહુહિરેની ફીહે મેનલે
ઓયૂબે વમ્તહિંને કુંલ્બી ફીહે બેતકુંવલે
કોલૂબે યા મોકીલ અંસંરાતિલે
મુઝંનેબીન.

૨૪-મી રાત્રે પણ ૨૩મી રાત મુજબ આઠ રક્ષત નમાઝ છે, તે પટે તો હજ અને ઉમરાનો સવાબ મળે છે.

૨૪-મી તારીખે નીચેની દુઆ પટે, તો હક તઆલા તેના અંગ અને માથાના વાળની ગણતરી મુજબ દરેક વાળના બદલામાં હજાર ખાદિમ અને હજાર ગુલામ, યાકૂત અને મરજાન જેવા અતા ફરમાવે છે.

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક ફીહે મા
યુરેઝીક વ અઊઝી બેક મિમ્મા યુઅઝીક
વ અસ્અલોકત્તવેફીકે ફીહે લેઅન ઓતીઅંક
વલા અઅસેયક યા જવાદસે સાએલીન.

૨૫-મી રાત્રે આઠ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં અલ્હમ્દના સૂરા પછી દસ વખત કુલ્હોવલ્લાહનો સૂરો પઢે.

૨૫-મી તારીખે નીચેની દુઆ પઢે, તો ખુદા તેને જન્નતમાં સો (૧૦૦) મકાન અતા કરશે. તે દરેક મકાનમાં ખયમો હશે.

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ

અલ્લાહુમ્મજી અંલની ફીહી મોહિંબ્બલે

લેઅલ્લોયાં એ ક વ માં અંદેયલે

લેઅઅંદાએક મુસૈતન્નને બેસુન્નતે ખાંતમે

અમ્બોયાં એ ક યા અંસોમ

કૌલૂબિન્નબિયીન.

૨૬-મી રાત્રે આઠ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં અલ્હમના સૂરા પછી સો (૧૦૦) વખત કુલ હો વલ્લાહનો સૂરો પઢે.

૨૬-મી તારીખે આ દુઆ પઢે, તો અલ્લાહ ફરમાવે છે:

બંદા! તું ડર નહીં અને ગમગીન ન થા, કારણકે મેં તને આજે બક્ષી આપ્યો છે.

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ

અલ્લાહુમ્મજે અંલે સઅંયી ફીહે મશકુરા,
વ અંમ્બી ફીહે મગ્ફૂરા, વ અંમલી ફીહે
મક્બૂલા વ અંયેબી ફીહે મસ્તૂરા, યા
અસ્મઅંસ્સામેઈન.

૨૭-મી રાત્રે ચાર રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં અલ્હમ્દના સૂરા પછી 'તબારકલ્લી'નો સૂરો એક વખત પઢે, અગર એ સૂરો યાદ ન હોય તો પચ્ચીસ (૨૫) વખત કુલ્હોવલાહનો સૂરો પઢે, તેનો સવાબ એ છે કે તેને તથા તેના માં-બાપને અલ્લાહ બક્ષી આપશે.

૨૭-મી તારીખે નીચેની દુઆ પઢે, તો એવું છે કે જાણે તેણે દરેક ભૂખ્યાને ખાણું ખવરાવ્યું, દરેક પ્યાસાને પાણી પીવરાવ્યું અને દરેક મોઅમીન પુરૂષ અને સ્ત્રીને માન આપ્યું.

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહુંમ

અલ્લાહુમ્મરેઝુકુંની ફીહે ફઝીલ લયલતિલ

કુંદરે વ સંયયિરે ઓમૂરી ફીહે મેનલ ઉંસરે
એલલે યુસરે વકુંબલે મઅંઝીરી વહુંત્તં

अंनिःशंभु वलविःर या र उःभं
भेभेभादेडी संसोलेडीन.

२८-भी रात्रे छ रकअत नमाः पढे. दरेक रकअतमां
अल्लेभना सूरा पछी दस-दस वपत
'आयतुल कुरसी', "सूरे धन्ना आतयना
कलकवसर" अने "सूरे अले कुल्लोवलाह" पढे
अने सलाम पछी सो वपत सलवात पढे.
तेना जदलामां अल्लोह तआला जक्षी आपे.

२८-भी तारीजे नीयेनी दुआ पढे, तो हक तआला
जन्नतमां पुष्कण हिस्सो अता इरमावशे,
जेनी गणतरी चालीस हजार दुनियानी
जराजर थाय छे.

बिस्मिल्लाहिर रहुंमानिर रहुंम

अल्लोहुम्म वईरि रहुंमी ईडे भेनन

નવાફેલે વ અકરિમની ફીહ બેએહુંઝારિલ
 મસાએલે વ કુંરરિબે ફીહ વસીલતી એલયેક
 મિમ બયેનિલ વસાએલે યા મને લા
 યશગંલોહૂ ઇલ્હુંહુંલે મોલીહુંહીન.

૨૯-મી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં
 સૂરે અલ્હમ્દ પછી વીસ વખત કુલ્હોવલ્લાહનો
 સૂરો પઢે. તેનો બદલો એ મળે કે રહેમત
 કરેલા લોકોમાંથી ગણાય અને “ઇલ્લીયીન”માં
 તેના આ’માલ બુલંદ થાય.

૨૯-મી તારીખે નીચેની દુઆ પઢે, તો હક તઆલા
 તેને સોના, રૂપા અને ઝર્મરૂદના હજાર શહેર
 અતા કરશે.

બિસ્મિલ્લાહિરે રહુમાનિરે રહીમ

અલ્લાહુમ્મ ગંશોની ફીહે બિરેરહુમતે
વરેઝુકૈની ફીહિત્તવફીકું વલ્હુસમત વ તંહિરે
કુંલ્બી મિન ગંયાહેબિત તોહુમતે યા રહીમમ
બેઅબાદેહિલે મોઅમેનીન.

30-મી રાત્રે બાર રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરએ અલ્હમ્દ પછી વીસ (૨૦) વખત કુલ્હોવલ્લાહનો સૂરો પઢે અને સલામ પછી સો વખત સલવાત પઢે, તો હક તઆલા રહેમતની સાથે તેનો ખાતમો કરે.

30-મી તારીખે આ દુઆ પઢે, તો પયગમ્બરો જેવી તેની ઇઝઝત કરે.

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીમ

અલ્લાહુમ્મજંઅંલે સૈયામી ફીહે બિશ્શુકરે
વલે કુંબૂલે અંલા મા તરેઝાહો વ યરેઝાહુરે
રસૂલો મોહુંકમતને ફોરૂઓહૂ બિલ્ઓસૂલે
બેહુંકુંકે સય્યેદેના મોહુંમદિંવ વ આલેહિ
ત્તાંહેરીન, વલેહુંમદો લિલ્લાહે રબ્બિલે
અંલમીન.

નમાઝે વહશત

મુસ્તહબ છે કે દફનની પહેલી રાત્રે મરનાર માટે નમાઝે વહશત પઢવામાં આવે. તેની રીત એ છે કે પહેલી રકઅતમાં સૂરએ અલ્હમ્ પછી એક વખત આયતુલ કુરસી પઢે, પછી રૂકુઅ સજદા કરી બીજી રકઅતમાં સૂરએ અલ્હમ્

પછી દસ વખત ઇબ્ના અન્નાહનો સૂરો પઢે. તશહહુદ અને સલામ પછી આ મુજબ કહે:

અલ્લાહુમ્મ સંલ્લે અંલા મોહુંમ્મદિવે
વ આલે મોહુંમ્મદિવે વબ્બેઅંસં સંવાબેહા
એલા કુંબ્રે ફુલાન

“ફુલાન”ની જગ્યાએ મરનારનું નામ લેવું.

આ નમાઝ (દફનની) પહેલી રાતના કોઈપણ ભાગમાં પઢી શકાય છે, પણ બેહતર છે કે ઇશાની નમાઝ પછી પઢે.

માહે શવ્વાલ

આ મહિનામાં નિકાહ કરવા મુસ્તહબ છે. આ મહિનાની ૬-છી અને ૮-મી તારીખ ‘નહસ’ છે અને બીજી રિવાયત પ્રમાણે ૨જી તારીખ “નહસે અકબર” છે.

આ મહિનાની ૧-લી તારીખે અમ્તે આસ ગુજરી ગયેલ છે.

૧૫-મી તારીખે ઓહદની લડાઈ થઈ હતી, તેમજ આજ તારીખે ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) માટે સૂર્ય ફરી પાછો નિકળેલ, પંદરમી તારીખે જનાબે હમઝા શહીદ થયા.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

જે ઈદની રાત્રે જાગે, તેનું દિલ એ દિવસે નહીં મરે, જ્યારે ડરના લીધે તમામ દિલ મરી જશે.

ઇમામે ઝયનુલ આબેદીન (અ.સ.) ઈદની રાત્રે જાગતા અને સવાર સુધી નમાઝ પઢતા અને ફરમાવતા:

“અય ફરઝંદ! આજની રાત ‘શબે કદ્ર’થી ઓછી નથી.”

આજે (ઈદની) રાત્રે ગુસ્લ કરવું સુન્નત છે.

એક શબ્દે ઈમામે જઅફર સાદિક (અ.સ.)ની ખિદમતમાં અરજ કરી કે લોકો કહે છે કે જેઓ માહે રમઝાનમાં રોઝા રાખે છે, તેઓ માટે “શબે કદ્ર”માં બક્ષિશ નાઝિલ થાય છે, તે શું બરાબર (સહી) છે?

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું:

કામ કરાવનાર કામ પુરૂ થયા પછી મજૂરી આપે છે અને મજૂરી મળવાનો (સમય) “ઘડની રાત” છે.

ઘડની રાત તથા દિવસની

ફઝીલત તથા દુઆ અને નમાઝ

ઇમામે જઅફરે સાદિક (અ.સ.)ની ખિદમતમાં રાવીએ અરજ કરી:

ઘડની રાત્રે ક્યુ કામ કરવું સારું છે?

આપ (અ.સ.)એ ફરમાવ્યું:

સૂર્ય અસ્ત થાય, તે વખતે ગુસ્લ કર અને મગરિબની નમાઝ તથા તેની સુન્નત નમાઝ પઢી લીધા પછી આસમાન તરફ હાથ ઊંચા કરીને આ દુઆ પઢ:

યા ઝંલ્મન્ને વત્તેવેલે યા ઝંલ્જૂદે વલે
એહુંસાને યા મુસ્તંફેય મોહુંમ્મદિંવ વ નાસેરહૂ

સંલ્લે અંલા મોહુંમ્મદિંવ વ આલે મોહુંમ્મદે,
વગોંફિરેલી કુલ્લ ઝંમ્બિન અહુંસંયેતહૂ વ
હોવ ઈન્દક ફી કિતાબિમ્મોબીન.

પછી સજદામાં એકસો વખત ‘અતૂબો એલલ્લાહ’
કહેવું. પછી જે હાજત (જરૂરત) હોય તે ખુદા પાસે માંગે,
પુરી થશે.

મોઅતબર સનદ સાથે મનકૂલ છે કે હઝરત અમીરૂલ
મોઅમેનીન (અ.સ.) “ઇદે ફિત્ર”ની રાત્રે બે રકઅત નમાઝ
પઢતા હતાં. પહેલી રકઅતમાં અલ્હમ્દના સૂરા પછી
‘કુલ્હોવલ્લાહો અહદ’નો સૂરો હજાર વખત અને બીજી
રકઅતમાં સૂરે અલ્હમ્દ પછી કુલ્હોવલ્લાહો અહદનો સૂરો
એક વખત પઢતા હતા. નમાઝ તમામ કરી સલામ પછી
સજદામાં જઇને એકસો વખત ‘અતૂબો એલલ્લાહ’ કહેતા
હતા અને આ દુઆ પઢતા હતા:-

યા ઝંલ્મન્ને વલ્જૂદે યા ઝંલ્મન્ને વત્તેલ્લે

યા મુસ્તંફેય મોહુંમદિનું સંલ્લલાહો અંલયહે
વ આલેહી સંલ્લે અંલા મોહુંમદીવ વ
આલેહી.

પછી પોતાની હાજતો ખુદા પાસે માંગતા હતા, પછી
સજદામાંથી માથું ઊંચું કરી ફરમાવતા:

એ ખુદાના હકની કસમ જેની કુદરતના હાથમાં
મારી જાન છે, જે કોઈ આ નમાઝ પઢે અને જે હાજત ચાહે
તે હક તઆલા પાસે માંગે, તો અલબત્ત તેની હાજત પુરી
કરે. અગર જંગલની રેતી જેટલા ગુનાહ હશે, તો પણ
ખુદા માફ કરી આપશે.

ઉપરોક્ત બે રકઅત નમાઝમાં પહેલી રકઅતમાં હજાર
વખત કુલ્હોવલ્લાહ પઢવાનું લખ્યું છે. તો જો કોઈને એથી
ઓછી વખત પઢવાની ઈચ્છા હોય, તો બીજી રિવાયતમાં
હજારને બદલે સો વખત પઢવાનું લખેલ છે. સુન્નત છે કે
આ નમાઝ પઢ્યા પછી આ નીચેની દુઆ પઢે.

બિસ્મિલ્લાહિરે રહુમાનિરે રહીમ

યા અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો
યા રહુમાનો યા અલ્લાહો યા રહીમો યા
અલ્લાહો યા મલેકો યા અલ્લાહો યા કુદુસો
યા અલ્લાહો યા સલામો યા અલ્લાહો યા
મોઅમેનો યા અલ્લાહો યા મોહયમેનો યા
અલ્લાહો યા અંઝીઝો યા અલ્લાહો યા
જબ્બારો યા અલ્લાહો યા મોતકબ્બેરો યા
અલ્લાહો યા ખાલેકી યા અલ્લાહો યા બારેઓ
યા અલ્લાહો યા મોસવ્વેરો યા અલ્લાહો
યા આલેમો યા અલ્લાહો યા અંઝીમો યા

અલ્લાહો યા અંલીમો યા અલ્લાહો યા કરીમો
યા અલ્લાહો યા હુંલીમો યા અલ્લાહો યા
હુંકીમો યા અલ્લાહો યા સમીઓ યા અલ્લાહો
યા બસીરો યા અલ્લાહો યા કુંરીબો યા
અલ્લાહો યા મોજીબો યા અલ્લાહો યા જવાદો
યા અલ્લાહો યા માજેદો યા અલ્લાહો યા
મલીયો યા અલ્લાહો યા વફિયો યા અલ્લાહો
યા મવેલા યા અલ્લાહો યા કુંઝી યા અલ્લાહો
યા સરીઓ યા અલ્લાહો યા શદીદો યા
અલ્લાહો યા રઊફો યા અલ્લાહો યા રકીબો
યા અલ્લાહો યા મજીદો યા અલ્લાહો યા

હુંફીઝાં યા અલ્લાહો યો મોહીંતોં યા અલ્લાહો
યા સય્યેદસે સાદાતે યા અલ્લાહો યા અવ્વલો
યા અલ્લાહો યા આર્ખેરો યા અલ્લાહો યા
ઝાંહેરો યા અલ્લાહો યા બાર્તેનો યા અલ્લાહો
યા ફાર્ખેરો યા અલ્લાહો યા કાંહેરો યા
અલ્લાહો યા રબ્બાહો યા અલ્લાહો યા
રબ્બાહો યા અલ્લાહો યા રબ્બાહો યા
અલ્લાહો યા વદૂદો યા અલ્લાહો યા નૂરો
યા અલ્લાહો યા રાફેઓં યા અલ્લાહો યા
માનેઓં યા અલ્લાહો યા દારફેઓં યા અલ્લાહો
યા ફાતેહોં યા અલ્લાહો યા નફાઓં યા

અલ્લાહો યા જલીલો યા અલ્લાહો યા જમીલો
યા અલ્લાહો યા શહીદો યા અલ્લાહો યા
શાહેદો યા અલ્લાહો યા મોગીંસો યા અલ્લાહો
યા હુંબીબો યા અલ્લાહો યા ફાર્તેરો યા
અલ્લાહો યા મોતુંહુંહેરો યા અલ્લાહો યા
મલેકો યા અલ્લાહો યા મુકુંતદેરો યા
અલ્લાહો યા કુંબેઝો યા અલ્લાહો યા બાસેતો
યા અલ્લાહો યા મોહુંચી યા અલ્લાહો યા
મોમીતો યા અલ્લાહો યા બાર્ઝેસો યા
અલ્લાહો યા વારેસો યા અલ્લાહો યા મોઅુંતી
યા અલ્લાહો યા મુફુંઝેલો યા અલ્લાહો યા

મુન્ઝેમો યા અલ્લાહો યા હુંકુંકો યા અલ્લાહો
યા મોબીનો યા અલ્લાહો યા તંયેબો યા
અલ્લાહો યા મોહુંસેનો યા અલ્લાહો યા
મુજમેલો યા અલ્લાહો યા મુબ્દેઓ યા
અલ્લાહો યા મોઈંદો યા અલ્લાહો યા બારેઓ
યા અલ્લાહો યા બદીઓ યા અલ્લાહો યા
હાદી યા અલ્લાહો યા કાફી યા અલ્લાહો
યા શાફી યા અલ્લાહો યા અંલિયો યા
અલ્લાહો યા અંઝીમો યા અલ્લાહો યા
હુંન્નાનો યા અલ્લાહો યા મન્નાનો યા
અલ્લાહો યા ઝંતંવેલે યા અલ્લાહો યા

મોતઝાલી યા અલ્લાહો યા અંદલો યા
અલ્લાહો યા ઝંભઝાંરેજે યા અલ્લાહો યા
સાંદેકાં યા અલ્લાહો યા સંદૂકાં યા અલ્લાહો
યા દયાનો યા અલ્લાહો યા બાકીં યા
અલ્લાહો યા વાકીં યા અલ્લાહો યા ઝંજલાલે
યા અલ્લાહો યા ઝંલે ઈકરમો યા અલ્લાહો
યા મહૂંમૂદો યા અલ્લાહો યા મઝૂંબૂદો યા
અલ્લાહો યા સાંનેઝાં યા અલ્લાહો યા મોઈનો
યા અલ્લાહો યા મોકવ્વેનો યા અલ્લાહો
યા ફઝાંલો યા અલ્લાહો યા લતીફો યા
અલ્લાહો યા ગંફૂરો યા અલ્લાહો યા શકૂરો

યા અલ્લાહો યા નૂરો યા અલ્લાહો યા
કુંદીરો યા અલ્લાહો યા રબ્બાહો યા અલ્લાહો
યા રબ્બાહો યા અલ્લાહો યા રબ્બાહો યા
અલ્લાહો યા રબ્બાહો યા અલ્લાહો યા
રબ્બાહો યા અલ્લાહો યા રબ્બાહો યા
અલ્લાહો યા રબ્બાહો યા અલ્લાહો યા
રબ્બાહો યા અલ્લાહો યા રબ્બાહો યા
અલ્લાહો યા રબ્બાહો યા અલ્લાહો,
અસ્અલોક અને તોસંલેય અંલા મોહુંમદિવં
વ આલે મોહુંમદે વ તમુન્ન અંલય્ય બેરેઝાંક
વ તઅંફો વ અંન્ની બેહિંલમેક વ તોવસ્સેઅં

અંલય્ય મિરે રિઝકેકલે હુંલાલિત્તંયેબે વ
 મિનં હુંયેસો અહંતસેબો વ મિનં હુંયેસો
 લા અહંતસેબો ફઈન્ની અંબદોક લયેસ લી
 અહંદુનં સેવાક વલા અહંદુનં અસ્અલોહુ
 ગંયેરોક યા અરહુંમરે રાહુંમીન
 માશાઅલ્લાહો લા કુંવત ઇલ્લા બિલ્લાહિલ
 અંલિયિલ અંઝીમ.

પછી સજદામાં જઈ આ નીચેની દુઆ પઢે:

યા અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો
 યા રબ્બે યા રબ્બે યા રબ્બે યા મુનંઝેલલે
 બરકાતે બેક તુનંઝલો કુલ્લો હાંજતિનં

અસ્સલોક બે કુલ્લિસમિનં ફી મખ્મૂનિલ
 ગૌંબે ઈન્દક વલ અસ્માઈલ મશહૂરાતે
 ઈન્દકલ મકતૂબતે અંલા સોરાદેકે અંશોક
 અન્તો સંલ્લેય અંલા મોહુંમ્મદિનં વ આલે
 મોહુંમ્મદિનં વ અનં તકુંબલ મિન્ની શહૂર
 રમઝાંન વ તકતોબની મેનલ વાફેદીન
 એલા બયતેકલ હુંરામે તસુંફહુંલી અંનિઝ
 ઝાંનૂબિલ એઝાંમે વતસે તખ્રેજલી યા
 રબ્બે કોનૂઝક યા રહુંમાન.

તાકીદ ભરેલી (ભારતપૂર્વકની) સુન્નત છે કે ઈદની
 રાત્રે મગરિબની નમાઝ પછી અને ઈશાની નમાઝ પછી
 અને ઈદની સવાર અને ઈદની નમાઝ વખતે આ લખેલી

તકબીરો પડે.

અલ્લાહો અકબર અલ્લાહો અકબર
લા એલાહ ઇલ્લાહો વલ્લાહો અકબર
અલ્લાહો અકબર, વ લિલ્લાહિલ્લે હુંમ્દ,
અલ્લાહો અકબર અંલામા હદાના.

મુસ્તહબ છે કે ઈદુલના અઝહાના પ્રસંગે તે
દિવસની નમાઝે ઝોહરથી લઈને ઝિલહજની તેરમી
તારીખે નમાઝે સુબ્હ સુધી દસ નમાઝો બાદ ઉપરોક્ત
તકબીરો સાથે નીચે મુજબ વધારે પટે.

અલ્લાહો અકબર, અંલા મા રઝકંના
મિમ્ બહીમતિલ્ અનઅંમ, વલ્લે હુંમ્દો
લિલ્લાહે અંલા મા અબ્લાના.

ઇદની નમાઝનું બયાન

માહે રમઝાનની અને કુરબાનીની ઇદની નમાઝ (ઈદુલ ફિત્ર અને ઇદુઝ ઝોહાની નમાઝ) જ્યાં સુધી ઇમામે ઝમાના (અ.સ.) ઝુહૂર ન ફરમાવે, ત્યાં સુધી સુન્નત છે અને જમાઅતથી પઢવી અફઝલ છે, જો કે એકલો પણ પઢી શકે છે. ઇદની નમાઝ ખુલ્લા વિના પણ જાએઝ છે. બંને ઇદોની નમાઝનો સમય સૂર્ય ઉદયથી બે પહોર સુધી છે. બંને નમાઝની રીત ટૂંકમાં આ મુજબ છે:

સૌપ્રથમ નિચ્યત કરે કે “હું ઇદની બે રકઅત નમાઝ પઢું છું કુરબતન એલલાહ” તે પછી “અલ્લાહો અકબર” કહીને સૂરએ અલ્હમ્દ પઢે અને તે પછી એક વખત બીજો કોઇપણ સૂરો પઢે. “સબ્બે હિસ્મ”નો સૂરો પઢે તો સારું. તે પછી પાંચ વખત કુનૂત પઢે. દરેક કુનૂતની પહેલા તકબીર પણ કહે. પાંચ કુનૂત પછી “અલ્લાહો અકબર” કહીને રૂકુઅમાં જાય અને રૂકુઅ પછી સીધો ઉભો રહે અને “સમેઅલ્લાહો લેમન હમેદાહ”

કહે અને બંને સજદા બજાવી લાવે, તે પછી બીજી રકઅત માટે ઉભો રહે અને અલ્હમ્દ પછી બીજો કોઈપણ સૂરો પઢે. “વશશમ્સ”નો સૂરો પઢે તો સાઈ, તે પછી પહેલાની જેમ ચાર વખત દુઆએ કુનૂત પઢે, પછી રૂકુઅ અને સજદા પછી નમાઝ પુરી કરે. કુનૂતમાં કોઈપણ દુઆ પઢે, અગર સલવાત પઢે તો પણ કાફી છે. પરંતુ બંને ઈદની નમાઝમાં કુનૂત ખાસ વારિદ થયું છે અને તે આ છે.

અલ્લાહુમ્મ અહ્લેલ્લે કિબરિયાએ
 વલે અંઝંમહ્, વ અહ્લેલ્લે જૂદે વલે
 જબરૂતે, વ અહ્લેલ્લે અંફેવે વરૂંમતે
 વ અહ્લેલ્લે તકૃવા વલે મગૃફેરહ્,
 અસ્અલોક બેહ્કૃકૃ હાઝંલે યવમિલે
 લઝી જઅંલ્તાહૂ લિલેમુસ્લેમીન ઈંદા,

વલો મોહુંમમદિનું સંલલલલાહો અંલયહે
 વ આલોહી ઝુંખેરંવ વ કરામતંવ વ
 શરફંવ વ મઝીદા, અન્તો સંલલેય અંલા
 મોહુંમમદિંવ વ આલો મોહુંમમદ', વ
 અનં તુદ'ખેલની ફી કુલ્લો ખંયેરિનં
 અદ'ખેલ્તા ફીહે મોહુંમમદંવ વ આલ
 મોહુંમમદ', વ અનં તુખેરેજની મિનં
 કુલ્લો સૂંઈનં અખેરજ'તા મિનહો
 મોહુંમમદંવ વ આલ મોહુંમમદ',
 સંલલાતોક અંલયહે વ અંલયહેમિ,
 અલ્લાહુમ્મ ઈન્ની અસંઅલોક ખંયેર

મા સઅલક બેહી ઐબાદોકસૈં સૌલેહૂંન,
 વ અઉંઝોબેક મિમ્મસ્તઅોઝં મિન્હો
 ઐબાદોકલે મુખેલેસૂંન.

નોંધ: ઇદની નમાઝ વિષે જેની તકલીદ કરતા હો,
 તેના મસઅલા મુજબ અમલ કરવો જોઈએ.

૧લી રકઅતમાં અલ્હમ્દના સૂરા પછી આ સૂરો પઢે:

બિસ્મીલ્લાહિરે રહૂંમાનિરે રહૂંમ

સબ્બેહિંસમ રબ્બોકલે અઅંલા ં
 અલ્લાઝી ખંલકું ફસવ્વા ં વલ્લાઝી કુંદર
 ફહદા ં વલ્લાઝી અખરેજલે મરઓ ં
 ફજઅંલહૂ ગૌસાઅને અહૂવા ં સનુકરેઓક
 ફલા તન્સા ં ઇલ્લા માશાઅલ્લાહો, ઇન્નહૂ

યઅંલમુલે જહરે વમા યષ્ટિા ં વ
 નોયસ્સેરોક લિલ્યુસ્સા ં ફમંકકિરે ઇને
 નફઅંતિમં મિંકરે ં સંયમ્કરો
 મંયેયષ્ટિા ં વ યતજન્નબોહલે અશકે ં
 અલ્લમી યસેલન્નારલે કુબરા ં સુંમમ લા
 યમૂતો ફીહા વલા યહ્યા ં કંદે અફેલહું
 મને તઝકા ં વમંકરસ્મ રબ્બેહી ફસૈલા
 ં બલે તુઅસૈરુનલે હ્યાતદદુન્યા ં વલે
 આખેરતો ખંયેરુવ્વઅબકો ં ઇન્ન હામં
 લફિસૈહૌફિલેઉલા ં સૌહૌફે ઇબ્રાહીમ
 વ મૂસા ં

(સૂરએ અઅલા: ૧ થી ૧૯)

બીજી રકઅતમાં અલ્લ્હના સુરા પછી આ સૂરો પઢે:

બિસ્મિલ્લાહિરે રહીમાનિરે રહીમ

વશશમ્સે વ ઝાહીહા ં વલે કુંમરે એઝાં

તલાહા ં વન્નહારે એઝાં જલ્લાહા ં

વલ્લયલે એઝાં યગૌશાહા ં વસ્સમાએ વમા

બનાહા ં વલ અરેઝે વમા તેહીહા ં

વનફેસિવે વમા સવ્વાહા ં ફઅલેહમહા

ફેજૂરહા વ તકૌવાહા ં કુંદે અફેલહું મને

ઝકાહા ં વ કુંદે ખાંબ મને દસ્સાહા ં

કઝબતે સંમૂદો બે તેગૌવાહા ં એઝિંમબઅંસં

અશકાહા ં ફકાલ લહુમ રસૂલુલ્લાહ

નાકેતલાહે વ સુકૈયાહાં ફકમંમંબૂહો
 ફઅંકેરૂહા ફદમદમ અંલયોહિમં રબ્બોહુમ
 બેમંબેહિમં ફસવાહાં વલા યખાંફો
 ઉંકેબાહાં

(સૂરએ શમ્સ, ૧ થી ૧૫)

સુન્નત છે કે ઇદને દિવસે ઇદની નમાઝ પહેલા
 સવારમાં ઇફતાર કરે અને તેમાં પણ સુન્નત છે કે ખજૂરથી
 ઇફતાર કરે. ઇદને દિવસે ગુસ્લ કરવું તાકીદ ભરેલી
 સુન્નત છે અને કેટલાક આલિમો વાજિબ કહે છે.

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે
 છે:

છાપરાની નીચે ગુસ્લ કરવું, ખુલ્લા આસમાનની નીચે
 ન કરવું અને ગુસ્લ પહેલાં આ દુઆ પઢવી:

અલ્લાહુમ્મ ઇમાનમં બેક વ તસદીકમં

બેકેતાબેક વતેતેબાઅં સુન્નત નબિય્યેક
મોહંમદિને સંલ્લલ્લાહો અંલયહે વ આલેહી

પછી “બિસ્મિલ્લાહ” કહીને ઇદનું ગુસ્લ કરવું અને
આ દુઆ પઢવી:

અલ્લાહુમ્મજેઅંલ્હો કફૌરતલે લેઝાનૂબી
વ તંહુહિરે દીની, અલ્લાહુમ્મ અઝ્હિબ
અંનિદે દનસ.

ઇદના દિવસે ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત
પઢવી તાકીદ ભરેલી (ભારપૂર્વકની) સુન્નત છે અને
તેનો ઇશો સવાબ ખતાવવામાં આવેલ છે.

ફિજ્રાનું વર્ણન

અલ્લાહ સુખ્હાનહુ વ તઆલા પોતાની કિતાબ
કુરઆને કરીમમાં ફરમાવે છે:

કદ અફલહ મન તઝકકા ૦ વ ઝકરરમ રબ્બેહીફસલ્લા૦

“ખરેખર જેણે ઝકાત આપી અને પોતાના ખુદાને
યાદ કર્યો, તે નજાત પામ્યો.”

(સૂરએ આમલા, આયત : ૧૪,૧૫)

(ઉપરોક્ત આયતમાં) ઝકાતથી મુરાદ ફિત્રો છે
અને યાદ કરવાથી મુરાદ ઇદની રાત્રે અને સવારે
પઢવામાં આવતી તકબીરો છે.

ફિત્રા વિષે અલ્લામા મજલિસી (અ.મ.) લખે છે કે
ફિત્રો આપવો વાજિબ છે, અને તેની શરતો પુરી હોવા
છતાં ન આપે, તો ગુનાહે કબીરા છે, અને ફિત્રો આપવો
તે રોઝા કબૂલ થવાનું કારણ છે. જેમકે,

હઝરત ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે
છે:

ફિત્રો આપવાથી રોઝા કામિલ (સંપૂર્ણ) થાય છે, જે
રીતે મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ ઉપર
સલવાત પઢવાથી નમાઝ કામિલ થાય છે.

આમ, જે કોઈ રોજા રાખે અને ફિત્રો જાણી જોઈ ન આપે, તેના રોજા કબૂલ થતા નથી, જેવી રીતે નમાઝમાં તશહહુદની અંદર મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ ઉપર સલવાત ન પઢે, તો નમાઝ કબૂલ નથી. ઉપરાંત ખુદાએ નમાઝની પહેલા ઝકાત વિષે ફરમાવેલ છે. જેમકે ઉપરની આયતમાં બયાન થયું છે.

ઝકાત આપવાથી માલ પાક થાય છે અને સુરક્ષિત રહે છે તેમજ ફિત્રો આપવો તે પોતાના અંગની ઝકાત છે અને બખીલી (કંજૂસી) વગેરેથી તેને પાક કરે છે અને બીજા વર્ષ સુધી તેને બલાઓથી હિફાઝતમાં રાખે છે. જેમકે,

ઇમામે જઅફરે સાદિક (અ.સ.) પોતાના ખર્ચનો હિસાબ રાખનારને ફરમાવતા હતાં કે ઘરની તમામ વ્યક્તિ તથા ગુલામ, કનીઝોનો ફિત્રો આપ અને કોઈનો પણ ફિત્રો આપવો બાકી રાખીશ નહીં, કારણકે હું ડરું છું કે જે કોઈનો પણ ફિત્રો આપવો બાકી રાખીશ, તો તે આ વર્ષની અંદર મરી જશે.

ફિત્રો આપવો શક્તિશાળી ઉપર વાજિબ છે. ફિત્રાના

મસાએલ ઘણા છે. ટૂંકમાં વિગતો નીચે મુજબ છે:

ફિત્રામાં જે ચીજ ખાવામાં મોટે ભાગે વાપરવાની હોય જેમકે ઘઉં, જવ, ચોખા, ખજૂર વગેરે આપે.

ફિત્રાનું વજન એક શખ્સ માટે એક “સાઅ” થાય છે.

નાખાલિગનો પણ ફિત્રો આપવો વાજિબ છે, એટલે સુધી કે બચ્ચું માહે રમઝાનના છેલ્લા દિવસના સૂર્ય અસ્ત થવાની પહેલા જન્મ પામ્યું હોય, તેનો પણ ફિત્રો આપવો વાજિબ છે.

ઘર ઘણીએ પોતાના ઘરના સભ્યો તથા ગુલામ-કનીઝો જેનું ભરણ પોષણ કરતો હોય તેનો ફિત્રો આપવો જોઈએ અને તે તેના ઉપર વાજિબ છે.

જે મહેમાન ઇદની રાત પહેલાં આવ્યો હોય, એટલે સૂર્ય અસ્ત થવાની પહેલા આવ્યો હોય અને તેને ત્યાં ખાધું હોય, તેનો ફિત્રો ઘરઘણી ઉપર વાજિબ છે.

જે મહેમાન ઇદની રાત્રે આવે અને ખાણું ખાય અથવા ન ખાય, તેનો ફિત્રો ઘરઘણી ઉપર નથી.

જે મહેમાન ઇદની રાત પહેલાં એટલે સૂર્ય અસ્ત થવા પહેલાં આવે અને ખાણું ન ખાય, તો પણ જાહેર એ છે કે ઘરઘણી ઉપર ફિત્રો લાજિમ થશે અને અહવત (સાવચેતી) એ છે કે ખંને ફિત્રો આપે.

અગર મહેમાન કાફીર અથવા મુશરિક હોય, તો તેઓનો ફિત્રો પણ ઘરઘણી ઉપર વાજિબ છે.

ફિત્રાની ચીજને ખદલે કિંમત આપવી જાએઝ છે.

કોઇ શખ્સ માહે રમઝાનની છેલ્લી તારીખે પોતાને ત્યાં મજલિસ કરે અને તે મજલિસ મગરિબ બાદ ખતમ થાય અને અઝાદારોને તબરૂક, મીઠાઇ અને મેવો વગેરે વહેંચે અથવા ત્યાંજ બેસાડીને ખવરાવે, તો ઘરઘણી ઉપર તે સર્વે જણનો ફિત્રો વાજિબ નથી.

જે મોઅમીન ઇસ્નાઅશરી અને મુસ્તહક (હકદાર) હોય, તેને જ ફિત્રો આપવો. ‘મુસ્તહક’થી મતલબ એ છે કે જેની પાસે એક વર્ષ સુધીનો ખર્ચ ન હોય અથવા કોઇ એવી આવક-ધંધો વગેરે ન હોય કે જે તેના ગુજરાન માટે પૂરતુ (કાફી) હોય, તો તેવા શખ્સને ‘મુસ્તહક’ કહે છે.

ગરીબ, મોહતાજ ઉપર ફિત્રો વાજિબ નથી.

ફિત્રો આપવાનો સમય ઇદની રાતથી ઇદના દિવસે ઝોહર સુધી છે.

અગર મુસ્તહક ન મળે, તો જ્યાં મુસ્તહક હોય, ત્યાં મોકલે.

શિયા ઇસ્નાઅશરી સિવાય બીજાને ફિત્રો આપવો જાએઝ નથી.

ફિત્રાના કેટલાક મસાએલ નીચે મુજબ છે:

૧. જેને ફિત્રો આપો, તે લેનાર આદિલ હોવાની શરત નથી, પણ એવા ફાસિકને ન આપે કે જેથી તેને ગુનાહના કામમાં મદદ (પ્રોત્સાહન) મળે, જેમકે શરાબ પીએ - જુગાર રમે વગેરે.
૨. જે ગામમાં રહેતો હોય, ત્યાં મુસ્તહક હોય, તો ત્યાં જ ફિત્રો આપી દેવો અફઝલ અને એહવત (સલાહભર્યું) છે. અગરચે (તેમ છતાં) બીજે મોકલવો જાએઝ છે.
૩. કોઈ ગામમાં મુસ્તહક ન હોવાના કારણે અથવા

બીજા કોઈ કારણે ઇદની રાતથી ઇદની નમાઝ સુધી મુસ્તહકને ફિત્રો પહોંચાડી ન શકે, તો ફિત્રાને મજકૂર ટાઇમમાં એટલે કે ઇદની રાતથી ઇદની નમાઝ સુધીમાં ફિત્રો પોતાના માલથી જુદો કાઢી રાખે અને જ્યારે મુસ્તહક મળે, ત્યારે તેને આપે, અથવા મુજતહિદને મોકલી આપે, જે હકદારને પહોંચાડે.

ફિત્રો આપવા વિષે “ઝાદુલ મઆદ” કિતાબમાં વર્ણન છે કે જાહેરમાં ગુનાહો કરતો હોય એવાને ફિત્રો ન આપે, બલ્કે પરહેઝગારને આપે. હકદાર સગાને આપવો, મોહતાજ પાડોશીને આપવો, તે પછી પરહેઝગાર અને નેક હોય તેને આપવો, અને સૈયદનો ફિત્રો સૈયદ તેમજ ઉમ્મતી લઇ શકે છે, પણ ઉમ્મતીનો ફિત્રો સૈયદ લઇ શકતો નથી.

ઝીલ્કાદ મહિનાના આ'માલ

આ મહિનાની ૬-છી અને ૧૦-મી અને બીજી રિવાયત મુજબ ૨૮-મી તારીખ 'નહસે અકબર' છે.

૧-લી તારીખે ખુદાએ હઝરત મૂસા (અ.સ.)ને ત્રીસ રાતનો વાયદો આપ્યો હતો.

૫-મી તારીખે ઇબ્રાહીમ (અ.સ.) અને ઇસ્માઇલ (અ.સ.)એ ખાનએ કાઅબા બનાવવાની શરૂઆત કરી.

૧૧-મી તારીખે ઇમામે અલી રઝા (અ.સ.)ની વિલાદત છે.

૨૫-મી તારીખે 'દહવુલ અર્ઝ' છે. ખુદાએ તે દિવસે જમીન ફેલાવી છે.

૨૬-મી રાત્રે હઝરત ઇબ્રાહીમ (અ.સ.) અને હઝરત ઇસા (અ.સ.)ની વિલાદત છે.

આ મહિનાની છેલ્લી તારીખે ઇમામે મોહમ્મદ તકી (અ.સ.)ની શહાદત છે.

ખુદાએ જે ચાર મહિના હરામ ફરમાવ્યા છે તે આ મુજબ છે:

૧. ઝિલ્કાદ, ૨. ઝિલ્હજ, ૩. મોહર્રમ,

આ મહિનાઓમાં કાફરો સાથે લડાઈ શરૂ કરવાની મનાઈ છે.

એ હરામ મહિનાની જુમેરાત, જુમ્મા અને શનિવાર મળી ત્રણ ત્રણ રોઝા રાખે, તો તેને નવસો વરસની ઇબાદતનો સવાબ મળે છે. આ મહિનાની પંદરમી રાત્રે અલ્લાહ મોઅમીન બંદાઓ તરફ નજર કરે છે. એ રાત્રે ઇબાદત કરે, તો એકસો આબિદનો સવાબ મળે કે જેણે આંખના એક પલકારા જેટલો સમય પણ ખુદાની નાફરમાની કરી ન હોય. અરધી રાત થાય, ત્યારે ઇબાદત શરૂ કરે, નમાઝ પઢે, હાજત માંગે. ઇન્શાઅલ્લાહ પુરી થશે.

પચીસમી તારીખે “દહવુલ અર્ઝ” છે. જમીનને કાચબાની નીચેથી ફેલાવી છે. આજના દિવસે બારમા ઇમામ મુહૂર ફરમાવશે.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

ખુદાએ માહે ઝિલકાદની ૨૫-મી તારીખે પોતાની

રહેમત બંદાઓ ઉપર નાઝિલ ફરમાવી છે.

હઝરત અલી (અ.સ.) ફરમાવે છે:

આસમાન ઉપરથી જે દિવસે રહેમત સૌપ્રથમ નાઝિલ થયું, તે આજ દિવસ હતો.

હઝરત આદમ (અ.સ.)ને કાઅબાની તઅઝીમનો આ જ દિવસે હુકમ થયો છે. આ જ દિવસે કાઅબાની શરૂઆત થઈ છે. આજે હઝરત આદમ (અ.સ.) જમીન પર આવ્યા છે. સુન્નત રોઝો રાખે તો ૬૦ મહિનાના રોઝાનો સવાબ મળે અને આસમાન તથા જમીનની વચ્ચેની તમામ ચીજો તેના માટે ઇસ્તિઝ્કાર કરે.

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે:

જે કોઈ આ મહિનાની પરચીસમી રાત્રે ઇબાદત કરે અને દિવસે રોઝો રાખે, તો તેના માટે એવા સો વરસની ઇબાદત લખાય કે (જેમાં) રાતના ઇબાદત કરી હોય અને દિવસે રોઝા રાખ્યા હોય. જેઓ ઇબાદત કરવા માટે ભેગા થાય, તેઓ વિખેરાઈ જાય તે પહેલાં તેઓની હાજતો પુરી થાય. દસ લાખ રહેમત નાઝિલ થાય છે.

તેમાંથી નવ્વાણું ટકા રહેમત એ લોકો માટે છે કે જેઓ ભેગા થઈને ખુદાનો ઝિક્ક કરે અને રોઝો રાખે છે અને તે રાત્રે ઇબાદત કરે છે. આ દિવસે નાસ્તાના સમયે બે રકઅત નમાઝ પઢવી સુન્નત છે. દરેક રકઅતમાં અલ્હમ્દના સૂરા પછી પાંચ વખત વશ્શમ્સનો સૂરો પઢે અને સલામ પછી આ નીચેની દુઆ પઢે:

લા હું વેલ વલા કું વ્વત ઇલ્લા
 બિલ્લાહિલ અંલિયિલ અંઝીમ, યા
 મોકીલલ અંસંરાતે અકિંલ્ની અંસંરતી
 યા મોજબદ દઅંવાતે અજિબ દઅંવતી
 યા સામેઅંલ અસંવાતે ઇસ્મઅં સંવતી
 વરહુંમ્ની વ તજાવઝ અંન સય્યેઆતી વમા
 ઈન્દી યા ઝંલજલાલે વલ્હકરામે.

જનાબ શેખ તૂસી અ.મ.એ લખ્યું છે કે ઝીલ્કાદની
૨૬-મી તારીખે આ નીચેની દોઆ પઢે:

અલ્લાહુમ્મ દાહ્યેલે કઅંબતે વ ફાલેકુંલે
હુંબતે વ સૌરેફલે લઅંબતે વ કાશેફ કુલ્લે
કુરબતિને અસ્અલોક ફી હાઝંલે યવમે મિને
અયામોકલ્લતી અઅંઝંમ્ત હુંકુંકુંહા વ
અકુંદમ્ત સબકુંહા વ જઅંલ્તાહા ઈન્દલે
મોઅંમેનીન વ દીઅંતને વ એલયક
ઝંરીઅંતને વ બેરહુંમતેકલે વસીઅંતે
અનેતોસંલ્લેય અંલા મોહુંમ્મદિને અંબ્દેકુંલે
મુનેતજબે ફિલે મીસાકિંલે કુંરીબે યવ્મત્તલાકું
ફાતેકું કુલ્લે રતકિંને વ દાઈને એલા કુલ્લે

હુંકીકેને વ અંલા અહલેબયેતેહિલે અંત્હારિલે
 હોદાતિલે મનારે દઝાંએમિલે જબ્બારે વ
 વોલાતીલે જન્નતે વન્નારે વ અઅંતેના ફી
 યવમેના હાઝાં મિને અંતોએકલે મખેઝૂને
 ગંયેર મકેતૂંઈને વલા મમ્નૂઈને તજમઓ
 લના બેહિતતવેબત વ હુંસ્નલે અવેબતે યા
 ખંયેર મદેઉવેવિંવે વ અકેરમ મરજુવેવિંયે
 યા કફિયો યા વફિયો યા મલે લુત્ફેહૂ
 ખંફિયુને ઉલ્તુંફે લી બેલુત્ફેક વ અસ્ઈદેની
 બેઅંફેવેક વ અયેયિદેની બેનસંરેક વલા
 તુન્સેની કરીમ ઝિંકેરેક બેવોલાતે અમ્રેક

વ હુંફઝંતે સિરેક વહુંફઝંની મિન શવાયેબિદ
 દહરે એલા યવમિલે હુંશરે વન્નશરે વ
 અશોહિદની અવલેયાએક ઈન્દ ખોરુજે નફસી
 વ હોલૂલે રમ્સી વનેકેતોએ અંમલી વનેકેઝાએ
 અજલી, અલ્લાહુમ્મ વઝંકુરની અંલા
 તૂંલિલ્બોલા એઝા હુંલલ્તાો બયન
 અત્બાકિસ્સંરા વ નસેયનિન્નાસૂન મેનલે
 વરા વ અહુંલિલ્ની દારલે મોકાંમતે વ
 બવેવેઅની મનેઝેલલે કરામતે વજઅંલ્ની
 મિમં મોરાફેકાં અવલેયાએક
 વઅહુંલિજતેબાએક વસ્તેફાએક વ બારિકે

લી ફી લેકાંએક વરેઝુકેની હુંસ્નલે અંમલે
 કુંબલ હાંલૂલિલે અજલે બરીઅમ મેનઝઝલલે
 વ સૂઠલે ખંતંલે, અલ્લાહુમ્મ વઅવરિદેની
 હુંવેઝં નબિય્યેક મોહુંમ્મદિને સંલ્લલ્લાહો
 અંલયેહે વ આલેહી વસેકેની મિન્હો મશરબને
 રવિય્યને સાએગંને હનીઅને લા અઝંમઓ
 બઅંદહૂ વલા ઓહુંલ્લઓ વિરેદહૂ વલા
 અંન્હો ઔઝાંદો વજઅંલ્હો લી ખંયેર ઝાદિંવે
 વઅવેફા મીઆંદિંયે યવેમ યકૂંમુલે અશહાદો
 અલ્લાહુમ્મ વલ્અંને જબાબેરતલે અવ્લીન
 વલે આખેરીન વબેહાંકૂંકે અલ્લેયાએકલે

મુસ્તઅસૌરીન અલ્લાહુમ્મ વકૃસિંમૈ
 દઝાએમહુમૈ વ અહલિકે અશ્યાઅહુમૈ વ
 આંમેલહુમૈ વ અંજજિલે મહાલેકહુમૈ
 વસ્લુબહુમૈ મમાલેકહુમૈ વ ઝંયૈયિકૈ અંલયહિમૈ
 મસાલેકહુમૈ વલઅંનૈ મોસાહેમહુમૈ વ
 મોશારેકહુમૈ અલ્લાહુમ્મ વ અંજજિલે ફરજ
 અવલોયાએક વરદુદ અંલયહિમૈ
 મઝાલેમહુમૈ વ અઝહિર બિલહુકકૈ
 કાએમહુમૈ વજઅંલહો લેદીનેક મુન્તસૈરવૈ
 વ બેઅમ્રેક ફી અઅંદાએક મોઅતમેરનૈ
 અલ્લાહુમ્મહુફુહુહો બે મલાએકતિન્નસૈરૈ
 વ બેમા અલકંયૈત એલયહે મેનલ અમ્ને

ફી લયલતિલે કુંદરે મુન્તકેમલે લક હુંતા
 તરેઝાં વ યઊદ દીનોક બેહી વ અંલા
 યદયહે જદીદને ગાંઝાંઝાંને, વ યમહુંઝાંલે
 હુંકુંકું મહુંઝાંવે વ યરેફેઝાંલે બાતેલ રફેઝાંને,
 અલ્લાહુમ્મ સંલ્લે અંલયહે વ અંલા જમીએ
 આબાએહી વ જ'અંલ્ના મિને સંહુંબેહી
 વ ઉસ્ર તેહી વબ'અંસના ફી કર'તેહી હુંતા
 નકૂન ફી ઝમાનેહી મિને અઅંવાનેહી
 અલ્લાહુમ્મ અદરિકે બેના કૈયામહૂ વ
 અશોહિદના અયામહૂ વ સંલ્લે અંલયહે
 વરેદુદ' એલયના સલામહૂ વસ્સલામો
 અંલયહે વ રહુંમતુલ્લાહે વ બરકાતોહું.

માહે ઝીલ્હજ

આ મહિનાની ૮-મી, ૨૦-મી અને બીજી રિવાયત મુજબ ૨૮-મી તારીખ “નહસે અકબર” છે.

આ મહિનાની પહેલી તારીખ મુબારક છે. આ દિવસે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ જનાબે ફાતેમા (સ.અ.)ની શાદી હઝરત અલી (અ.સ.) સાથે કરી આપી. આજ દિવસે હઝરત ઇબ્રાહીમ (અ.સ.)ની વિલાદત થઈ. અલ્લાહે આપને પોતાના ખલીલ બનાવ્યા.

૭-મી તારીખે ઇમામે મોહમ્મદે બાકિર (અ.સ.)ની શહાદત છે અને એજ તારીખે હઝરત મૂસા (અ.સ.)એ જાદુગરો ઉપર વિજય મેળવ્યો.

૮-મી તારીખ “તરવિયાહ”નો દિવસ છે.

૯-મી તારીખે “અરફા”નો દિવસ છે. ૯-મી તારીખે હઝરત મુસ્લિમ અ.ની કુફામાં શહાદત થઈ. ૯-મી તારીખે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ સહાબીઓના દરવાજા મસ્જિદમાં (ખુલતા) હતા,

તે બંધ કરાવ્યા, ફક્ત અલી (અ.સ.)નો દરવાજો ખુલ્લો રહેવા પામ્યો. ૯-મી તારીખે હઝરત ઇસા (અ.સ.)ની વિલાદત થઈ.

૧૦-મી તારીખે “ઈદુઝઝોહા” (બકરી ઇદ) છે.

૧૫-મી તારીખે ઇમામે અલી નક્કી (અ.સ.)ની વિલાદત છે.

૧૮-મી તારીખે ઇદે ગદીર છે. ૧૮-મી તારીખે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ સહાબીઓમાં બે-બે જણને એક બીજાના ભાઈ મુકર્રર (નક્કી) કર્યા, ત્યારે હઝરત અલી (અ.સ.)ને કોઈના ભાઈ મુકર્રર કર્યા નહીં. તેથી ગમગીન થઈ એનું કારણ પૂછ્યું, તો હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું કે:

“અન્ત અખી ફિદદુન્યા વલ આખેરહ”

“તું દીન અને દુન્યા બંને જગ્યાએ મારો ભાઈ છો.” ૧૮-મી તારીખે હઝરત ઇબ્રાહીમ (અ.સ.) નમરૂદની આગથી નજાત પામ્યા. હઝરત મૂસા

(અ.સ.)એ હઝરત યુશાઅને, હઝરત ઘસા
(અ.સ.)એ હઝરત શમઉનને, હઝરત
સુલયમાન (અ.સ.)એ હઝરત આસિફ બિન
બરખિયાને અને રસૂલે ખુદા (સ.અ.વ.)એ
હઝરત અલી (અ.સ.)ને ૧૮-મી ઝીલ્હજના
દિવસે ખુદાના હુકમથી પોતાના વસી નિયુક્ત
કર્યા. ૧૮-મી તારીખે શ્રીજા ખલીફા કત્લ થયા.

૧૯-મી તારીખે જનાબે ફાતેમા (સ.અ.) હઝરત અલી
(અ.સ.)ને ઘરે ગયા.

૨૪-મી ઝીલ્હજના દિવસે હઝરત રસૂલે ખુદા
(સ.અ.વ.)ને કુરૈશના કુફ્ફારોએ કત્લ કરવા
ચાહ્યું. તેથી આપે પોતાના બિસ્તર ઉપર હઝરત
અલી (અ.સ.)ને સુવરાવી પોતે ગારમાં છૂપાઈ
ગયા.

૨૪મી ઝીલ્હજના દિવસે હઝરત અલી (અ.સ.)એ
રુકુઅમાં સાઇલ (માંગનાર)ને વીંટી આપી અને
તેથી આપ (અ.સ.)ની શાનમાં “ઇન્નમા

વલીયોકોમુલ્લાહ” (આયએ વિલાયત) નાઝિલ થઈ અને એ ૪ દિવસે “ઈદે મુબાહેલા” છે. એટલે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ દીને ઈસ્લામ વિષે નસારા સાથે વાદવિવાદમાં એવું નક્કી કર્યું કે ખુદા પાસે દુઆ કરવી કે જૂઠા ઉપર અઝાબ નાઝિલ થાય વગેરે અને તેમાં નસારા હારી ગયા.

૨૫-મી તારીખે અહલેબૈત (અ.મુ.સ.)ની શાનમાં સૂરએ હલઅતા (સૂરે દહર) નાઝિલ થયેલ.

૨૬-મી તારીખે રસૂલે ખુદા (સ.અ.વ.) માટે બેહિશ્તથી પ્યાલો આવ્યો. ૨૬-મી તારીખે હ. ઉમર ખંજરથી ઝખ્મી થયો.

૨૭-મી તારીખે મરવાન મરી ગયો.

અલ્લાહના રસૂલ મોહમ્મદ (સ.અ.વ.) ફરમાવે છે:

માહે ઝીલ્હજના પહેલા દસ દિવસો દરમ્યાન ખયરાત અને ઇબાદત કરવી ખુદાને જેટલી પ્યારી છે, તેટલી બીજા દિવસોમાં પ્યારી નથી.

જ્યારે આ મહિનો આવતો ત્યારે સહાબીઓ તથા તાબેઇનો ઇબાદત કરવામાં વધારે કોશિશ કરતા હતા.

અલ્લાહ સુખ્હાનહુ વ તઆલા પોતાની કિતાબ કુરઆનમાં ફરમાવે છે:

“વઝકોરુલ્લાહ ફી અય્યામિમ મઅદુદાત”

“ખુદાને થોડા ગણતરીના દિવસોમાં યાદ કરો”

અને બીજી જગ્યાએ ફરમાવે છે:

“લોકોને ખબર આપો કે હજ કરવા માટે આવે કે તેથી દીન દુનિયાના ફાએદા મેળવે, અને ખુદાને થોડા ગણતરીના દિવસોમાં યાદ કરે, એટલા માટે કે ચોપગા હયવાનનું ગોશ્ત તમારા માટે રોઝી કરી.”

ઝીલ્હજની દસમી તારીખ સુધીના આ'માલ

ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

મારા માનનીય પિતા ઇમામે મોહમ્મદે બાકિર (અ.સ.)એ ફરમાવ્યું:

અય વહાલા પુત્ર! ઝીલ્લજ મહિનાની પહેલી રાતથી દસમી રાત સુધી મગરિબ અને ઇશાની નમાઝ વચ્ચે બે રકઅત નમાઝ પઢ અને દરેક રકઅતમાં સૂરે અલ્હમ્ અને સૂરએ કુલ્હોવલ્લાહ પછી આ આયત પઢ:

વ વાઅંદના મૂસા સંલાસીન લયલતંવ
 વ અતમમ્નાહા બેઅંશરિને ફતમ્મ મીકાંતો
 રબ્બેહી અરબઈન લયલતંવ વ કાંલ મૂસા
 લેઅબીહે હારૂનખંલુફની ફી કુંવેમી વ અસ્લેહું
 વલા તત્તબેઅં સબીલલે મુફ્સેદીન.

(સૂરએ અઅરાફ : ૧૪૨)

આ પ્રમાણે દસેય રાત નમાઝ પઢીશ, તો હાજુઓના સવાબમાં શરીફ (ભાગીદાર) થઈશ.

ઝીલ્લજ મહિનાની પહેલી તારીખે જનાબે ફાતેમા (સ.અ.)ની નમાઝ પઢવી સુન્નત છે. બે બે રકઅત કરીને

ચાર રકઅત નમાઝ પઢવી. દરેક રકઅતમાં અલ્હમ્દના સૂરા પછી પચાસ વખત કુલ્હોવલ્લાહનો સૂરો પઢવો. અને સલામ પછી આ દુઆ પઢવી.

સુબ્હાંન ઝિંલ્હાંઝે ઝિશ્શામેબિલે મોનીફ,
 સુબ્હાંન ઝિંલ્હાલિલે બાઝંબિલે અંઝીમ,
 સુબ્હાંન ઝીલેમુલ્કીલે ફાબેરીલે કંદીમ,
 સુબ્હાંન મનં યરા અસંરન્નમ્લતે ફિસંસંફા,
 સુબ્હાંન મનં યરા વકંઅંતંયેરે ફિલેહવાએ,
 સુબ્હાંન મનં હોવ હાકઝાં વલા હાકઝાં
 ગંયેરોહૂ.

રિવાયતમાં છે કે જે કોઈ ઝાલિમથી ડરતો હોય, તેણે ઝીલ્હજ મહિનાની પહેલી તારીખે આ મુજબ પઢવું:

હુંસ્બી હુંસ્બી હુંસ્બી મિનં સોઆલી
ઈલ્મોક બેહુંલી,

(તો તે ઝાલિમના ખોફથી રક્ષણમાં રહેશે.)

હઝરત ઇમામે મૂસા કાઝિમ (અ.સ.) ફરમાવે છે:

જે કોઈ આ મહિનાની પહેલી તારીખે રોઝો રાખે,
તેના માટે એંશી (૮૦) મહિનાના રોઝાનો સવાબ લખાય.
ઝીલ્હજ મહિનાની પહેલીથી નવમી તારીખ સુધી રોઝા
રાખે, તો આખી ઉમર રોઝા રાખવાનો સવાબ મળે છે.

ઇમામે મોહમ્મદે બાકિર (અ.સ.) ફરમાવે છે:

અલ્લાહ તઆલાએ જિબ્રઇલ સાથે હઝરત ઇસા
(અ.સ.) માટે હદિયા તરીકે નીચેની પાંચ દુઆ મોકલી
અને ફરમાવ્યું:

અય ઇસા (અ.સ.)! આ પાંચ દુઆ ઝીલ્હજ મહિનાના
પહેલા દસકામાં પઢો, અને આ દસ દિવસની ઇબાદત
જેવી કોઈ દિવસની ઇબાદત ખુદાને વધારે પ્યારી નથી.

પહેલી દુઆ :

અશુદ્ધો અલૈ લા એલાહ ઇલ્લલ્લાહો
વહ્દેહૂ લા શરીક લહૂ લહુલૈ મુલ્કો વ લહુલૈ
હુમ્દો બેયદેહિલૈ ખંયેરો વ હોવ અંલા કુલ્લે
શયેઈને કુંદીર.

બીજી દુઆ :

અશુદ્ધો અલૈ લા એલાહ ઇલ્લલ્લાહો
વહ્દેહૂ લા શરીક લહૂ અહ્દને સંમદને
લમે યત્તખિરૈ સૌહૈબતંવે વલા વલદા

ત્રીજી દુઆ :

અશુદ્ધો અલૈ લા એલાહ ઇલ્લલ્લાહો

વહુંદહૂ લા શરીક લહૂ અહુંદને સંમદલે
લમં યલિદે વ લમં યૂલદે વ લમં યકુલેલહૂ
કોફોવને અહુંદ.

ચોથી દુઆ :

અશહદો અલે લા એલાહ ઇલ્લલાહો
વહુંદહૂ લા શરીક લહૂ લહુલ મુલ્કો વલહુલે
હુંમદો યોહુંચી વ યોમીતો વ હોવ હુંચુલે
લા યમૂતો બેયદેહિલે ખંચેરો વ હોવ અંલા
કુલ્લે શયેઈને કુંદીર.

પાંચમી દુઆ :

હુંસબેયલાહો વ કફા સમેઅંલાહો લેમને

દાં લયસ વરોઅલાહે મુન્તહો અશહદો
 લિલાહે બેમા દાં વ અન્નહૂ બરોઉમ
 મિમ્મન તબરઅ વ અન્ન લિલાહિલ
 આર્ત વલ ઉલા.

હવારીયોએ અરજ કરી: યા રહુલાહ! જે કોઈ આ
 દુઆઓ પઢે, તેને કેટલો સવાબ મળશે?

ઈસા (અ.સ.)એ ફરમાવ્યું: પહેલી દુઆ એકસો
 (૧૦૦) વખત પઢે, તો જમીનવાળાઓના અમલમાંથી કોઈનો
 અમલ તેના કરતા બેહતર નહીં હોય અને કયામતના
 દિવસે બધાની નેકીઓ કરતાં તેની નેકીઓ વધારે હશે.

બીજી દુઆ સો (૧૦૦) વખત પઢે, તો એવું છે કે
 જાણે બાર વખત તવરેત અને ઇન્જીલ વાંચી.

ત્રીજી દુઆ સો (૧૦૦) વખત પઢે, તો તેના માટે ખુદા
 એક કરોડ નેકીઓ લખે, એક કરોડ ગુનાહો માફ કરે,

બેહિશ્તમાં એક કરોડ દરજ્જા બુલંદ ફરમાવે. અને આસમાનથી સિતેર હજાર ફરિશ્તા આવે અને તેઓએ પોતાના હાથ ઊંચા કર્યા હોય, તેઓ આ દુઆને ગણતરી પ્રમાણે પઢનાર ઉપર સલવાત પઢે.

હઝરત ઈસા (અ.સ.)એ જિબ્રિલને પૂછ્યું:

મલાએકા પયગમ્બરો (અ.મુ.સ.) સિવાય બીજાઓ ઉપર સલવાત પઢે છે?

જિબ્રિલે કહ્યું : જેઓ પયગમ્બરો ઉપર, ખુદા તરફથી આવેલી ચીજો ઉપર ઈમાન લાવ્યા છે અને તેઓની શરીરમાં ફેરફાર ન કરે, તો ખુદા તેઓને પયગમ્બરોનો સવાબ અતા ફરમાવે છે.

પછી હઝરત ઈસા (અ.સ.)એ ફરમાવ્યું:

ચોથી દુઆ એકસો વખત પઢે, તો તે દુઆની સાથે એક ફરિશ્તો જાય, અને તે દુઆ ખુદાની સમક્ષ લઈ જાય, તે બંદા ઉપર ખુદા રહેમતની નજર કરે અને ખુદા જેના ઉપર રહેમતની નજર કરે, તે કદી શકી અને બદ આકેબત નહીં થાય.

પછી પાંચમી દુઆનો સવાબ જિબ્રિલને પુછ્યો.
જિબ્રિલ (અ.સ.)એ કહ્યું: ખુદાએ તેનો સવાબ બયાન
કરવાની રજા આપી નથી.

સૈયદ બીન તાઉસ (અ.ર.) હઝરત અમીરૂલ
મોઅમેનીન (અ.સ.)થી વર્ણન કરે છે કે:

નીચે લખેલા તહલીલાત ઝીલ્હજ મહિનાની પહેલી
દસ તારીખ સુધી હંમેશા દસ-દસ વખત પઢ્યા કરે, તો
દરેક તહલીલને બદલે જન્નતમાં મોતી અને ચાકૂતનો
એક-એક દરવાજો અતા કરે. એક દરવાજાથી બીજા
દરવાજા સુધી બહુ જ ઝડપથી ચાલનાર ઘોડાના સો
વરસના પંથ જેટલું અંતર હશે. એ દરેક દરવાજામાં
એક શહેર હશે. નોકર-ચાકર, ઝાડ, નહેરો, લિબાસ
વગેરે વગેરે ચીજો હશે. મોતી, તપ્ત, કુરસીયો, બીછાના
ઉપર હૂરો તકીયા લગાડીને બેઠી હશે. નોકર-ચાકર
ઝાડ, નહેરો, પોશાક વગેરે વગેરે એવી ચીજો હશે કે
કોઈપણ તેની તારીફ કરી શકશે નહીં. જ્યારે એ શખ્સ
કબરમાંથી બહાર આવશે, ત્યારે દરેક વાળમાંથી નૂર

ચમકશે અને તેની સામે સિત્તેર હજાર ફરિશ્તા જઇ
 અને તેની આગળ-પાછળ અને આજુબાજુ ચાલશે.
 એટલે સુધી કે તેને બેહિશ્તના દરવાજા સુધી પહોંચાડી
 આપશે અને બેહિશ્તમાં દાખલ થતી વખતે તેને આગળ
 કરશે અને ફરિશ્તા પાછળ ચાલશે અને તે એવા શહેરમાં
 જશે કે તેની બહારનો ભાગ રાતા ચાકૂતનો અને
 અંદરનો ભાગ લીલા ઝબરઝબનો હશે. મલાએક કહેશે
 કે દુન્યામાં તું આ પઢતો હતો, ત્યારે અમો હાજર હતા.
 આ શહેર તથા આની અંદરની તમામ નેઅમતો તેના
 સવાબમાંનો એક સવાબ છે. આ ખુદાની નેઅમત અને
 રહેમત કદી નાશ પામવાની નથી.

તે તહલીલાત આ મુજબ છે:

لَا إِلَهَ إِلَّا اللَّهُ مُحَمَّدٌ رَسُوْلُهُ
 વદોહૂરે,

لَا إِلَهَ إِلَّا اللَّهُ مُحَمَّدٌ رَسُوْلُهُ مُحَمَّدٌ

અમવાજિલ બોહુંરે,

લા એલાહ ઇલ્લાહો વ રહીમતોહૂ
બંયરૂમ મિમ્મા યજીમઊન,

લા એલાહ ઇલ્લાહો અંદદશ શવકે
વશશજરે,

લા એલાહ ઇલ્લાહો અંદદશ શઅરે વલ
વબરે,

લા એલાહ ઇલ્લાહો અંદદલ હુંજરે
વલ્મદરે,

લા એલાહ ઇલ્લાહો અંદદ લમહિલ
ઓયુને (વલ બસંરે,)

લા એલાહ ઇલ્લાહો ફિલ્લયલે એઝાં
અંસ્અંસ વસ્સૌબ્હે એઝાં તનફ્ફસ,

લા એલાહ ઇલ્લાહો અંદદરે રેયાહ્
ફિલ્બરારી વસ્સૌબૂરે,

લા એલાહ ઇલ્લાહો મેનલે યવમે
એલા યવમે યુનેફખાં ફિસ્સૂર.

હઝરત ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ઝીલ્હજ
મહિનાની પહેલી તારીખથી નવમી તારીખ સુધી હંમેશા
સુપ્હની નમાઝ પછી અને સૂર્ય અસ્ત થતી વખતે સાંજની
પહેલા આ દુઆ પઢતા હતા :

અલ્લાહુમ્મ હાઝ્હિલે અયામુલ્લતી
ફઝ્ઝેલ્લાહા અંલલે અયામે વ શરફેતહા

વ કુંદે બલ્લગૌતનીહા બેમન્નેક વ રહુંમતેક
 ફઅનેઝિલે અંલયેના મિમં બરકાતેક, વ
 અવેસેઅં અંલયેના ફીહા મિનં નઅંમાએક,
 અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક અનં તોસંલ્લેય
 અંલા મોહુંમ્મદિંવે વ આલે મોહુંમ્મદે, વ
 અન તહુદેયના ફીહા લેસબીલિલ્હોદા વલે
 અંફાફે વલ્ગૌના વલે અંમલે ફીહા બેમા
 તોહિંબ્બો વ તરેઝાં, અલ્લાહુમ્મ ઇન્ની
 અસ્અલોક યા મઝ્ઝેઅં કુલ્લે શકેવા (વ યા
 સામેઅં કુલ્લે નજેવા વ યા શાહેદ કુલ્લે
 મલઈવે) વ યા આંલેમ કુલ્લે ખંફિયતિનં,

અને તોસંલ્લેય અંલા મોહુંમદિનં વ આલે
 મોહુંમદિનં વ અને તકશેફ અંન્ના ફીહલે
 બલોઅ, વ તસંતજિબ લના ફીહદદોઆંઅ
 વ તોકંવવેયના ફીહા વ તોઈનના વ
 તોવફફેકંના ફીહા લેમા તોહિંબ્બો રબ્બના
 વ તરેઝાં વ અંલા મફતરઝંત અંલયેના
 મિને તાંઅંતેક વ તાંઅંતે રસૂલેક વ અહલે
 વિલાયતેક, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક
 યા અરહુંમરે રાહુંમીન, અને તોસંલ્લેય
 અંલા મોહુંમદિનં વ આલે મોહુંમદિનં વ
 વ અને તહબ લના ફીહરે રેઝાં ઇન્નક

સમીઉંદે દોઆંએ વલા તહુંરિમ્ના ખંયેર
 મા તુનેઝેલો ફીહા મેનસમ્માએ વ તંહુંહિરેના
 મેનઝંઝોનૂબે, યા અંલ્લામલે ગોંયૂબે વ
 અવજિબ લના ફીહા દારલે ખોલૂદે.
 અલ્લાહુમ્મ સંલ્લે અંલા મોહુંમ્મદિંવે વ
 આલે મોહુંમ્મદિને વલા તતરૂકે લના ફીહા
 ઝંમેબને ઇલ્લા ગંફરેતહૂ વલા હમ્મને ઇલ્લા
 ફરેરજેતહૂ, વલા દર્યને ઇલ્લા કુંઝંયેતહૂ,
 વલા ગોંએબને ઇલ્લા અદ્યેતહૂ, વલા
 હોજતમે મિને હંવાએજિદુન્યા વલે આખેરેતે
 ઇલ્લા સહહલેતહા વયસ્સરેતહા, ઇન્નક
 અંલા કુલ્લે શયેઇને કુંદીર, અલ્લાહુમ્મ

યા આંલેમલે ખંકિય્યાતે, યા રાહુંમલે અંબરાતે
 યા મોજીબદઅંવાતે, યા રબ્બલે અરેઝીન
 વસ્સમાવાતે, યા મને લા તતશાબહૂ
 અંલયોહિલે અસ્વાતો, સંલ્લે અંલા મોહુંમ્મદિંવે
 વ આલે મોહુંમ્મદિંવે વજેઅંલ્ના ફીહા મિને
 આંતકાંએક (વ તાંલકાંએક) મેનન્નારે,
 વલે ફાએઝીન બેજન્નાતેક વન્નાજીન
 બેરહુંમતેક યા અરહુંમર રાહુંમીન, વ
 સંલ્લલ્લાહો અંલા સય્યેદેના મોહુંમ્મદિંવે
 વ આલેહી અજેમઈને (વ સલ્લમ તસ્લીમા.)

આ મહિનાની ૮-મી તારીખે “તરવિયહ”નો દિવસ
 છે. તે દિવસ ઘણો જ મુબારક છે.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું:

ખુદાએ તમામ દિવસોમાં ચાર દિવસોને બુઝુર્ગી આપે છે:

૧. જુમ્હા ૨. તરવિય્યહ, ૩. અરફા, ૪. ઇદે ફુરબાન.

ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

“તરવિય્યહના દિવસનો રોઝો ૬૦ વર્ષના ગુનાહનો કફ્ફારો છે.”

આ દિવસે ગુસ્લ કરવું સુન્નત છે.

આ મહિનાની ૯ મી તારીખે “અરફા” છે. “અરફા”ની રાત મુબારક રાત્રિઓમાંથી છે.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

“અરફા”ની રાત્રે જાગે અને ખુદાની ઇબાદતમાં પસાર કરે, તો એકસો સિતેર (૧૭૦) વર્ષની ઇબાદતનો સવાબ મળે. આ રાત ખુદાની બારગાહમાં મુનાજાત કરવાની રાત છે.

આ રાત્રે તોબા કબૂલ થાય છે. અરફાની રાત્રે એક મોટી દુઆ પઢવાની છે, પણ લાંબી હોવાથી લખી નથી. અરફાની રાત્રે તથા દિવસે હઝરત ઇમામે હુસૈન (અ.સ.)ની ઝિયારત કરવાની તથા પઢવાની ઘણી તાકીદ છે.

“અરફા”ના દિવસે હજ કરવા જાય, તેઓ માટે ઘણા આ’માલ છે. અરફાના દિવસે બેહતરમાં બેહતર આ’માલ દુઆ છે, તેથી દુઆ માંગ્યા કરે, એટલે સુધી કે મુસ્તહબ છે કે તે દિવસે ઝોહર અને અસરની નમાઝ સાથે પઢી લે અને ઝોહર પછી અસર માટે અઝાન ન કરે. અસરની નમાઝ પઢીને સાંજ સુધી દુઆમાં રહેવું તથા પોતાના જીવંત અને મરહૂમ બિરાદરે ઇમાની માટે દુઆ કરવી.

હદીસે સહીહમાં મનફૂલ છે કે ઇબ્રાહીમ બિન હાશમ કહે છે કે મેં અરફાને દિવસે અરફાતમાં અબ્દુલ્લાહ બિન જુન્દબ્ને જોયા. તેઓ કરતાં કોઇની ઇબાદતની હાલત સારી જોઇ નહીં. તેઓએ પોતાના બંને હાથ આસમાન તરફ ઊંચા કર્યા હતા અને આંખોમાંથી આંસુઓ નીકળી

ગાલ ઉપર થઇ જમીન ઉપર ટપકતા હતા. જ્યારે લોકો ફારેગ થયા, ત્યારે મેં કહ્યું કે મેં આપની દુઆની હાલત કરતાં બીજા કોઇની હાલત બેહતર જોઇ નહીં.

તેઓએ કહ્યું કે ખુદાની કસમ! મેં મારા માટે દુઆ કરી નથી, બલ્કે બિરાદરે મોઅમિન માટે દુઆ કરી છે, કારણકે મેં ઇમામે મૂસા કાઝિમ (અ.સ.)થી સાંભળ્યું છે કે:

જે શખ્સ પોતાના બિરાદરે મોઅમિન માટે તેની પાછળ દુઆ કરે. તો અર્શથી અવાજ આવે છે કે તે તારા બિરાદર માટે માંગ્યું તે કરતાં લાખ ગણું તારા માટે છે.

તો મેં ચાહ્યું નહીં કે મલાએકાની લાખ દુઆ, વળી તે એવી દુઆ કે કબૂલ થાય તે મૂકીને પોતાના માટે દુઆ કરું કે જેની કબૂલ થવાની ખાત્રી નથી.

અરફાને દિવસે ઇમામે હુસૈન (અ.સ.)ના રોઝાના કુબ્બા નીચે હોય તો જે શખ્સ અરફાતમાં હોય તેની કરતા તેનો સવાબ ઓછો નથી, બલ્કે વધારે છે. જેમકે,

ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

જે શપ્ત અરફાને દિવસે ઇમામે હુસૈન (અ.સ.)ની ઝિયારત માટે જાય અને હઝરતના હકને ઓળખતો હોય અને તેઓને એવા ઇમામ જાણતો હોય કે આપની તાબેદારી વાજિબ છે, તો હક તઆલા તેના માટે બે હજાર હજનો, મકબૂલ ઉમરાનો, હજાર જેહાદ કે જે પયગમ્બરે મુરસલ અથવા ઇમામે આદિલની સાથે જઈને કરેલ હોય, એટલો સવાબ લખાય.

રાવીએ અરજ કરી કે તો અરફાતમાં ઠહેરવાનો સવાબ શું છે? તે વખતે આપ (અ.સ.)એ ગુસ્સામાં તેની તરફ જોઈને ફરમાવ્યું કે બેશક, જે મોઅમિન બંદો અરફાને દિવસે હઝરત ઇમામે હુસૈન (અ.સ.)ની કબર ઉપર હાજર થાય અને ફુરાતની નહેરમાં ગુસ્લ કરે અને ઝિયારત પઢવા જાય, તો તેના એક-એક કદમ ઉપર એક-એક હજ અને ઉમરાહનો સવાબ લખવામાં આવે છે.

હક તઆલા પહેલા ઇમામે હુસૈન (અ.સ.)ના ઝવ્વારો તરફ રહેમતની નજરથી જુએ છે. તેઓના ગુનાહ માફ કરી તેઓની હાજતો પુરી કરે છે, ત્યાર પછી અરફાતના

લોકો તરફ ધ્યાન આપે છે, કારણકે અરફાને દિવસે ઇમામ હુસૈન (અ.સ.)ના ઝવ્વારોમાં કોઈ હરામઝાદો હતો નથી અને અરફાતમાં હરામઝાદો પણ હોઈ શકે છે.

જે શખ્સ અરફાને દિવસે અરફાતમાં ન હોય તેમજ ફરખલામાં પણ ન હોય, તો જ્યાં હોય ત્યાં ગુસ્લ કરે. મોઅમીન લોકોના મજમામાં જાય અને ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત પઢે. જો કોઈ ઊંચી જગ્યાએ અથવા વિશાળ મેદાનમાં પઢે, તો બેહતર છે. પછી તમામ મોઅમીનો સાંજ સુધી દુઆ પઢવામાં તેમજ ખુદાનો ઝિક્ર કરવામાં મશગૂલ રહે, જેથી તે લોકોના સવાબમાં દાખલ થાય.

કેટલીક હદીસોમાં છે કે અરફાને દિવસે રોઝો રાખવાની મનાઈ વારીદ થઈ છે. જ્યારે આ બાબતે મતભેદ છે, ત્યારે મોટા ભાગના આલિમોએ એ બંને હદીસોને ભેગી કરી છે કે બીજ થવામાં શક હોય એટલે ૯મી તારીખ તે ૧૦મી હોવાનો શક હોય, તેમજ રોઝો રાખવામાં અશક્ત બની દુઆ પઢવામાં તથા ઇબાદત કરવામાં ખલેલ પડતી હોય, તો રોઝો ન રાખવો, અને જો રાખે તો મફરૂહ છે.

અડચણ ન હોય તો સુન્નત છે.

ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

જે શખ્સ અરફાને દિવસે દુઆમાં મશગૂલ થવાની પહેલા આસમાનની નીચે બે રક્અત નમાઝ સુન્નત પઢીને ખુદા પાસે પોતાના ગુનાહોનો ઇક્રાર કરે, તો હક તઆલા તેને અરફાતવાળાઓનો સવાબ અતા ફરમાવે, તેના થયેલ અને થનાર તમામ ગુનાહ માફ કરી આપે.

શેખ મુફીદ (અ.મ.)એ લખ્યું છે કે અસરની નમાઝ પઢ્યા પછી એ નમાઝ પઢે. આ નમાઝ ખાસ એ લોકો માટે છે કે જેઓ અરફાતમાં ન હોય.

ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

અરફાતના દિવસે દુઆમાં મશગૂલ થવા ચાહે, તે વખતે પહેલા

અલ્લાહો અકબર (૧૦૦ વખત) પઢે.

અલ્હુમ્બિલ્લાહ (૧૦૦ વખત) પઢે.

લા એલાહ ઇલ્લાહ (૧૦૦ વખત) પઢે.

સુંબહૌનિલાહ (૧૦૦ વખત) પઢે.

કુંલે હો વલાહનો સૂરો (૧૦૦ વખત) પઢે.

ઈન્ના અનિમ્લાહ નો સૂરો (૧૦૦ વખત)
પઢે.

અન્ય એક રિવાયતમાં છે કે :

આયતુલે કુરસી (૧૦૦ વખત) પઢે.

લા હુંવેલ વલા કુંવ્વત ઇલ્લા બિલાહ
(૧૦૦ વખત) પઢે.

અલાહુમ્મ સૈલે અંલા મોહુંમ્મદ વ આલે

મોહુંમદ (૧૦૦ વખત) પટે.

પછી આ દુઆ માંગવામાં મશગૂલ થાય. આ દિવસે બેહતરમાં બેહતર દુઆ “સહીફએ કામેલા”ની છે.

ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

જે શખ્સ અરફાને દિવસે ઇમામે હુસૈન (અ.સ.)ની ઝિયારત કરે, તો અલ્લાહ તેના માટે દસ લાખ એવી હજનો સવાબ આપે છે કે જે બારમા ઇમામ (અ.સ.)ની સાથે કરી હોય, અને દસ લાખ એવા ઉમરાહનો સવાબ અતા કરે છે, જે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની સાથે કર્યા હોય, અને એવું છે કે જાણે દસ લાખ ગુલામો આઝાદ કર્યા હોય.

હઝરતે રસૂલે ખુદા (સ.અ.વ.)એ અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને ફરમાવ્યું:

અગાઉના પયગમ્બરોની દોઆ કે જે અરફાને દિવસે પઢવાની દુઆ છે, તે ચાહો છો કે તમોને તઅલીમ કરું?

કહ્યું હા!

અને તે દુઆ આ છે :

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ

(અશુદ્ધો અને) લા એલાહ ઇલ્લલ્લાહો
વહ્દહૂ લા શરીક લહૂ લહુલ મુલ્કો વ
લહૂલ હુમ્દો યોહુયી વ યોમીતો વ હોવ
હુયુન લા યમૂતો બેયદેહિલ ખંયેરો વ
હોવ અંલા કુલ્લે શયેઈન કંદીર, અલ્લાહુમ્મ
લકલ હુમ્દો કલ્લમી તકૂલો વ ખંયેરને
મિમ્મ નકૂલો વ ફવકે માયકૂલુલ કાંએલૂન,
અલ્લાહુમ્મ લક સંલાતી વનોસોકી વ મહુયાય
વમમાતી વલક બરોઅતી વબેક હુવેલી
વમિનેક કુવ્વતી. અલ્લાહુમ્મ ઇન્ની અઉમ્મો

બેક મેનલે ફકરે વમિન વ સ્વાસિસંદરે
 વમિન શતાતિલે અમરે વમિન અંઝાંબિલે
 કંબ્રો, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક
 ખંચેરરેયાહું વઅઊઝાંબેક મિનશરેમાતજીઓ
 બેહિરેરેયાહું વઅસ્અલોક ખંચેરલે લયલે
 વખંચેરને નહારે, અલ્લાહુમ્મજેઅંલે ફી કુંલ્બી
 નૂરને વફી સમ્ઈ નૂરને વફી બસંરી નૂરને
 વફી લહુંમી નૂરને વફીદમી વઅઊઝાંમી
 વઅઊરૂકી વમકાંમી વમકુંઅંદી વ મદેખંલી
 વમખંરજી નૂરને વઅઅંઝિંમલે યન્નૂર, યા
 રબ્બે યવમે અલકાંક ઇન્નક અંલા કુલ્લે
 શયેઈને કંદીર.

ઇમામે અલી રજા (અ.સ.) ફરમાવે છે કે અરફાને દિવસે આ દુઆ પઢે.

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીમ

અલ્લાહુમ્મ કમા સતરતે અંલય્ય માલમ
અઅંલમ ફગૌફિરેલી મા તઅંલમો વકમા
વસેઅંની ઇલ્મોક ફલયસઅંની અંફવોક
વકમા બદઅંતની બિલે એહુંસાને ફઅતિમ્મ
નેઅંમતક બિલે ગુંફેરાને વકમા અકરેમ્તની
બેમઅંરેફતેક ફશફઅંહા બેમગૌફેરતેક વકમા
અંરફેતની વહુંદાનિય્યતક ફકરિમ્ની
બેતૌઅંતેક વકમા (અંસંમ્તની મિમ્માલમ
અકુને અઅંતસેમો મિન્હો ઇલ્લાહ બેઇસ્મતેક

ફગોંફિરેલી માલવે શેઅંત) અંસિંમ્તની મિન્હો
યા જવાદો યા કરીમો યા ઝંજલાલે
વલ્હકેરામ.

અને હજરતે ઇમામે મૂસા કાઝીમ (અ.સ.)થી આ
દુઆ મનકૂલ છે.

બિસ્મિલ્લાહિરે રહુમાનિરે રહીમ

અલ્લાહુમ્મ ઇન્ની અંબદોક વબ્નો અંબદેક
ઇન્તોઅંઝં ઝિંબ્ની ફબે ઓમૂરિને કંદે સલફતે
મિન્ની વઅના બયેન યદયેક બેરૂમ્મતી વઇને
તઅંફો અંન્ની ફઅહલલ અંફેવે અન્ત યા
અહલલ અંફેવે યા અહકું મને અંફા
ફગોંફિરેલી વલે ઇબ્વાની.

આ મહિનાની દસમી રાત બકરી ઇદ (ઈદુઝ ઝોહા)ની રાત છે. આ રાત્રે ઇબાદત કરવા અને જાગવાનો ઘણો સવાબ છે. હાજુઓની દુઆનો અવાજ ઉપર જાય તે માટે આસમાનના દરવાજા બંધ થતા નથી.

ખુદાએ તઆલા હાજુઓને આવાજ આપે છે કે હું તમારો રબ છું અને તમો મારા બંદા છો, તમોએ મારો હક અદા કર્યો, હવે તમારી દુઆ કબૂલ કરું.

પછી જે શખ્સ બક્ષિશને લાયક હોય, તેના ગુનાહ માફ કરે છે અને જે બક્ષીશને લાયક નથી, તેના ગુનાહ ઓછા કરે છે, તો જે શખ્સ તેઓની સાથે ઇબાદત અને દુઆમાં શરીફ થાય, તે તેઓના સવાબમાં પણ શરીફ થશે. આ રાત્રે ગુસ્લ કરી ઇમામે હુસૈન (અ.સ.)ની ઝિયારત કરે, તો તેના ભૂતકાળના અને હવે પછી થનારા ગુનાહ માફ થાય છે.

ઇદને દીવસે ગુસ્લ કરવું તાકીદ ભરેલી સુન્નત છે. કેટલાક ઓલમા આજનું ગુસ્લ વાજિબ જાણે છે અને બેહતર એ છે કે ઇદની નમાઝ પહેલા ગુસ્લ કરે. ઇમામે ઝમાના (અ.સ.)ની ગૈબતના (વર્તમાન) સમયમાં ઇદની

નમાઝ તાકીદ ભરેલી સુન્નત છે.

ઝીલ્હજની ૧૦મી તારીખે ઝોહરની નમાઝથી ઝીલ્હજની ૧૨મી તારીખની સુબ્હની નમાઝ સુધી દરેક નમાઝ પછી નીચેની તકબીરો પઢવી મશહૂર અને સુન્નત છે, અને કેટલાક આલિમો વાજિબ જાણે છે. તેને ઓછામાં ઓછી એક વખત પઢે, અને વધારે પઢે તો બેહતર છે. વધુ ખુલાસો એ કે ઇદને દિવસે ઝોહરની નમાઝ પઢી આ તકબીર પઢે અને અસરની નમાઝ પછી પણ, એ મુજબ દરેક નમાઝની પાછળ પઢ્યા કરે એટલે સુધી કે બારમી તારીખે સુબ્હની નમાઝ પછી પઢે, તકબીરો આ મુજબ છે:

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહુંમ

અલ્લાહો અકબરે, અલ્લાહો અકબરે,
લા એલાહ ઇલ્લલ્લાહો વલ્લાહો અકબરે,
અલ્લાહો અકબરે વલિલ્લાહિલે હુંમદ,
અલ્લાહો અકબરે, અંલામા હદાના અલ્લાહો

અકેબરે, અંલામા રઝકેના મિમં બહીમતિલે
અન્ઓમે વલેહુંમદો લિલ્લાહે અંલા મા
અબ્લાના.

અલ્લામા મજલિસી (અ.ર.) લખે છે કે બકરી ઘદ
(ઈદુઝ ઝોહા)ને દિવસે સુન્નત છે કે ઘદની નમાઝ પછી
કુરબાનીના ગોશ્તથી ઇફ્તાર કરે. કુરબાની કરવી 'સુન્નતે
મોઅક્કેદહ' છે, અને કેટલાક આલિમો ફરમાવે છે કે
શક્તિવાન ઉપર વાજિબ છે.

ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

પોતાના માટે કુરબાની કર અને પોતાના બચ્ચાઓ
માટે કુરબાની કર અથવા ન કર.

ઉમ્મે સલમા કહે છે કે મેં હઝરત રસૂલે ખુદા
(સ.અ.વ.)ને અરજ કરી કે કુરબાની કરવા માટે પૈસા
નથી, તો કરજ કરીને કુરબાનીનું જાનવર વેચાતું લઉં?

હઝરતે જવાબ આપ્યો કે હા, તે કરજ ખુદા અદા

કરશે.

બેહતર છે કે ઇદને દિવસે કુરબાની કરે અને ૧૧મી તથા ૧૨મી તારીખે પણ કુરબાની કરી શકે છે, અને હજ કરવા જાય, ત્યાં મીનામાં હોય, તો ૧૩મી તારીખ સુધી પણ કુરબાની કરી શકે છે.

જે જાનવર ઘરમાં પાળેલું હોય, તેની કુરબાની મફરૂહ છે. કુરબાની નીચે લખેલા જાનવરો સિવાય બીજા કોઈ જાનવરની થઈ શકતી નથી:

(૧) ઊંટ, (૨) ગાય, (૩) બકરૂં, (૪) ઘેટું

આ (ઉપરોક્ત) ચાર જાતના જાનવર નર હોય કે માદા, તેઓની કુરબાની થઈ શકે છે.

૧. ઊંટ હોય તો પુરા પાંચ વર્ષ અથવા તેથી વધારે, પાંચ વર્ષથી નાનુ ન હોય.

૨,૩ ગાય અથવા બકરૂં હોય, તો એક વર્ષ પુરૂં થઈ બીજું વર્ષ શરૂ હોય, મતલબ કે એક વર્ષથી મોટું હોય, તેની કુરબાની કરે અને બે વર્ષ પુરા થયા હોય, તો બેહતર છે.

૪. ઘેટું હોય, તો છ મહિનાનું પુરતુ છે.

કુરખાનીના જાનવરમાં ખોડ (ખામી) કે ઐબ ન હોય, કાણું અથવા આંધળું ન હોય, બહુ જ લંગડું ન હોય કે ચાલવું તેના માટે મુશ્કિલ હોય, કાન કાપેલું ન હોય. અગર કાન ચીરેલો હોય અને જુદો થયેલો ન હોય તો વાંધો નથી. શીંગડાની અંદરનું હાડકું ભાંગેલું ન હોય, શીંગડાની ઉપરનો ભાગ પણ ભાંગેલો ન હોય તો બેહતર છે અને બેહતર એ છે કે બીમાર અને બહુ જ ઘરડું ન હોય. સુખ્નત છે કે તંદુરસ્ત હોય અને બહુ જ દુખળું પણ ન હોવું જોઈએ કે ગુરદાની ચરબી ચાલી ગઈ હોય અને ખસી પણ હોવું ન જોઈએ, એટલે તે ખંને અવયવ કાપી નાંખેલા ન હોય અને અગર કાપેલ ન હોય અને ચોળી નાંખેલ હોય, તો મફરહ છે અને અગર ખસી સિવાય બીજુ ન મળે, તો હરકત (વાંધો) નથી.

કુરખાની માટે ઊંટ અથવા ગાય હોય, તો માદા એટલે ઊંટણી અને ગાય સુખ્નત છે, અને બકરું અથવા ઘેટું હોય તો નરની કુરખાની કરવી સુખ્નત છે. એટલે

બકરો અથવા ઘેટો હોય તો વધારે સવાબ છે, અને સુખ્નત છે કે પોતાના હાથે કુરબાનીના જાનવરને ‘ઝખ્હ’ કરે અને અગર પોતે ન કરી શકે, તો કસાઈના હાથ ઉપર પોતાનો હાથ રાખીને મદદ કરે અને તે ‘ઝખ્હ’ કરે. ઊંટ માટે ‘ઝખ્હ’ કરવાનો હુકમ નથી, બલ્કે ‘નહર’ કરે. કુરબાનીના જાનવરને ‘ઝખ્હ’ અથવા ‘નહર’ કરતી વખતે નીચે લખેલી દુઆ પઢવી સુખ્નત છે.

ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

કુરબાનીનું જાનવર ‘નહર’ અથવા ‘ઝખ્હ’ કરતી વખતે તેના મોઢાને કિબ્લા તરફ કરે અને પેહલા આ દુઆ પઢે:

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ

ઈન્ની વજ્જહુતો વજ્જહેય લિલ્લાહી

ફત્તેરસમાવાતે વલ્અરેઝ્ઝં હુનીફમ મુસ્લેમંવ

વમાઅના મેનલ્ મુશરેકિન, ઈન્ન સંલાતી

વ નોસોકી વ મહુંયાય વ મમાતી લિલ્લાહે
રબ્બિલે ઑલમીન લા શરીક લહૂ વબેઝાલેક
ઓમિરેતો વ અના મેનલે મુસ્લેમીન.
અલ્લાહુમ્મ મિન્ક વલક બિસ્મિલ્લાહે
વલ્લાહો અકબરે.

જાનવરને ‘ઝબ્હ’ કે ‘નહર’ કર્યા પછી નીચે મુજબ
દુઆ પઢે:

અલ્લાહુમ્મ તકુંબલે મિન્ની.

“અય પરવરદિગાર આ ફુરખાની મારા તરફથી
કબૂલ કર”

ફુરખાનીમાં ભાગીદાર હોય તો, નીચે મુજબ કહેવું:

અલ્લાહુમ્મ તકુંબલે મિનેહુમ્

હઝરતે ફરમાવ્યું કે જ્યાં સુધી જાનવર મરી ન જાય, ત્યાં સુધી માથું જુદું કરવું નહીં. પછી ચામડી કાઢ્યા પછી સુન્નત છે કે એક ભાગ પોતે તથા પોતાના ઘરના માણસો ખાય, અને બેહતર એ છે કે પોતે તેનાથી ઇફતાર કરે એટલે “નાસ્તો” કરવાની પહેલા તે ગોશ્ત ખાય અને બીજો ભાગ પાડોશીઓને હદીયો (ભેટ) મોકલે. અગર તેઓ ગરીબ હોય, તો બેહતર છે, અને ત્રીજો ભાગ મિસ્કીન મોઅમીનોને આપે. સુન્નત છે કે ચામડું-મૂંડી વગેરે એવા હલાલ ભાગ હોય, તે ન વાપરે, બલ્કે સદકો કરે તેમજ કસાઇને પણ ન આપે, પણ તે ગરીબ (મોઅમીન) હોય તો સદકા તરીકે આપે. સુન્નત છે કે વચલી રાસની કિંમત સદકો કરે, અને એક જાનવર પોતાના માટે અને પોતાના ઘરના માણસો માટે ફુરખાની કરે તો પૂરતુ (કાફી) છે અને એક પોતાના માટે તથા એક ઘરના માણસો માટે ફુરખાની કરે, તો બેહતર છે, અને અગર પોતાના ઘરના દરેક માણસો માટે એક-એક જુદી-જુદી ફુરખાની કરે, તો વધારે સવાબ થશે, અને પોતાના માં-બાપ અને ઔલાદ તથા સગાઓ જે

ગુજરી ગયા હોય, તેઓ માટે કુરબાની કરે, તો સાફ છે.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) બે કુરબાની કરતા. પહેલી કુરબાનીમાં ફરમાવતા હતા કે ખુદાવંદા, આ મારા તરફથી તથા મારી અહલેબૈતમાંથી જેઓએ કુરબાની નથી કરી તેઓ તરફથી છે અને બીજી કુરબાનીમાં ફરમાવતાં કે ખુદાવંદા, મારા તરફથી તથા મારી ઉમ્મતમાંથી જેઓએ કુરબાની નથી કરી તેઓ તરફથી છે.

હઝરત અલી (અ.સ.) દર વર્ષે કુરબાની કરીને ફરમાવતા હતા કે ખુદાવંદા! આ તારા પયગમ્બર તરફથી છે. બીજો દુખો પોતાના માટે કુરબાની કરતા અને ફરમાવતા : ખુદાવંદા! “તકબ્બલ મિન્ની”.

અગર દરેક શખ્સ એક-એક કુરબાની જુદી-જુદી કરી ન શકે, તો જાએઝ છે કે ભાગીદાર થઈને કુરબાની કરે.

ઘટે ગદીરની ફઝીલત તથા આ'માલ

ઝીલ્હજ મહિનાની ૧૮મી તારીખે 'ઘટે ગદીર' છે. રસૂલે ખુદા (સ.અ.વ.) છેલ્લી હજ કરીને પાછા ફર્યા, તે સમયે રસ્તામાં 'ગદીરે ખુમ' નામની જગ્યાએ આશરે એક લાખ માણસોની વચ્ચે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને પોતાની પાછળ ખલીફા-વસી મુકર્રર કર્યા.

ઈમામ અલી રઝા (અ.સ.) ફરમાવે છે:

કયામતના દિવસે ચાર ઘટને શણગારી અર્શ પાસે લાવવામાં આવશે:

- | | |
|---------------------|-----------------|
| (૧) ઇદુઝઝોહા, | (૨) ઇદુલ ફિત્ર, |
| (૩) જુમ્માની ઇદ અને | (૪) ઇટે ગદીર. |

'ઘટે ગદીર' બધી ઈદોમાં સિતારામાં ચંદ્ર દેખાય છે, તેમ દેખાશે.

'ઘટે ગદીર' ઘણી જ ખુશીનો દિવસ છે. આ દિવસે ખુદાએ દીનને કામીલ (સંપૂર્ણ) કર્યો. અહલેબૈત

(અ.મુ.સ.)ના દોસ્તોના આ'માલ કબૂલ થાય છે અને તેઓના દુશ્મનોના આ'માલ ખાતિલ છે. ખુદાયે તઆલા જિબ્રઇલને હુકમ કરે છે કે 'બયતુલ મઅમુર' ઉપર કરામતની કુરસી રાખે અને પછી જિબ્રઇલ તે કુરસી ઉપર બેસીને મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (સ.અ.વ.)ની તઅરીફ કરે છે. તમામ આસમાનના મલાએકા (ફરિશ્તા) તેને સાંભળવા ભેગા થાય છે અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના દોસ્તો માટે ઘસ્તિગફાર કરે છે અને ખુદા હુકમ કરે છે કે ત્રણ દિવસ સુધી અહલેબૈત (અ.મુ.સ.)ના દોસ્તોના ગુનાહ લખે નહીં.

આ દિવસે સલવાત બહુ જ પઢવી જોઈએ. મોઅમીનોને દઅવત કરવી વિગેરે ઘણી બાબતો લખી છે. આજને દિવસે રોઝેદારને જમાડે, તો લાખ મોઅમેનીનને જમાડવા જેટલો સવાબ છે.

આજે મોઅમેનીનને જોઈને ખુશ થાય, તેના ઉપર કયામતમાં ખુદા રહેમતની નજર કરે, અને તેની હજાર હાજત પુરી કરે અને તેના માટે બેહિશ્તમાં સફેદ મોતીનું

મકાન બનાવે અને તેના ચહેરાને નૂરાની કરે.

ઘડે ગદીરની ખુશહાલી માટે જે કોઈ ઝીનત (શણગાર) કરે, તેના તમામ નાના મોટા ગુનાહ માફ થાય અને ખુદા કેટલાક ફરિશ્તાને મોકલે, જે તેના માટે બીજા વરસ સુધી નેકીઓ લખે અને તેના દરબજા બુલંદ કરે અને ગુજરી જાય તો શહીદ મર્યો ગણાય.

આ દિવસે એક મોઅમીનને જમાડે, તો તમામ પયગમ્બરો અને સીદ્દીકોને જમાડવા જેટલો સવાબ મળે. આજે બિરાદરે મોઅમીનને મળે, તો તેની કબરમાં ખુદા સિતેર નૂર દાખલ કરે, અને કબરને પહોળી કરે અને હંમેશા તેની કબરમાં સિતેર હજાર ફરિશ્તા ઝિયારત કરે અને તેને બેહિશ્તની ખુશખબરી આપે.

આજના દિવસે હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની ઝિયારત પઢવાની ઘણી ફઝીલત છે. એ ઝિયારત નજીકથી તેમજ દૂરથી પઢી શકાય છે. પછી ઝિયારતની બે રકઅત નમાઝ પઢે. પહેલી રકઅતમાં સૂરએ અલ્હમ્દ પછી ઇન્ના અન્નાહનો સૂરો અને બીજી

રકઅતમાં સૂરએ અલ્હમ્ પછી કુલ્હોવલાહનો સૂરો પઢે,
પછી આ નીચેની દુઆ પઢે:

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીંમ

અલ્લાહુમ્મ સંલ્લે અંલા વ લિય્યેક વ
અખીં નબિય્યેક વ વઝીરેહી વ હુંબીબેહી
વ ખંલીલેહી વ મવઝંએ સિરેરેહી વ
ખંયરતેહી મિનં ઉસરતેહી વ વસિંય્યેહી વ
સંફેવતેહી વ ખાંલેસંતેહી વ અમીનેહી વ
વલીય્યેહી વ અશરફે ઈંતરતે હિલ્લમીન
આમનૂ બેહી વ અબી ઝુંરરિયંતેહી વ બાબે
હિંકેમતેહી વન્નાતેકે બેહુંજેજતેહી વદાઈ
એલા શરીઅંતેહી વલ્માઝીં અંલા સુન્નતેહી

વ ખંલીફતેહી અંલા ઉમ્તેહી સય્યદિલ
 મુસોલેમીન વ અમીરિલ મોઅમેનીન
 વકાંએદિલ ગુરરિલ મોહુંજલીન અફઝલ
 મા સંલ્લયત અંલા અહંદિન મિન ખંલકેક
 વ અસંફેયોએક વ અવસેયોએ અમ્બેયોએક
 અલ્લાહુમ્મ ઇન્ની અશહદો અન્નહૂ કંદ
 બલ્લગું અંને નબીયેક સંલ્લલ્લાહો અંલયહે
 વ આલેહી માહુંમ્બેલ વરઓ મસ્તોહુંફેઝ
 વ હુંફેઝ મસ્તૂદેઅં વ હુંલ્લલ હુંલાલક વ
 હુંરમ હુંરામક વ અકાંમ અહુંકામક વ
 દઓ એલા સબીલેક વ વાલા અવલેયોઅક
 વ ઓદા અઅંદોઅક વ જાહદન્નાકેસીન

ॐने सभीलोक वलं कौंसेतीन वल्मारेकीने
 ॐने अमरेक सांभेरमं मोळंतसेभमं मुकुंभेलने
 गोंयेर मुटुंभेरिले ला तअभाँजोळू झिल्लाडे
 लवमत लाअभिनं उंत्ता बलगों झी जालेकरेजो
 व सल्लम अेलयंकलं कुंजोअ व अंभदक
 मुण्लेसंव व नसंउं लक मुजतडेदनं उंत्ता
 आता लुलं यकींनो इकुंभजंतलू अेलयंक
 शडीदनं सछेंदंवं वलियनं तकिंयनं रजीयनं
 जकियनं हादेयमं मळदियनं अल्लाहुम्म
 सल्ले अंला मोळंमद्विंवं व अंलयडे अइजंल
 मा सल्लायंत अंला अंउद्विमं भिनं
 अम्भेयोअेक व अरेंइयोअेक या रबलं

ઑલમીન.

અને હઝરતની કબર તરફ ઘશારો કરીને આ ઝિયારત પઢે:

(અસ્સલામો ઑલયક યા અમીરલ્ મોઅમેનીન વ રહ્મતુલ્લાહે વ બરકાતોહ) અસ્સલામો ઑલયક યા અમીનલ્લાહે ફી અરઝેહી વ હુજૂતહૂ ઑલા ઑબાદેહી, અસ્સલામો ઑલયક યા અમીરલ્ મોઅમેનીન અશહદો અન્નક જાહદત ફિલ્લાહે હુકૂકૂ જેહાદેહી વ ઑમિલ્ત બેકેતાબેહી વત્તબઅંત સોનન નબીય્હેહી સંલ્લલ્લાહો ઑલયહે વ આલેહી હુન્તા દઑકલ્લાહો એલા જેવારેહી

ફકુંબઝંક એલયહે બેઇખંતયારેહી વ અલેઝમ
 અઅંદાઅકલે હુંજૂત મઅં માલક મેનલે
 હાંજજિલે બાલેગંતે અંલા જમીઅે ખંલકેહી
 અલ્લાહુમ્મ ફજેઅંલે નફેસી મુત્તમઇન્નતમ
 બેકંદરેક રાઝેયતને બેકઝાએક મૂલઅંતને
 બેઝિંકરેક વ દોઆએક મોહિંબંતલે લેસંફવતે
 અવલેયાએક મહુંબૂબતને ફી અરેઝંક વ
 સમાએક સાંબેરતને અંલા નોઝૂલે બલ્લાએક
 શાકેરતલે લેફવાઝેલે નઅંમાએક ઝાંકેરતલે
 લે સવાબેગે આલ્લાએક મુશ્તાકંતને એલા
 ફરેહુંતે લેકાંએક મોતઝવેદતત્તકેવા લે
 યવમે જઝાએક મુસ્તન્નતમ બેસોનને

અવલેયોએક મોફારેકુંતલે લે અખંલાકે
 અઅંદાએક મશગૂલતને અંનિદુન્યા બેહુંમ્દેક
 વસંનાએક અલ્લાહુમ્મ ઇન્ન કૌલૂબલે
 મુખ્બેતીન એલયેક વાલેહતુંવ વ સોબોલરે
 રાગેબીન એલયેક શારેઅંતુંવ વ અઅંલામલે
 કૌસેદીન એલયેક વાઝેહુંતુવે વઅફેએદતલે
 ઔરેફીન મિન્ક ફાઝેઅંતુને વ અંસ્વાતદે
 દાઈને એલયેક સાંઅેદતુંવ વ અબ્વાબલે
 એજાબતે લહુમ મોફત્તહુંતુવે વ દઅંવત
 મને નાજાક મુસેતજાબતુવે વ તવેબત મને
 અનાબ એલયેક મકેબૂલતુવે વ અંબરત મમ
 બકા મિને ખંવેફેક મરેહુંમતુવે વલે એગોસંત

લેમનિસંતગોસં બેક મવેજૂદતુંવ વલે એઓનત
 લેમનિસ્તઓન બેક મબ્જૂલતુને વ એદાતેક
 લેએબાદેક મુનેજઝતુને વઝલલ મનિસં
 તકોલક મોકોલતુન વ અએમાલલે ઓમેલીન
 લદયેક મહુંકૂરતુને વ અરેઝાકુંક એલલે
 ખંલોએકે મિને લદુન્ક નાઝેલતુન
 વએવાએદલે મઝીદે એલયેહિમ વાસેલતુને
 વઝોનૂબલે મુસ્તગુંફેરીન મગુંકૂરતુને વ
 હંવાએજ ખંલકુંક ઈન્દક મકુંઝીયતુને વ
 જવાએઝસે સાએલીન ઈન્દક મોવફૂરતુને
 વ એવાએદલે મઝીદે મોતવાતેરતુને વ
 મવાએદલે મુસ્તતંએમીન મોએદતુને વ

મનાહેલઝં ઝંમોએ (લદયેક) મુત્રઅંતુને
 અલ્લાહુમ્મ ફસ્તજીબે દોઆઈઠ વકેબલે સંનાઈ
 વજેમઅં બયેની વ બયેન અવલેયોઈ (વ
 અહિબ્બોઈ) બેહુંકેકે મોહુંમ્મદિને વ
 અંલિયીન વ ફાતેમત વહુંસને વહુંસયેને
 (વલે અઈમ્મતે મિને ઝુંરિયતિલે હુંસયેને
 અઈમ્મતી) ઇન્નક વલિયો નઅંમોઈ
 વમુન્તહા મોનાય વ ગોંયતો રજોઈ ફી
 મુનેકેલબી વ મસ્વાય.

ઇદે ગદીરની રાત પણ ઘણી મુબારક છે. તે રાત્રે
 મુનાસિબ છે કે ઉપરની ઝિયારત પઢે. ઇદે ગદીરના દિવસે
 રોઝો રાખવો.

હઝરત ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે

છે:

ઇદે ગદીરના દિવસના રોઝાનો સવાબ આખી ઉમર સુધી રોઝો રાખે એટલો છે તેમજ એકસો (૧૦૦) હજ તથા એકસો (૧૦૦) ઉમરાનો સવાબ મળે છે. આ દિવસે એક દિરહમ સદકો કરે, તો એક લાખ દિરહમ સદકો કરવા જેટલો સવાબ મળે છે.

આજના દિવસે દિવસના પહેલા ભાગમાં ગુસ્લ કરવું તાકીદ ભરેલી સુન્નત છે. આજને દિવસે બે રકઅત નમાઝ પઢવી સુન્નત છે. બે પહોર થવાને અર્ધી કલાક પહેલા બે રકઅત નમાઝ “ઇદે ગદીર”ની સુન્નતની નિચ્યતથી પઢે. દરેક રકઅતમાં અલ્લેમ્દના સૂરા પછી દસ વખત ફુલ્હોવલ્લાહનો સૂરો, દસ વખત ઇન્ના અન્નલ્લાનો સૂરો અને દસ વખત ‘આયતુલ ફુરસી’ પઢે.

હઝરત ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે કે એ (ઉપરોક્ત) નમાઝનો સવાબ લાખ હજ અને લાખ ઉમરા કરવા જેટલો મળે, દીન તથા દુનિયાની જે હાજત ખુદા પાસે માંગે, તે આસાનીથી પુરી થાય.

નમાઝ પછી એક દુઆ પઢવાની છે, તે ઘણી મોટી હોવાથી લખી નથી. શેખ મુફ્ફીદ (અ.મ.)એ રિવાયત કરી છે કે ઘટે ગદીરને દિવસે આ દુઆ પઢવી સુન્નત છે:

બિસ્મિલ્લાહિરે રહુમાનિરે રહીમ

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બેહુકકે
 મોહુમ્મદિનં નબિય્યેક વ અંલિયીનં વલિય્યેક
 વશશઅને વલે કંદરિલ્લાહી ખંસંસ્તહોમા
 બેહી દૂન ખંદકેક અને તોસંલ્લેય અંલા
 મોહુમ્મદિનં વ અંલિયીનં વ અને તબ્દઅ
 બેહોમા ફી કુલ્લે ખંયરિનં આંજેલિનં
 અલ્લાહુમ્મ સંલ્લે અંલા મોહુમ્મદિનં વ
 આલે મોહુમ્મદનિલઅઇમ્મતિલે કાંદતે

વદોઁતિસ્સાદતે વન્નોજૂમિઝં ઝાહેરતે વલં
 અઁલામિલં બાહેરતે વ સાસતિલં ઁબાદે
 વ અરંકાનિલં બેલાદે વન્નાકંતિલં મુરંસલતે
 વસ્સફીનતિનં નાજેયતિલં જારેયતે ફિલં
 લુજંજીલં ગાંમેરતે અલ્લાહુમ્મ સંલ્લે ઁલા
 મોહંમ્મદિનં વ આલે મોહંમ્મદિનં ખુંઝાંને
 ઈલ્મોક વ અરંકાને તવેહીંદેક વ દઁઁએમે
 દીનેક વ મઁઁદેને કરામતેક વ સિંફવતેક
 મિનં બરિય્યતેક વ ખેંયરતેક મિનં ખંલકેકલં
 અત્કેંયાઇલં અન્કેંયાઇનં નોજબાઇલં અબરારે
 વલં બાબિલં મુખ્તલા બેહિન્નાસો મનં અતાહો

નજા વ મને આબાહો હવા અલ્લાહુમ્મ
 સંલ્લે અંલા મોહુંમદિને વ આલે મોહુંમદિને
 અહ દિઝં ઝિંકરિ લ્લાઝીન અમરેત
 બેમસ્અલતેહિમે વ ઝંવિલે કુંરેબલ્લાઝીન
 અમરેત બેમવદ્દતેહિમે વ ફરઝંત હુંકેકુંહુમે
 વ જઅંલ્લે જન્નત મઅંદ મનિકે તસેસે
 આસારહુમે, અલ્લાહુમ્મ સંલ્લે અંલા
 મોહુંમદિને વ આલે મોહુંમદિને કમા
 અમરૂ બેતૌઅંતેક વ નહવેઅંને મઅંસેયતેક
 વ દલ્લુ અંબાદક અંલા વહદાનિયતેક,
 અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બેહુંકેકે

મોહુંમ્મદિનં નબિય્યેક વ નજ્જબેક વ સંફવતેક
 વ અમીનેક વ રસુલેક એલા ખંલકેક વખેહુંકેકે
 અમીરિલં મોઅમેનીન વ યઅંસૂબિદીન વ
 કાંએદિલં ગુરરિલં મોહુંજેજલીનલં વસિંચિલં
 વફિયે વસંસીદિકિંલં અકુંબરે વલં ફારુકે
 બયનલં હુંકેકે વલ્ખાતેલે વશશાહેદે લક
 વદદાલે અંલયેક વસંસાંદેએ બેઅમરેક
 વલ્મોજાહેદે ફી સબીલેક લમં તઅખુંઝંહો
 ફીક લવમતો લાએમિન અનં તોસંલ્લેય
 અંલા મોહુંમ્મદિનં વ આલે મોહુંમ્મદિનં
 વ અનં તજેઅંલની ફી હાઝંલં યવમિલ્લઝી

અકંઠેત ફીહે લે વલિય્યેકલે અંહંદ ફી
 અઅંનાકે ખંદકેક વ અકમલ્ત લહોમુદીન
 મેનલે આંરેફીન બેહુંરેમતેહી વલેમોકિરેરીન
 બેફઝંલેહી વ મિનં આંતકાંએક વ તાંલકાંએક
 મેનનારે વલા તુશમીતે બી હાંસેદીને નેઅંમે,
 અલ્લાહુમ્મ ફકમા જઅંલ્તહુ ઇંદકલે અકબર
 વ સમ્મયેતહૂ ફિસ્સમાએ યવેમલે અંહદિલે
 મઅંહૂદે વ ફિલે અરેઝે યવેમલે મીસાંકિલે
 મઅંખૂઝે વલે જમેઈલે મસ્તીલે, સંલ્લે અંલા
 મોહંમ્મદિને વ આલે મોહંમ્મદિને વ અકરિરે
 બેહી આંયૂનના વજેમઅં બેહી શમ્લના વલા

તોઝીલ્લના બઅંદ ઇઝં હદયેતના વજઅંલ્ના
 લેઅનઅૌમેક મેનશાકેરીન યા અરહુંમરે
 રાહુંમીન, અલહુંમદો લિલ્લાહિલ્લઝી અરફના
 ફઝલ હાઝલે યવમે વ બસંસરના હુરેમતહૂ
 વ કરમના બેહી વ શરફના બેમઅરેફતેહી
 વ હદાના બેનૂરેહી યા રસૂલલ્લાહે યા
 અમીરલે મોઅમેનીન અંલયકોમા વ અંલા
 ઇતરતેકોમા વ અંલા મોહિબ્બીકોમા મિન્ની
 અફઝલુસ્સલામે મા બકેયલ્લયેલો વન્નહારો
 વ બેકોમા અતવજહો એલલ્લાહે રબ્બી
 વરબ્બેકોમા ફી નજાહે તંલેબતી વ કંઝાએ

હું વાંએજી વ તયેસીરે ઓમૂરી, અલ્લાહુમ્મ
 ઇન્ની અસેઅલોક બેહુંકેકે મોહુંમદિને વ
 આલે મોહુંમદિને અનંતોસંલ્લેય અંલા
 મોહુંમદિને વ આલે મોહુંમદિને વ અનં
 તલ્લેઅંન મને જહુંદ હુંકેકે હાઝંલ યવમે વ
 અનંકર હુંરેમતહૂ ફસંદ અંને સબીલેક
 લેઈત્ફાએ નૂરેક ફઅબલ્લાહો ઇલ્લા અનં
 યોતિમ્મ નૂરહૂ અલ્લાહુમ્મ ફરરિજે અંને
 અહલેબયેતે મોહુંમદિને નબિય્યેક વકશિફે
 અંહૂમ વ બેહિમ અંનિલે મોઅમેનીનલે
 કોરોબાતે અલ્લાહુમ્મમલઇલે અરેઝં બેહિમ

અંદેલને કમા મોલેઅતે ઝુંદમને વ જવરને
વ અનેજિઝે લહુમે મા વઅંદેતહુમે ઇન્નક
લા તુબ્લેકુલે મીઆંદ.

આ દુઆ પઢ્યા પછી સજદામાં જઇ નીચે મુજબ પઢે.

શુકરને (૧૦૦ વખત)

અહુંમદો લિલ્લાહ (૧૦૦ વખત)

અને સો (૧૦૦) વખત અથવા બની શકે તેટલી
વખત નીચેની દુઆ પઢે તો બેહતર છે:

અહુંમદો લિલ્લાહે અંલા ઇક્રમાલિદ
દીને વ ઇત્મામિન્નેઅમતે, વ રઝેયર
રખિલે કરીમ, વહુંમદો લિલ્લાહે

રબ્બિલ આંલમીન, વસ્સેલ્લાતો અંલા
બંયરે ખંલકેહી મોહુંમદિનં વ ઈતરતેહિ
ત્તોહેરીન

આ મહિનાની રઠમી તારીખે ‘ઘટે મુબાહેલા’ છે. ‘મુબાહેલા’ બદદુઆ કરવાને કહે છે. એ મુજબ નઝરાનના નસારાઓ કે જે અરબમાં મોટેરા (અગ્રણી) હતા, તેઓ પાસે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ હિદાયત માટે માણસો મોકલ્યા. તેઓના આલિમોએ હઝરતની સચ્ચાઈની બાબતો પોતાની કિતાબોમાં જોએલી, પરંતુ દુનિયાની લાલચના કારણે ઘણા લોકો ઇમાન લાવ્યા નહીં અને એ લોકોએ પોતાના નામાંકિત આલિમોને મોકલ્યા કે જેથી તેઓ મદીના જઈને હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની સિફતો (ખાસિયતો) કે જે આગલી કિતાબોમાં જોઈ હતી તે તપાસે. તેઓ મદીનામાં આવ્યા અને કિતાબો મુજબ સિફતો (ખાસિયતો) નખી (સ.અ.વ.)માં જોઈ. હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ પણ તેઓ ઉપર પુરેપુરી હુજૂત

તમામ કરી, છતાં દુન્યાની મોહબ્બતના કારણે તેઓ ઇમાન લાવ્યા નહીં. તે વખતે અલ્લાહ તઆલાએ આયત નાઝિલ કરી કે

“તે લોકોને કહો કે અમો અમારા ફરજંદોને અને તમો તમારા ફરજંદોને, અમો અમારી દીકરીઓને અને તમો તમારી દીકરીઓને, અને અમો અમારી જાનો (જેવાને) અને તમો તમારી જાનો (જેવાને) બોલાવીએ, પછી ખુદાની દરગાહમાં આજેજુ અને કરગરીને દુઆ કરીએ કે જે જૂઠા હોય તેઓ ઉપર ખુદાનો અઝાબ ઉતરે.”

જેમકે હાજુ નાજુના ગુજરાતી કુરઆને શરીફની તફસીરમાં ખુલાસાથી લખેલ છે. પછી હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ખભા ઉપર અબા લીધી અને હઝરત અલી (અ.સ.), જનાબે ફાતેમા (સ.અ.), ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ને બોલાવી પોતાની અબાની નીચે બેસાર્યા અને તેઓ માટે દુઆ કરી અને ખુદાએ “તલ્હીર”ની આયત મોકલી કે અહલેબૈત તમામ ગુનાહ અને બૂરાઈથી પાક પાકીઝા છે. પછી એ ચારેય બુરુગવારોને

સાથે લઈ હઝરત મદીનાથી જે ઠેકાણે નસારા સાથે વાયદો હતો, ત્યાં ગયા, અને આપના જવાથી જમીન અને આસમાન ઉપર ગઝબની નિશાનીઓ દેખાવા લાગી અને નસારા જાણતા પણ હતા કે હઝરત હક ઉપર છે. તેથી તેઓના અગ્રણી આલિમે કહ્યું કે

‘ખુદાની કસમ! હું કેટલાક એવા ચેહરા જોઉં છું કે અગર તેઓ પહાડને પોતાની જગ્યાથી ઉખડી જવાની દુઆ કરે, તો ઉખડી જાય,’

પછી આ કારણે તેઓએ દુઆ કરવા માટે આવવાની હિમ્મત કરી નહીં, અને લાચાર થઈ સુલેહ કરી અને દર વર્ષે જઝીઓ (વેરો) દેવો કબૂલ કર્યો. હઝરતે તેઓ માટે બદદુઆ કરી નહીં અને ખુદાના હુકમથી તેઓ ઉપર જઝીઓ (ટેક્સ) મુકર્ર કર્યો.

હઝરતે ફરમાવ્યું કે ‘ખુદાની કસમ! ખુદાનો અઝાબ અફર હતો. જો તેઓ દુઆ કરવા આવતે, તો તમામ જણ વાંદરા અને સુવ્વર થઈ જતે, અને આ જંગલ આગનું થઈ જતે અને તે આગ નઝરાન સુધી પહોંચી સર્વેને બાળી

નાખતે, અને એક વર્ષમાં તમામ જણ મરી જતે અને આ દુનિયામાં એક પણ નસરાની ન રહેતે’.

આ આયતો નાઝિલ થવાથી અહલેબૈત (અ.મુ.સ.)ની ઘણી ઉચ્ચ બુઝૂર્ગી અને ઇસ્મત, પાક પાકીઝાપણું સાબિત છે.

આજે ગુસ્લ કરવું, રોઝો રાખવો અને નમાઝ દુઆ વગેરે પણ છે.

ઝીલ્હજ મહિનાની ૨૪મી તારીખે હઝરત અલી (અ.સ.) નમાઝ પઢતાં હતાં અને રૂકૂઅમાં ગયા ત્યારે ફકીરે સવાલ કર્યો (માંગણી કરી). આપ (અ.સ.)એ પોતાની કિંમતી વીંટી આપી દીધી. ખુદાએ આપ (અ.સ.)ની શાનમાં બહુજ વખાણ કર્યા અને મોઅમીનના હાકીમ (વલી) હોવાની આયત નાઝિલ ફરમાવી. તેનું વર્ણન અમોએ ખુલાસાથી તફ્સીરમાં લખેલ છે.

આ તારીખે રોઝો રાખવો અને ગુસ્લ કરવું સુન્નત છે, અને શક્તિ પ્રમાણે સદકો કરવો. ઇદે ગદીરના દિવસે જે બે રક્અત જે સમયે, જેવી રીતે પઢવાની લખી છે, તે

જ રીતે આ દિવસે પણ પઢે. તેનો સવાળ પણ ઘણો વારીદ થયો છે. આજે પઢવાની દુઆ ઘણી મોટી છે, તેથી લખી નથી.

આ મહિનાની પરચીસમી તારીખે હઝરત અલી (અ.સ.), જનાબે ફાતેમા (સ.અ.), ઇમામે હસન (અ.સ.) અને ઇમામે હુસૈન (અ.સ.)ની શાનમાં હલઅતાનો સૂરો (સૂરએ દહર) નાઝિલ થયેલ છે, અને તેનું કારણ એ છે કે એક વખત ઇમામ હસન (અ.સ.) અને ઇમામે હુસૈન (અ.સ.) બિમાર થઇ ગયા. તેઓને જોવા માટે રસૂલે ખુદા (સ.અ.વ.) ગયા. આપે ફરમાવ્યું કે અલી (અ.સ.), ફાતેમા (અ.સ.), હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) નજર કરે કે શિફા થશે, તો ત્રણ ત્રણ રોઝા રાખીશું. જ્યારે શિફા થઇ, ત્યારે તે ચારેય ખુશ્ખુશ્વાર અને તેઓની ખાદેમા જનાબે ફીઝ્ઝા, એમ પાંચેય ખુશ્ખુશ્વારોએ રોઝા રાખ્યા, પણ ઇફતાર માટે કંઈ ન હોવાથી અલી (અ.સ.) શમઉન ચહૂદી પાસેથી થોડી ઉન કાંતવા માટે લાવ્યા અને તેની મજૂરી ત્રણ સાઅ જવ નક્કી કરી કે જનાબે ફાતેમા (અ.સ.) ઉનનો એક ભાગ લઇ કાંતે અને એક સાઅ

જવ મજૂરીમાં લે. પહેલા દિવસે આપે ઉનનો એક ભાગ કાંતી એક સાઝ જવ મજૂરીના દળીને પાંચ રોટીઓ પકાવી. સાંજે અલી (અ.સ.), રસૂલે ખુદા (સ.અ.વ.) સાથે નમાઝ પઢીને ઘરે આવ્યા. જનાબે ફાતેમા (સ.અ.)એ પાંચ રોટીઓ હાજર કરી અને જમવાની તૈયારી કરી, ત્યાં મિસ્કીને આવીને અવાજ આપી કે: “અય અહલેબૈતે મોહમ્મદ (સ.અ.વ.)! તમારા ઉપર સલામ થાય! હું મિસ્કીન છું, મને ખાવાનું આપો કે ખુદા તમોને બેહિશ્તનું ખાણુ અતા કરે.”

આ સાંભળીને અલી (અ.સ.)એ પોતાના ભાગની રોટી આપવા ચાહ્યું. ત્યાં સર્વે જણે પોતપોતાના ભાગની રોટી આપવા ચાહ્યું, એ સર્વે રોટીઓ મિસ્કીનને આપી દીધી અને પાણીથી રોઝો ખોલી બીજે દિવસે રોઝો રાખ્યો.

બીજે દિવસે પણ પહેલા દિવસની જેમ તમામ બાબતો થઈ અને કોઈએ “યતીમ છું” કહીને ખાવાનું માંગ્યું અને એ સર્વે રોટી તેઓએ આપી દીધી.

ત્રીજે દિવસે પણ એમ જ ભૂખ્યા રોઝો રાખ્યો અને

ઘફ્તાર વખતે કેદીએ આવીને ખાવાનું માંગ્યું, ત્યારે તેને પણ આપી દીધું. સવારે ખુદાએ તેઓની શાનમાં હલઅતાનો સૂરો (સૂરે દહર) મોકલ્યો. જેનું બયાન તફ્સીરમાં ખુલાસાથી લખ્યું છે.

રસૂલે ખુદા (સ.અ.વ.), અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ઘરે ગયા. આપે જોયું કે ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસૈન (અ.સ.) એક તો બીમારી ભોગવી ઉઠેલા છે અને ત્રણ દિવસથી કાંઈ ખાવાનું મળ્યું નહીં, તેથી સુકાઈ ગયા હતા અને ધ્રુજતા હતા અને ફાતેમા (સ.અ.) ઇબાદતની મેહરાબમાં ઉભા છે અને ભૂખના કારણે પેટ પીઠ સાથે મળી ગયું હતું અને આંખમાં ખાડા પડી ગયા હતા. જ્યારે નમાઝ પઢી રહ્યા, ત્યારે ખુદાએ બેહિશ્તમાંથી જમવાનો ખ્વાન મોકલ્યો અને પંજેતને પાકે તે ખાણું ખાધું એટલે સુધી કે સાત દિવસ સુધી તેમાંથી ખાધું, તો પણ ખલાસ થયું નહીં.

ઇમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે કે એ ખ્વાન અમારી પાસે છે. અને બારમા ઇમામ (અ.સ.)ની

પાસે પણ હશે અને તેમાંથી ખાશે.

તો આ ખુશીના કારણે આજે મિસ્કીનો અને ચતીમોને જમાડવા અને નેઅમતની શુક્ર ગુઝારી માટે રોઝો રાખવો તેમજ ઝિયારત પઢવી અને ઝિયારતનું ગુસ્લ કરવું.

માહે મોહરમ

માહે મોહરમના આ'માલ

હઝરત અલી (અ.સ.)થી રિવાયત છે કે મોહરમની ૧૧મી, ૧૪મી અને બીજી રિવાયત મુજબ ૨૨મી તારીખ 'નહસે અકબર' છે.

મોહરમની પહેલી તારીખનો રોઝો રાખવો સુન્નત છે.

ઇમામે અલી રઝા (અ.સ.) ફરમાવે છે કે પેહલી તારીખે હઝરત ઝકરિયા (અ.સ.)એ ખુદા પાસે ફરઝંદ માટે દુઆ કરી, તે કબૂલ થઇ. આજે જે કોઇ રોઝો રાખે અને દુઆ કરે તો ખુદા કબૂલ ફરમાવે.

ત્રીજી તારીખ મુબારક છે. તે દિવસે હજરત યુસુફ (અ.સ.) કૂવામાંથી બહાર નીકળ્યા છે, તો જે કોઈ ત્રીજી તારીખે રોઝો રાખે, તો તેના સપ્ત કામો ખુદા આસાન કરે.

પાંચમી તારીખે મૂસા (અ.સ.) દરિયામાંથી પસાર થયા છે.

સાતમી તારીખે મૂસા (અ.સ.) તૂરના પર્વત ઉપર ગયા.

નવમી તારીખે યુનુસ (અ.સ.) માછલીના પેટમાંથી બહાર નીકળ્યા છે.

આ મહિનાની નવમી તથા દસમી તારીખે રોઝો રાખવો નહીં, કારણકે આ તારીખે બની ઉમૈયાવાળાઓએ હજરત ઇમામે હુસૈન (અ.સ.)ને કતલ કરવાના સબબથી બરકત જાણીને રોઝા રાખ્યા હતા. અહલેબૈત (અ.મુ.સ.)થી તે બંને તારીખના રોઝાની ઘણી જ બૂરાઈ વારીદ થઈ છે. બની ઉમૈયા બરકત માટે મોહરમની દસમી તારીખે આખા વર્ષ માટે સંગ્રહ કરતા હતા. તેથી જ ઇમામ અલી રઝા (અ.સ.) ફરમાવે છે કે “આશૂરાના દિવસે જે શખ્સ પોતાના

કામની હાજત માટે કોશિશ ન કરે અને કોઈ કામ માટે જાય નહીં, તો ખુદાએ તઆલા તેની દીન અને દુન્યાની હાજતો પૂરી કરે.”

મોહરત્મની દસમી તારીખ ઇમામે હુસૈન (અ.સ.) અને આપના સાથીઓની શહાદતનો દિવસ છે.

સત્તરમી તારીખે હાથીવાળા ખાન-એ-કાઅબાને બરબાદ કરવા માટે આવ્યા હતા. તેઓ ઉપર અઝાબ નાઝિલ થયો.

આ મહિનાની રપમી તારીખે ઇમામે ઝયનુલ આબેદીન (અ.સ.)ની શહાદત છે.

ઇમામ અલી રઝા (અ.સ.) ફરમાવે છે:

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) મોહરત્મની પહેલી તારીખે બે રકઅત નમાઝ પઢતા હતા અને નમાઝ ખતમ કર્યા પછી દુઆ માટે હાથ ઉંચા કરીને નમ્રતા અને આહોઝારીથી નીચેની દુઆ ત્રણ વખત પઢતા હતા:

બિસ્મિલ્લાહિરૃ રહુંમાનિરૃ રહુંમ

અલ્લાહુમ્મ અન્તલે એલાહુલે કુંદીમો
 વ હાઝંહી સનતુને જદીદતુને ફઅસ્અલોક
 ફીહલે ઈસ્મત મેનશશયેતોને વલેકુવ્વત અંલા
 હાઝંહિને નફસિલે અમ્મારતે બિસેસૂએ વલે
 ઇશ્તેગોલ બેમા યોકુંરેરેબોનીં એલયેક યા
 કરીમો યા ઝંલે જલાલે વલે ઇક્રામે. યા
 એમાદ મલ્લા એમાદ લહુ યા ઝંખીરત
 મલ્લા ઝંખીરત લહુ યા હિંરેઝ મલ્લા હિંરે
 ઝલહુ યા ગેયાસં મલે લા ગેયાસં લહુ યા
 સનદ મલે લા સનદ લહુ યા કન્ઝ મલે લા
 કન્ઝ લહુ યા હુંસનલે બલાએ યા અંઝીમરે

રજાએ યા ઈઝઝઝ ઝાઝઝાએ યા મુનેકેઝલે
 ગાંકાં યા મુનેજેયલે હલકા યા મુનેઝમો યા
 મુજેમોલો યા મુફેઝલો યા મુહુસેનો
 અન્તલેલઝાં સજદ લક સવાદુલે લયલે વ
 નૂરને નહારે વ ઝવેઉલે કમરે વ
 શોઝાંઉંશશમ્સે વ દવિચ્ચુલે માએ વ
 હુંફીફુશશજરે યા અલ્લાહો લા શરીક લક
 અલ્લાહુમ્મજેઝલ્ના ખંયેરમે મિમ્મા યઝુન્નૂન
 વગાંફિરે લના માલા યઝલમુન વલા
 તોઆખિંઝના બેમા યકૂલૂન હુંસ્બેયલ્લાહો
 લા એલાહ ઇલ્લા હોવ ઝલયહે તવકકલ્તો

વ હોવ રબ્બુલે અંરેશિલે અંઝીમે, આમન્ના
 બેહી કુલ્લુમ્ મિને ઈન્દે રબ્બેના વમા
 યઝ્કેકરો ઇલાં ઓલુલે અલ્બાબે રબ્બના
 લા તોઝિગો કૌલૂબના બઅંદ ઇઝ્ હદયેતના
 વ હબ્લના મિલ્લદુન્ક રહૂમતને ઇન્નક
 અન્તલે વહૌબ.

આશૂરાનો અહવાલ અને ઝિયારતે આશૂરા

મોહર્રમની પહેલી તારીખથી દસ તારીખ સુધી ઇમામ
 હુસૈન (અ.સ.) ગમગીન અને મશગૂલ રહ્યા અને દસમી
 તારીખે શહીદ થયા. એ દિવસોમાં ગમની મજલિસો કરવી
 અને ગમગીન રહેવું જોઈએ. ઉપરાંત એ ખુઝુર્ગવારોની
 મુસીબતોને યાદ કરે. કેટલાક ઓલમા કહે છે કે એ
 દિવસોમાં કેટલીક લજ્જત તર્ક કરે.

ઇમામ અલી રઝા (અ.સ.) ફરમાવે છે:

મોહર્રમ એવો મહિનો હતો કે કાફીરો પણ આ મહિનામાં જંગ કરવી હરામ જાણતા હતા. પણ આ ઉમ્મતના મુનાફીકોએ અમારું ખૂન કરવું હલાલ જાણ્યું, અમારી હુરમત ખરબાદ કરી, અમારી ઔરતો અને બચ્ચાઓને કેદ કર્યા, ખયમાઓમાં આગ લગાડી, માલ તથા સામાન લૂંટી લીધા અને અમારા બારામાં હઝરતે રસૂલે ખુદા (સ.અ.વ.)ની હુરમતનો પણ ખ્યાલ રાખ્યો નહીં, ઇમામે હુસૈન (અ.સ.)ની મુસીબતે અમારી આંખોને જખ્મી કરી નાખી અને આંખોમાંથી આંસુ જારી થયા. અમારા સગાઓને ઝાલિમોએ ઝલીલ કર્યા. કરબલાનો ભયંકર બનાવ કયામત સુધી અમારી નજરમાં રહેશે, માટે એ મુસીબત ઉપર રોવાવાળાઓએ રોવું જોઈએ. એ જનાબ પર રોવાથી મોટા-મોટા ગુનાહ માફ થાય છે.

પછી આપ (અ.સ.)એ ફરમાવ્યું કે મારા વાલીદ ઇમામે મૂસા કાઝિમ (અ.સ.)ને મોહર્રમનો ચાંદ જોયા પછી કોઈ હસતા જોવું ન હતું, પહેલી તારીખે ગમ તથા મુસીબતના

આસાર જાહેર થતા હતા, દસમી તારીખે રોવા અને ગમ કરવામાં મશગૂલ રહેતા હતા અને કહેતા કે આજે ઇમામે હુસૈન (અ.સ.)ની શહાદતનો દિવસ છે.

બીજી હદીસમાં ફરમાવ્યું કે મારા જદ હઝરત હુસૈન (અ.સ.) શહીદ થયા, ત્યારે આસમાનથી લોહી અને લાલ માટી વરસી. એ હઝરત ઉપર એટલું રડે કે આંસુ જારી થાય, તો ખુદા તમામ નાના અને મોટા ગુનાહ માફ કરી આપે. અને ચાહે કે મરવા પછી કોઈ ગુનાહ ન રહે, તો ઇમામે હુસૈન (અ.સ.)ની ઝિયારત કરે અને ચાહે કે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની સાથે બેહિશ્તના ગુરફામાં રહે, તો ઇમામે હુસૈન (અ.સ.)ના કાતિલ પર લઅનત કરે, અને ચાહે કે કરબલાના શહીદોનો સવાબ મળે, તો જ્યારે ઇમામે હુસૈન (અ.સ.)ની મુસીબત યાદ આવે, ત્યારે કહે કે:

یا لایمتની کونتو مائکومہ ફائکૂમ
ફવેલનૈ અંઝીમા.

“અય કાશ! હું તમારી સાથે હોત, તો મોટો મરતબો પામતે.”

અને ચાહે કે બેહિશ્તમાં આલી દરજ્જામાં રહે, તો અમારા ગમમાં ગમ કરે અને અમારી ખુશીમાં ખુશી કરે.

જે કોઈ બરકત જાણી આશૂરાના દિવસે કાંઈ ચીજ સંગ્રહ માટે લાવે, તો તે મુબારક નહીં થાય અને ક્યામતના દિવસે ઓબયદુલ્લાહ ઇબ્ને ઝિયાદ અને ઇબ્ને સાઅદની સાથે તેનો હશર થાય. આશૂરાના દિવસે પોતાના વ્હાલામાં વ્હાલા સગાના ગમ જેવો ગમ કરે, માતમ તથા રોવામાં મશગૂલ થાય.

ફાકો કરે એટલે કાંઈ પણ ખાંઈ-પીવે નહીં. અસર પછી ફાકો તોડે. આશૂરાના દિવસે રમત ગમતમાં મશગૂલ થાય નહીં તેમજ હસે નહીં. આશૂરાના દિવસે ઇમામે હુસૈન (અ.સ.)ના કાતિલો પર હજાર વખત લઅનત આ પ્રમાણે કરે :

अल्लाहुम्भले अँने कँतलतले हुँसयेन.

ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

આશૂરાના દિવસે જે કોઇ હજાર વખત ફુલ્હોવલ્લાહનો સૂરો પઢે, તેના ઉપર ખુદા રહેમતની નજર કરે અને જેના ઉપર ખુદા રહેમતની નજર કરે, તેને હરગીઝ અઝાબ નહીં કરે.

આશૂરાની રાત્રે પણ જાગે અને ગમ તથા મુસીબતમાં રડે, કારણકે તે રાત્રે ઇમામે હુસૈન (અ.સ.) તથા આપના અસ્થાબો દુશ્મનોના હજારો માણસો વચ્ચે જાગ્યા અને શહાદતની તૈયારી કરી હતી.

ઝિયારતે આશૂરા

હઝરત ઇમામે જઅફરે સાદિક અ.સ.સે મનકૂલ હય કે શબે આશૂર ઔર રોઝે આશૂર ઇમામે હુસયન અ.કી કબ્રકી ઝિયારત કી જાએ તો કયામત કે રોઝ શોહદાએ કરબલાકે માનીંદ ખુન-આલુદા ઉઠાયા જાએગા ઔર ઐસા સવાબ મિલેગા કે હઝરત ઇમામે હુસૈન (અ.સ.) કે સાથ શહીદ હુવા.

ઇમામે હુસૈન (અ.સ.) કી ઝિયારત કરનેસે બેહિશ્ત વાજિબ હોતી હય. માલિકે ઝોહજાસે રિવાયત હય કે ઇમામે મોહમ્મદ બાકિર (અ.સ.)ને ફરમાયા કે દસવી મોહર્મકો અગર ઇમામે હુસયન (અ.સ.) કી ઝિયારત કી જાએ, તો ઉસ્કો દો હજાર હજ, દો હજાર ઉમરાહ ઓર દો હજાર જેહાદ કા ઐસા સવાબ મિલેગા કે જેસા રસૂલે ખુદા (સ.અ.વ.) ઓર અઇમ્મએ તાહેરીન (અ.મુ.સ.)કે સાથ શરીફ હોકે ક્રિયા હો.

માલિકને અર્ઝ કી કે, મય આપ પર ફિદા હો જાઉં! અગર કોઇ દૂર રહેતા હો તો ઉસકે લિયે કિત્ના સવાબ હય?

આપને ફરમાયા કે, રોઝે આશૂરા સેહરામેં, યા ઘરમેં ઊંચે કોઠે પર ચલા જાએ ઓર હઝરતકી કબ્રકી તરફ ઇશારા કરકે સલામ કરે, ઓર આપકે કાતિલ પર નફરીન કરનેકી કોશિશ કરે, ઓર દો રકઅત નમાઝ અદા કરે. યેહ આ'માલ દો પહરકે કબ્લ હોના ચાહીએ. બાઅદ ઇમામે હુસૈન (અ.સ.)કી મુસીબત પર ગિર્યા

કરે. ઘરમેં સફે માતમ બિછાએ ઔર આપસમેં એક દુસરેકો તાઅઝિયત કરના ચાહીએ. અગર ઇસ તરહસે ક્રિયા જાએગા તો મંચ ખુદાકે પાસ ઝામિન હોતા હું કે વોહ તમામ સવાબ ઉસ્કો મિલેગા. જબ એક દુસરેકો મિલે તો ઇસ તરહસે તાઅઝિયતકે અલ્હાઝ અદા કરે:

અઅંઝમલ્લાહો ઔજૂરના બેમોસાંબેના
 બિલ હુંસયને અંલયહિસ્સલામ, વ જઅંલેના
 વ ઇય્યાકુમ મેનત્તાંલેબીન બેસારેહી મઅં
 વલિય્યેહિલ ઇમામિલ મહદિય્યે મિન આલે
 મોહંમદિન અંલયહેમુસ્સલામ.

ઈમામે હુસૈન (અ.સ.) કે સોગવાર ઔર અઝાદાર હોનેકી વજહસે અલ્લાહ હમ લોગોં કે અજરો સવાબકો બડા કરે, ઔર હમેં ઔર તુમ સબકો ઉન લોગોમેં શામિલ કર લે, જો કાએમે આલે મોહમ્મદ હઝરત મહદી (અ.સ.)

કે સાથ હોકર ખૂને હુસૈન કા બદલા લેનેવાલે હંચ.

અલ્કમા બિન મોહમ્મદકા બયાન હૈ કે મંચને ઇમામે મોહમ્મદ બાકિર (અ.સ.) સે અર્ઝ કી કે, રોઝે આશૂરા પઢનેકી દુઆ તાઅલીમ ફરમાઇએ કે દૂરસે ઓર કરીબસે પઢ શકું.

આપને ફરમાયા કે, પહેલે દો રકઅત નમાઝ અદા કર. ઉસ્કે બાદ ઇમામ (અ.સ.) કી કબ્રકી તરફ ઇશારા કરકે સલામ કર ઓર અગર ઇસ તરહ પઢેગા તો હઝરત કી ઝિયારત કે વક્ત જો દુઆ મલાએકા પઢતે હંચ વોહ તુને અદા કીયા ઐસા માના જાયેગા ઓર ખુદા તેરે લિએ ઇસ લાખ નેકી બક્ષેગા, ઓર ઇસ લાખ ગુનાહ માફ કરેગા, ઓર ઇસ લાખ દરબે બલંદ હોંગે ઓર ઇમામ (અ.સ.) કે સાથ જો શહીદ હુએ હંચ ઉસ્કે માનીન્દ હોગા ઓર ઉન લોગોં કે દરજોમેં શરીફ હોગા. તમામ પયગમ્બર ઓર રસૂલ ઓર વોહ હઝરાત શહીદ હુવે ઉસ વક્તસે આજ તક બિન બિન લોગોંને ઝિયારત કી હોગી વયસા સવાબ તુજે ઇસ ઝિયારતમેં મિલેગા. વોહ ઝિયારત ઇસ

તરહ કબ્રકી તરફ ઇશારા કરકે પઠી જાએ.

અસ્સલામો અંલયક યા અબ્બા
અંબદીલ્લાહ, અસ્સલામો અંલયક યબ્ન
રસૂલિલ્લાહ, અસ્સલામો અંલયક યબ્ન
અમીરિલે મોઅમેનીન વબ્ન સય્યોદિલે
વસિયીન અસ્સલામો અંલયક યબ્ન ફાતેમત
સય્યેદતે નેસાઈલ અંલમીન, અસ્સલામો
અંલયક યા સારલ્લાહે વબ્ન સારેહી વલે
વિતરલે મવતૂર, અસ્સલામો અંલયક વ
અંલલે અરવાહિલ્લતી હુંલ્લતે બેફેનાએક
અંલયકુમ મિન્ની જમીઅને સલામુલ્લાહે

અબદમ મા બકીંતો વ બકીંયલ લયલો
 વન્નહારો યા અબા અંબિદલાહે, લકંદે
 અંઝોમતિરે રઝિયતો વજલ્લત વ
 અંઝોમતીલ મુસીબતો બેક અંલયના વ અંલા
 જમીઅે અહલિલ ઇસ્લામે વ જલ્લત વ
 અંઝોમત મોસીબતોક ફિસ્સમાવાતે અંલા
 જમીઅે અહલિસ્સમાવાતે, ફલઅંનલાહો
 ઉમ્મતને અસ્સતે અસાસઝંઝુલમે વજવેરે
 અંલયકુમ અહલલબયતે વ લઅંનલાહો
 ઉમ્મતને દફઅંતકુમ અંને મકીંમેકુમ વ
 અઝાલતકુમ અંમે મરાતેબેકોમુલ્લાતી

રત્તબકોમુલ્લાહો ફીહા વ લઅંનલ્લાહો
 ઉમ્મતને કંતલત્કુમ, વ લઅંનલ્લાહુલ
 મોમહુહેદીન લહુમ બીત્તમકીને મિને
 કંતાલેકુમ બરેઅતો એલલ્લાહે વ એલયકુમ
 મિન્હુમ વ મિને અશ્યાઅહિમ વ
 અત્બાઅહિમ વ અલ્લીયાઅહિમ યા અબા
 અંબદીલ્લાહે ઇન્ની સિલ્મુલ લેમને સાલમકુમ
 વ હુરેબુલ લેમને હુરબકુમ એલા યવમિલ
 કંયામતે, વ લઅંનલ્લાહો આલ ઝીયાદિંવ
 વઆલ મરવાન વ લઅંનલ્લાહો બની
 ઉમયત કાંતેબતંવ વ લઅંનલ્લાહુબ્ન

મરજાનહ, વ લઅનલ્લાહો ઉમરબન સઅંદ,
 વ લઅંનલ્લાહો શિમરંવ વ લઅંનલ્લાહો
 ઉમ્મતન અસરજત વ અલજમત વ
 તનકકંબત લેકેતાલેક બે અબી અન્ત વ
 ઉમ્મી, લકંદ અંઝોમ મોસોબી બેક,
 ફઅસ્અલુલ્લાહલ્લઝી અકરમ મકામક, વ
 અકરમની બેક વ અંચરઝોકેની તંલબ
 સાંરિક મઅં ઇમામિમ મન્સૂરિમ મિન
 અહલેબય્તે મોહંમદિન સંલ્લલ્લાહો અંલય્હે
 વ આલેહી, અલ્લાહુમ્મજઅંલની ઈન્દક
 વજ્જહમ બિલ્હુસય્ને અંલયહિસ્સલામો ફિદુન્યા

વલ્ આખેરું, યા અબા અંબ્દીલાહે ઇન્ની
 અતકુંરબો એલલાહે વ એલા રસૂલેહી વ
 એલા અમીરિલ મોઅમેનીન વ એલા
 ફાતેમહ, વ એલલ હુંસને વ એલચક
 બેમોવાલાતેક વ બિલ બરોઅતે (મિમ્મન
 કાંતલક વ નસંબ લકલ હુંરબ વ બિલ
 બરોઅતે મિમ્મન અસ્સસ અસાસઝું ઝુંદમે
 વલજવેરે, અંલચકુમ વઅબરઓ એલલાહે
 વ એલા રસૂલેહી) મિમ્મન અસ્સસ અસાસ
 ઝાંલેક વ બના અંલચહે બુન્યાનોહૂ વ જરા
 ફી ઝુંદમેહી વ જવેહી અંલચકુમ વ અંલા

અશ્યાએકુમ બરેએતો એલલાહે વ એલચકુમ
 મિન્હુમ વ અતકરેબો એલલાહે સુંમ
 એલચકુમ બેમોવાલાતેકુમ વ મોવાલાતે
 વલિય્યોકુમ વ બીલે બરોઅતે મીન
 અએદાએકુમ વન્નાસેબીન લકોમુલે હુંરેબ
 વ બિલબરોઅતે મિને અશ્યાએહિમ વ
 અતબાએહિમ ઇન્ની સિલમુલે લેમને
 સાલમકુમ વ હુંરેબુલે લેમને હુંરબકુમ વ
 વલિય્યુને લેમને વાલાકુમ વઅંદુવ્વુલે લેમને
 આંદાકુમ ફઅસેઅલુલાહલ્લઝી અકરમની
 બેમઅરેફતેકુમ વ મઅરેફતે અલ્લેયાએકુમ

વ રઝકુંનિલે બરોઅત મિને અઝંદાએકુમ
 અંચજેઝંલની મઝંકુમ ફિદુન્યા વલે
 આખેરહે, વ અંચોસંબ્બેતલી ઈન્દકુમ કંદમ
 સિદેકિને ફિદુન્યા વલઆખેરહે, વ અસ્અલોહૂ
 અંચોબલ્લેગૈનિલે મકામલે મહૂમૂદ લકુમ
 ઈન્દલ્લાહે વ અંચરઝોકુંની તંલબ સારી
 મઝં ઈમામિને હોદને ઝાહેરિને નાતેકિમ
 બિલે હુકુંકું મિન્કુમ વ અસ્અલુલ્લાહ
 બેહુકુંકુંકુમ વબીશશ અનિલે લઝી લકુમ
 ઈન્દહૂ અંચોઝંતેયની બેમોસાંબી બેકુમ
 અફઝંલ મા યોઝંતી મોસાંબમ બે

મોસીબતેહી મોસીબતમે મોઅઅંઝંમહા,
 વ અઅંઝંમ રઝીચતહા ફિલે ઇસ્લામે વ
 ફી જમીઈસ્સમાવાતે વલ્અરઝે અલ્લાહુમ્મજ
 અંલ્ની ફી મકાંમી હાઝાં મિમ્મને તનાલોહૂ
 મિન્ક સંલવાતુંવે વરહૂમતુંવે વમઁફેરતુને
 અલ્લાહુમ્મજ અંલે મહૂયાય મહૂયા
 મોહૂમ્મદિંવ વ આલે મોહૂમ્મદે વ મમાતી
 મમાત મોહૂમ્મદિંવે વઆલે મોહૂમ્મદે,
 અલ્લાહુમ્મ ઇન્ન હાઝાં યવ્મુને તબરકતે
 બેહી બનૂ ઉમય્યહ, વબ્નો આકેલતિલે
 અકબાદિલે લઈનુબ્નુલે લઈને અંલા લેસાનેક

વ લેસાને નબિયોક સંલ્લલાહો અંલયહે વ
 આલેહી ફી કુલ્લે મર્તોનિને વમર્કોફિવે વકંફ
 ફીહે નબીયોક સંલ્લલાહો અંલયહે વ
 આલેહી, અલ્લાહુમ્મલ્લેને અબા સુફ્યાન
 વ મોઆવેયત(બન અબી સુફ્યાન) વ
 યઝીદબન મોઆવેયહ, અંલયોહિમ મિન્કલ
 લઅંનતો અબદલ આબેદીન, વ હાઝા યબ્મુન
 ફરેહંતે બેહી આલો ઝિયાદિને વ આલો
 મરવાન બેકંત્લેહેમુલે હુંસયન સંલવાતુલ્લાહે
 અંલયહે, અલ્લાહુમ્મ ફઝાઈફે અંલયહે
 મુલ્લઅંન મિન્ક વલે અંઝાબ(લઅલીમ)

અલ્લાહુમ્મ ઇન્ની અતકુંરબો એલયક ફી
 હાઝંલે યવમે વ ફી મકકેફી હાઝં વ અય્યામે
 હુંયાતી બિલે બરોઅતે મિન્હુમ વલ્લઅંનતે
 અંલયહિમ વ બિલે મોવાલાતે લેનબિય્યેક
 વ આલે નબિય્યેક અંલયહે વ અંલયહે
 મુસ્સલામ.

આશૂરકે અલાવાહ ઇસ તરહ પડહા જાએ,

“અલ્લાહુમ્મ ઇન્ન હાઝં યવમુન્
 તબરૂકતે બેહી બનૂ ઉમ્મયહ”

કે બજાએ

“અલ્લાહુમ્મ ઇન્ન યવ્મ કુંતલીલે હુંસઅને

સૈલવાતોક અંલયહે યવ્મનં તબરૃકતં બેહી
બનૂ ઉમયયહૃ”કહે.

બાદ ઉસકે ૧૦૦ મરતબા પડહે,

અલ્લાહુમ્મલે અંને અવ્વલ ઝાંલેમિન
ઝાંલમ હુંકુંકું મોહુંમ્મદિને વ આલે
મોહુંમ્મદિને વ આખૈર તાબેઈને લહૂ
અંલા ઝાંલોક અલ્લાહુમ્મલે અંનિલે
અંસૌબતિલે લતી જાહદતિલે હુંસયન
અંલયહિસ્સલામ, વશાયઅંતે વ બાયઅંતે
વ તાબઅંતે અંલા કૈત્લેહી અલ્લાહુમ્મલે
અંન્હુમૈ જમીઆં.

બબદ ઉસકે ૧૦૦ મરતબા પડહે,

અસ્સલામો અંલયક યા અબા અંબદીલાહે
વ અંલલ અરવાહિંલ્લતી હુંલ્લત બેફેનાએક
અંલયક મિન્ની સલામુલાહે અબદન
માબકીતો વ બકૈયલ લયલો વન્નહારો,
વલા જઅંલહુલાહો આબેરલ અંહદે મિન્ની
લે ઝિયારતેકુમ, અસ્સલામો અંલલ હુંસયને
વ અંલા અંલીયિબનિલ હુંસયને વ અંલા
અલાદિલ હુંસયને વ અલા અરુંહાબિલ
હુંસયને.

બાદ ઉસકે ૧ મરતબા પડહે,

अल्लाहुम्म षुँरुँसुँ अन्त अव्वल
 ङुँलेमिभुँ, षिलुँ लअँने मिन्नी वण्डअँ षेडी
 अव्वलने सुँम्मरुँसानेय, वरुँसानेसुँ. वरुँषेअँ,
 अल्लाहुम्मलुँ अँने यतीद षुँमेसवँ वलुँअँने
 अँषुँयुँदल्लाडिषुँन ङियादिवँ वषुँन मरुँजानत
 व उँमरुँषुँन सअँदिवँ व शिभरुँवँ व आल
 अषुँसुँइयान व आल ङियादिवँ व आल
 मरुँवान अेला यवुँमिलुँ कुँयामडुँ.

इीर सजडेमें जाअे और घस तरह पडहे :

अल्लाहुम्म लकलुँ उँभुँदो उँभुँदुँ शुकुँरीन
 लक अँला मोसुँाषेडिभुँ अलुँडुँभुँदो लिल्लाडे
 अँला अँगीभे रङियती अल्लाहुम्मरुँ सुँकुँनी

શકાઅંતલે હુંસચને યવ્મલે વોરૂદે વ સંબિલ્લી
કંદમ સિંદકિને ઈન્દક મઅંલે હુંસચને વ
અસંહોબિલે હુંસચિલે લઝીન બઝંલૂ
મોહજહુમ દુનલે હુંસચને અંલયોહિસ્સલામ.

ઇમામે મોહમ્મદે બાકિર અ.સ.ને ફરમાયા કે આશૂરા
કે અલાવા હંમેશા યે ઝિયારત પડહી જાયે, તો ઉસ્કા જો
સવાબ હય વોહી મીલેગા. ઇસ ઝિયારત કે બાદ દો રકઅત
સુન્નત નમાઝ પડહે, બાદ યે દુઆ પડહે:

દુઆ-એ-અલ્કમા

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીમ

યા અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો

યા મોજબ દઅવતિલે મુઝંતરેરીન, યા

કાશેફ કોરબિલે મકરૂબીન, યા ગૈયાસંલે
 મુસ્તગીસીન, વ યા સંરિખંલે મુસ્તસંરેખીન,
 વ યા મન્હોવ અકરૂબો એલય્ય મિન્હુંબલિલે
 વરીદે વયા મને યહુંલો બયનેલે મરએ વ
 કુંલબેહી, વ યા મન્હોવ બિલે મન્ઝરિલે
 અઅંલા વ બિલે ઓફોકિલે મોબીને, વ યા
 મનેહોવરે રહુંમાનુરે રહીમો અંલલે
 અંરેશિસ્તવા વ યા મયં યઅંલમો ખાંએનતલે
 અઅંયોને વમા તુખાંફિસ્સૌદૂરો વયામલે
 લાયખંફા અંલયહે ખાંફેયતુને વયામલે
 લાતશતબેહો અંલયેહીલે અસંવાતો વયામલે

લાતો ગૌલે તૌહુલ હૌજાતો વયામલ
 લાયુબ્રેમોહો ઇલ્હૌહુલ મોલીહૌહીન વ
 યામુદરેક કુલ્લે ફવૈતિવં વયા જામેઅં કુલ્લે
 શમૈલિવં વયાબારેઅન નોફૂસે બઅંદલ મવૈતે
 વયામન્હોવ કુલ્લ યવૈમિન ફીશઅનિન
 યાકૌઝૈયલ હૌજાતે યા મોનફૈફેસલ કોરોબાતે
 યામોઅંતૈયસ સુઅલાતે યાવલિયર ૨ગંબાતે
 યાકાફેયલ મોહિમ્માતે યા મંચકફી મિન્કુલ્લે
 શય્ઠવં વલાયકફીમિન્હો શયેઉન ફિસ્સમાવાતે
 વલ અરૈઝ અસ્અલોક બેહુકફે મોહુમ્મદિન
 ખાંતમિન્નબિયીન વ અંલીયીન અમીરીલ

મોએમોનીન વબેહુંકુંકું ફાતેમત બિન્તે
 નબિયેક વ બેહુંકુંકુંલે હુંસને વલે હુંસયને
 ફઈન્ની બેહીમ અતવજજહો એલયેક ફી
 મકાંમી હાઝાં વ બેહીમ અતવસ્સલો વ
 બેહીમ અતશફફઓ એલયેક વ બે હુંકુંકુંહીમ
 અસ્અલોક વઉકુંસેમો વઅઅંઝેમો અંલયક
 વબિશશઅ નિલ્લઝી લહુમ ઈન્દક વબિલે
 કુંદરિ લ્લઝી લહુમ ઈન્દક વબિલે
 લઝીફઝ્લ્લહુમ અંલલે ઑલમીન, વબીસ્મે
 કલ્લઝી જઅંલ્લહૂ ઈન્દહુમ વ બેહી
 ખંસંસંતહુમ દુનલે ઑલમીન વબેહી

અબન્તલુમ વ અબન્ત ફઝલુમ મીન
 ફઝલીલ ઑલમીન હતા ફક ફઝલોલુમ
 ફઝલલ્ઑલમીન જમીઅન અસ્અલોક
 અન્તોસલ્લેય ઑલા મોહુમ્મદિવ વઆલે
 મોહુમ્મદિવ વઅન તકશેફ અન્ની ગમ્મી
 વ હમ્મી વકરેબી વતકફેયનિલ મોહિમ્મ
 મિન્ઓમૂરી વતકફઝેય અન્ની દરની
 વતોજિરની મેનલ ફકરે વતોજિરની મેનલ
 ફકતે વતુગનેયની અનિલ મસ્અલતે એલલ
 મખલુકીન, વ તકફેયની હમ્મ મન અખાફો
 હમ્મહૂ વ ઉંસ્ર મન અખાફો ઉંસ્રહૂ

વહૈઝૂનત મન અખૌફો હૈઝૂનતહૂ વશરે
 મન અખૌફો શરેરહુ વમકેર મન અખૌફો
 મકેરહૂ વ બગૈયમન અખૌફો બગૈયહુ વ
 જવેર મન અખૌફો જવેરહુ વસુલ્તૌન મન
 અખૌફો સુલેતૌનહૂ વકયેદ મન અખૌફો
 કયેદહૂ વમકેદોરત મન અખૌફો મકેદોરતહૂ
 અંલય્ય વતરુદ અંની કયેદલે કયેદતે
 વમકેરલે મકેરતે અલ્લાહુમ્મ મન અરાદની
 (બે સુઈને) ફઅરિદેહો વમને કાદની ફકિદેહો
 વસૈરિફે અંની કયેદહૂ વમકેરહૂ વ બઅસહૂ
 વ અમાનિયહૂ વમનઅંહો અંની કયેફશેઅંત

વઅન્ના શેઅંત અલ્લાહુમ્મશૌગૅલ્હો અંન્ની
 બેફકૅરિલૅ લાતજૅબોરોહૂ વબે બલૌ ઇલૅ
 લાતસ્તોરોહૂ વબે ફાકૅતિલૅ લાતસુદોહા વબે
 સુકૅમિના લાતોઆફીહૅ વઝુંલિલાલૅ
 લાતોઈઝૅઝોહૂ વબે મસ્કનતિલૅ લા
 તજૅબોરોહા અલ્લાહુમ્મ ઝૅરીબ બિઝૅઝુંલે
 નસૅબ અંયૅનયૅહે વઅદૅબિલૅ અંલયૅહિલૅફકૅરૅ
 ફીમન્ઝેલેહી વલૅઈલ્લત વસ્સુકૅમ ફી બદનેહી
 હૅત્તા તશૅગૅલહૂ અંન્ની બેશુૅલીને શાગૅલિને
 લાફરાગૅલહૂ વ અન્સેહી ઝિંકૅરી કમા અને
 સપ્તાહૂ ઝિંકૅરક વ ખુંઝૅ અંન્ની બે સમ્મૅહી

વબસંરેહી વલેસાનેહી વયદેહી વરિજલેહી
 વકુંભેહી વજમીએ જવારેહી વઅદખિલે
 અંલયહે ફી જમીએ ઝાલેકસે સુકુંમ વલા
 તરફેહી હંત્તા તજઅંલ ઝાલેક લહૂ શુગ્લને
 શાગેલમ બેહી અંની વઅંને ઝિંકરી વકફેની
 યા કાફેય માલા યકફી સેવાક ફઇન્નકલે
 કાફી લા કાફેય સેવાક વ મુફરેજુન લા
 મુફરેજ સેવાક મોગીસુંલે લામોગીસં સેવાક
 વજારૂને લાજાર સેવાક ખાંબ મને કાન
 જારોહુ સેવાક વમોગીસોહુ સેવાક વ
 મફઝઓહુ એલા સેવાક વ મહરબહુ એલા

સેવાક વમલજઓહુ એલા ગંચરેક વ મન્જાહો
 મિમં મખંલુકિને ગંચરેક ફઅન્ત સંકંતી
 વરજાઈ વમફ ઝઈ વમહરબી વ મલજાઈ
 વ મન્જાય ફબેક અસ્તફતેહો વબેક
 અસ્તજેહો વ બેમોહંમદિવં વ આલે
 મોહંમદિને અતવજહો એલચક વ
 અતવસ્સલો વ અતશફઓ ફઅસ્અલોક યા
 અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો ફલકલે
 હંમદો વલકશી શુકરો વએલચકલે મુશતકા
 વઅન્તલે મુસ્તઓનો ફઅસ્અલોક યા
 અલ્લાહો યા અલ્લાહો યા અલ્લાહો બેહંકંકે

મોહુંમ્મદિવં વ આલે મોહુંમ્મદિનં વ
 અન્તકેશેફ અંન્ની ગંમ્મી વહમ્મી વકરેબી
 ફીમકાંમી હાઝાં કમા કશફત અંને નબિય્એક
 હમ્મહૂ વ ગંમ્મહૂ વ કરેબહૂ વ કફતહૂ
 હવેલ અંદુવેહી ફકેશિફ અંન્ની કમા કશફત
 અંન્હો વફરેરિજે અંન્ની કમા ફરજેત અંન્હો
 વકફેની કમા કફતહૂ વસંરિફે અંન્ની હવેલ
 મા અખાંફો હવેલહૂ વમઊનત માઅખાંફો
 મઊનતહૂ વહમ્મ માઅખાંફો હમ્મહૂ બેલા
 મઊનતીન અંલા નફસી મિન ઝાંલેક
 વસંરિફેની બેકંઝાંએ હંવાએજી વકેફાયતે

મા અહમ્મની હમ્મોહુ મિનેઅમ્મે આખેરતી
 વદુન્યાય યા અમીરલે મોઅમેનીન વયા
 અબા અંબદીલ્લાહે અંલયક મિન્ની
 સલામુલ્લાહે અબદમ્ માબકીંતો વબકેયલે
 લયલો વન્નહારો વલા જઅંલહુલ્લાહો
 આખેરલે અંહદે મિને ઝિયારતેકોમા વલા
 ફરેર કંલ્લાહો બરની વ બયેનકોમા.
 અલ્લાહુમ્મ અહંયેની હંયાત મોહંમદિવે
 વઝુંરેરીયતેહી વઅમિત્ની મમાતહુમ્
 વતવફની અંલા મિલ્લતેહિમ્ વહંશુરેની

ફીઝુમ્તેહિમં વલા તોફરરિંકે બયેની
 વબધનહુમં તંરેફત અંયેનિને અબદને ફિદુન્યા
 વલ્આખેરતે યા અમીરલે મોઅમેનીન વયા
 અબા અંબદીલ્લાહે “અતયતોકોમા ઝાએરવે”
 વ મોતવસ્સેલને એલલ્લાહે.

અગર કરબલા કે અલાવા ઔર મકામ પર હો તો
 ‘અતયતોકોમા’ કે બજાયે ‘તવજજહતો એલા ઝરીહે
 કોમા’ પડહે.

રબ્બી વરબ્બેકોમા વમોતવજ્જેહને
 એલયેહે બેકોમા વમુસ્તશફેઅંમં બેકોમા
 એલલ્લાહે ફીહાંજતી હાઝંહી ફશફાંલી
 ફઈન્ન લકોમા ઈન્દલ્લાહિલે મકાંમલે મહૂંમૂદ

વલ્જાહલે વજ્જહ વલે મન્ઝેલરે રફીઅં
 વલ્વસીલત ઇન્ની અન્કલેબો અન્કોમા
 મુન્તઝેરલે લેતનજજોઝિલ હાંજતે વકંઝાંએહા
 વનજાહ્હા મેનલ્લાહે બે શફાઅંતેકોમા
 લીએલલ્લાહે ફી ઝાંલેક ફલાઅખીંબો વલા
 યકૂનો મુનેકંલબી મુન્કંલેબને ખાંએબને
 ખાંસેરને બલેયકૂનો મુનેકંલબી મુનેકંલેબરે
 રાજેહંને મુફેલેહંને મુન્જેહંને મુસ્તજાબમ
 બેકંઝાંએ જમીએ હંવાએજી વતશફાંલી
 એલલ્લાહિને કંલખ્તો અંલા માશાઅલ્લાહો
 વલા હંવેલ વલા કુંવ્વત ઇલ્લા બિલ્લાહે

મોફવેઝંને અમરી એલલ્લાહે મુલ્જેઅને
 ઝંહરી એલલ્લાહે મોતવકેકેલને અંલલ્લાહે
 વઅકૂંલો હુંસ્બેયલ્લાહો વકફા સમેઅંલ્લાહો
 લેમને દઝાં લયસલી વરોઅલ્લાહે વ
 વરોઅકુમ્બે યા સાદતી મુન્તહા માશોઅ રબ્બી
 કાન વમાલમ્બે યશઅ લમ્યકુવં વલાહુંલ્લ
 વલા કુંવ્વાત ઇલ્લાહિલ્લાહે
 અસ્તઘ્દેઝાંકોમુલ્લાહ વલા જઅંલહુલ્લાહો
 આખોરલે અંહુદે મિન્ની એલયકોમા
 ઇન્સૈરફતો યા સય્યેદી યા અમીરલે
 મોઅમેનીન વમલ્લાય વઅન્ત યા અબા

અંબેદીલાહે યા સચ્ચેદી વસલામી અંલચકોમા
 મુત્તસેલૂમ મત્તસેલલે લયલો વન્નહારો
 વાસેલુને ઝાલેક એલચકોમા ગંચેર મહુંજૂબિને
 અં-કોમા સલામી ઇન્શાઅલાહો વ
 અસ્અલોહૂ બેહુંકેકેકોમા અચ્ચશાઅ ઝાલેક
 વચફેઅંલો ફઇન્નહૂ હુંમીદૂમ મજીદુને,
 ઇન્કેલબ્તો યા સચ્ચેદય અં-કોમા તાએબને
 હુંમોદલે લિલાહો શાકેરરે રાજેયલે
 લિલ્એજાબતે ગંચર આયેસિવં વલા કાનેતિને
 આએબને આએદરે રાજેઅંને એલા
 ઝિયારતેકોમા ગંચર રાગેબિને અંનેકોમા

વલા મિનં ઝિયારતેકોમા બદરાજે ઉંને
 ઔએદુને ઇન્શાઅલ્લાહો વલા હુંવલ વલા
 કુંવત ઇલ્લાબિલ્લાહે યાસાદતી રગિબ્તો
 એલયકોમા વએલા ઝિયારતેકોમા બઅંદ
 અને ઝહેદ ફીકોમા વફી ઝિયારતેકોમા
 અહુલુદુન્યા ફલા ખંયબનેયલ્લાહો માં
 રજવ્તો વમા અમ્મલતો ફી ઝિયારતેકોમા
 ઇન્નહૂ કુંરીબુમ મોજબ.

સૈફ બિન મોગીરા કહે છે કે સફવાને બયાન કર્યું કે
 ઇમામે જઅફરે સાદિક (અ.સ.)એ તેને (સફવાનેને)
 ફરમાવ્યું:

સફવાન! આ ઝિયારત પઢ્યા કર અને આ દુઆ

પણ પટ, હું ઝામીન છું કે જે આ ઝિયારત અને આ દુઆ
 એ હઝરતની કબ્ર પાસે અથવા દૂરથી પઢે, તો તેની
 ઝિયારત કબૂલ થશે, તેની કોશિશોનો બદલો અલ્લાહ
 આપશે, તેના સલામ ઇમામ (અ.સ.) સુધી પહોંચશે, તે
 નાઉમ્મીદ નહીં થાય. ખુદા પાસે જે નાની કે મોટી હાજત
 માંગશે તે પુરી થશે. અને આપે પોતાના આબાએ તાહેરીન
 અ.થી નક્કલ કરતા ફરમાવ્યું કે, એ ઝમાનત રસૂલે
 ખુદા (સ.અ.વ.)એ જિબ્રઇલથી અને જિબ્રઇલે ખુદાવંદે
 કરીમથી સાંભળેલ છે કે તેણે પોતાની પાક ઝાતની કસમ
 ખાધી છે કે જે કોઈ નજીકથી અથવા દૂરથી ઇમામે હુસૈન
 (અ.સ.)ની ઝિયારત કરે અને એ દુઆ પઢે, તો જે
 હાજત માંગે પુરી થશે, મારી દરગાહમાંથી નાઉમ્મીદ
 થશે નહીં. તેને બેહિશ્તનો હકદાર કરું, જહન્નમથી
 આઝાદ કરું, જેના માટે શફાઅત કરે, તેના માટે પણ
 કબૂલ કરું, પણ અહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનોના
 હકમાં શફાઅત થશે નહીં. ખુદાએ આ વાત પર
 મલાએકાને અને અમોને પણ સાક્ષી રાખ્યા છે.

અય સફવાન! જ્યારે તારા ઉપર કોઈ સપ્તી આવી પડે, ત્યારે આ ઝિયારત પઢ અને ખુદા પાસે પોતાની હાજત તલબ કર, આ ઝિયારત અને દુઆની બરકતથી (ખુદા) તારી હાજત પુરી કરશે, ભલે પછી કબરની પાસે હોય અથવા દૂર હોય. ખુદા પોતાના વાયદાથી ખિલાફ કરતો નથી. (અજમાવેલ છે.)

સૈયદ ઇબ્ને તાઉસ (અ.મ.) લખે છે કે રસૂલે ખુદા (સ.અ.વ.)એ રિવાયત કરી છે કે જે શખ્સ આશૂરાની રાત્રે જાગે અને ખુદાની ઇબાદતમાં મશગૂલ રહે, તો એવું છે કે જાણે તેણે તમામ ફરિશ્તાઓ જેવી ઇબાદત કરી.

જે શખ્સ આશૂરાની રાત્રે બે-બે રકઅત કરીને ચાર રકઅત નમાઝ પઢે અને દરેક રકઅતમાં અલ્લેમ્બનો સૂરો પઢ્યા પછી પચાસ વખત ફુલ્હોવલ્લાહનો સૂરો પઢે, તો પચાસ વર્ષના થયેલા અને પચાસ વર્ષના થનારા ગુનાહ માફ કરી આપે અને આસમાન ઉપર તેના માટે લાખ શહેર નવા બનાવે.

હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)એ ફરમાવ્યું:

જે શખ્સ આશૂરાની રાત્રે હઝરત ઇમામે હુસૈન (અ.સ.)ની કબર પાસે હોય અને તે હઝરતની ઝિયારત કરે, તો કયામતના દિવસે પોતાના લોહીમાં ખરડાયેલા શહીદો જેવી હાલતમાં ઉઠશે. જે શખ્સ આશૂરાની રાત્રે અને દિવસે એ હઝરતની ઝિયારત કરે, તો એવું છે કે જાણે તે હઝરત ઇમામે હુસૈન (અ.સ.)ની મદદમાં એ હઝરતની સાથે શહીદ થયો.

આશૂરાના દિવસે નીચેની ઝિયારત પઢવી, તમામ શહીદોની ઝિયારત છે અને હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) અને અઇમ્મએ તાહેરીન (અ.મુ.સ.)ને પુરસો આપવા તરીકે પાછલા પહોરના પદે:

અસ્સલામો અંલયક યા વારેસં આદમ
 સિંફવતિલ્લાહે અસ્સલામો અંલયક યા વારેસં
 નૂહીનં નબીયિલ્લાહે અસ્સલામો અંલયક
 યા વારેસં ઇબ્રાહીમ ખંલીલિલ્લાહે અસ્સલામો

અંલચક યા વારેસં મૂસા કલીમિલ્લાહે
 અસ્સલામો અંલચક યા વારેસં ઈસા રૂહિલ્લાહે
 અસ્સલામો અંલચક યા વારેસં મોહુંમૈદિને
 હુંબીબિલ્લાહે અસ્સલામો અંલચક યા વારેસં
 અંલિચિયને અમીરિલ મોઅમોનીન
 વલીયીલ્લાહ અસ્સલામો અંલચક યા વારેસંલે
 હુંસનિશ શહીદે સિબ્તે રસૂલિલ્લાહે
 અસ્સલામો અંલચક યબ્ન રસૂલિલ્લાહ
 અસ્સલામો અંલચક યબ્નલે બશીરિને નઝીરે
 વબ્ન સય્યેદિલે વસિંચીન અસ્સલામો અંલચક
 યબ્ન ફાતેમત(ઝઝહરેએ) સય્યેદતે નેસાઇલે

ઔલમીન, અસ્સલામો ઔલયક યા અબા
 ઔબ્દિલ્લાહે અસ્સલામો ઔલયક યા
 ખૈયરતલ્લાહે વબ્ન ખૈયરતેહ, અસ્સલામો
 ઔલયક યા સારલ્લાહે વબ્ન સારેહી
 અસ્સલામો ઔલયક અય્યોહલ્ વીતરુલ્
 મવતુરે, અસ્સલામો ઔલયક અય્યોહલ્
 ઇમામુલ્ હાદીઝે ઝકીય્યો વ અલ્લા અરવાહિંને
 હુંલ્લત બેફેનાએક વ અકૌમતે ફી જેવારેક
 વ વફદતે મઅં ઝુવ્વારેક અસ્સલામો ઔલયક
 મિન્ની મા બકૌતો વ બકૌયલ્ લય્લો વન્નહારો
 ફલકંદે અંઝોમતે બેકરુઝિય્યાતો વ

જલ્લલમુસાંબો ફિલો મોઅંમેનીન વલો
 મુસ્લેમીન વ ફી અહલિસ્સમાવાતે અજૈમઈન
 વફી સુકકાનિલો અરૈઝીન ફઈન્ના લિલ્લાહે
 વ ઈન્ના એલયહે રાજેઉન વ સંલવાતુલ્લાહે
 વ બરકાતોહૂ વ તહીય્યાતોહૂ અંલયક વ
 અંલો આબાએકતૌ તોહેરીનત્તયેબીનલો
 મુન્તજબીન વ અંલો ઝંરારીહેમુલહોદાતિલો
 મહદિયીન, અસ્સલામો અંલયક યા મવ્લાય
 વ અંલયહિમ વ અંલો રૂહૈક વ અંલો
 અરેવાહૈહિમ વ અંલો તુરબતેક વ અંલો
 તુરબતેહિમ અલ્લાહુમ્મ લકૈકૈહિમ રહૈમતંવે

વ રિઝંવાનંવે વરવેહુંવે વ રહુંનન
 અસ્સલામો અંલયક યા મલ્લાય યા અબા
 અંબિદલાહે યબ્ન ખાંતમિનં નબિયીન વ
 યબ્ન સય્યેદિલે વસિયીન વ યબ્ન સય્યેદતે
 નેસાઇલ આલમીન અસ્સલામો અંલયક યા
 શહીદો યબ્નશહીદે યા અખંશહીદે યા
 અબશશોહદાએ અલ્લાહુમ્મ બલ્લિગુંહો અંની
 ફી હાઝંહિસ્સાઅંતે વફી હાઝંલે યબ્મે વફી
 હાઝંલે વકંતે વફી કુલ્લે વકંતિનં તહિય્યતનં
 કસીરતંવે વ સલામનં સલામુલ્લાહે અંલયક
 વ રહુંમતુલ્લાહે વ બરકાતોહૂ યબ્ન સય્યેદિલે

ઔલમીન, વ ઔલલે મુસ્તશહદીન મઅંક
 સલામમ મુત્તસૈલમ મત્તસૈલલે લયલો
 વન્નહારો અસ્સલામો ઔલલે હુંસયેનિબ્ને
 અંલીયોશહીદે અસ્સલામો અંલા
 અંલીયિબ્નીલે હુંસયેનિશહીદે, અસ્સલામો
 અંલલે અંબ્બાસીબ્ને અમીરિલે
 મોઅંમેનીનશહીદે, અસ્સલામો
 અંલશોહદાએ મિનં વુલ્દે અમીરિલે
 મોઅંમેનીન, અસ્સલામો અંલશોહદાએ
 મિનં વુલ્દિલે હુંસને, અસ્સલામો
 અંલશોહદાએ મિનં વુલ્દિલે હુંસને,

અસ્સલામો અંલશોહદાએ મિન વુદ્દે
 જઅંફરિવ વ અંકીલિન, અસ્સલામો અંલા
 કુલ્લો મુસ્તશહદિમ મઅંહુમ મેનલ
 મોઅમેનીન અલ્લાહુમ્મ સંલ્લો અંલા
 મોહુંમ્મદિવ વ આલે મોહુંમ્મદિવ વ
 બલ્લિહુંહુમ અંની તહિયતન કસીરતવ
 વ સલામન અસ્સલામો અંલયક યા
 રસૂલલ્લાહે અહુંસનલ્લાહો લકલ અંઝાઅ
 ફી વલદેકલ હુંસને અસ્સલામો અંલયકે
 યા ફાર્તેમતો અહુંસનલ્લાહો લકિલ અંઝાઅ
 ફી વલદેકિલ હુંસને, અસ્સલામો અંલયક

યા અમીરલે મોઅમેનીન અહુંસનલ્લાહો
 લકલે અંઝાઅ ફી વલદે કલે હુંસરને
 અસ્સલામો અંલરક યા અબા મોહુંમદેનિલે
 હુંસન અહુંસનલ્લાહો લકલે અંઝાઅ ફી
 અખીંકલે હુંસરને, યા મલ્લાય યા અબા
 અંબિદલ્લાહે અના ઝંયેફુલ્લાહે વ ઝંયેફોક વ
 જારૂલ્લાહે વ જારોક વલે ફુલ્લે ઝંયેફિંવે વ
 જારિને કેરવે વ કેરાય ફી હાઝંલ વકંતે અને
 તસેઅલલ્લાહ સુબહાનહૂ વ તઆલો
 અંયરેઝોકેની ફકાક રકંબતી મેનનારે ઇન્નહૂ
 સમીઉંદે દોઆએ કંરીબુમ મોજબ.

માહે સફર

સફર મહિનાના આ'માલ

જનાબે અમીરુલ મોઅમેનીન (અ.સ.)એ ફરમાવ્યું કે સફર મહિનાની ૧લી અને ૨૦મી તારીખ તથા હઝરત ઇમામે જઅફરે સાદિક (અ.સ.)મે ફરમાવ્યું કે સફર મહિનાની ૧૦મી તારીખ 'નહસે અકબર' છે.

આ મહિનાની બીજી તારીખે હિજરી સન ૬૪માં મુસ્લિમ બિન અકબાએ કાઅબામાં આગ લગાડી, તેથી કાઅબાનો પોશાક બળી ગયો.

૭મી તારીખે હઝરત ઇમામે મૂસા કાઝિમ (અ.સ.)ની વિલાદત છે.

૧૭મી તારીખે હઝરત ઇમામે અલી રઝા (અ.સ.)ની શહાદત છે.

૨૦મી તારીખે ઇમામે હુસૈન (અ.સ.)નું ચેહલુમ છે.

૨૮મી તારીખે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની વફાત અને ઇમામે હસન (અ.સ.)ની શહાદત છે.

સફર મહિનો ‘નહસ’ છે એમ મશહૂર છે. તેના નહસ હોવા માટે બે કારણો મળી આવે છે, તેથી નહસ હશે. પહેલું કારણ એ કે આ મહિનામાં હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની વફાત છે તેથી ‘નહસ’ છે. બીજું કારણ એ કે ઉપરા ઉપર ત્રણ મહિના હરામ ગયા એટલે કે ઝીલ્કાદ, ઝીલ્હજ અને મોહર્રમ, અરબો આ ત્રણ મહિનામાં લડાઈ કરવી હરામ જાણતા હતા અને લડાઈ કરવી હોય તો સફર મહિનાથી કરતા હતા, તેથી ‘નહસ’ જાણે છે. આ સિવાય આપણા મઝહબમાં સફર મહિનો ‘નહસ’ હોવાનું અન્ય કોઈ કારણ મળી આવતું નથી.

ઝિયારતે અરબઘન

ઇમામ જઅફરે સાદિક (અ.સ.)ને ફરમાયા કે અરબઘન કે રોઝ જિસ વક્ત દિન કાફી બલંદ હો જાએ ઉસ વક્ત ચેહ ઝિયારત પડહો:

અસ્સલામો અંલા વલિયિલ્લાહે વ
 હુંબીબેહી, અસ્સલામો અંલા ખંલીલિલ્લાહે

વ નજીબેહી, અસ્સલામો અંલા સંફીયિલ્લાહ
 વબ્ને સંફીય્યેહી, અસ્સલામો અંલલ
 હુંસયોનિલ મઝૂમિશહીદે, અસ્સલામો
 અંલા અસીરિલ કોરોબાતે વ કંતીલિલ
 અંબરાતે અલ્લાહુમ્મ ઇન્ની અશહદો અન્નહૂ
 વલિય્યોક વબ્નો વલિય્યેક વસંફીય્યોક વબ્નો
 સંફીય્યેકલ્ફાએઝો બે કરામતેક અકરમ્તહૂ
 બિશહાદતે વ હુંબવતહૂ બિસ્સઅંદતે
 વજતબતહૂ બેતીંબિલવેલાદતે વ જઅંલ્તહૂ
 સય્યેદમ મેનસ્સાદતે વ કાંએદમ મેનલકાંદતે
 વ ઝાંએદમ મેનઝંઝાંદતે વ અઅંતંતહૂ

મવારીસંલે અમ્બેયોએ વ જાંલ્તહૂ હુંજેજતને
 અંલા ખંલકેક મેનલે અવ્સોયોએ ફઅઅંતર
 ફિદોઆએ વ મનહુંને નુસુંહું વ બમંલ
 મોહજતહૂ ફીક લેયસ્ત-કેમં ઓબાદક મેનલે
 જહાલતે વ હુંચરતિમં મંલાલતે વ કંદે તવાઝર
 અંલચ્હે મને ગંરેરતહુદુન્યા, વ બાઅં હુંમંમંહુ
 બિલે અરેમંલિલે અદેના વ શરા આખેરતહૂ
 બિસંસંમનિલેઅવકસે વ તગુંતેરસ વ તરદા
 ફી હવાહો વ અસ્ખંતેક વ અસ્ખંતે નબિચ્ચક
 વ અતોંઆં મિને ઓબાદેક અહુંલશશોકાંકે
 વન્નેફાકે વહુંમલતલે અવ્ઝારિ લે

મુસૈતવૈજેબિનનારે ફજાહદહુમ્ ફીક સાંબેરમ્
 મુહૈતસેબને હૈત્તા સોફેક ફી તાંઅંતેક દમોહૂ
 વસ્તોબીહૈ હૈરીમોહૂ, અલ્લાહુમ્મ ફલેઅંનેહુમ્
 લઅંને વૈબીલને, વ અંઝંઝિંબુમ્ અંઝંબને
 અલીમને અસ્સલામો અંલયેક યબ્ન
 રસૂલિલ્લાહે અસ્સલામો અંલયેક યબ્ન
 સય્યોદિલે અવેસૈયોએ. અશહદો અન્નક
 અમીનુલ્લાહે વબ્નો અમીનેહી ઈશત સઈદંવે
 વ મઝંયેત હૈમીદંવે વ મુત્ત ફકીદમ્ મઝંલૂમને
 શહીદંવે વ અશહદો અન્નલ્લાહ મુન્જેઝુને
 મા વઅંદક વ મોહૈલેકુમ્ મને ખંઝંલક વ

મોઁઁઁઁઁઁઁ મને કંતલક વ અશહદો અન્નક
 વફત બેઁઁઁઁઁઁઁ વ જાહદત ફી સબીલેહી
 હંતો અતાકલે યકીનો ફલઁઁઁઁઁઁઁ મને
 કંતલક વ લઁઁઁઁઁઁઁ મને ઁલમક વ
 લઁઁઁઁઁઁઁ ઁમ્મતને સમેઁઁઁઁઁ બેઁઁઁઁઁ
 ફરઁઁઁઁઁઁ, અલ્લાહુમ્મ ઈન્ની ઁશહેદોક
 અન્ની વલિયુલ લેમનેવાલાહો વ ઁંદુવ્વુલે
 લેમને ઁંદાહો બેઁઁઁઁઁ અન્ત વ ઁમ્મી
 યબ્ન રસૂલિલ્લાહે અશહદો અન્નક કુન્ત
 નૂરને ફિલે અલ્લાહિશશામેખંતે વલે
 અરેહંઁમિલે મોતેહંઁહરતે લમે તોનજેઁઁઁઁ

જાહેલિય્યતો બેઅન્જાસેહા વ લમં તુલેબિસ્કલે
 મુદ્દલહિમ્માતો મિનં સંયાબેહા વ અશહદો
 અન્નક મિનં દઝાએમિદીને વ અરકાનિલે
 મુસ્લેમીન, વ મઅંકેલિલે મોઅમેનીન વ
 અશહદો અન્નકલે ઇમામુલે બરરૂતતકિય્યુરે
 રઝિય્યુઝે ઝકિય્યુલે હાદિલે મહદિય્યો વ
 અશહદો અન્નલે અઇમ્મત મિંવે વુલ્દેક
 કલેમતુત્તકેવા વ અઅંલામુલે હોદા વલે
 ઉરેવતુલે વુસ્કાં વલે હુજૂતો અંલા અહલિદુન્યા
 વ અશહદો અન્ની બેકુમં મોઅમેનુંવે વબે
 એયાબેકુમં મૂકેનુંમં બે શરાયેએ દીની વ

ખંવાતીમે અંમલી વ કુંલ્બી લેકુંલ્બેકુમ સિલ્મુંવે
 વ અમરી લે અમરેકુમ મુત્તબેઉને વ નુસરતી
 લકુમ મોઅંદતુને હુંતા યઅંનલ્લાહો લકુમ
 ફમઅંકુમ મઅંકુમ લા મઅં અંદુલ્લેકુમ
 સંલવાતુલ્લાહે અંલચકુમ વ અંલો અરવાહુંકુમ
 વ અજસાદેકુમ વ શાહેદેકુમ વ ગાંએબેકુમ
 વ ઝાંહેરેકુમ વ બાતૈનેકુમ આમીન રબ્બલ
 અંલમીન.

ઇસકે બાદ દો રકઅત નમાઝ પઢકર તલબે હાજત
 કરો ઓર સચ્ચદ બીન તાઉસ (અ.ર.) ફરમાતે હય કે
 મેંને ઇસ ઝિયારત કે લીએ વિદાય ભી દેખા હય, જો
 ઇસ ઝિયારત કે સાથ મખ્સૂસ હય ઓર વોહ ચેહ હય:

અસ્સલામો અંલચક યબ્ન રસૂલિલ્લાહે

અસ્સલામો અંલયક યબ્ન અંલિય્યેનિલ
 મુરેતઝો વસિયે રસૂલિલ્લાહે અસ્સલામો
 અંલયક યબ્ન ફાર્તેમતઝહૈરાએ સય્યેદતે
 નેસાઇલ અંલમીન અસ્સલામો અંલયક યા
 વારેસંલ હુંસનઝે ઝકિય્યે અસ્સલામો અંલયક
 યા હુંજેજતલ્લાહે ફી અરેઝેહી વ શાહેદહૂ
 અંલા ખંદકેહી. અસ્સલામો અંલયક યા અબા
 અંબિદલ્લાહિશહીદે, અસ્સલામો અંલયક
 યા મલ્લાય વબ્ન મલ્લાય અશહદો અનક
 કંદે અકંમ્તસેસૈલાત વ આતય્તઝકાત વ
 અમરેત બિલ્મઅંરૂફે વ નહય્ત અંનિલ મુન્કરે,
 વ જાહદેત ફી સબીલિલ્લાહે હુંત્તા અતાકલે

યકીન વ અશહદો અન્નક અંલા બચ્ચેનતિને
 મિરે રબ્બેક અતપ્તોક યા મલ્લા ઝાએરને
 વાફેદને રાગેબને મોકિરેરને લક બિઝંઝાનૂબે
 હારેબને એલચક મેનલે ખંતોયા લેતશફઅંલી
 ઈન્દ રબ્બેક યબ્ન રસૂલિલ્લાહે સંલ્લલ્લાહો
 અંલચક હુંચ્ચન વ મચ્ચેતને ફઈન્ન લક
 ઈન્દલ્લાહે મકાંમને મઅલૂમને વ શફાઅંતને
 મકેબૂલતને લઅંનલ્લાહો મને ઝંલમક વ
 લઅંનલ્લાહો મને કંસંદ હુંરમક વ ગંસંબ
 હુંકેકેક વ લઅંનલ્લાહો મને કંતલક વ
 લઅંનલ્લાહો મને ખંઝંલક વ લઅંનલ્લાહો
 મને દઅંત્તહૂ ફલમ યોજિબક વ લમ

યોએનેક વ લએનેલાહો મને મનએક
 મિને હેરમિલાહો વ હેરમે રસૂલિલાહો
 વ હેરમે અબીક વ અબીક વ લએનેલાહો
 મને મનએક મિન્શૂર્બે માઈલેફૂરાતે લએનેને
 કસીરને યત્બઓ બએઝોહા બએઝને
 અલાહુમ્મ ફાતેરસમાવાતે વલઅરેઝે
 આલેમલે ગેયબે વશહાહાદતે અન્ત તહકુમે
 બયન એબાદેક ફી મા કાનૂ ફીહે યખ્તલેફૂને
 વ સયએલમુલ્લાઝીન ઝેલમૂ અંયમુને
 કલેબિને યનેકલેબૂન અલાહુમ્મ લા
 તજએહો આખેરલે એહદે મિને

ઝિયારતેહી વરેઝુકેનીહે અબદમ મા બકીતો
વ હુંચીતો યા રબ્બે વ ઇને મુત્તોફહુંશુરેની
ફી ઝુમરતેહી યા અરેહુંમરે રાહુંમીન.

જનાબે ઝયનબ (સ.અ.)કી ઝિયારત

યેહ ઝિયારત આપકે રવઝમે મુનવ્વરમે આવેઝા હય.
વહાંસે નકલ કી ગઈ હય:

અસ્સલામો અંલરકે યા બિન્ત
રસૂલિલ્લાહે અસ્સલામો અંલરકે યા બિન્ત
નબિયિલ્લાહે, અસ્સલામો અંલરકે યા બિન્ત
મોહુંમદેનિલે મુસ્તંફા, અસ્સલામો અંલરકે
યા બિન્ત સય્યોદિલે અમ્બીયાએ વલે

મુરેસલીન, અસ્સલામો અંલરકે યા બિન્ત
 વલિયિલ્લાહે, અસ્સલામો અંલરકે યા બિન્ત
 અંલિયેનિલે મુરેતઝાં સય્યેદિલે અવ્સેયાએ
 વસ્સેંદીકીંન અસ્સલામો અંલરકે યા બિન્ત
 ફાતેમતઝે ઝહરોએ સય્યેદતે નેસાઈલે
 આંલમીન, અસ્સલામો અંલરકે યા ઉબ્તલે
 હુંસને વલે હુંસને સય્યેદયે શબાબે અહલિલે
 જન્નતે અજેમઈંન, અસ્સલામો અંલરકે
 અય્યતોહસે સય્યેદતુઝે ઝકીય્યતો, અસ્સલામો
 અંલરકે અય્યતોહદે દાઈય્યતુલે ખંફિય્યતો
 અસ્સલામો અંલરકે અય્યોહત્તકીંય્યતુને

નકિંચતો, અસ્સલામો અંલચકે અચ્ચતોહરે
 રાઝંચિયુલે મરઝિંચતોહરે અસ્સલામો અંલચકે
 અચ્ચતોહલે આંલેમતુલે ગંચરુલે ગંચેરુલે
 મા અલ્લામહ, અસ્સલામો અલાયકે
 અચ્ચતોહલે મુફહમતે ગંચરુલે મોફહહમહ,
 અસ્સલામો અંલચકે અચ્ચતોહલે મઝલૂમતો
 અસ્સલામો અંલચકે અચ્ચતોહલે મહમૂમતો,
 અસ્સલામો અંલચકે અચ્ચતોહલે મઝમૂમતો
 અસ્સલામો અંલચક અચ્ચતોહલે મઅસૂરતો
 અસ્સલામો અંલચકે
 અચ્ચતોહરે સીદીકતુરે સુંગરા, અસ્સલામો

અંલયકે અચ્ચતોહસંસોહેબતુલે મુસીબતુલે
 ઉઝંમા અસ્સલામો અંલયકે યા ઝયેનબલે
 કુબ્રા અસ્સલામો અંલયકે યા ઈસંમતસંસુંગૌરા
 અશહદો અન્નકે કુન્તે સોબેરતને શાકેરતને
 મોજલ્લતને મોઅંઝંઝંમતને મોકરમતને
 મોખંદરતને મોવકકેરતને ફી જમીઅ
 હોલાતેકે વ મુન્કલેબાતેકે વ મોસીબાતેકે
 વ બલિયાતેકે વ ઈમ્તેહોનાતેકે હંત્તા ફી
 અશદેહા વ અમ્રેહા વહેય વોકૂફોકે ફી
 હાઝલે મકાને વ અખૂંકિલે અંતશાનો મસંરુઉને
 ફી ઔમોકિલે હોએરે મિને કસંરતે જરા

હાંતિસં સચ્કે વસ્સેનાને વશીમરો જાલેસુને
 અંલા સંદરેહી વાહુંઝનાહો અંલચ્કે વ અંલચ્કે
 યા બિન્તઝઝહરોએ વ બિન્ત ખંદીજતિલે
 કુબરા, અશહદો અન્નકે કંદે નંસંહંતે લિલ્લાહે
 વલેરસૂલેહી વલે અમીરિલે મોઅમેનીન,
 વલેફાતૈમત વલેહુંસાને વલેહુંસૈને
 અંલચ્કેમુસ્સલામ, વ નસંરંતેહિમ બેકુંલ્બેકે
 વ લેસાનેકે વ જાહદંતે ફિલ્લાહે બેલેસાનેકે
 હુંકુંકું જેહાદેહી ફનેઅંમતુલે ઉખંતે અનંતિલે
 હુંસાને વ નેઅંમલે અખાૈલકે અબૂ
 અંબદીલ્લાહે સંલવાતુલ્લાહે વસલામોહૂ

અંલરકોમા વઅંલામનં અહુંબ્બકોમો વ
 નસંરકોમા વલ અંનલ્લાહો ઉમ્મતનં સલબતં
 કંનાઅંકે વ ઝંરબતં કઅંબરરેમાહું અંલા
 અઅંઝાએકે વ હુંરરકંત ખંયામકે વ
 અસરરતં અંયાલેક અમસમેઅંતં બેઝાલેક
 ફરઝંયતં બેહ, વ લમ તહુંઝન યા સય્યેદતી
 વ મલ્લાતી અના ઝાએરો વ અખીંકિલ
 હુંસયને વ ઝાએરોકે વ મોહિંબ્બોકોમા વ
 મોઈનોકોમા ફશફઉલી વલે આબાઈ વ
 ઉમ્મહાતી વ અજદાદી વ અસ્અલુલ્લાહ
 અંઝ વ જલ્લ બેહુંકંકેકે વ બેહુંકંકે જદેકે

વ અબીકે અમીરિ લે મોઅંમોનીન
 અંલયહિ સ્સલામ, વ ઉમ્મોકે
 ફાતેમતઝઝહરેએ અંલયહસ્સલામ, વ
 અબીકિલે હુસનો વલે હુસરને
 અંલયહેમસ્સલામ. વસ્સલામો અંલયકુમ્બે યા
 અહલબયતિન્નોબુવ્વતે વ મુખ્તલોફિલે
 મલાએકતે વ મહુબતિલે વહુયે વત્તનેઝીલે
 જમીઅંને વ રહુમતુલ્લાહે વ બરકાતોહ.

સફર મહિનાના આ'માલ

આ મહિનાની ત્રીજી તારીખે મુસ્તહબ છે કે બે
 રકઅત નમાઝ પઢે. પહેલી રકઅતમાં 'અલ્હમ્દ'ના સૂરો
 પછી 'ઇન્ના ફતહના'નો સૂરો પઢે, અને બીજી રકઅતમાં

અલ્લમ્હના સૂરા પછી કુલ હો વલ્લાહનો સૂરો પઢે અને
નમાઝ તમામ કર્યા પછી નીચે મુજબ પઢે:

અલ્લાહુમ્મ સંલ્લે અંલા મોહુંમ્મદ, વ
આલે મોહુંમ્મદ

(૧૦૦ વખત)

અલ્લાહુમ્મલે અંને આલ અબી સુફ્યાન.

(૧૦૦ વખત)

અસ્તઁફેરુલ્લાહ રબ્બી વ અતૂબો એલયહ.

(૧૦૦ વખત)

આ મહિનામાં હંમેશા દસ વખત નીચેની દુઆ
પઢે, તો આ મહિનામાં જેટલી બલા આવનાર છે, તે
તમામથી ખુદાએ તઆલા હિફાઝતમાં રાખે.

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહુંમ

યા શદીદલકૌવા યા શદીદલ્મોહૌલ,
 યા અંઝીઝો યા અંઝીઝો યા અંઝીઝો,
 ઝંલ્લતે બે અંઝંમતેક જમીઓ ખંલ્કેક,
 ફકફેની શરેર ખંલ્કેક, યા મોહુંસેનો યા
 મુજમેલો યા મુનેઅંમો. યા મુફેઝેલો યા
 લા એલાહ ઇલ્લા અન્ત સુબ્હાનક ઇન્ની
 કુન્તો મેનઝાલેમીન ફસ્તજબના લહૂ
 વનજેજબનાહો મેનલે ગંમ્મે વ કઝાલેક
 નુનેજલ મોઅમેનીન, વ સંલ્લલ્લાહો અંલા
 મોહુંમ્માદિં વ વ આલે
 હિત્તંયેબીનત્તંહૈરીન.

૨૦મી તારીખે ઇમામે હુસૈન (અ.સ.)નું ચેહલુમ છે.
ઇમામે હસને અસકરી (અ.સ.) ફરમાવે છે:
પાંચ ચીજો મોઅમીનની નિશાની છે:

૧. ફરજ અને નાફેલા મળી એકાવન રકઅત નમાઝ પઢવી.
૨. ઇમામે હુસૈન (અ.સ.)ના ચેહલુમને દિવસે ઝિયારત પઢવી.
૩. જમણા હાથમાં વીંટી પહેરવી.
૪. શુક્રનો સજદો કરવા માટે ખાક ઉપર કપાળ રાખવું.
૫. નમાઝમાં 'બિસ્મિલ્લાહ' અવાજથી કહેવું.

આશૂરાના દિવસે પાછલા પહોરના ઝિયારત પઢાય છે તે ઝિયારત વીસમી સફરના પઢે, તો મુનાસીબ છે, અને તે ઝિયારત આગળ (આવી ગઈ) છે.

‘ઝાદુલ મઆદ’ કિતાબમાં છે કે સફર મહિનાની

વીસમી તારીખે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત પઢવાની તાકીદ છે.

માઠે રબીઉલ અવ્વલ

આ મહિનાની દસમી અને વીસમી તારીખ અને બીજી રિવાયત મુજબ ચોથી તારીખ ‘નહસે અકબર’ છે.

આ મહિનાની પહેલી રાત્રે રસૂલે ખુદા (સ.અ.વ.) મક્કાથી હિજરત કરી ગારમાં રોકાયા અને પોતાના બિછાના ઉપર હઝરત અલી (અ.સ.)ને સૂવરાવ્યા. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) પોતાની જાનની પરવા ન રાખતા ખુદાની ખુશી માટે બેઘડક સુઘ રહ્યા. તે રાત્રે મુશરિકોએ રસૂલે ખુદા (સ.અ.વ.)ને તે જગ્યાએ મારી નાખવાનો બંદોબસ્ત કર્યો હતો.

હઝરત અલી (અ.સ.)ની આવી હિંમત જોઈને મલાએકા (ફરિશ્તાઓ)એ ગર્વ કર્યો અને આપ (અ.સ.)ની તઅરીફ કરવા લાગ્યા, અને ખુદાએ આપની શાનમાં “**વ મેનન્નાસે મંથ્યશરી નફસહુપ્તેગાય મરઝાતિલ્લાહ**” આયત નાઝિલ ફરમાવી.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) અને અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) બંને બુરુગવારોની જાન બચી અને અલ્લાહે તેઓને કુફરના શરથી નજાત આપી, તે માટે શુક્રનો રોઝો રાખવો અને બંને મઅસૂમોની ઝિયારત પઢવી મુનાસીબ છે.

આ મહિનાની નવમી તારીખે આપણી ‘મોટી ઘટ’ છે. ઉપરાંત અહલેબૈત (અ.મુ.સ.)નો દુશ્મન ઉમર બીન સાઅદ આજે મરી ગયો છે.

દસમી તારીખે રસૂલે ખુદા (સ.અ.વ.)ની શાદી જનાબે ખદીજતુલ કુબરા સાથે થઈ છે. એ ખુશહાલી માટે રોઝો રાખવો સુન્નત છે.

બારમી રબીઉલ અવ્વલના હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ઝાલિમોના શરથી બચીને સહી સલામત મદીના પહોંચ્યા.

૧૨-મી તારીખ સન ૮૨ હીજરીમાં બની મરવાનની હુકૂમત નાબૂદ થઈ.

૧૪-મી તારીખ સન ૬૪ હીજરીમાં યઝીદ જહન્નમ

વાસીલ થયો.

૧૭-મી તારીખે હજરત રસૂલે ખુદા મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.) અને ઇમામે જઅફર સાદિક (અ.સ.)ની વિલાદત છે.

રહીઉલ અવ્વલ મહિનાના આ'માલ

આ મહિનાની ૧૭મી તારીખે રોઝો રાખે, તો એક વર્ષના રોઝા રાખવા જેટલો સવાબ મળે.

આ દિવસે મોઅમીનોને ખુશ કરવા, સદકો આપવો, ગુસ્લ કરવું અને અઇમ્મએ માઅસૂમીન (અ.મુ.સ.)ના રોઝા મુબારકમાં અને ખાસ કરીને રસૂલે ખુદા (સ.અ.વ.) અને અલીએ મુરતઝા (અ.સ.)ના રોઝા મુબારકમાં ઝિયારત માટે જવું.

જનાબે શેખ મુફ્ફીદ (અ.ર.) અને જનાબે શેખ શહીદ (અ.ર.)અને હજરત સૈયદ ઇબ્ને તાઉસ રહેમતુલ્લાહે ફરમાવ્યું છે કે મદીના સિવાય રસૂલે ખુદા (સ.અ.વ.)ની ઝિયારત કરવી હોય, તો ગુસ્લ કરવું

અને આપની કબર મુબારકની શબીહ બનાવી તેના ઉપર હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)નું નામ મુબારક લખવું, પછી તેની સામે ઉભા રહીને એ ઝિયારત પઢવી.

સૈયદ ઇબ્ને તાઉસ (અ.ર.)એ ફરમાવ્યું છે કે મુસ્તહબ છે કે રબીઉલ અવ્વલની ૧૭-મી તારીખે બે રકઅત નમાઝ પઢે અને દરેક રકઅતમાં સૂરએ અલ્હમ્દ પઢ્યા પછી દસ વખત સૂરએ ઇબ્ના અન્જલ્નાહ અને દસ વખત કુલ્હોવલ્લાહનો સૂરો પઢે અને નમાઝ તમામ કરે.

માઠે રબીઉલ આખર

આ મહિનામાં પહેલી અને અગિયારમી તારીખ અને બીજી રિવાયત મુજબ અઠ્યાવીસમી તારીખ ‘નહસે અકબર’ છે.

આ મહિનાની દસમી તારીખે ઇમામ હસને અસ્કરી (અ.સ.)ની વિલાદત છે, માટે ઇદ કરે અને ખુશહાલીનો રોઝો રાખે અને આપની ઝિયારત પઢે અને નેક કામ કરે.

સોળમી તારીખે જનાબે મુપ્તાર (અ.ર.)એ ઇમામ

હુસૈન (અ.સ.)ના ખૂનનો ખદલો લીધો છે.

માહે જમાદીઉલ અવ્વલની જાણવા જેવી બાબતો

માહે જમાદીઉલ અવ્વલની ૧૦-મી અને ૧૧-મી તારીખ તેમજ બીજી રિવાયત મુજબ ૨૮-મી તારીખ 'નહસે અકબર' છે.

જનાબે ફાતેમા (સ.અ.), હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની વફાત પછી પંચોતેર દિવસ હયાત રહ્યા છે. તો તે હિસાબે જનાબે ફાતેમા (સ.અ.)ની વફાત જમાદીઉલ અવ્વલની ૧૩-મી, ૧૪-મી અથવા ૧૫-મીના હોવી જોઈએ અને ૧૪મી તારીખ વધારે મહત્ત્વપૂર્ણ છે, માટે તે દિવસે બે મઅસૂમોની ઝિયારત પઢવી મુનાસીબ છે.

આ મહિનાની ૧૫મી તારીખે ઇમામે ઝયનુલ આબેદીન (અ.સ.)ની વિલાદત છે. આ દિવસે રોઝો રાખે અને કારે ખૈર કરે. આ મહિનાની ૧૫-મી તારીખે હઝરત અલી

ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ બસરા ઉપર વિજય મેળવેલ, માટે આ દિવસે તે બંને ઇમામો (અ.મુ.સ.)ની ઝિયારત પઢવી યોગ્ય છે. અને આવા દિવસોમાં ઝિયારતે જામેઅહ પઢે તો બેહતર છે.

માહે જમાદીઉલ આખર

આ મહિનાની પહેલી અને અગિયારમી તથા બીજી રિવાયત મુજબ બારમી તારીખ બહુજ ખરાબ છે.

એક રિવાયત મુજબ આ મહિનાની ત્રીજી તારીખે જનાબે ફાતેમા (સ.અ.)ની વફાત છે.

૭-મી તારીખે જનાબે ઝયનબ (સ.અ.)ની શહાદત છે.

આ મહિનાની વીસમી તારીખે જનાબે ફાતેમા (સ.અ.)ની વિલાદત છે. આ દિવસે મુસ્તહબ છે કે રોઝો રાખે અને નેક કામ કરે. ગરીબ મોઅમીનોને સદકો કરે અને એ માઅસૂમાની ઝિયારત પઢે. એક ઝિયારત જનાબ સૈયદ ઇબ્ને તાઉસ (અ.ર.)એ લખી છે, જે નીચે મુજબ છે:

અસ્સલામો અંલરકે યા સય્યોદત
 નેસૌઇલ્લૌલમીન, અસ્સલામો અંલરકે યા
 વાલેદતિલ્ હૌજજે અંલન્નાસે અજમઈન
 અસ્સલામો અંલરકે અય્યતોહલ્ મઝલૂમતુલ્
 મમ્નૂઅંતો હુકકુંહા.

અલ્લાહુમ્મ સંલ્લે અંલા અમતેક વખ્નતે
 નબીયેક વ ઝવજતે વસિયે નબીયેક,
 સંલાતને તુઝલેફોહા ફવકું ઝુલ્ફા અબાદેકલ્
 મુકરમીન મિને અહલિસ્સમાવાતે વ અહલિલ્
 અરઝીન.

પછી ખુદા પાસે ગુનાહોની માફી માંગે એટલે ખુદા
 બક્ષી આપે અને બેહિશ્તનો હકદાર કરે. આ ઝિયારત

મોઅતબર છે. બીજી ઝિયારત માટે અલ્લામા મજલિસી (અ.મ.) લખે છે કે આલિમોએ ઝિયારતોની કિતાબોમાં લખેલ છે તે નીચે મુજબ છે:

અસ્સલામો અંલરકે યા બિન્ત
રસૂલિલ્લાહે અસ્સલામો અંલરકે યા બિન્ત
નબિયિલ્લાહે અસ્સલામો અંલરકે યા બિન્ત
હુંબીબિલ્લાહે અસ્સલામો અંલરકે યા બિન્ત
ખંલીલિલ્લાહે અસ્સલામો અંલરકે યા બિન્ત
સંફીયિલ્લાહે અસ્સલામો અંલરકે યા બિન્ત
અમીનિલ્લાહે અસ્સલામો અંલરકે યા બિન્ત
ખંરે ખંલેકિંલ્લાહે અસ્સલામો અંલરકે યા
બિન્ત અફઝંલે અમ્બીયાઈલ્લાહે, વ રોસોલેહી

વ મલાએકતેહી અસ્સલામો અંલયકે યા
 બિન્ત ખંયેરિલે બરિયંતે, અસ્સલામો અંલયકે
 યા સય્યદત નેસૌઇલ અંલમીન મેનલે
 અવ્વલીન વલે આખેરીન, અસ્સલામો
 અંલયકે યા ઝવેજત વલિય્ચિલ્લાહે વ ખંયેરીલે
 ખંલકે બઅંદ રસૂલિલ્લાહે, અસ્સલામો
 અંલયકે યા ઉમ્મલે હુંસને વલે હુંસયને
 સય્યેદયે શબાબે અહલિલ જન્નતે,
 (અસ્સલામો અંલયકે યા ઉમ્મલે મોઅમેનીન,)
 અસ્સલામો અંલયકે અયંતોહસં સિદ્દીકંતુ
 શશહીદતો, અસ્સલામો અંલયકે અયં

તોહરંઝિંયંતુલ મરંઝિંયંતો અસ્સલામો
 અંલયકે અયંતોહલે ફાઝેલતુઝં ઝકિય્યતો
 અસ્સલામો અંલયકે અયંતોહલે હુંવેરાઉલે
 ઇન્સિય્યતો અસ્સલામો અંલયકે અય્યતોહતે
 તકિય્યુતને નકિય્યતો અસ્સલામો અંલયકે
 અયંતોહલે મોહુંદેદસંતુલે અંલીમતો
 અસ્સલામો અંલયકે અય્યાતોહલે મઝૂલૂમતુલે
 મગેસૂંબતો અસ્સલામો અંલયકે અય્યતોહલે
 મુઝંતેહદતુલે મકેહૂરતો, અસ્સલામો અંલયકે
 યા ફાતેમતો બિન્ત (મોહુંમમદિરે)
 રસૂલિલ્લાહે વ રહૂંમતુલ્લાહે વ બરકાતોહ,

સંલલલાહો અંલયકે વ અંલા રૂલકે વ
 બદનેકે, અશહદો અન્નકે મઝંયેતે અંલા
 બય્યેનતિમં મિનં રબ્બેકે વ અન્ન મનં સરકે
 ફકંદે સરં રસૂલલાહે સંલલલાહો અંલયહે
 વ આલેહી વ મનં જફાકે ફકંદે જફા
 રસૂલલાહે સંલલલાહો અંલયહે વ આલેહી,
 વ મનં અઝાંકે ફકંદે અઝાં રસૂલલાહે
 સંલલલાહો અંલયહે વ આલેહી વ મનં
 વસંલકે ફકંદે વસંલ રસૂલલાહે સંલલલાહો
 અંલયહે વ આલેહી. વ મનં કંતંઅંકે ફકંદે
 કંતંઅં રસૂલલાહે સંલલલાહો અંલયહે વ

આલેહી, લેઅન્નકે બિઝંઝંતુમં મિન્હો વ
 રૂહોહુલ્લમીં બયન જમ્બયહે, ઉશહેદુલ્લાહ
 વ રોસોલહૂ વ મલોએકતહૂ અન્ની વલિય્યુલે
 લેમન વાલાકે વ ઝંદુવેવુલે લેમને ઝાંદાકે
 વ હંરેબુલે લેમને હાંરબકે, અના યા
 મવેલાતીબેકે વબે અબીકે વ બઅંલેકે, વલે
 અઠમ્મતો મિંવે વુલ્દેકે મૂકેનુને, વ
 બેવેલાયતેહિમં મોઅમેનુને, વ લેતોંઝંતેહિમં
 મુલ્તઝેમુને, અશહદો અન્નદીન દીનોહુમ
 વલેહુંકેમ હુંકેમોહુમ, વ હુમં કંદે બલ્લગૂં
 ઝંનિલ્લાહે ઝંઝં વજલ્લ વ દઅંવે એલા

સબીલિલ્લાહે બિલ હિંકમતે વલ મવેઝેઝંતિલે
 હંસનતે, લા તઅખાઝાહુમ ફિલ્લાહે લવમતો
 લાએમિંવે વ સંલવાતુલ્લાહે અંલયકે, વ
 અંલા અબીકે વ બઅંલેકે વ ઝુંરરિયતેકિલે
 અઠમ્મતિત્તાંહેરીન, અલ્લાહુમ્મ સંલ્લે અંલા
 મોહંમદિવં વ અહલેબયતેહી વ સંલ્લે અંલલે
 બતુલિત્તાંહેરતિસં સિંદીકંતિલે મઅંસૂમતિ
 ત્તકિંયતિનં નકિંયતિરં રઝિંયતિલે
 મરંઝીયતીઝં ઝકિંયતિરં રશીદતિલે
 મઝંલૂમતિલે મકંહૂરતિલે મઝંસૂબતે હંકંકોહલે
 મમ્નૂઅંતે ઇરંસોહલે મકસૂરતે ઝિંલ્ઓહલે

મઝલૂમે બઝલોહલે મકૂતૂલે વલદોહા ફાતેમત
 બિન્તે રસૂલેક વ બિઝંઝંતે લહૂંમેહી વ
 સંમીમે કુંલ્બેહી વ ફિલ્હંતે કબેદેહી, વન્નુખંબતે
 મિન્ક લહૂ વત્તોહૂંફતે ખંસંસ્ત બેહા વસિય્હૂ
 વ હુંબીબેહિલે મુસ્તંફા, વ કુંરીનતીલે મુરતઝા
 વ સય્યેદતિન્નેસાએ, વ મોબશ્શોરતિલે
 અલ્લેયાએ ખંલીફતિલે વરઝાં વઝઝોહૂદે,
 વ તુફાહંતિલે ફિરેદવસે વલે ખુંલેદિલ્લતી
 શરરફત મવલેદહા બેનેસાઇલે જન્નતે વ
 સલલ્ત મિન્હા અન્વારલે અઠમ્મતે વ
 અરે ખંયેત દૂનહા હૂંજાબને નોબુલ્લતે

અલ્લાહુમ્મ સંલ્લે અંલયેહા સંલાતન તઝીદો
 ફી મહુંલ્લેહા ઈન્દક વ શરફેહા લદયેક વ
 મન્જેલતેહા મિરેરેઝાંક વ બલ્લિગુંહા મિન્ના
 તહિયૈતને વ સલામવં વ આતેના મિને
 લદુન્ક ફી હુબ્બેહા ફઝીલંવે વ એહુંસાનંવે
 વ રહુંમતંવે વ ગુંફેરાનને ઈન્નક ઝુંલે અંફેવિલે
 કરીમ.

આ પછી ઝિયારતની બે રકઅત નમાઝ સુન્નતની
 નિચ્યતથી પઢવી અને અગર બની શકે તો એ મઅસૂમા
 નમાઝ પઢતા, તે પઢે, અને તે બે રકઅત છે. દરેક
 રકઅતમાં અલ્હમ્દના સૂરા પછી સાંઘઠ વખત ફુલ હો
 વલ્લાહનો સૂરો છે અને ન બની શકે, તો પહેલી રકઅતમાં
 સૂરએ અલ્હમ્દ પછી એક વખત ફુલ્હોવલ્લાહનો સૂરો
 અને બીજી રકઅતમાં સૂરએ અલ્હમ્દ પછી એક વખત

કુલ યા અચ્યોહલ કાફેરૂનનો સૂરો પઢે અને નમાઝ તમામ કર્યા પછી જનાબે ફાતેમા (સ.અ.)ની તસ્બીહ, જે મશહૂર છે અને આપણે દરેક નમાઝ પછી પઢીએ છીએ, તે પઢવી અને તે પછી આ દુઆ પઢવી:

અલ્લાહુમ્મ ઈન્ની અતવજ્જહો એલયક
બે નબીયેના મોહુંમદિને વ બે અહલેબય્તેહી
સૈલવાતોક અંલયોહિમ વ અસ્અલોક બે
હુંકુંકુંકલે અંઝીમે અંલયહે મુલ્લાઝી લા
યઅંલમો કુન્નહૂ સેવાક વ અસ્અલોક બે
હુંકુંકું મને હુંકુંકુંહૂ ઈન્દક અંઝીમુને વબે
અસ્માએકલે હુંસ્નલ્લતી અમરતની અને
અદઉંવ બેહા વ અસ્અલોક બિસ્મોકલે
અઅંઝીમિલ્લાઝીઅમરત બેહી ઈબ્રાહીમ અને

યદૈઔવ બેહિત્તંયેર ફઅજાબત્હો વ બિસ્મેકલે
 અંઝીમિલ્લઝી કુંલ્ત લિન્નારે કૂની બરેદનં
 વ સલામનં અંલા ઇબ્રાહીમ ફકાનતં બરેદનં
 વબે અહુંબિબલે અસ્માએ એલચક વ અશરફેહા
 વ અઅંઝીમોહા લદચક વ અસરઔહા
 એજાબતનં વ અન્જેહુંહા તંલેબતનં વ બેમા
 અન્ત અહુંલોહૂ વ મસ્તહિકેકૌહૂ વ
 મુસ્તવ્જેબોહૂ અતઝંરૌઔ વ ઓલેહુંહો અંલચક
 વ અસ્અલોક બેકોતોબેકલ્લતી અન્ઝલ્તહા
 અંલા અમ્બેયાએક વ રોસોલેક સંલવાતોક
 અંલચહિમં મેનતં તવેરાતે વલે ઇન્જલે

વઝંબૂરે વલં કુરંકોનિલં અંઝીમ ફઈન્ન ફી
 હસ્મકલં અઅંઝીમ વ બેમા ફીહા મિનં
 અસ્માએકલં ઉંઝીમા અનં તોસંલ્લેય અંલા
 મોહંમદિનં વ આલે મોહંમદિનં વ અનં
 તોફરેજ અંન્આલે મોહંમદિનં વ શીઅંતેહિમં
 વ મોહિબ્બીહિમં વ અન્ની વ તફતહં
 અબ્વાબસં સમાએ લેદોઆઈ વ તરફઅંહૂ
 ફી ઈલ્લીયીન વ તઅઝંન ફી હાઝંલં યબ્મે
 વફી હાઝંહિસ્સાઅંતે બેફરજી વ એઅંતોઈ
 અમલી વ સોઅલી ફિદુન્યા વલં આખરંતે
 યા મનં લા યઅંલમો અંહુદુનં કયેફ હોવ

વ કુંદરતોહૂ ઇલ્લા હોવ યા મન સદૈદલ
 હવાઅ બિસ્સામોએ વ કબસલ અર્જ
 અંલદમાએ યા મન સમ્મ નફસહૂ બિલ
 ઇસ્મિલ્લાઝી યુકંઝી બેહી હાંજતો મન યદૈઉહો
 અસ્અલોક બેહુંકંકે ઝાલેકલ ઇસ્મે ફલા
 શફીઅં અકંવાલી મિન્હો અન્તોસંલેય અંલા
 મોહુંમ્મદિન વઆલે મોહુંમ્મદિન વતકંઝેયલી
 હુંવાએજી વતુસ્મેઅં બે મોહુંમ્મદિન વ
 અંલિયિન વફાર્તેમત વહુંસને વલ હુંસને
 વ અંલિયિબિનલ હુંસને વમોહુંમ્મદિને
 અંલિયિન વજઅંફરિને મોહુંમ્મદિન વ

મૂસબને જાઅંફરિને વાઅંલિયિબને મૂસા
 વમોહુંમ્મદિબને અંલિયિને વાઅંલિયિબને
 મોહુંમ્મદિને વહુંસનિબને અંલિયિને
 વહુજાતિલે મુન્તઝરે લેઈઝનેક સંલવાતોક
 વ સલામોક વરહુંમતોક વખરકાતોક
 અંલયોહિમ સંવેતી લેયશફઉલી એલરક
 વતોશફફેઅંહુમ ફિય વલાતરુદની ખાંએબને
 બેહુંકેકે લાએલાહ ઇલ્લા અન્ત.

આ મહિનામાં નીચે લખ્યા મુજબ બે-બે રકઅત કરીને
 ચાર રકઅત નમાઝ પઢે, તો ખુદાની નેઅમત, અવલાદ,
 માલ, દીન-દુનિયા મળે. એક વર્ષ સુધી હિફાઝતમાં રાખે.
 એ નમાઝની તરતીબ (રીત) આ પ્રમાણે છે:

બે રકઅત સુન્નતની નિચ્યત કરી અલ્હમ્દના સૂરા પછી એક વખત ‘આયતુલ કુરસી’ અને પચ્ચીસ વખત સૂરે ઇન્નાઅન્ના, બીજી રકઅતમાં અલ્હમ્દના સૂરા પછી એક વખત સૂરે ‘અલ્હાકોમુતકાસોરો’ (સૂરે તકાસૂર) અને પચ્ચીસ વખત ‘કુલ્હોવલ્લાહો અહદ’નો સૂરો પઢીને નમાઝ તમામ કરે.

પછી બીજી બે રકઅતની નિચ્યત કરી અલ્હમ્દના સૂરા પછી એક વખત ‘કુલ યા અય્યોહલ કાફેરન’નો સૂરો અને પચ્ચીસ વખત ‘કુલ અઉમો બેરબ્બીલ ફલક’નો સૂરો પઢે અને બીજી રકઅતમાં અલ્હમ્દના સૂરા પછી એક વખત ‘એઝાજાઅ’નો સૂરો અને પચ્ચીસ વખત ‘કુલઅઉમો બેરબ્બિન્નાસ’નો સૂરો પઢે. પછી નમાઝને તમામ કરી પંચોતેર (૭૫) વખત ‘તસ્બીહાતે અરબા’ અને સિત્તેર (૭૦) વખત સલવાત પઢી, ત્રણ વખત

અલ્લાહુમ્મગોંફિરે લિલ મોઅમેનીન વલે

મોઅમેનાત

કહી સજદામાં જઇ ત્રણ વખત કહે

યા હૃંચો યા કૃંચુમો યા ઝંજલાલે
વલ્લે ઇક્રામે, યા અલ્લાહો યા રહ્માનો
યા રહીમો યા અરહીમરે રાહીમીન.

રોઝી માટેની નમાઝ

સન્નતની નિયતથી બે રકઅત નમાઝ પઢે. તેની પહેલી રકઅતમાં સૂરએ **અલહમ્દ** પછી ત્રણ વખત સૂરએ **ઇન્ના અઅતય્ના કલ કલ્સર** અને બીજી રકઅતમાં સૂરએ **અલહમ્દ** પછી ત્રણ વખત સૂરએ **કુલ અઉઝો બે રઘિલ ફલક** અને ત્રણ વખત સૂરએ **કુલ અઉઝો બે રઘિન્નાસ** પઢે. ત્યારબાદ દુઆ માંગે.

માહે રજબ

માહે રજબની ફઝીલત અને આ'માલ

આ મહિનાની અગિયારમી તારીખ અને તેરમી તારીખ અને બીજી રિવાયત મુજબ બારમી તારીખ 'નહસે અકબર' છે.

પહેલી રજબ ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)ની વિલાદત છે અને આ દિવસે હઝરત નૂહ (અ.સ.) કશ્તી ઉપર સવાર થયેલ છે.

ત્રીજી તારીખે ઇમામ અલીયુન્નકી (અ.સ.)ની શહાદત છે.

દસમી તારીખે ઇમામે મોહમ્મદ તકી (અ.સ.)ની વિલાદત છે.

તેરમી તારીખે ઇમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાદત છે.

પંદરમી તારીખે ઇમામ જઅફર સાદિક (અ.સ.)ની શહાદત છે.

અઢારમી તારીખે રસૂલે ખુદા (સ.અ.વ.)ના ફરઝંદ ઇબ્રાહીમની વફાત છે.

બાવીસમી તારીખે મોઆવીયા (લ.અ.) મરી ગયેલ છે.

તેવીસમી તારીખે ઇમામ હસન (અ.સ.)ની રાન ઉપર ખારજુઓએ ખંજર માર્યું છે.

ચોવીસમી તારીખે ‘ખૈબર’ ફતેહ થયેલ છે.

પચ્ચીસમી તારીખે ઇમામ મૂસા કાઝિમ (અ.સ.)ની શહાદત છે.

છવ્વીસમી તારીખે જનાબે અબુ તાલિબ (અ.સ.)ની વફાત છે.

રસૂલે ખુદા મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.)ને સત્યાવીસમી રજબે નબુવ્વત મળી છે. જિબ્રઇલ (અ.સ.) સત્તાવીસમી રાતના નાઝિલ થયા છે. અને આ રાત ઘણી મુખારક છે. સત્તાવીસમી રાત્રે હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ને મેઅરાજ થઇ. તેઓની ઝિયારત પઢવી મુસ્તહબ છે. ૨૭મી તારીખના રોઝાનો ઘણો સવાબ છે.

હઝરતે રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

માહે રજબ ખુદાનો ખુઝુર્ગ મહિનો છે. કોઈ મહિનો આ મહિનાની ખુઝુર્ગીએ પહોંચી શકતો નથી. આ મહિનામાં જંગ અને લડાઈ કરવી હરામ છે અને શાઅખાન મહિનો મારો છે અને મુબારક રમઝાન મારી ઉમ્મત માટે છે. રજબ મહિનામાં કોઈ એક રોઝો રાખે, તો ખુદા તેનાથી ખુશ થશે અને તેનાથી ખુદાનો ગઝબ દૂર થશે અને તેના માટે જહન્નમના દરવાજામાંથી એક દરવાજો ખંધ થશે.

ઇમામ મૂસા કાઝિમ (અ.સ.) ફરમાવે છે:

બેહિશ્તની નહેરોમાં એક નહેરનું નામ ‘રજબ’ છે. તેનું પાણી દૂધ કરતાં વધારે સફેદ અને મધ કરતાં વધારે મીઠું છે. જે કોઈ રજબ મહિનામાં એક રોઝો રાખે, તો ખુદા તેને તે નહેરનું પાણી પીવડાવાશે.

ઇમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું કે જે શખ્સ માહે રજબમાં ત્રણ દિવસ રોઝા રાખે, તો તેના

માટે દરેક રોજાને બદલે એક એક વર્ષના રોજાનો સવાબ લખે અને સાત રોજા રાખે, તો તેનામાટે દોઝખના સાત દરવાજા બંધ થાય છે અને આઠ રોજા રાખે, તો તેના માટે બેહિશ્તના આઠેય દરવાજા ખોલી નાખવામાં આવે છે અને પંદર રોજા રાખે, તો હિસાબ આસાન કરે અને જે કોઈ માટે રજબના આખા મહિનાના રોજા રાખે, તો તેના માટે ખુદા પોતાની ખુશનુદી લખે, અને જેના માટે ખુદા પોતાની ખુશનુદી લખે. તેના ઉપર કદી અઝાબ નહીં કરે.

ઇબ્ને બાબવયહે મોઅતબર સનદ સાથે સાલિમથી રિવાયત કરી છે. તે કહે છે કે હું માટે રજબના છેલ્લા દિવસોમાં ઇમામ જઅફર સાદિક (અ.સ.)ની ખિદમતમાં ગયો.

ઇમામ (અ.સ.)એ મને જોઈને પૂછ્યું, “આ મહિનામાં તેં રોજા રાખ્યા?”

મેં અરજ કરી: “નહીં.”

આપ (અ.સ.)એ ફરમાવ્યું:

એટલો બધો સવાબ તારાથી ચાલ્યો ગયો કે જેની કદર (મૂલ્ય) ખુદા સિવાય બીજું કોઈ જાણતું નથી, અરે આ એ મહિનો છે, જેને બીજા મહિના ઉપર ખુદાએ ફઝીલત આપી છે અને તેની મોટી હૂરમત છે અને એ મહિનામાં રોઝો રાખે, તેને માનવંત કરવો વાજિબ જાણેલ છે.

આ સાંભળીને મેં અરજ કરી:

યા રસૂલુલ્લાહ (સ.અ.વ.)ના ફરઝંદ! અગર આ બાકી રહેલા દિવસોમાં રોઝા રાખું, તો રોઝા રાખનારાઓના સવાબમાંનો થોડો સવાબ મળશે?

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: અય સાલિમ! રજબ મહિનાના છેલ્લા દિવસોમાં જે કોઈ એક રોઝો રાખે, તો તેને ખુદાવંદે આલમ મોતની સખતીથી અને મૃત્યુ પછી ડરવાથી અને અઝાબ થવાથી નિર્ભય કરે, અને છેલ્લા બે રોઝા રાખે, તો પુલે સેરાત ઉપરથી આસાનીથી પસાર થઈ જાય, અને જો છેલ્લા ત્રણ રોઝા રાખે, તો કયામતના દિવસની સખત બીકથી અમાન પામે, અને તે દિવસની સખતીઓ અને ડરથી બચાવે અને જહન્નમની આગથી

નજાત આપે.

હઝરત અલી (અ.સ.) ફરમાવે છે:

જે કોઈ માહે રજબમાં પહેલો અથવા વચલો છેલ્લો રોઝો રાખે, તો તેના ભૂતકાળના અને (ભવિષ્યમાં) થનારા ગુનાહ માફ થાય. અને આ મહિનામાં કોઈ એક રાત જાગે, તો હકતઆલા તેને જહન્નમની આગથી આઝાદ કરે અને સિત્તેર ગુનેહગારોના હકમાં તેની શફાઅત કબૂલ કરે.

રોઝા રાખી ન શકે તેઓ વિષે હુકમ

મોઅતબર રિવાયતોથી વારીદ છે કે જેઓ રોઝો રાખવાથી લાચાર હોય અથવા બહુ જ ભારે પડતા હોય, તો તેઓ સુન્નત રોઝાના બદલામાં એક દિરહમ સદકો કરે અને બીજી રિવાયતમાં છે કે દરેક રોઝાના બદલામાં એક મુદ ઘઉં અથવા જવ સદકો આપે.

એક રિવાયતમાં ખાસ માહે રજબના રોઝા માટે એક રોટી સદકો કરવાનું વર્ણન છે, અને આ વિષે એમ

કહે છે કે જેને દિરહમ અથવા મુદ ઘઉં આપવાની શક્તિ ન હોય તેના માટે ઈજાઝત છે કે રોટી આપે.

ખાસ માહે રજબના રોઝા માટે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)થી ફરમાવે છે:

રોઝા રાખી ન શકે તો નીચે લખેલી દુઆ હંમેશા સો વખત પઢે, તો તેને રોઝો રાખવાનો સવાબ મળે. તે દુઆ નીચે મુજબ છે:

સુબ્હાંનલ્લે એલાહિલ્લે જલીલે સુબ્હાંન
મનં લા યમ્બગિંત્તસ્બીહાં ઇલ્લા લહૂ
સુબ્હાંનલ્લે અઅંઝંઝિલ્લઅક્રમે, સુબ્હાંન મનં
લબ્સલ્લિલ્લે વ હોવ લહૂ અહલુનં.

મોઅતબર રિવાયતમાં છે કે સુન્નત રોઝો રાખ્યો હોય અને કોઈ બિરાદરે મોઅમીનના ઘરે જાય અને તે ખાવાનું હાજર કરે અને જમવા કહે, તો રોઝો ખોલી

નાખીને ખાય, તો રોઝો રાખવા કરતાં સિત્તેર ગણો વધારે સવાબ મળે છે, અને પોતે રોઝો રાખ્યો હતો, તે જાહેર ન કરે, તો એક વર્ષના રોઝા જેટલો સવાબ વધારે મળે છે.

હદીસોથી જાહેર થાય છે કે સુન્નત રોઝો પત્નિએ પતિની રજા વિના અને ગુલામ તથા કનીઝોને માલિકની રજા વિના, અને ફરઝંદે માં-બાપની રજા વિના અને મહેમાને ઘરઘણીની રજા વિના, અને ઘરઘણીએ મહેમાનની રજા વિના રાખવો સારો નથી અને આલિમોમાં મશહૂર એ છે કે ગુલામ અને કનીઝ માલિકની રજા વિના સુન્નત રોઝો રાખે, તો બાતિલ છે તેમજ સુન્નત રોઝો ઔરત, પતિની રજા વિના રાખે, તો સહીહ નથી અને મા-બાપની રજા વિના સુન્નત રોઝો રાખવા વિષે આલિમોમાં મશહૂર એ છે કે મકરૂહ છે, બાતિલ નથી, અને કેટલાક કહે છે કે બાપની રજા વિના બાતિલ છે. પણ અહવત (સાવચેતી) એ છે કે માં-બાપની રજા વિના સુન્નત રોઝો રાખવો નહીં. અને મહેમાન તથા ઘરઘણી

માટે ઇપ્તેલાફ છે, અને અહવત (સાવચેતી) એ છે કે એક બીજાની રજા વિના સુન્નત રોઝો રાખે નહીં, અગરચે વધારે મશહૂર તો એ છે કે રાખે તો મફરૂહ છે.

માહે રજબના આ'માલ

મોઅતબર સનદ સાથે મનકુલ છે કે ઇમામે ઝયનુલ આબેદીન (અ.સ.) રજબ મહિનાની પહેલી તારીખે આ દુઆ પઢતા હતા, અને આલીમોએ લખેલ છે કે તે હંમેશા પઢવી સુન્નત છે:

યા મંયં યમ્લેકો હુંવાએજસ્સાએલીન
 વ યઅંલમો ઝંમીર સંસાંમેતીન લેકુલ્લે
 મસ્અલતીમં મિન્ક સમીઉને હુંઝેરૂવે વ
 જવાબુને અંતીદુને અલ્લાહુમ્મ વ મવાઈદોકસે
 સૌદેકંતો વ અયાદીકલે ફાઝેલતો વ

રહીમતોકલે વાસેઅંતો, ફઅસ્અલોક અન્તો
 સંલ્લેય અંલા મોહીમ્મદિંવે વ આલે
 મોહીમ્મદિંવે, વ અને તકીમ્મયે હીવાએજી
 લિદ્દુન્યા વલે આખેરતે ઇન્નક અંલા કુલ્લે
 શયેઈને કંદીર.

મોઅતખર સનદ સાથે મનકૂલ છે કે ઇમામે જાઅફરે
 સાદિક (અ.સ.) માહે રજબમાં હંમેશા આ દુઆ પઢતા
 હતા:

ખાંબલે વાફેદુને અંલા ગંધરેક વ ખંસેરલે
 મોતઅરેરે ઝૂન ઇલ્લા લક, વઝાંઅંલે
 મોલિમ્મૂન ઇલ્લા બેક વ અજ્જેદબલે
 મુન્તજેઝીને ઇલ્લા મનિને તજઅં ફઝીલક

બાબોક મફતૂહુંલે લિરેરાગેબીન વ ખંચરોક
 મખૂંલુલે લિત્તૌલેબીન, વફઝંલોક
 મોબાહુંલેલિસ્સાએલીન વનચલોક
 મોતાહુંલેલિલે આમેલીન વરિઝકૌક મખૂતુંલે
 લેમને અંસૌક વહિંલેમોક મોઅંતરેઝુંલે લેમને
 નાવાક આંદતોકલે એહંસાનો એલલે
 મોસીઇન વ સબીલોકલે ઇબકૌઓ અંલલે
 મોઅંતદીન, અલ્લાહુમ્મ ફહદેની હોદલે
 મોહંતદીન, વરેઝુકેની ઇજતેહાદલે
 મુજતહેદીન, વલા તજઅંદની મેનલે

ગોંફેલીનલે મુબ્બંદીન વગોંફિરેલી યવેમદીન.

મોઅતબર સનદથી મનકૂલ છે કે મોહમ્મદ બીન ઝકવાને ઇમામે જાઅફરે સાદિક (અ.સ.)ની ખિદમતમાં અરજ કરી કે આપ (અ.સ.) ઉપર ફીદા થાઉં. આ મહિનો રજબ છે. મને એવી દુઆ તઅલીમ કરો કે હક તઆલા તેથી મને ફાયદો આપે.

આપ (અ.સ.)એ ફરમાવ્યું કે માહે રજબમાં હંમેશા સવારે અને સાંજે દરેક નમાઝ પછી રાત-દીવસ આ દુઆ પઢે :

યા મને અરજુહો લેકુલ્લે ખંયેરીંવે વ
આમન સખંતંહૂ ઈન્દ કુલ્લે શરરિંયે યા
મંયે યોઅંતિલે કસીર ખિલે કંલીલે યા મંયે
યોઅંતિી મને સઅલહૂ યા મંયે યોઅંતિી

મલેલમં યસ્અલહો વ મલેલમં યઅંરિફેહો
 તહુંનોનમં મિન્હો વરહુંમહું, અઅંતેની
 બે મસ્અલતી ઇય્યાક જમીઅં ખંયેરિદુન્યા
 વ જમીઅં ખંયેરિલે આખેરહું, વસંરિફે અંની
 બેમસ્અલતી ઇય્યાક જમીઅં શરેરિદુન્યા
 વ શરેરિલે આખેરહું, ફઈન્નહૂ ગંયેરો
 મન્કૂસિંમે મા અઅંતેયેત, વ ઝિદની મિને
 ફઝલેક યા કરીમ.

પછી હજરતે ઈમામ (અ.સ.)એ પોતાની દાઢી મુબારક
 ડાબા હાથથી પકડી અને જમણા હાથમાં શહાદતની (અંગૂઠા
 પાસેની) આંગળી જમણી અને ડાબી બાજુ હલાવતા હતા
 અને આ મુજબ પઢતા (અને જ્યાં સુધી આંસુથી દાઢી
 પલળી જતી નહીં, ત્યાં સુધી પઢતા રહેતા.)

યા ઝંલે જલાલે વલે ઇકરમ, યા ઝંન્નઅં
 માએ વલે જુદે યા ઝંલેમન્ને વત્તેવલે હુંરેરિમ
 શયબતી અંલન્નાર.

શેખ તૂસી (અ.ર.) ભરોસાપાત્ર સનદ સાથે વર્ણન
 કરે છે કે હઝરત ઇમામે જઅફર સાદિક (અ.સ.)એ
 મોઅલ્લા બીન ખુનેસને ફરમાવ્યું કે માહે મુબારકે રજબમાં
 આ દુઆ પઢે :

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક
 સુંબરશશાકેરીન લક વ અંમલલે ખાંએફીન
 મિન્ક વ યકીનલે આંબેદીન લક, અલ્લાહુમ્મ
 અન્તલે અંલિયુલે અંઝીમ વ અના અંબદોકલે
 ખાંએસુલે ફકીરો અન્તલે ગાંનિયુલે હુંમીદો
 વ અનલે અંબદુઝંઝંલીલો અલ્લાહુમ્મ

સંલ્લોઅંલા મોહુંમ્મદિંવ વ આલેહી વમ્નુન
 બેગેનાક અંલા ફકરી વબેહિંલ્મેક અંલા
 જહલી વબેકુંવ્વતેક અંલા ઝંઅંફી, યા કંવિય્યો
 યા અંઝીઝો, અલ્લાહુમ્મ સંલ્લો અંલા
 મોહુંમ્મદિંવ વ આલેહિલે અવ્સોયોઇલે
 મરઝીયીન વકફેની મા અહમ્મની મિન
 અમરિ દુન્યા વલઆખોર હ, યા
 અરહુંમરહુંમીન.

અને જનાબ સૈયદ ઈબ્ને તાહિસ (અ.ર.)ની
 રિવાયતથી જાહેર થાય છે કે ઉપરની દુઆ ઘણી સારી
 દોઆ છે અને દરેક વખતે પઢી શકાય છે.

શેખ તૂસી (અ.ર.) અને સૈયદ ઈબ્ને તાહિસ (અ.ર.)
 અને બીજા આલિમોએ મોઅતબર સનદોની સાથે હઝરત

સાહેબુલ અમ્ર (અ.સ.)થી રિવાયત કરી છે કે સુખ્નત છે
કે માહે રજબમાં હંમેશા દિવસે આ દુઆ પઢે :

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિલ
મવલૂદયને ફી રજબિમ મોહુંમદિબને
અંલીયે નિસ્સાની વબનેહી અંલીયીબને
મોહુંમદેનિલ મુન્તજબે વ અતકુંરેરબો
બેહેમા એલયક ખંરલ કોરબે યા મને
એલયહિલ મઅરૂફો તોલેબ, વ ફીમા લદયહે
રોગેબ અસ્અલોક સોઆલ મુકુંતરેફિમ
મુઝનેબીને કુંદે અવ બકુંતેહૂ ઝોનૂબોહૂ વ
અવ સંકુંતહો ઓયુબોહૂ ફતોલ અંલલ ખંતોયા
દોઊબોહૂ વ મેનરે રઝાયા ખોતૂંબોહૂ

યસ્મલોક ત્વંબત વહુંસ્નલ અવંબત
 વન્નોઝૂં અંનિલ હુંવંબતે વ મેનન્નારે
 ફકાક રકંબતેહી વલ અંફેવ અંમ્મા ફી
 રિષ્કંતેહી ફઅન્ત મવંલાય અઅંઝંમો
 અમલેહી વ સંકંતેહી અલ્લાહુમ્મ વ
 અસ્મલોક બે મસાએલેકશશરીફતે વ
 વસાએલેકલ મોનીફતે અન તતગંમ્મદની
 ફી હાઝંશહરે બે રહુંમતિમ મિન્ક
 વાસેઅંતિવં વ નેઅંમતિવં વાઝેઅંતિવં વ
 નફસિમ બેમા રઝકંતહા કાનેઅંતિનં એલા
 નોઝૂલિલ હાંફેરતે વ મહુંલ્લિલ આખેરતે
 વ મા હેય એલયહે સંએરહું.

રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

માહે રજબમાં હંમેશા સવારે અને સાંજે સિતેર (૭૦)

વખત

અસ્તગૌંફેરુલ્લાહ રબ્બી વ અતૂબો એલયહુ

કહે, પછી બંને હાથ આસમાન તરફ ઊંચા કરીને
આ મુજબ કહે:

અલ્લાહુમ્મગૌંફેરેલી વ તુબે અંલય્ય

આ ઇસ્તિગ્ફાર ઉપર મુજબ હંમેશા આખું વર્ષ પઢવું
મુસ્તહબ છે અને આખા રજબમાં હજાર વખત
કુલ્હોવલ્લાહનો સૂરો પઢવામાં ઘણો સવાબ છે. મરજુમાં
આવે તો એક દિવસમાં પઢે અને મરજુમાં આવે તો
આખા મહિનામાં પઢે.

મનકૂલ છે કે જે કોઈ આખા મહિનામાં હજાર વખત

લાં એલાહ ઇલ્લલ્લાહ

પટે, તેના માટે એક લાખ નેકી લખાય અને હક તઆલા તેના માટે બેહિશ્તમાં એક શહેર બનાવે અને રજબમાં હંમેશા રાત્રે હજાર વખત પઢવાનું પણ વારીદ થયું છે. અને નીચે મુજબ હંમેશા સો વખત પટે :

अस्तर्गैरुस्लाउस्लर्मी ला ऐलाउ ँस्ला
 डोव वडुँदु लु ला शरीक लडू व अतूबो
 ऐलयडे

અમીરલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે:

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું છે કે જે કોઈ માહે રજબ, માહે શાઅબાન અને માહે રમઝાનમાં હંમેશા રાત્રે અને દિવસે સૂરએ અલહમ્દ, આયતુલ કુરસી, સૂરએ કુલ યા અય્યોહલ કાફેરન, સૂરએ ઈખ્લાસ, સૂરએ ફલક અને સૂરે નાસ ત્રણ-ત્રણ વખત પટે અને પછી ત્રણ વખત આ મુજબ પટે...

સુખડુંનલાહે વહુંમ્દોલિલાહે વ લા
એલાહ ઇલલાહો વલાહો અકબરે, વ
લા હુંવેલ વલા કુંવત ઇલા બિલાહિલ
અંલિયિલ અંઝીમ.

અને ત્રણ વખત આ મુજબ કહે..

અલાહુમ્મ સંલે અંલા મોહુંમ્દિંવે
વ આલે મોહુંમ્દે

અને તે પછી ત્રણ વખત આ પ્રમાણે કહે...

અલાહુમ્મગૌફિરે લિલે મોઅમેનીન વલે
મોઅમેનાત

અને તે પછી નીચે મુજબ ચાર સો (૪૦૦) વખત
કહે...

અસ્તૌંકેરુલ્લાહ વ અતૂબો એલયહ.

તો એ મુજબ અમલ કરવાથી તેના ગુનાહ વરસાદના ટીપા જેટલા હોય, ઝાડના પાંદડા જેટલા હોય અને દરિયાના ફીણ જેટલા હોય, તો પણ અલ્લાહ માફ કરી આપે છે અને ઇદને દિવસે હક તઆલા તેને ફરમાવે છે કે તું મારો દોસ્ત છે અને આ અમલમાં જેટલા અક્ષર છે તેટલા તારા મોઅમીન બિરાદરો અને બહેનોની શફાઅત કરવાનો અધિકાર આપું છું.

પછી રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું:

અગર પોતાની આખી ઉંમરમાં એક વખત આ અમલ કરે, તો હક તઆલા એક-એક અક્ષરના બદલામાં સિતેર હજાર નેકી અતા ફરમાવે, જે દરેક નેકી દુનિયાના તમામ પહાડ કરતા ભારે હોય અને મરતી વખતે તેની સાત સો હાજતો (માંગણીઓ) અને કબરમાં સાત સો હાજતો (ઈચ્છા) અને કબરમાંથી બહાર નીકળતી વખતે સાત સો હાજતો તેમજ અમલનામું ખોલતી વખતે, અમલ તોળતી

વખતે, સેરાત ઉપરથી પસાર થતી વખતે તેની હાજતો (માંગણી) પુરી થશે અને અર્ધના છાંયા નીચે જગ્યા મળશે અને તેનો હિસાબ આસાનીથી લેવામાં આવશે અને સિતેર હજાર ફરિશ્તા તેની સાથે જશે એટલે સુધી કે તે બેહિશ્તમાં દાખલ થાય અને તેને એવી ચીજો આપશે કે કોઈ આંખે જોઈ નહીં હોય તેમજ કોઈ કાને સાંભળી નહીં હોય.

માહે રજબની પહેલી તારીખના આ'માલ

જાણવું જોઈએ કે માહે રજબની પહેલી રાત્રે ગુસ્લ કરવું સુન્નત છે.

મનકૂલ છે કે જે કોઈ માહે રજબની પહેલી, પંદરમી અને છેલ્લી રાત્રે ગુસ્લ કરે તો ગુનાહથી એવો પાક થાય છે કે જાણે પોતાની માના પેટમાંથી જન્મ પામ્યો હો.

બીજ (ચાંદ) જોઈને સહીફએ કામેલામાં લખેલી દુઆ પઢે કારણકે તે બેહતરમાં બેહતર દુઆ છે અને બીજ જોઈને સાત વખત અલ્હમ્દનો સૂરો પઢે તો આંખના દર્દથી સુરક્ષિત રહેશે અને એ મુજબ દરેક મહિનાની બીજ જોઈને

પટવું સુન્નત છે.

મનકૂલ છે કે માહે રજબની બીજ જુએ, ત્યારે આ દુઆ પઢે:

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ

અલ્લાહુમ્મ અહિલ્લહૂ અંલરના બિલે
અમ્ને વલે ઇમાને, વસ્સલામતે વલે ઇસ્લામે
રબ્બી વ રબ્બોકલ્લાહો અંઝ વ જલ્લ

પહેલી રાત્રે તથા દિવસે ઇમામે હુસૈન (અ.સ.)ની ઝિયારત પઢવી સુન્નત છે. તેની ઘણી ફઝીલત વર્ણવવામાં આવી છે. ભરોસાપાત્ર હદીસમાં છે કે જે કોઈ રજબ મહિનાની પહેલી તારીખે ઇમામે હુસૈન (અ.સ.)ની ઝિયારત પઢે, તો અલબત્તા તેના માટે બેહિશ્ત વાજિબ થાય અને એ ઝિયારત આગળ આવી ગઈ છે.

રજબની પહેલી રાત્રે જાગવું સુન્નત છે.

ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

બનતાં સુધી ઇદુલ ફિત્ર તથા ઇદુલઝોહાની રાત્રે તથા મોહર્રમની પહેલી અને દસમી રાત્રે તથા રજબની પહેલી રાત્રે તથા શાઅબાનની પંદરમી રાત્રે જાગવું અને નમાઝ પઢવી, દુઆ કરવી, કુરઆને શરીફની તિલાવત કરવી.

ઈમામ મોહમ્મદ તકી (અ.સ.) ફરમાવે છે:

રજબની પહેલી રાત્રે ઇશાની નમાઝ પછી આ દુઆ પઢે:

બિસ્મિલ્લાહિરે રહુમાનિરે રહીમ

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બેઅન્નક
મલેકુને વ અન્નક અંલા કુલ્લે શયેઈમ
મુકૈતદીરે વ અન્નક મા તશાઓ મિને
અમરીયે યકૂનો, અલ્લાહુમ્મ ઇન્ની

અતવજૃહો એલચક બેનબિચ્યેક મોહુંમદિનં
 નબિચિરં રહુંમતે સંલ્લલ્લાહો અંલચહે વ
 આલેહી, યા મોહુંમદો યા રસૂલુલ્લાહે
 ઇન્ની અતવજૃહો બેકએલલ્લાહે રબ્બેક
 વ રબ્બી લેયુન્જેહું બેક તંલેબતી અલ્લાહુમ
 બે નબિચ્યેક મોહુંમદિંવં વલં અઇમ્મતે
 મિનં અહલે બયતેહી સંલ્લલ્લાહો અંલચહે
 વ અંલચેહીમ અન્જેહું તંલેબતી.

પછી પોતાની હાજતો (જરૂરીયાતો) માંગવી અને બે-
 બે રકઅત કરીને વીસ રકઅત નમાઝ પઢે. દરેક રકઅતમાં
 સૂરએ અલહમ્દ પછી એક વખત સૂરે કુલ્હોવલ્લાહો અહદ
 પઢે, તો દુનિયાની બલા અને આખેરતના અઝાબથી નજાત
 પામે.

શેખ તૂસી (અ.ર.) અને બીજા આલિમોએ ભરોસાપાત્ર સનદ સાથે વર્ણન કર્યું છે કે:

ઇમામે મૂસા કાઝિમ (અ.સ.) રજબ મહિનાની પહેલી રાત્રે નમાઝે શબ્થી ફારીગ થયા પછી નીચેની દુઆ સજદામાં પઢતા હતા:

લકલે મહુંમેદતો ઇને અતંઅંતોક વ
લકલે હુંજેજતો ઇને અંસંથતોક લા સુંઅંલી
વલા લેગંયેરી ફી એહંસાનિને ઇલ્લા બેક
યા કાએનો કુંબલ કુલ્લે શયઇવં, વ યા મોકવ્વેન
કુલ્લે શયઇને, ઇન્નક અંલા કુલ્લે શયઇને
કુંદીર, અલ્લાહુમ્મ ઇન્ની અઊંઝાં બેક મેનલે
અંદીલતે ઇન્દલે ભવેતે વ મિને શરરરિલે
મરજેએ ફિલ્કોબૂરે વ મેનન્નદામતે યવેમલે

અઝેફતે ફઅસઅલોક અને તોસંલ્લેય અંલા
 મોહુંમદિવં વ આલે મોહુંમદે, વ અને
 તજઅંલ અંચી ઈંશતને નકીયતને વ મર્યતી
 મીતતને સવિચ્ચતંવં વ મુન્કંલબી મુન્કંલબને
 કરીમને ગંચેર મુખંઝિંવં વલા ફાઝેહિને
 અલ્લાહુમ્મ સંલ્લેઅંલા મોહુંમદિવં વ
 આલેહિલ અઈમ્મતે યનાબીઈલ હિંકમતે
 વ ઓલિને નેઅંમતે વ મઆદેનિલ ઈંસમતે
 વઅંસિંમની બેહિમ્મિને કુલ્લે સૂઈવં વલા
 તઅખુંઝની અંલા ગીરેરતીવં વલા અંલા
 ગંફલતિને વલા તજઅંલ અંવાકેબ અઅંમાલી

હુંસ્તંવે વરેઝં ઐન્ની ફઇન્ન મગૈરેતક
 લિઝંઝાલેમીન વ અના મેનઝંઝાલેમીન,
 અલ્લાહુમ્મગૈરેલી માલા યઝુંરૌક વ
 અઅંતેની મા લા યન્કૌસૌક ફ ઇન્નકલે
 વસીઓ રહુંમતોહુલેબદીઓ હિંકમતોહુ વ
 અઅંતેનિસે સઅંત વદઅંત વલે અમ્ન
 વસેહુંહુંત વલે બોખૂંઅ વલે કૌનૂઅં વશ્શુકર
 વલ મોઆફાત વત્તકૌવા વસેસંબ્ર વસિંસંદકૌ
 અંલયક વ અંલા અવલેયાએક વલે યુસર
 વશ્શુકર વઅંમુમ્ બેઝાલેક યા રબ્બે અહુલી
 વ વલદી વ ઇબ્વાની ફીક વ મને અહુંબબતો

વ અહુંબની વ વલતતો વ વલદની મેનલ
મુસ્લેમીન વલ મોએમેનીન યા રબ્બલ
ઓલમીન.

અને સુન્નત છે કે વિત્રની નમાઝ પછી જે હાલતમાં
છે તે જ હાલતમાં આ દુઆ પઢે:

અહુંમદો લિલ્લાહિલ્લહી લા તન્ફદો
બંઝાએનોહૂ વલા યબાંફો આમેનોહૂ રબ્બે
એનિરે તકબ્તુલ મઆસેય ફઝાલેક સંકંતુમે
મીન્ની બેકરમેક ઇન્નક તકબ્લુત તવબત
અંને એબાદેક વ તઅફૂ અંને સય્યેઆતેહિમે
વ તગેફેરૂઝ ઝલલ વ ઇન્નક મોજબો લેદાઈક
વ મિન્હો કંરીબુને વઅના તાએબુને એલયેક

મેનલે ખેંતાંયા વ રાગેંબુને એલયેક ફી
 તવેફીરે હેંઝેંઝી મેનલે અંતાંયા યા ખાંલેકેલે
 બરાયા યા મુન્કેંઝી મિને કુલ્લે શદીદતીને
 યા મોજીરી મિને કુલ્લે મહુંઝેંરિવે વફેફિરે
 અંલય્યસ્સોરૂર વકેફેની શરૂ અંવાકેંબિલે
 ઓમૂરે ફઅન્તલ્લાહો અંલા નઅંમાએક વ
 જઝીલે અંતાંએક મશકૂરૂવે વલે કુલ્લે ખંયેરિમ
 મઝંખૂરે .

હઝરત ઇમામે અલી નકી (અ.સ.) ફરમાવે છે કે
 વિત્રની નમાઝ પછી આ દુઆ પઢે:

યા નૂરને નૂરે યા મોદબ્બેરલે ઓમૂરે
 યા મુજેરેયલે બોહૂરે યા બાએસં મનેફિલે

કોંબૂરે યા કહફીહીન તોઅંયીનિલ મઝાહેબો
 વ કન્ઝી હીન તોઅંજેઝોનિલ મકાસેબો વ
 મુનેસીહીન યજ'ફૂનિલ અબાઅંદો
 વતમલ્લોનિલ અકાંરેબો, વ મોનઝંઝેહી
 બે મોજાલેસત અવલેયાએહી વ મોરાફકંતે
 અહિંબ્યાએહી ફી રેયાઝંતીને વ સાકીંબે
 મોવાનસતેહી મિને નમીરે હંયાઝંહ, વ
 રાફેઈ બે મોજાવરતેહી મિને વરેતંતિંઝં ઝાંનુબે
 એલા રબેવતિત તકંરીબે વ મોબદેલી બે
 વલાયતેહી ઈંઝંઝતલ અંતંયા મિને ઝિંલ્લતિલ
 ખંતંયા અસ્અલોક યા મવલાય બિલ ફજરે

વ લયાલિલે અંશરે વશૈંએ વલે વત્રે વલે
 લયેલે એઝાં યસરે વ બેમા જરાબેહી કુંલમુલે
 અંકુંલામે બેગૈંયરે કફૈંફિન વલા ઇબેહામે
 વબે અસ્માએકલે એઝાંમે વબે હૌજજેક
 અંલા જમીઈલે અનામે અંલયેહિમં મિન્ક
 અફૈંઝલસૌલામે વબે મસ્તહૈંફૈંઝતહુમં મિનં
 અસ્માએકલે કેરામે અનંતોસૈંલ્લેય અંલયેહિમં
 વ તરહૈંમ્ના ફી શહરેના હાઝાં વમા બઅંદહૂ
 મેનશ શોહૂર વલે અય્યામે વ અનં તોબલ્લેગૈંના
 શહરેસૈંયામે ફી આંમેના હાઝાં વફી કુલ્લે
 આંમિનં યા ઝલેજલાલે વલે ઇકેરામ વલે

મેનનિલં જેસામ વ અંલા મોહુંમદિનં વ
આલેહી મિન્ના અફઝલસં સલામ.

આ સિવાય રાતે પઢવાની દુઆ અને આ'માલ ઘણા છે. પહેલી તારીખના રોઝાનો સવાબ પણ પુષ્કળ છે.

ઇમામે મોહમ્મદે બાકિર (અ.સ.) ફરમાવે છે:

માહે રજબની પહેલી તારીખે હઝરત નૂહ (અ.સ.) કિશ્તી ઉપર સવાર થયા. તમામ જિન્નાત અને ઇન્સાન કે જેઓ તેમની સાથે કિશ્તીમાં હતા તેઓને હુકમ કર્યો કે આજે રોઝો રાખો. તો જે કોઈ પહેલી તારીખે રોઝો રાખે, તો તેનાથી જહન્નમની આગ એક વર્ષના રસ્તા જેટલી દૂર થઈ જાય.

હઝરતે ઇમામે અલી રેઝા (અ.સ.)મે ફરમાવે છે:

જે માહે રજબની પહેલી તારીખે સવાબની ચાહનાથી રોઝો રાખે, તેના ઉપર બેહિશ્ત વાજિબ થાય. એ મહિનાની વચલી તારીખે રોઝો રાખે, તેની શફાઅત હક તઆલા

રબીઆ અને મોઝીરના ટોળાના લોકો જેટલી કબૂલ ફરમાવે. આ મહિનાની છેલ્લી તારીખનો એક રોઝો રાખે તેને ખુદા બેહિશ્તના બાદશાહમાં મુકર્રર કરે અને તેના મા-બાપની, ભાઈ, બહેનની, પુત્ર, પુત્રી, કાકા, કાકીની, માસા, માસીની ઉપરાંત પડોશી અને ઓળખીતાઓની શફાઅત કરે તેમજ તેઓ જહન્નમને લાયક હોય તો પણ ખુદા શફાઅત કબૂલ ફરમાવે.

જનાબે સલમાને ફારસી (અ.ર.)થી રિવાયત કરી કે તેઓએ કહ્યું કે: હું જમાદીઉલ આખરની છેલ્લી તારીખે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની ખિદમતમાં ગયો.

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: અય સલમાન! તું અમો અહલેબૈત (અ.મુ.સ.)માંથી છે, જે કોઈ મોઅમીન કે મોઅમેના રજબ મહિનામાં ત્રીસ રકઅત નમાઝ પઢે. દરેક રકઅતમાં અલહમ્દના સૂરા પછી ત્રણ વખત કુલ હો વલ્લાહનો સૂરો અને ત્રણ વખત કુલ યા અય્યોહલ કાફેરૂનનો સૂરો પઢે, તો તેના અમલનામામાંથી તેણે નાની વયમાં કરેલા તમામ ગુનાહ માફ કરી આપે અને આખા

મહિનાના રોજી રાખ્યા હોય તેટલો સવાળ અતા ફરમાવે. બીજા વરસ સુધી તેને નમાઝ ગુઝારોમાં લખે. એ મહિનામાં હંમેશા તેના માટે બદ્રની લડાઈમાં શહીદ થયેલા જેવો સવાળ આસમાન ઉપર લઈ જાય. આ મહિનામાં રોજી રાખે તો તેનો સવાળ એક વર્ષની ઇબાદત જેટલો મળે અને તેના માટે બેહિશ્તમાં હજાર દરબજા બુલંદ કરે. અગર આખા મહિનાના રોજી રાખે તો ખુદા તેને જહન્નમની આગથી નજાત અતા ફરમાવે અને બેહિશ્ત તેના માટે વાજિબ કરે.

અય સલમાન! આ નમાઝ મારા માટે જિબ્રિલ લાવ્યા અને કહ્યું કે, અય મોહમ્મદ (સ.અ.વ.) આ નમાઝ તમારી અને મુનાફિકો વચ્ચે નિશાની છે, કારણકે આ નમાઝ મુનાફિકો પઢતા નથી.

મેં અરજ કરી: યા રસૂલુલ્લાહ (સ.અ.વ.)! આ નમાઝ કેવી રીતે અને ક્યા સમયે પઢું?

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: રજબ મહિનાની પહેલી તારીખે બે-બે રકઅત કરીને દસ રકઅત. દરેક

રકચતમાં અલ્હમના સૂરા પછી ત્રણ વખત કુલ્હોવલાહો
 અહદનો સૂરો અને ત્રણ વખત કુલ યા અચ્ચોહલ
 કાફેરનો સૂરો પઢે. જ્યારે બે રકચત પુરી થાય ત્યારે
 બંને હાથ આસમાન તરફ ઊંચા કરી આ દુઆ પઢે :

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ

લા એલાહ ઇલ્લાહો વહ્દહૂ લા શરીક
 લહૂ લહુલે મુલ્કો વ લહુલે હુમ્દો યોહુયી
 વ યોમીતો વ હોવ હુચ્ચુલે લા યમૂતો
 બેયદેહિલે ખંયેરો વ હોવ અંલા કુલ્લે શયેઈને
 કંદીર અલ્લાહુમ્મ લા માનેઅં લેમા
 અઅંતંયેત વલા મોઅંતંય લેમા મનઅંત
 વલા યન્ફાઉં ઝંલે જદે મિન્કલે જદો.

આ પટ્યા પછી બંને હાથ મોટા ઉપર ફેરવવા.

પછી રજબ મહિનાની પંદરમી તારીખે એજ પ્રમાણે દસ રકઅત નમાઝ પઢે અને બે-બે રકઅત પછી બંને હાથ આસમાન તરફ ઊંચા કરી નીચેની દુઆ પઢે:

લા એલાહા ઇલ્લાહાહો વહ્દેહૂ લા
શરીફ લહૂ લહુલ મુલ્કો વ લહુલ હુમ્દો
યોહુયી વ યોમીતો વ હોવ હુયુલ લા
યમૂતો બેયદેહિલ ખૈરો વ હોવ અંલા કુલ્લે
શયેઈને કંદીર એલાહંવે વાહ્દેને અહ્દેને
ફરેદને સૈમદલે લમ્ યત્તખિંઝં સૌહૈબતંવે
વલા વલદા.

આ દુઆ પટ્યા પછી પોતાના બંને હાથ મોટા ઉપર ફેરવવા.

પછી રજબ મહિનાની છેલ્લી તારીખે પણ એજ મુજબ બે-બે રકઅત કરીને દસ રકઅત નમાઝ પઢવી અને બે-બે રકઅત પછી સલામ કહી બંને હાથ આસમાન તરફ ઊંચા કરી આ દુઆ પઢવી:

લા એલાહ ઇલ્લાહો વહ્દેહૂ લા શરીક
 લહૂ લહુલ્ મુલ્કો વ લહુલ્ હુમ્દો યોહુયી
 વ યોમીતો વ હોવ હુયુલ્ લા યમૂતો
 બેયદેહિલ્ ખૈરો વ હોવલ અંલા કુલ્લે
 શયેઈનૈ કંદીર વ સંલ્લાલ્લાહો અંલા
 મોહુમ્મદિં વ આલેહિત્તાહેરીન વલા હુવલ
 વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ્ અંલિયિલ્
 અંઝીમ.

દુઆ પઢ્યા પછી મોઢા ઉપર હાથ ફેરવવા. પછી પોતાની હાજત માંગવી, ઇન્શાઅલ્લાહ પુરી થશે. ખુદા તારી અને જહન્નમની વચ્ચે સાત ખંદકનું અંતર કરશે. દરેક ખંદકની પહોળાઇ જમીન અને આસમાન જેટલી હશે. ઉપરાંત દરેક રકઅતના બદલામાં હજાર રકઅતનો સવાબ લખાય અને જહન્નમની આગથી મુક્તિ તથા પુલે સેરાત ઉપર પાર થવાની સનદ મળે.

મનકૂલ છે કે જે કોઇ રજબ મહિનામાં જુમ્આના દિવસે એક સો (૧૦૦) વખત કુલ્હોવલ્લાહો અહદનો સૂરો પઢે, તો ખુદા કયામતમાં તેને એવું નૂર અતા ફરમાવે કે તેથી તે બેહિશ્તમાં દાખલ થાય.

ઇમામે જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

ખુદાવંદે તઆલાએ આ ઉમ્મતને ત્રણ મહિનાની ફઝીલત આપી છે અને એવી ફઝીલત બીજી ઉમ્મતને આપી ન હતી:

(૧) માહે રજબ (૨) માહે શાઅબાન, (૩) માહે

તેમજ આ ઉમ્મતને ત્રણ રાત આપી છે, એવી રાત કોઈ ઉમ્મતને આપી નથી:

દરેક મહિનાની ૧૩મી, ૧૪મી અને ૧૫મી રાત

આ ઉમ્મતને ત્રણ સુરા આપ્યા છે, એવા સુરા કોઈ ઉમ્મતને આપેલ નથી.

૧. સૂરએ યાસીન,
૨. સૂરએ તબારકલ્લી બેયદેહીલ મુલ્ક
૩. સૂરએ તૌહીદ

તો જે કોઈ એ ત્રણેય ફઝીલતને ભેગી કરે, તો આ ઉમ્મતની તમામ ફઝીલતોને ભેગી કરવા સમાન છે.

પૂછવામાં આવ્યું: એ ત્રણ ફઝીલત કેવી રીતે ભેગી કરવી ?

ફરમાવ્યું: ત્રણેય મહિનાની ૧૩મી રાત્રે બે રકઅત

નમાઝ પઢે અને દરેક રકઅતમાં અલ્લ્હના સૂરા પછી ઉપરોક્ત ત્રણેય સૂરા પઢે અને એ ત્રણેય મહિનાની ૧૪મી રાતે બે-બે રકઅત કરી ચાર રકઅત નમાઝ પઢે. દરેક રકઅતમાં અલ્લ્હના સૂરા પછી એ ત્રણેય સૂરા પઢે, પછી એ ત્રણેય મહિનાની ૧૫મી રાત્રે બે-બે રકઅત કરીને છ રકઅત નમાઝ પઢે. દરેક રકઅતમાં અલ્લ્હના સૂરા પછી એ ત્રણેય સૂરા પઢે. એ મુજબ કરવાથી એ ત્રણેય મહિનાની તમામ ફઝીલત મળે છે અને ખુદાની સાથે કોઈને શરીફ કરવા સિવાય તમામ ગુનાહો માફ કરી આપે છે.

ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

જે કોઈ માહે રજબની ૧૩, ૧૪ અને ૧૫મી તારીખના રોઝા રાખે, જે ત્રણ તારીખો “અય્યામુલ બીજ” કહેવાય છે, તો ખુદા દરેક રોઝાના બદલામાં એક વર્ષની ઇબાદતનો અને એક વર્ષના રોઝાનો સવાબ અતા ફરમાવે અને ક્યામતમાં નિર્ભય જગ્યામાં રહેવા આપે.

માહે રજબની પંદરમી રાત મુબારક છે. તે રાત્રે ગુસ્લ કરવું સુન્નત છે અને જાગીને ઇબાદત કરે, તો

ઘણી ફઝીલત છે.

રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

રજબ મહિનાની પંદરમી રાત્રે હક તઆલા મલાએકાઓને હુકમ કરે છે કે એ મોઅમીનોના આ'માલનામામાં જેટલા ગુનાહ હોય તેટલા કાઢી નાખો.

ઉપરાંત આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે રજબ મહિનાની ૧૩, ૧૪ અને ૧૫મી તારીખે રોઝો રાખે અને ત્રણેય રાતના જાગીને ઇબાદત કરે તો તે દુનિયાથી “તૌબાએ નસુહ” (ખરી તૌબા)ની સાથે જશે અને દરેક રોઝાના બદલામાં સિતેર કબીરા (મોટા) ગુનાહ માફ થાય. ઉપરાંત કબરમાંથી બહાર નીકળે તે વખતે અમલ તોળવાના ત્રાજવા પાસે અને પુલે સેરાત પાસે સિતેર હાજતો (માંગણીઓ) પુરી થાય અને એવો સવાબ મળે કે જાણે હઝરત ઇસ્માઇલ (અ.સ.)ની અવલાદમાંથી સિતેર બંદા આઝાદ કર્યા હોય અને તેના ઘરના સગાઓમાંથી સિતેર જણ જહન્નમમાં જવા લાયક હોય, તેઓ માટે શફાઅત કબૂલ કરે. ઉપરાંત તેઓ માટે

ફિરદૌસમાં સિતેર હજાર શહેર બનાવે. તે દરેક શહેરમાં સિતેર હજાર મહેલ હશે, દરેક મહેલમાં હૂરો હશે અને સિતેર હજાર લોંડીઓ હશે.

શેખ તૂસી (અ.ર.)એ સહીહ સનદ સાથે હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)થી રિવાયત કરી છે કે:

રજબ મહિનાની પંદરમી રાત્રે બે-બે રકઅત કરીને બાર રકઅત નમાઝ પઢે. દરેક રકઅતમાં સૂરએ અલહમ્દ પછી ગમે તે સૂરો એક વખત પઢવો. બાર રકઅત તમામ થયા પછી સૂરે અલહમ્દ, સૂરે કુલ અઉઝો બેરખ્બિન્નાસ, સૂરે કુલ અઉઝો બેરખ્બિલ ફલક, સૂરે કુલ હોવલ્લાહો અહદ અને આયતુલ કુરસી ચાર ચાર વખત પઢે. પછી નીચે મુજબ ચાર વખત પઢે:

સુબ્હાંનલાહે વલે હુંમ્દો લિલ્લાહે વ
લા એલાહ ઇલ્લલાહો વલ્લાહો અકબરે,

ચાર વખત પઢે:

અલ્લાહો અલ્લાહો રબ્બી લા ઉશરેકો
બેહી શયઅંવે વ માશાઅલ્લાહો લા કુંવ્વત
ઇલ્લા બિલ્લાહીલે અંલીયીલે અંઝીમ્.

રજબ મહિનાની પંદરમી રાત્રે તથા દિવસે ઇમામે
હુસૈન (અ.સ.)ની ઝિયારત પઢવી તાકીદ ભરેલી સુન્નત
છે.

ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

અમિરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ
(અ.સ.) રજબ મહિનાની પંદરમી તારીખે બે-બે રકઅત
કરીને ચાર રકઅત નમાઝ પઢતાં હતાં અને બંને હાથ
ઊંચા કરીને નીચેની દુઆ પઢતા હતા અને ફરમાવતા
હતા કે જે કોઈ ગમ અથવા મુસીબતમાં ફસાય, તે આ
દુઆ પઢે તો અલબત્તા તેનો ગમ દુર થાય, તે દુઆ આ
છે:

અલ્લાહુમ્મ યા મોઝિલ્લ કુલ્લે જબ્બારિવં
 વયા મોઈઝ્લે મોઅમેનીન અનત કહ્ફી
 હીન તોઅંયીનલે મઝાહેબો વ અન્ત બારેઓ
 ખેલ્કી રહ્મતમે બી વકંદે કુન્ત અંને ખેલ્કી
 ગોનિયંવે વ લવેલા રહ્મતોક લકુન્તો મેનલે
 હાલેકીન વ અન્ત મોઅય્યેદી બિન્નસેરે અંલા
 અઅંદાઈ વ લવેલા નસેરોક ઇય્યાય લકુન્તો
 મેનલે મફ્ઝુહીન યા મુર સેલર રહ્મતે
 મિમ મઆદેનેહા વ મુન્શેઅલે બરકતે મિમ
 મવાઝેએહા યા મનેખેસેસે નફેસહૂ બિશ્શોમૂખે
 વરરિફે અંતે ફઅલ્લેયોઓહૂ બેઈઝ્લેહી

યતઐઝ્ઞૂન વ યામનૌ વઝ્ઞૈત્લાહુલૌ
 મોલૂકોનીરલૌમઝ્ઞલતે ઐલા અઐનાકૈહિમૌ
 ફહુમૌ મિન્સતૈવાતેહી ખૌએફૂન, અસ્અલોક
 બે કયૈનૂનિચ્યતે કલ્લતિશતકૈકૈતહા મિન
 કિબ્રયાએક વ અસ્અલોક બે કિબ્રયાએકલૌ
 લતિશતકૈકૈતહા મિનૌ ઈઝ્ઞૈતેક વ અસ્અલોક
 બે ઈઝ્ઞૈતેકલૌ લતિસ્તવયૈત બેહા ઐલા અરૈશેક
 ફખૈલકૈત બેહા જમીઐ ખૈલકૈક ફહુમૌ લક
 મુઝ્ઞૈનૂન અન્તો સૈલ્લેય ઐલા મોહૈમ્મદિવૌ
 વ અહૈલેબયૈતેહી.

માહે રજબની ૧૬ થી ૩૦ તારીખ સુધી

આ મહિનાની ૧૮મી તારીખે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ના ફરજંદ જનાબે ઇબ્રાહીમની વફાત છે અને તેથી કેટલાક મુનાફિકો રસૂલે ખુદા (સ.અ.વ.)ને મહેલાા મારી ઇબ્રા આપતા હતા, તેઓ (મુનાફીકો) ઉપર લઅનત કરવી મુનાસીબ છે.

આ મહિનાની ૨૨મી તારીખે મોઆવીયા લઅનતુલ્લાહે અલરહ મરી ગયો છે.

૨૪મી તારીખે હઝરત અલી (અ.સ.)એ ખૈબરના યુદ્ધમાં વિજય મેળવ્યો, અને મરહબ (ચહૂદી પહેલવાન)ને માર્યો તેથી તે દિવસે રોઝો રાખવો અને હઝરત અલી (અ.સ.)ની ઝિયારત પઢવી સુન્નત છે.

હઝરત અલી (અ.સ.) ફરમાવે છે:

માહે રજબની ૨૪-મી તારીખે રોઝો રાખે, તો બરસો (૨૦૦) વર્ષના ગુનાહોનો કફ્ફારો (ભુગતાન) છે. છવ્વીસમી તારીખે રોઝા રાખે, તો એંસી (૮૦) વર્ષના

ગુનાહનો કફ્ફારો (ભુગતાન) છે, સત્યાવીસમી તારીખે મોટી ઘટ છે. તે દિવસે રસૂલે ખુદા (સ.અ.વ.)ને પયગમ્બરી મળી છે. એ દિવસ ઘણો જ મુબારક છે અને સત્યાવીસમી રાત પણ મુબારક છે.

ઈમામ મોહમ્મદ તકી (અ.સ.) ફરમાવે છે: માહે રજબમાં એક રાત છે. તે રાત જેટલી ચીઝો ઉપર સૂર્યનું અજવાળું પડે છે તે તમામ કરતા બેહતર છે અને તે સત્યાવીસમી રજબની રાત છે. તે રાત તમામ થઈ અને દિવસ થયો તે દિવસે હજરત રસૂલે ખુદા મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.)ને પયગમ્બરી મળી છે. એ રાત્રે ઇબાદત કરે તો સાંઈઠ (૬૦) વર્ષની ઇબાદતનો સવાબ મળે છે.

૨૭મી રાત્રે મગરિબ અને ઇશાની નમાઝ પઢીને સૂઈ જાય, પછી અર્ધી રાત પહેલા જાગૃત થાય, ત્યારે બે-બે રકઅત કરીને બાર રકઅત નમાઝ પઢે. દરેક રકઅતમાં અલહમ્દના સૂરા પછી કોઈ એક નાનો સૂરો પઢવો અને (તે પછી યાસીનનો સૂરો પઢવો.) બાર રકઅત પુરી થાય, ત્યારે બેસીને **અલહમ્દ, કુલ અઉઝો બેરઘિનાસ, કુલ**

અઉઝો બેરઞ્જિલ ફલક, કુલ્હોવલ્લાહો અહદ, કુલ
 યા અચ્ચોહલ કાફેરન, ઇન્ના અન્નલ્લા અને આયતુલ
 કુરસી સાત-સાત વખત પઢી આ દુઆ પઢે:

અલ્હુમ્બદો લિલ્લાહિલ્ લીલ્મી લમ્બે યત્તૈબિંઝ
 (સાંહુંબતન વલા) વલદવમ્બકુલ્ લહૂ શરીકુન
 ફિલ્મુલકે વ લમ્બે યકુલ્ લહૂ વલીયુમ્બે
 મોનઝંઝુલ્લો વ કબ્બિરિહો તકબીરા,
 અલ્લાહુમ્બે ઇન્ની અસ્અલોક બે મઅોકેદે
 ઈઝ્ઝેક અંલા અરકાને અંરેશેક વ મુન્તહરે
 રહુમ્બતો મિનિ કેતાબેક વ બિસ્મોકલે
 અઅંઝંમીલે અઅંઝંમીલે અઅંઝંમે વ
 ઝિંકરેકલે અઅંલલેઅઅંલલે અઅંલા, વ

બેકલેમાતેકત્તામ્માતે અનં તોસુંલ્લેય અંલા
મોહુંમ્મદિંવં વ આલેહી વ અનં તફઅંલ
બી મા અન્ત અહલોહું.

પછી ખુદા પાસે હાજત માંગો, ઇન્શાઅલ્લાહ જે હાજત
(ઈચ્છા) હશે તે પૂરી થશે.

હઝરત ઇમામે મૂસા કાઝિમ (અ.સ.) ફરમાવે છે:

રજબ મહિનાની ૨૭મી રાત્રે ગમે તે સમયે બે-બે
રકઅત કરીને બાર રકઅત નમાઝ પઢવી. પણ દરેક
રકઅતમાં અલહમ્દના સૂરા પછી ચાર ચાર વખત કુલ
અઉઝો બેરઘિનાસ, કુલ અઉઝો બેરઘિલ ફલક,
કુહોવલ્લાહો અહદનો સૂરો પઢે. બાર રકઅત પઢી
રહે, ત્યારે તે નીચે મુજબ બાર વખત પઢે:

લા એલાહુ ઇલ્લાહાહો વલ્લાહો
અકબરે, વ સુબ્હાંનલ્લાહે વલે હુંમ્દો લિલ્લાહે

વલા હુંવેલ વલા કુંવત ઇલ્લા બિલ્લાહિલ
અંલીયિલ અંઝીમ.

પછી હાજત હોય તે ખુદા પાસે માંગો.

અલ્લામા મજલિસી અઅલ્લાહો મકામોહુ લખે છે કે આ રાત્રે બાર રકઅત નમાઝ પઢવાની બે રિવાયત છે. તે બંનેમાંથી કોઈ પણ એક રિવાયત મુજબ પઢે તો સાઈ છે. અગર બંને રિવાયત મુજબ પઢે તો બેહતર છે. અને આ મહિનાની પંદરમી રાત્રે જે નમાઝ પઢવાની લખી છે તે નમાઝ આ ૨૭મી રાત્રે પઢે તો સાઈ છે, કારણકે તે વિષે રિવાયત વારીદ થઈ છે.

જનાબે શોખ તૂસી (અ.ર.) ફરમાવે છે કે, ૨૭-મી રાત્રે ગુસ્લ કરવું સુન્નત છે અને હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) તથા હઝરત અલી (અ.સ.)ની ઝિયારત પઢવી સુન્નત છે.

૨૭-મી તારીખે ગુસ્લ કરવું સુન્નત છે અને ૨૭મી તારીખે સુન્નત રોઝો રાખવાનો ઘણો સવાબ છે.

ઘમામે જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

રજબની ર૭મી તારીખે રોઝાનો સવાબ સિતેર વર્ષ સુધી રોઝા રાખવા બરાબર છે.

ર૭મી તારીખે પણ હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) અને હઝરત અલી (અ.સ.)ની ઝિયારત પઢવી મુસ્તહબ છે. આ દિવસે સલવાત પણ બહુ જ પઢવી.

ર૭મી તારીખની નમાઝ આ મુજબ છે:

ઝોહરના સમય પહેલા પઢે, ઘણી હદીસોથી જાહેર થાય છે કે જ્યારે પણ પઢે, ત્યારે સાઈં છે.

મોઅતબર સનદ સાથે રચ્યાન ઈબ્ને સલ્તથી મનકૂલ છે કે ઘમામે મોહમ્મદે તકી (અ.સ.) જ્યારે બગદાદ ગયા, ત્યારે રજબ મહિનાની પંદરમી અને સત્યાવીસમી તારીખે રોઝો રાખ્યો અને પોતાના તમામ નોકરો અને સહાબીઓને ફરમાવ્યું કે આ બંને દિવસે રોઝો રાખે અને તે દરેક દિવસે બે-બે રકઅત કરીને બાર રકઅત નમાઝ પઢે, જ્યારે બાર રકઅત પુરી થાય ત્યારે **સૂરએ અલહમ્દ, સૂરએ ફુલ્હોવલાહો**

અહદ, સૂરએ કુલ અઉઝો બેરબ્બીન્નાસ, સૂરએ
કુલ અઉઝો બેરબ્બીલ ફલક એ બધા સૂરા ચાર
વખત પઢે. પછી ચાર વખત આ મુજબ પઢે:-

લા એલાહ ઇલ્લાહો વલ્લાહો અકબરે
વ સુબ્હાનલ્લાહે વલે હુંમ્દોલિલ્લાહે વલા
હુંવેલ વલા કુંવ્વત ઇલ્લા બિલ્લાહિલે
અંલિયિલે અંઝીમ.

પછી ચાર વખત કહે:

અલ્લાહો અલ્લાહો રબ્બી લા ઉશરેકો
બેહી શયઆ,

પછી ચાર વખત કહે :-

લાઉશરેકો બે રબ્બી અહુંદા.

ઘમામે અલી રઝા (અ.સ.) ફરમાવે છે:

માહે રજબની રટમી તારીખે સુન્નત રોઝો રાખે, તો નેવું વર્ષના ગુનાહોનો કફ્ફારો (ભુગતાન) છે અને રટમી તારીખે રોઝો રાખે, તો એક સો (૧૦૦) વર્ષના ગુનાહનો કફ્ફારો (ભુગતાન) છે અને અગર ત્રીસમી તારીખે રોઝો રાખે, તો તેના ભૂતકાળના અને હવે પછી થનારા ગુનાહ ખુદા માફ કરી આપે.

છેલ્લી તારીખે જનાખે સલમાને ફારસી (અ.ર.)ની દસ રકઅત નમાઝ, જે શરૂઆતમાં બયાન થઇ છે તે મુજબ પઢે અને અગર રલનો ચાંદ થવાનો વહેમ હોય, તો રટમી તારીખે પણ એહતીયાતન એ નમાઝ પઢી લે.

રજબ મહિનામાં હંમેશા પઢવાની નમાઝ

માહે રજબમાં હંમેશા રાતના સમયે સુન્નત નમાઝ પઢવાની છે અને તે વિષે અલ્લામા મોહમ્મદ બાકિર મજલિસી (અ.ર.) લખે છે કે અગરચે તેની ભરોસાપાત્ર

સનદ મળી નથી, પણ મશહૂર છે તેથી લખું છું:

પહેલી રાત્રે ત્રીસ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરઅે અલહમ્દ પછી ત્રણ વખત કુલ યા અય્યોહલ કાફેરન અને ત્રણ વખત કુલ હો વલ્લાહનો સૂરો પઢે.

જાણવું જોઈએ કે તમામ સુન્નત નમાઝ ગમે તેટલી રકઅત હોય, પણ બે-બે રકઅત કરીને પઢવી.

બીજી રાત્રે દસ રકઅત નમાઝ છે દરેક રકાતમાં અલ્હમદ પછી કુલ્યા અય્યોહલ કાફેરનનો સૂરો પઢે.

ત્રીજી રાત્રે દસ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરઅે અલહમ્દ પછી પાંચ વખત એઝાજઅ નસરલ્લાહનો સૂરો પઢે.

ચોથી રાત્રે સો રકઅત નમાઝ પઢે. બે-બે રકઅત પઢવી, તેમાં દરેક પહેલી રકઅતમાં અલહમ્દના સૂરા પછી કુલ અઉઝો બેરબ્બીલ

ફલકનો સૂરો પઢે અને દરેક બીજુ રકઅતમાં સૂરએ અલહમ્દ પછી કુલ અઉઝો બેરબ્બીન્નાસનો સૂરો પઢે.

પાંચમી રાત્રે છ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરએ અલહમ્દ પછી પચીસ વખત કુલ્હોવલ્લાહનો સૂરો પઢે.

છઠ્ઠી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરએ અલહમ્દ પછી સાત વખત આયતુલ કુરસી પઢે.

સાતમી રાત્રે ચાર રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરએ અલહમ્દ પછી ત્રણ વખત સૂરએ કુલ્હોવલ્લાહ, કુલ અઉઝો બેરબ્બીન્નાસ અને કુલ અઉઝો બેરબ્બીલ ફલક પઢે, ચાર રકઅત પુરી થયા પછી દસ વખત સલવાત પઢે અને દસ વખત “તસ્બીહાતે અરબાઅ” પઢે.

આઠમી રાત્રે વીસ રકઅત નમાઝ છે, દરેક રકઅતમાં

સૂરએ અલહમ્દ પછી ત્રણ વખત કુલ યા અર્યોહલ કાફેરન, કુલ અઉઝો બેરબ્બિન્નાસ, કુલ અઉઝો બેરબ્બીલ ફલક પઢે.

નવમી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરએ અલહમ્દ પછી પાંચ વખત અલહાકોમુતકાસોરોનો સૂરો (સૂરે તકાસૂર) પઢે.

દસમી રાત્રે મગરિબની નમાઝ પછી બાર રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરએ અલહમ્દ પછી ત્રણ વખત કુલ્હોવલ્લાહો અહદનો સૂરો પઢે.

અગિયારમી રાત્રે બાર રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરએ અલહમ્દ પછી બાર વખત ‘આયતુલ કુરસી’ પઢે.

બારમી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરએ અલહમ્દ પછી “આમનર રોસોલો”ની

આયત દસ વખત પઢે.

તેરમી રાત્રે દસ રકઅત નમાઝ છે. બે-બે રકઅત કરીને પઢે, તેમાં દરેક પહેલી રકઅતમાં સૂરએ અલહમ્દ પછી 'વલ આદેયાત'નો સૂરો એક વખત પઢે અને દરેક બીજી રકઅતમાં સૂરએ અલહમ્દ પછી અલહાકોમુતકાસોરોનો સૂરો (સૂરે તકાસૂર) એક વખત પઢે.

ચઉદમી રાત્રે ત્રીસ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરએ અલહમ્દ પછી કુલ્હોવલ્લાહનો સૂરો અને 'કુલ ઇન્નમા અના બશરૂમ'ની પૂરી આયત એક વખત પઢે. (સૂરએ કહફની આયત ૧૧૦)

પંદરમી, સોળમી અને સત્તરમી રાત્રે ત્રીસ-ત્રીસ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરએ અલહમ્દ પછી દસ વખત કુલ હોવલ્લાહનો સૂરો પઢે.

અઠારમી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરએ અલહમ્દ પછી દસ વખત

કુલહોવલ્લાહ, દસ વખત કુલ અઉઝો
બેરખ્ખિન્નાસ અને દસ વખત કુલ અઉઝો
બેરખ્ખિલ ફલકનો સૂરો પઢે.

ઓગણીસમી રાત્રે ચાર રકઅત નમાઝ છે. દરેક
રકઅતમાં સૂરએ અલહમ્દ પછી પંદર વખત
કુલ હો વલ્લાહનો સૂરો અને પંદર વખત
'આયતુલ કુરસી' પઢે.

વીસમી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં
સૂરએ અલહમ્દ પછી પાંચ વખત સૂરએ ઇન્ના
અનઝલનાહોનો સૂરો પઢે.

એકવીસમી રાત્રે છ રકઅતમાં અલ્હમ્દ પછી (સૂર-એ-
કૌવસર) ઈન્ના અઅતચ્ચાનો સૂરો અને (સૂર-
એ-તૌહીદ) કુલ્હોવલ્લાહનો સૂરો દસ દસ
વખત.

બાવીસમી રાત્રે આઠ રકઅત દરેક રકઅતમાં અલ્હમ્દો
પછી કુલ્યા અચ્ચોહલ કાફેરૂન સાત સાત વખત
નમાઝ પુરી થયા પછી દસ વખત સલવાત અને

દસ વખત ઈસ્તિગ્ફાર પઢે.

ત્રેવીસમી રાત્રે બે રકઅત દરેક રકઅતમાં અલ્હમદ પછી
પાંચ વખત વઝઝોહાનો સૂરો પઢે.

ચોવીસમી રાત્રે ચાલીસ રકઅત દરેક રકઅતમાં અલ્હમદ
પછી કુલ્હોવલ્લાહો અહદનો સૂરો અને આયએ
આમનર રસૂલો પઢે.

પચ્ચીસમી રાત્રે વીસ રકઅત મગરિબ અને ઈશાની વચ્ચે
પઢે દરેક રકઅતમાં અલ્હમદો પછી આયએ
આમનર રસૂલ અને કુલ્હોવલ્લાહનો સૂરો પઢે.

છવ્વીસમી રાત્રે બાર રકઅત દરેક રકઅતમાં અલ્હમદ
પછી ચાલીસ વખત કુલ્હોવલ્લાહનો સૂરો પઢે.

સત્યાવીસમી, રાત્રે બાર રકઅત પેજ નં. ૨૪૯-૨૫૦ મુજબ
પઢે.

અઠ્યાવીસમી, ઓગણત્રીસમી રાત્રે બાર રકઅત દરેક
રકઅતમાં અલ્હમદો પછી આ'અલા અને ઈબ્રા
અનઝલનાનો સૂરો દસ દસ વખત પઢે નમાઝ

પુરી થયા બાદ સો વખત સલવાત અને ઇસ્તિગ્ફાર પઢે.

શ્રીસમી રાત્રે દસ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરએ અલહમ્દ પછી દસ વખત કુલ હો વલ્લાહનો સૂરો પઢે. જ્યાં ઇસ્તિગ્ફાર પઢવાનું લખ્યું છે, ત્યાં ફક્ત “અસ્તગ્ફે રલ્લાહ રબ્બી વ અતુબો એલયહ” પઢે, તો પુરતું છે.

માહે શાઅબાન

માહે શાઅબાનની ફઝીલત

આ મહિનાની ૪થી અને ૨૦મી તારીખ, બીજી રિવાયત મુજબ ૨૭મી તારીખ ‘નહસે અકબર’ છે.

આ મહિનાની બીજી તારીખે માહે રમઝાનના રોઝા વાજિબ થયા છે.

શ્રીજી તારીખે ઇમામે હુસૈન (અ.સ.)ની તથા ૧૫મી રાત્રે હઝરત ઇમામે મહદી (અ.સ.)ની વિલાદત છે.

આ મહિનો હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)નો કહેવાય છે.

હઝરત ઇમામે જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે:

જ્યારે શાઅબાન મહિનો ખેસતો, ત્યારે રસૂલે ખુદા (સ.અ.વ.) મુનાદી (અવાજ આપનાર)ને ફરમાવતા હતા કે મદીનાના લોકોને કહો કે ખુદાના રસૂલનો હું પયગમ્બર છું. તેઓ ફરમાવે છે કે શાઅબાન મહિનો મારો છે. ખુદા રહેમત કરે એ શખ્સ પર જે આ મહિના મા રોઝા રાખી મારી મદદ કરે અમિરૂલ મોમેનીન ફરમાવે છે જ્યારથી મે મુનાદીથી એ મુજબ સાંભળ્યું, ત્યારથી માહે શાઅબાનનો રોઝો તર્ક કર્યો નથી અને હયાતી છે ત્યાં સુધી ઇન્શાઅલ્લાહ તર્ક નહીં કરું.

માહે શાઅબાનનો રોઝો તમામ ગુનાહોથી તોખા છે. હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) શાઅબાનમાં આખા મહિનાના રોઝા રાખતા હતા.

હઝરત ઇમામે મોહમ્મદ બાકિર (અ.સ.)એ ફરમાવ્યું:

જે કોઈ માટે શાઅબાનનો રોગો રાખે, તેને ખુદાએ તઆલા તમામ ખરાબી તથા બૂરાઈથી પાક કરે છે. અર્શ ઉપાડનારા આ મહિનાની તાઅઝીમ કરે છે તથા તેના હક અને હુરમતને ઓળખે છે. આ મહિનામાં માટે રમઝાન માટે ખંદાઓની રોઝીમાં વધારો થાય છે. આ મહિનામાં બેહિશ્તને શણગારવામાં આવે છે. આ મહિનામાં એક નેકીનો સવાબ સિત્તેર ગણો લખાય છે.

માટે શાઅબાનના રોઝાનો ઘણો સવાબ લખાયેલો છે. એમાંથી એ પણ છે કે આ મહિનાના રોઝાનો ઓછામાં ઓછો સવાબ એ છે કે તેના માટે બેહિશ્ત વાજિબ થાય છે.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું:

શાઅબાન મારો મહિનો છે અને માટે રમઝાન ખુદાનો મહિનો છે. તો જે કોઈ મારા મહિનામાં એક રોગો રાખે, તેની હું કયામતમાં શફાઅત કરીશ, જે કોઈ બે રોઝા રાખે, તેના તમામ ગુનાહ માફ થાય અને ત્રણ રોઝા રાખે, તેને અવાજ આપવામાં આવે કે નવેસરથી અમલ કરે

કારણકે થયેલા તમામ ગુનાહ માફ થઈ જાય છે.

માહે શાઅબાનમાં એક દિવસમાં સિતોર વખત ઇસ્તિગ્ફાર કરનાર ક્યામતમાં હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ના ટોળામાં દાખલ થાય અને તેને માનવંતો કરવો ખુદા ઉપર વાજિબ થાય. જે કોઈ માહે શાઅબાનમાં સદકો આપે અગરચે (ભલે પછી) ખુરમાની અર્ધી પેશી હોય, તેના અંગને જહન્નમની આગ માટે હરામ કરે. જે કોઈ શાઅબાનના છેલ્લા ત્રણ દિવસના રોઝા રાખે અને માહે રમઝાન સાથે મેળવી દે, તેને ખુદાવંદે કરીમ બે મહિના સતત રોઝા રાખવાનો સવાબ અતા ફરમાવે.

હઝરત ઇમામે જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

શાઅબાનનો રોઝો ક્યામતના દિવસ માટે સંગ્રહ છે તથા જે શાઅબાનનો રોઝો રાખે, તેના ગુજરાન (રોઝી)માં હક તઆલા સુધારો કર્યા કરે છે અને તેને તેના દુશ્મનોની ઈજાથી બચાવે છે.

હઝરત અમિરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ

(અ.સ.)થી રિવાયત છે કે હઝરત રસૂલે ખુદા
(સ.અ.વ.)એ ફરમાવ્યું:

શાઅબાન મારો મહિનો છે અને માહે રમઝાન ખુદાનો
મહિનો છે. જે કોઈ મારા મહિનામાં રોઝા રાખે, તેની
ક્યામતમાં શફાઅત કરીશ. અને જે કોઈ મારા મહિનામાં
રોઝો રાખશે, તેને કબરમાં ખુદા ભય નહીં આપે. ક્યામતના
દિવસે કબરમાંથી નીકળશે, ત્યારે તેનું મોઢું નૂરાની હશે,
તેનું અમલનામું તેના જમણા હાથમાં આપવામાં આવશે.
બેહિશ્તમાં જવાનો પરવાનો ડાબા હાથમાં આપવામાં આવશે.
એટલે સુધી કે તેને અર્શની નીચે લાવવામાં આવશે. પછી
ખુદા અવાજ આપશે કે અય મારા બંદા!

તે જવાબ આપશે: અય ખુદા! હું હાજર છું,

પછી ખુદા ફરમાવશે: તેં મારી ખુશી માટે રોઝો રાખ્યો?

તે કહેશે: હા! અય મારા આકા!

તે વખતે અલ્લાહ ફરિશ્તાઓને ફરમાવશે કે મારા
બંદાનો હાથ પકડી મારા પયગમ્બરને સોંપો, તે વખતે
મલાએકા તેને મારી પાસે લાવશે, ત્યારે હું તેને કહીશ કે

તેં મારા મહિનામાં રોઝા રાખ્યા હતા!

તે કહેશે કે ‘હા,’

હું કહીશ કે આજે હું તારી શફાઅત કરું છું.

પછી ખુદા ફરમાવશે કે મેં મારા હક આને માફ કરી આપ્યા અને મારા બંદાઓમાંથી જેનો હક આના ઉપર હોય તે બક્ષી આપે, તો તેના બદલામાં હું એવી ચીઝ અતા કરીશ કે તે રાજી થશે. એ પછી હું તેનો હાથ પકડી સેરાત પાસે લાવીશ. તે વખતે હું જોઈશ કે ‘સેરાત’ હલે છે અને ગુનેહગારોના પગ તેના ઉપર ઠહેરતા નથી. તો એ વખતે હું તેનો હાથ પકડીશ ત્યારે ફરિશ્તો ‘મોવક્કલ’ હશે. તે કહેશે: આ કોણ છે ? હું કહીશ કે આ શખ્સ મારી ઉમ્મતમાંથી છે. તેણે મારા મહિનામાં મારી શફાઅતની ઉમ્મીદથી રોઝો રાખ્યો હતો. માહે રમઝાનમાં ખુદાનો વાયદો ચાહવા માટે રોઝો રાખ્યો હતો, પછી હું તેને ‘સેરાત’ ઉપરથી લઈ જઈ બેહિશ્તના દરવાજા સુધી પહોંચાડી દઈશ. એ વખતે રિઝવાન કહેશે કે આજ એ દિવસ છે કે આપની ઉમ્મત માટે બેહિશ્તનો દરવાજો ખોલુ છું અને આને

બેહિશ્તમાં દાખલ કરું છું.

માહે શાઅબાનના આ'માલ

ઈમામ અલી રઝા (અ.સ.) ફરમાવે છે:

જે કોઈ માહે શાઅબાનમાં હંમેશા સિતેર વખત ઇસ્તિગ્ફાર કરે, તેના ગુનાહ અગર આસમાનના સિતારા જેટલા હોય, તો પણ માફ થઈ જશે.

ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે:

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું કે માહે શાઅબાન મારો મહિનો છે, તેથી મારી ઉપર અને મારી આલ ઉપર સલવાત પઢો.

શાઅબાનને શફાઅતનો મહિનો કહેવામાં આવે છે કારણકે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) તેઓની શફાઅત કરશે કે જે લોકો આપ અને આપની આલ ઉપર સલવાત પઢે. જે કોઈ શાઅબાનમાં હંમેશા સિતેર વખત ઇસ્તિગ્ફાર કરે તો બીજા મહિનામાં સિતેર હજાર વખત પઢવા સમાન છે.

પૂછ્યું કે કેવી રીતે ઇસ્તિગ્ફાર કરે?

ફરમાવ્યું આ મુજબ કહે..

અસ્તગોંફે રૂલ્લાહ ર બ્બી વ

અસ્મલોહૂત્તવબહ

જે કોઈ માટે શાઅબાનમાં હંમેશા સિતેર વખત ઉપર મુજબ કહે, તો ખુદાવંદે ગફ્ફાર જહન્નમની આગથી મુક્તિ આપશે અને સેરાત ઉપરથી પાર કરી અને બેહિશ્તમાં દાખલ કરશે.

મોઅતબર સનદથી મનકૂલ છે કે કોઈ માટે શાઅબાનમાં હંમેશા સિતેર વખત આ મુજબ કહે.

અસ્તગોંફે રૂલ્લાહલેલમી લા એલાહ ઇલ્લાહોવરે રહીમાનુરે રહીમુલે હુંચુલ કુંચૂમ, વ અતૂબો એલયેહ.

તો તેની રૂઠને ખુદાએ તઆલા ‘ઉકુકે મોબીન’માં જગ્યા આપે, અર્શની સામે એક વિશાળ જગ્યા છે, તે ‘ઉકુકે મોબીન’ છે. ત્યાં ઝરણા વહે છે, તે ઝરણાના કિનારે આસમાનના સિતારાની ગણતરી જેટલા પ્યાલા રાખેલા છે.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

કોઈ માહે શાઅબાનમાં એક હજાર વખત આ મુજબ પઢે..

લા એલાહ ઇલ્લાહો વલા નઅંબોદો
 ઇલ્લા ઇય્યાહો મુબ્લેસીન લહુદીન વલવ
 કરેહલ મુશરેફૂન.

તો તેના અમલનામામાં ખુદા એક હજાર વર્ષની ઇબાદત લખે, કબરમાંથી બહાર નીકળે તે વખતે પુનમના ચંદ્ર જેવો નૂરાની ચહેરો હશે અને તેને સિદ્દીક લખશે.

આ મહિનામાં બેહતરમાં બેહતર અમલ સદકો કરવો

અને ગુનાહની માફી માંગવી છે. આ મહિનામાં કોઈ સદકો આપે, તો ખુદા તે સદકાને એવી રીતે ઉછેરે છે, જેવી રીતે લોકો ઊંટના બચ્ચાને ઉછેરે છે અને તે સદકો કયામતના દિવસે ઓહદના પહાડ જેટલો મોટો થઈને સદકો આપનારને મળશે.

ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે:

માહે શાઅબાનની પહેલી તારીખે રોઝો રાખે, તો અલબત્તા તેના ઉપર બેહિશ્ત વાજિબ થાય.

ઈમામે અલી રઝા (અ.સ.) ફરમાવે છે:

શાઅબાનના પહેલા ત્રણ રોઝા, વચલા ત્રણ રોઝા અને છેલ્લા ત્રણ રોઝા રાખવા મુસ્તહબ છે.

જનાબે અમીર અ.સ.થી મનકૂલ છે કે હ. રસૂલે ખુદા સ.એ ફરમાવ્યું કે શાઅબાનની દરેક જુમેરાતે આસમાનોને શણગારવામાં આવે છે અને ફરિશ્તા કહે છે કે ખુદાવંદા આજે રોઝો રાખ્યો હોય, તેઓને માફ કરી આપ અને તેઓની દુઆઓને કબૂલ ફરમાવ.

પંદરમી શાઅબાનના આ'માલ

અમિરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે:

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું કે શાઅબાનની પંદરમી રાત્રે ઇબાદત કરો અને દિવસે રોઝો રાખો. પંદરમી રાત્રે સાંજથી સવાર સુધી હક તઆલા તરફથી અવાજ આપવામાં આવે છે કે કોઈ તોબા કરનાર છે (શબે બરાત) કે પોતાના ગુનાહની માફી માંગે? અમો તેના ગુનાહ માફ કરીએ, કોઈ એવું છે કે રોઝી માટે દુઆ કરે ? કે તેની રોઝીમાં વધારો કરીએ.

પંદરમી રાત્રે ગુસ્લ કરવું સુન્નત છે.

ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

માહે શાઅબાનમાં રોઝો રાખો અને પંદરમી રાત્રે ગુસ્લ કરો, તેનાથી ગુનાહ ઓછા થઈ જાય છે અને ખુદાની રહેમત મળે છે.

પંદરમી શાઅબાનની રાત્રે ઇમામ હુસૈન (અ.સ.)ની

ઝિયારત પઢવી સુન્નત છે.

ઇમામે ઝયનુલ આબેદીન (અ.સ.) ફરમાવે છે:

કોઇ ચાહે કે તેની સાથે એક લાખ ચોવીસ હજાર પયગમ્બરોની અરવાહ મુસાફરો કરે, તો તે શાઅબાનની પંદરમી રાત્રે ઇમામે હુસૈન (અ.સ.)ની ઝિયારત કરે, કારણકે મલાએકા અને પયગમ્બરો આ રાત્રે ખુદા પાસે રજા માંગે છે કે ઇમામે હુસૈન અ.સ.ની ઝિયારત માટે જાય. તેઓને રજા મળે છે. તો ખુશીનસીબ એના કે તેઓ ખુશુર્ગવારો સાથે મુસાફરો કરે અને તમામ પયમગમ્બરોમાં પાંચ 'ઓલુલ અઝમ' પયગમ્બરો પણ છે. એટલે કે હઝરત નૂહ (અ.સ.), હઝરત ઇબ્રાહીમ (અ.સ.), હઝરત મૂસા (અ.સ.), હઝરત ઇસા (અ.સ.) અને હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) પણ છે.

હઝરત ઇમામે જઅફરૈ સાદિક (અ.સ.) ફરમાવે છે:

શાઅબાનની પંદરમી રાત્રે જે કોઇ ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત કરે, તેના તમામ ગુનાહ માફ થઇ

જાય છે અને ઝિયારત કરવાની ટૂંકી રીત એ છે કે મકાનના કોઠા (અગાસી) ઉપર યા સહેનમાં ઉભા રહી જમણી તરફ અને ડાબી તરફ અને માથા ઉપર આસમાનની તરફ નજર કરે, (પછી કિબ્લા તરફ ઉભો રહીને કિબ્લાની જમણી તરફ આંગળીથી ઘશારો કરીને) ઝિયારત પઢે.

અસ્સલામો અંલયક યા અબા
 અંબદિલ્લાહ અસ્સલામો અંલયક વ
 રહુંમતુલ્લાહે વ બરકાતોહૂ

માહે શાઅબાનની પંદરમી રાત્રે નીચેની દુઆ પઢવી સુન્નત છે. અને તે ઝિયારત સમાન છે:

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહુંમ
 અલ્લાહુમ્મ બેહુંકુંકું લયલતેના (હાઝંહી,)
 વ મવેલૂદેહા વ હુંજેજતેક વ મવેઊદેહલ્લતી

કંરન્ત એલા ફઝેલેહા ફઝેલને ફતમ્મત
 કલેમતોક સિદ્દેકવે વ અંદેલલે લા મોબદેલ
 લેકલેમાતેક વલા મોઅંકેકેબ લેઆયાતેક
 નૂરોકલે મોતઅલ્લેકો વ ઝેયોઓકલે મુશરેકો,
 વલેઅંલમુન્નૂરો ફી તંખ્યાઇદયજૂરિલે
 ગાંએબુલે મસ્તૂરો, જલ્લ મલ્લેદોહૂ વકરોમ
 મહંતેદોહૂ વલ્મલોએકતો શુહૂહદોહૂ વલ્લાહો
 નાસેરોહૂ વ મોઅય્યેદોહૂ એઝાં આન
 મીઆંદોહૂ, વલ્મલોએકતો અમ્દાદોહૂ
 સયફુલ્લાહિલ્લઝીં લા યમ્બૂ વનૂરોહુલે લઝીં
 લાયખંબૂ, વ ઝુંલેહિં લેમિલ્લઝીં લા

યસૌંબૂમદા૩૬૯૩૨ે વનવામીસુલ્લઅંસૈરે વ
 વોલાતુલ અમ્રે વલ્મોનઝઝલો અંલયોહિમ
 મા યતનઝઝલો ફી લયેલતિલ્કંદરે. વ
 અસૈંહાંબુલે હંશરે વન્નશરે તરાજેમતો વહંયેહી
 વ વોલાતો અમ્રેહી વ નહંયેહી અલ્લાહુમ્મ
 ફસૈંલ્લે અંલા ખાંતેમેહિમ વ કાંએમેહેમુલે
 મસ્તૂરે અંને અંવાલેમેહિમ અલ્લાહુમ્મ
 વઅદરિકે બેના અધ્યામહૂ વ ઝાહૂરહૂ વ
 કેયામહૂ વજઅંલ્ના મિને અન્સૌરેહી વકરિને
 સારના બેસંઅરેહી, વકતુબ્ના ફી અઅંવાનેહી
 વ ખાંલસાંએહી, વ અહંયેના ફીદવેલતેહી

નાએમીન વ બેસૌહૈબતેહી ગાંનેમીન,
 વબેહૈકૈકૈહી કૌએમીન, વમેનસ્સૂએ સાલેમીન,
 યા અરહૈમરે રાહૈમીન, વહૈમ્દો લિલ્લાહે
 રબ્બિલ આલમીન, વ સંલવાતોહુ અંલા
 સય્યેદેના મોહૈમ્મદિને ખાંતમીન્નબીય્થીને
 વલે મુરેસલીન વ અંલા અહલેબય્તેહિ
 સંસાંદેકીન, વ ઈંતરતેહિને નાર્તેકીન, વલેઅંને
 જમીઅં ઝાલેમીન વહૈકુમ્ બયેનના વ
 બય્નહુમ્ યા અહૈકમલે હાંકેમીન.

જનાબે ઝયદ શહીદે રિવાયત કરી છે કે મારા
 વાલીદ ઇમામે ઝયનુલ આબેદીન (અ.સ.) શાઅબાનની
 પંદરમી રાત્રે અમો સર્વેને ભેગા કરતા હતા. અમે રાતના

ત્રણ ભાગ કરી પહેલા ભાગમાં નમાઝ પઢતા હતા, બીજા ભાગમાં દુઆ કરતા હતા અને આમીન કહેતા હતા તથા ત્રીજા ભાગમાં ઇસ્તિગ્ફાર કરતા હતા અને માફીની દુઆ માંગતા હતા. અમો પણ તેઓ સાથે સવાર સુધી ઇસ્તિગ્ફાર કરતા હતા.

આ રાતે પઢવાની નમાઝ ઘણી છે, તેમાં ચાર રકઅત નમાઝ પણ છે. તે નમાઝને હઝરત ઈમામે જઅફરે સાદિક (અ.સ.)ના ત્રીસ સહાબીઓએ એ હઝરતથી રિવાયત કરી છે. બે-બે રકઅત નમાઝ પઢે, દરેક રકઅતમાં અલહમ્દના સૂરા પછી એક સો વખત કુલ્હોવલ્લાહો અહદનો સૂરો પઢે અને નમાઝ પછી નીચેની દુઆ પઢે:

अल्लाहुम्म हन्नी अलحک इकीरुव व
 मिन अँलाँबेक षाँअकुम मुस्तजुर्न
 अल्लाहुम्म लातो बढढे लीस्मी, वला
 तोगँयिरु जस्मी, व ला तजुडढे बलाध

વલા તુશમિત્ત્વી અઅંદાઇ, અઊઊં ળે
 અંફેવેક મિનં અંકોબેક વ અઊઊં ળે રહંમતેક
 મિનં અંકોબેક, વ અઊઊં ળે રેઊંક
 મિન્સખંતેક વ અઊઊંબેક મિન્ક જલ્લ
 સંનાઓક અન્ત કમા અસંનયેત અંલા નફસેક
 વ ફવેકં મા યકૂલુલ્કોએલૂન (ફીક.)

ઇમામે મોહમ્મદ બાકિર (અ.સ.) ફરમાવે છે:

શબે કદ્ર પછી શાઅબાનની પંદરમી રાત બેહતરમાં
 બેહતર છે, હક તઆલા પોતાના બંદાઓ ઉપર આ રાત્રે
 પોતાનો ફઝલ અતા ફરમાવે છે, અને પોતાના એહસાનથી
 તેઓના ગુનાહ માફ કરે છે, માટે આ રાત્રે ઇબાદત
 કરવા કોશિશ કરો, કારણકે ખુદાએ પોતાની પાક ઝાતની
 કસમ ખાધી છે કે તે માંગનારને પોતાની દરગાહથી રદ
 નહીં કરે. આ રાત ખુદાએ પોતાના પયગમ્બરને અને

અહલેખૈત (અ.મુ.સ.) માટે શબ્દ કદ્રના બદલે અતા ફરમાવી છે. માટે આ રાત્રે ઇબાદત કરવાની કોશિશ કરે. જે કોઈ આ રાત્રે એકસો વખત “સુબ્હાનલ્લાહ”, એકસો વખત “અલહમ્દોલિલ્લાહ”, એક સો વખત “અલ્લાહો અકબર” અને એક સો વખત “લા એલાહ ઇલ્લલ્લાહ” પઢે, તો ખુદા તેના ભૂતકાળના ગુનાહો માફ કરી આપે અને તેની દીન અને દુન્યાની હાજતો પુરી કરે. ભલે પછી હાજત માંગે અથવા ન માંગે.

ઇબ્ને બાબવયહે ઇમામે હસને મુજતબા (અ.સ.)થી રિવાયત કરી છે કે જિબ્રિલ હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ઉપર નાઝિલ થયા અને કહ્યું કે અય મોહમ્મદ (સ.અ.વ.) પોતાની ઉમ્મતને હુકમ કરો કે પંદરમી શાઅબાનની અડધી રાતે દસ રકઅત નમાઝ પઢે. એટલે કે બે-બે રકઅત કરીને પાંચ નમાઝ પઢે અને દરેક રકઅતમાં અલહમ્દના સૂરા પછી દસ વખત કુહોવલ્લાહો અહદનો સૂરો પઢે અને દસ રકઅત પૂરી થયા પછી સજદામાં નીચે મુજબ પઢે:

અલ્લાહુમ્મ લક સજદ સવાદી વ ખંયાલી
 વ બયાઝીં યા અંઝીમ કુલ્લે અંઝીમિન
 ઇગંફિરેલી ઝંબેયલ્અંઝીમ, ફઈન્નહૂ લા
 યગંફેરોહૂ ગંયેરોક યા અંઝીમ.

જે કોઈ આ અમલ બજાવી લાવે, તો ખુદાએ તઆલા
 તેના ખોંતેર હજાર ગુનાહ માફ કરી આપે અને તેટલી જ
 નેકી તેના આમાલનામાં લખે અને તેના મા-બાપના સિતેર
 હજાર ગુનાહ માફ કરી આપે.

આ રાતની બીજી નમાઝ પણ વારીદ થઈ છે, જે
 સુન્ની અને શિયાઓ હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)થી
 રિવાયત કરી છે કે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે
 શાઅબાનની પંદરમી રાતે હું સુતો હતો, એટલામાં જિબ્રિલે
 નાઝિલ થઈને મને બકીઅના કબ્રસ્તાનમાં લઈ જઈ કહ્યું,
 કે આસમાન તરફ જુઓ કે ખરેખર આ એ રાત છે કે
 આસમાનના દરવાજા ખોલવામાં આવે છે, એટલે રહેમત

અને ખુદાએ તઆલાની ખુશનુદીના, ગુનાહોની બક્ષીશના, ફઝલ તથા એહસાનના, તોબા તથા એજબતના દરવાજા ખોલવામાં આવે છે અને ખુદાએ તઆલા આ રાતે પક્ષીઓના વાળ અને રૂંવાટાની ગણતરી જેટલા બંદાઓને બક્ષી આપે છે.

અય મોહમ્મદ (સ.અ.વ.)! જે કોઈ આ રાતે જાગે અને અલ્લાહો અકબર, સુબ્હાનલ્લાહ, લા એલાહ ઇલ્લલ્લાહ અને અલહમ્દોલિલ્લાહ કહ્યા કરે, નમાઝ પઢે, કુરઆન પઢે, ગુનાહોની બક્ષીશ ચાહે અને ઇસ્તિગ્ફાર કરે, તો આખેરતમાં તેની જગ્યા બેહિશ્તમાં છે. તેના થયેલા ગુનાહ માફ કરવામાં આવે.

અય મોહમ્મદ (સ.અ.વ.)! જે કોઈ આ રાતના બે-બે રકઅત કરીને સો રકઅત નમાઝ પઢે. તે દરેક રકઅતમાં અલહમ્દના સુરા પછી દસ દસ વખત કુહોવલ્લાહ પઢે. સો રકઅત પૂરી થયા પછી દસ વખત આયતુલ કુરસી, દસ વખત અલહમ્દનો સૂરો અને સો વખત સુબ્હાનલ્લાહ પઢે, તો ખુદાએ તઆલા હલાક

કરવાવાળા સો કબીરા ગુનાહ માફ કરે, ઉપરાંત સૂરા અને તસ્ખીહના બદલામાં બેહિશ્તમાં એક એક મકાન અતા કરે, તેના સગાં-વહાલાઓમાંના એકસો જણ માટે શફાઅત કબૂલ કરે અને તેને શહીદોના સવાબમાં દાખલ કરે. આ મહિનાના રોઝેદારોનો અને ઇબાદત કરનારાઓનો સવાબ અતા કરે અને એ લોકોના સવાબમાં કાંઈ પણ કમી કરે નહીં.

માટે અય મોહમ્મદ (સ.અ.વ.)! આ રાતે જાગો અને પોતાની ઉમ્મતને હુકમ કરો કે આ રીતે જાગો અને ઇબાદત કરી ખુદાની ખુશ્નુદી ચાહે. ખરેખર આ રાત ઘણી ખુશ્નુદગી છે. જ્યારે હું આપની પાસે આવ્યો, ત્યારે આસમાનના તમામ ફરિશ્તાઓને જોયા કે તેઓ ઇબાદતમાં મશગૂલ હતા. કેટલાક તકબીર કહેતા હતા, કેટલાક તસ્ખીહ પઢતા હતાં અને કેટલાક ઇસ્તિગ્ફાર કરતા હતાં. અય મોહમ્મદ (સ.અ.વ.)! ખરેખર ખુદાએ તઆલા આ રાત્રે પોતાના બંદાઓ પર રહેમતની નજર કરે છે.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) માહે શાઅબાનની

પંદરમી રાત્રે આ દુઆ પઢતા હતા:

અલ્લાહુમ્મકું સિમ્ લના મિન બંશયતેક,
મા યહૂલો બયનના વ બયન મઅંસીંયતેક
વ મિન તોઅંતેક મા તોબલ્લેગોના બેહી
રિઝવાનક, વ મેનલે યકીને મા યહૂનો
અંલયેના બેહી મોસીંબાતુદે દુન્યા અલ્લાહુમ્મ
અમતેઅંના બે અસ્માઅંના વ અબ્સોરેના
વ કુંવ્વતેના મા અહૂયેતના વજઅંલેહુલે
વારેસં મિન્ના વજઅંલેસોરના અંલા મન
ઝંલમના વન્સુરેના અંલા મન ઓંદાના વલા
તજઅંલે મોસીંબતના ફીદીનેના વલા

તજે અંલિદે દુન્યા, અકુંબર હમ્મેના વલા
 મબ્લગોં ઈંલ્મેના વલા તોસલ્લિતે અંલયેના
 મલે લા યરેહુંમોના બેરહુંમતેક યા અરેહુંમરે
 રાહુંમીન

આ દુઆમાં દુનિયા તથા આખેરતની તમામ માંગણીઓ સમાયેલી છે.

આજે રાત્રે “દુઆએ કુમૈલ” પઢવાનો ઘણો સવાબ છે. કુમૈલ ઇબ્ને ત્રિયાદ હજરત અમિરૂલ મોઅમેનીન (અ.સ.)ના ખાસ સહાબીઓમાંથી હતાં. સચ્ચદ જલીલ ઇબ્ને તાઉસ (અ.ર.)એ “કિતાબે ઇકબાલ”માં રિવાયત કરી છે કે કુમૈલ ઇબ્ને ત્રિયાદે કહ્યું કે એક દિવસ હું બસરાની મસ્જિદમાં મારા મૌલા હજરત અલી (અ.સ.)ની ખિદમતમાં બેઠો હતો અને શાઅબાનની પંદરમી રાત વિષે વાત નીકળી.

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું કે જે બંદો એ રાતના

જાગે અને ખિઝર (અ.સ.)ની દુઆ પઢે, તો અલબત્તા તેની દુઆ કબૂલ થાય છે.

પછી ઈમામ (અ.સ.) પોતાને ઉતારે ગયા, ત્યારે હું તેઓની ખિદમતમાં ગયો.

મને જોઈને આપ (અ.સ.)એ ફરમાવ્યું: અય કુમૈલ! શા માટે આવ્યા છો?

મેં અરજ કરી: યા અમિરૂલ મોઅમેનીન (અ.સ.)!. હઝરત ખિઝર (અ.સ.)ની દુઆ લેવા આવ્યો છું.

આપ (અ.સ.)એ ફરમાવ્યું: અય કુમૈલ! જેસી જા, અને અત્યારે એ દુઆ મોઢે કર. જે દરેક શબે જુમ્માના યા દરેક મહિનામાં એક વખત યા દરેક વર્ષમાં એક વખત અથવા આખી ઉમરમાં એક વખત આ દુઆ પઢે, તો તમામ દુશ્મનોની બદીથી રક્ષણમાં રહેશે.

દુઆએ કુમેલ

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ
અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક
બેરહ્મતેકલ્લતી વસેઅંતે કુલ્લ શયેઈને વ
બે કુંવતેકલ્લતી કુંહરેત બેહા કુલ્લો શયેઈને
વ ખેંઝેંઝેં લહા કુલ્લો શયેઈને વ ઝંલ્લ
લહા કુલ્લો શયેઈને વ બે જબરૂતેકલ્લતી
ગૈલખ્ત બેહા કુલ્લ શયેઈને વ બે ઈંઝેંઝેંતેકલ્લતી
લા યકૂંમો લહા શયેઈને વ બે અંઝેંઝેંમતેકલ્લતી
મલઅતે કુલ્લ શયેઈને વ બે સુલતૌનેક
લ્લઝી અંલા કુલ્લ શયેઈને વ બે વજહેકલે

બાકીં બઅંદ ફનાએ કુલ્લે શયેઈને વ બે
 અસ્માએકલ્લતી મલઅતે અરકાન કુલ્લે
 શયેઈને વ બેઈલ્મેકલ્લતી અહાંતે બેકુલ્લે
 શયેઈને વ બેનૂરે વજહેકલ્લતી અઝાઅ
 લહૂ કુલ્લો શયેઈને યા નૂરો યા કુંદૂસો યા
 અવ્વલલે અવ્વલીન વ યા આખૌરલે
 આખૌરીન અલ્લાહુ મમગૌફિરે
 લેયઝઝૌનૂબલ્લતી તહતેકુલે અસંમ,
 અલ્લાહુ મમગૌફિરે લેયઝઝૌનૂબલ્લતી
 તુન્નેલુન્નેકૌમ અલ્લાહુ મમગૌફિરે
 લેયઝઝૌનૂબલ્લતી તૌગૌયેરુન્નેઅંમ

અલ્લાહુમ્મગોફિરે લેયઝંઝોનૂબલ્લતી
 તહુંબેસુદોઆઅ, (અલ્લાહુમ્મગોફિરે
 લેયઝંઝોનૂબલ્લતી તકુંતંઉરે રેજાઅ)
 અલ્લાહુમ્મગોફિરે લેયઝંઝોનૂબલ્લતી તુન્ઝેલુલ
 બલાઅ અલ્લાહુમ્મગોફિરેલી કુલ્લ ઝંમબિન
 અઝંનબ્તોહૂ, વકુલ્લ ખાંતીઅતિન
 અખંતંઅતોહા અલ્લાહુમ્મ ઇન્ની અતકુંરબો
 એલયેક બેઝિંકરેક વઅસ્તશફેઆ બેક એલા
 નફસેક વ અસ્અલોક બેજુદેક અન તુદનેયની
 મિન કુંરબેક વ અન તૂઝેઅંની શુકરક વ
 અન તુલહેમની ઝિંકરક, અલ્લાહુમ્મ ઇન્ની

અસ્અલોક સોઆલ ખાંઝેઈમે મોતઝંલેલિને
 ખાંશેઈને (મોતઝંરેઈને) અને તોસામેહની
 વ તરેહમની વ તજેઅંલની બેકિસ્મેક રાઝેયન
 કાંનેઅંવં વફી જ મીઈલે અહવાલો
 મોતવાઝેઅંને અલ્લાહુમ્મ વ અસ્અલોક
 સોઆલ મનિશતદતે ફાકંતોહૂ વ અન્નલ
 બેક ઈન્દશે શદાએદે હાંજતહૂ વ અંઝામ
 ફીમા ઈન્દક રઁબતોહૂ અલ્લાહુમ્મ અંઝામ
 સુલ્તાનોક વ અંલા મકાનોક વ ખંફેય મકરોક
 વ ઝંહર અમરોક વ ગંલબ કંહરોક વ
 જરતે કુંદરતોક વલા યુમ્કેનુલ ફેરાઓ મિને

હોંકુમતેક, અલ્લાહુમ્મ લા અજેદો લેઝાંનૂબી
 ગોંફેરંવે વલા લેકુંબાએહી સાતેરંવે વલા
 લેશયેઇમ મિને અંમલેયલે કુંબીહી બિલે
 હુંસને મોબદેલને ગંયેરક, લા એલાહ ઇલ્લા
 અન્ત સુબ્હાંનક વ બેહુંમ્દેક ઝંલમ્તો નફેસી
 વ તજરંઅતો બેજહલી વ સકન્તો એલા
 કુંદીમે ઝિંકરેક લી વ મન્નેક અંલય્ય
 અલ્લાહુમ્મ મવેલાય કમ્મિને કુંબીહિંને
 સતરેતહૂ વ કમ્મિને ફાદેહિંમે મેનલે બલાએ
 અકુંલ્તહૂ વ કમ્મિને એસારિને વકુંયેતહૂ
 વ કમ્મિમે મકરૂહિન દફઅંતહૂ વ કમ્મિને

સંનાઇને જમીલિલે લસ્તો અહલલે લહૂ
 નશરેતહૂ અલ્લાહુમ્મ અઝ્ઝૌમ બલોઇ વ
 અફરતે બી સૂઓ હાંલી વ કંસૌરતે બી
 અઅંમાલી, વ કંઅંદતે બી અઠ્ઠાલી વ
 હુંબસની અંને નફેઈ બોઅંદો અમલી, વ
 ખંદઅંતેનિદુન્યા બે ગૌરુરેહા, વ નફેસી
 બેબૈનાયતેહા વ મેતૌલી યા સય્યેદી
 ફઅસ્અલોક બે ઈઝ્ઝતેક અલે લા યહુંજોબ
 અંન્ક દોઆઈ સુઓ અંમલી વ ફેઆલી
 વલા તફેઝ્ઝુંની બે ખંફિયે મત્તેલઅંત
 અંલયહે મિને સિરેરી વલા તોઆંજિલની

બિલ ઔકુંબતે અંલા મા અંમિલ્તોહૂ ફી
 ખંલવાતી મિન સૂએ ફેઅંલી વ એસાઅતી
 વ દવામે તફરીતી વ જહાલતી વ કસંરતે
 શહવાતી વ ગંફલતી વ કોનિલ્લાહુમ્મ બે
 ઈઝતેકલી ફિ કુલ્લીલ અહવાલે રઊફવે વ
 અંલય્ય ફી જમીઈલે ઓમૂરે ઔતૂંફને ઈલાહી
 વ રબ્બી મનેલી ગંયેરોક અસ્અલોહૂ કશફ
 ઝૂંરી વન્નઝૂંર ફી અમરી ઈલાહી વ મવલાય
 અજરયેત અંલય્ય હુંકેમનિત્તબઅંતો ફીહે
 હવા નફસી વ લમ અહતરિસે ફીહે મિન
 તઝયીને અંદુવેવી ફગંરની બેમા અહવા વ

અસઅંદ હૂં અંલા ઝાંલોકલે કુંઝાંઓ
 ફતજાવઝંતો બેમા જરા અંલય્ય મિને ઝાંલોક
 બઅંઝં હાંદુદેક વ ખાંલફંતો બઅંઝં અવામેરેક
 ફલકલે હુંમદો અંલય્ય ફી જમીએ ઝાંલોક
 વલા હુંજજત લી ફીમા જરા અંલય્ય ફીહે
 કુંઝાંઓક વ અલેઝમની હુંકેમોક વ બલાઓક
 વ કુંદે અતપ્તોક યા ઈલાહી બઅંદ તકુંસીરી
 વ ઈસ્રાફી અંલા નફસી મોઅંતઝંરને નાદેમમ
 મુન્કસેરમ મુસ્તકીલમ મુસ્તગંફેરમ મોનીબમ
 મોકિરમ મુઝંએનમ મોઅંતરેફલે લા અજદો
 મફરેરમ મીમા કાન મીની વલા મફઝઅંને

અતવજાહો એલયેહે ફી અમરી ગંચર કુંબૂલેક
 ઉંઝંરી વ ઇદેખાંલેક ઇચ્ચાય ફી સઅંતે
 રહુંમતેક અલ્લાહુમ્મ ફકુંબલે ઉંઝંરી વરહુંમ
 શિદત ઝુંરેરી વફુકુંની મિન શદે વ સાંકીં
 યા રબ્બીરહુંમ ઝંઅંફ બદની વ રિકુંકેત
 જિલ્દી વ દિકુંકેત અંઝંમી યા મમ બદઅ
 ખંલકીં વ ઝિંકેરી, વ તરબેયતી વ બિરેરી
 તગંઝંયતી હબની લે ઇબંતેદાએ કરમેક
 વ સાલેફે બિરેરેક બી, યા ઇલાહી વ સચ્ચેદી
 વ રબ્બી અતોરાક મોઅંઝંઝંબી બેનારેક
 બઅંદ તવેહીંદેક, વ બઅંદ મન તંવા અંલયેહે

કુંભી મિમં મઅરેફતેક વ લહેજ બેહી
 લેસાની મિનં ઝિંકરેક વઅંતકુંદહૂ ઝંમીરી
 મિનં હુંબ્બેક વ બઅંદ સિંદકેઅં તેરાફી વ
 દોઆઈ ખાંઝેઅંલે લેરોબૂબિયતેક હયેહાત
 અન્ત અકરમો મિનં અનં તોઝંયેઅં મરે
 રબ્બયેતહૂ અવં તુબંઅંદ મનં અદનયેતહૂ
 અવં તોશરેદ મનં આવયેતહૂ, અવં તોસલ્મ
 એલલે બલ્લાએ મનં કફયેતહૂ વ રહિમ્તહૂ
 વ લયેત શેઅંરી યા સય્યેદી વ ઈલાહી વ
 મવેલાય અતોસલ્લેતુંન્નાર અંલા વોજૂહિનં
 ખંરત લે અંઝંમતેક સાજેદતંવે વ અંલા

અલસોનિનં નતંકંતે બે તવેહીંદેક સોંદેકંતવં
 વબે શુકરેક મા દેહંતંવે વ અંલા કોલૂબે
 નીઅંતરફતે બે એલાહિય્યતેક મોહંકંકેકંતવં
 વ અંલા ઝંમાએર હંવતે મેનલે ઇલમે બેક,
 હંત્તા સોરતે ખોશોઅંતંવે વ અંલા જવારેહં
 સઅંતે એલા અવેતાંને તઅંબ્બોદેક તોંએઅંતંવે
 વ અશારતે બીસંતિગોંફારેક મુઝંએનતમ
 મા હા કઝંઝંઝંનો બેક વલા ઉખંબિરના
 બે ફઝંલેક અંન્ક યા કરીમો યા રબ્બે વ
 અન્ત તઅંલમો ઝંએફી અંને કંલીલિમ મિમ
 બલોઈદુન્યા વ ઓફૂબાતેહા વમા યજરી

ફીહા મેનલ મકારેહે અંલો અહલેહા અંલો
 અન્ન ઝાલેક બલોઉવે વ મકેરુહુને કંલીલુમે
 મકેસોહૂ યસીરુમે બકાંઓહૂ કંસીરુમે મુદ્દતોહૂ
 ફકયેફહંતેમાલી લે બલોઇલે આખેરતે વ
 જલીલે વોકૂંઇલે મકારેહે ફીહા, વહોવ
 બલોઉને તતૂંલો મુદ્દતોહૂ વ યદૂમો મકાંમોહૂ
 વલા યોખેફફો અંને અહલેહી લે અન્નહૂ
 લા યકૂનો ઇલ્લા અંને ગાંઝંબેક વનેતેકાંમેક
 વ સખંતેક વ હાઝાં મા લા તકૂંમો
 લહુસ્સમાવાતો વલે અરેઝાં યા સય્યેદી ફકયેફ
 લી વ અના અંબદોકઝં ઝંઇફુઝં ઝંલીલુલે

હુંકીંરૂલે મિસેકીનુલે મુસેતકીનો, યા ઈલાહી
 વ રબ્બી વ સય્યેદી વ મવલાય લેઅર્યેલે
 ઓમૂરે એલર્યેક અશકૂ, વલેમા મિન્હા
 અઝિંજેજો વ અબેકી લેઅલીમિલે અંઝાંબે
 વ શિદદતેહી, અમ લેતૂંલિલે બલ્લાએ વ
 મુદદતેહી, ફલઇન સંચરેતની લિલે ઔકૂંબાતે
 મઅં અઅંદાએક વ જમઅંત બર્યેની વ
 બર્યેન અહુલે બલ્લાએક વ ફરૂકૂંત બર્યેની
 વ બર્યેન અહિંબ્બાએક વ અવલેયાએક
 ફહબ્ની, યા ઈલાહી વ સય્યેદી વ મવલાય
 વ રબ્બી સંબરેતો અંલા અંઝાંબેક ફકર્યેફ

અસંખેરો અંલા ફેરાકેક. વ હબ્ની સંબરેતો
 અંલા હરે નારેક ફકયેફ અસંખેરો
 અંનિન્નઝેરે એલા કરામતેક, અમ કયેફ
 અસ્કોનો ફિન્નારે વ રજાઈ અંફવોક ફબે
 ઈઝઝતેક યા સય્યેદી વ મવેલાય ઉકેસેમો
 સોંદેકેલે લઈને તરકેતની નાતેકેલે
 લઅઝિજન્ન એલયેક બયેન અહલેહા
 ઝંજીલે આમેલીન, વલ અસંરોખેન્ન
 એલયેક સોંરાખેલે મુસેતસેરેખીન, વલ
 અબકેયન્ન અંલયેક બોકાઅલે ફાકેદીન વલ
 ઓનાદેયનેક અયેન કુન્ત યા વલિય્યલે

મોઅંમેનીન યા ગૌયત આમાલિલ અંરેફીન,
 યા ગૌયાસંલે મુસ્તગીસીન યા હુંબીબ
 કૌલૂબિસ્સાંદેકીન, વ યા એલાહલે આંલમીન
 અફતોરાક સુબહાંનક યા ઇલાહી વ બેહુંમ્દેક
 તસ્મઆ ફીહા સંવેત અંબેદિમ મુસ્લેમિને
 સોજેન ફીહા બે મોખાંલફતેહી વ ઝાંકં
 તંઅંમ અંઝાંબેહા બેમઅંસેયતેહી, વ હાંબેસ
 બયને અતંબાકેહા બેજુરમેહી, વ જરીરતેહી
 વ હોવ યઝિંજ'જો એલયક ઝંજીજ
 મોઅમ્મેલિલ લે રહુંમતેક વ યોનાદીક બે
 લેસાને અહલે તવેહીંદેક વ યતવસ્સલો

એલયેક બેરોબૂબિયતેક યા મવેલાય ફકયેફ
 યબેકોં ફિલે અંઝાંબે વ હોવ યરેજૂ મા
 સલફ મિને હિલ્મેક (વરઅફતેક વ રહુંમતેક)
 અમં કયેફ તુઅલેમોહુન્નારો વ હોવ
 યઅમોલો ફઝલક વ રહુંમતક અમં કયેફ
 યો હરેકોહૂ લહીબોહા વ અન્ત તસમઆ
 સંવેતહૂ વ તરા મકાનહૂ અમં કયેફ યશતમેલો
 અંલયેહે ઝફીરોહા વ અન્ત તઅલમો ઝંઅફહૂ
 અમં કયેફ યતકલેકલો બયેન અત્બાકેહા
 વ અન્ત તઅલમો સિદકેહૂ અમં કયેફ
 તઝજોરોહૂ ઝબાનિયતોહા વ હોવ યોનાદીક

યા રબ્બહૂ અમ કયેફ યરેજૂ ફઝલક ફી
 ઇત્કેહી મિનેહા ફતતરોકોહૂ ફીહા હયેહાત
 મા ઝાલેકઝઝન્નો બેક વલલે મઅરૂફો મિને
 ફઝલેક, વલા મુશબેહુલે લેમા આમલેત
 બેહિલે મોવહૃહૃદીન મિમ બિરેક વ
 એહૃસાનેક ફબિલે યકીને અંકૃતૃઓ લવ
 લા મા હંકમ્ત બેહી મિને તઅઝીબે જાહૃદીક
 વ કૃઝયેત બેહી મિને ઇખૃલાદે મોઆનેદીક
 લજઅસ્તન્નાર કુલ્લહા બરેદંવે વ સલામંવે
 વ મા કાન લેઅહૃદિને ફીહા મકૃરેરંવે વલા
 મોકામલે લાકિન્નક તકૃદસતે અસ્માઓક

અકુંસમ્ત અને તમ્લઅહા મેનલે કાફેરીન
 મેનલે જીન્નતે વન્નાસે અજમઈન, વ અને
 તોખંલ્લેદ ફીહલે મોઝાનેદીન, વ અન્ત
 જલ્લ સંનાઓક કુંલ્ત મુખ્તદેઅવં વ તતેવ્વલેત
 ખિલે ઇનેઝામે મોતકરેમને અફમને કાન
 મોઅમેનને કમને કાન ફાસેકુંલે લા યસ્તવૂન,
 ઈલાહી વ સય્યેદી ફઅસ્અલોક ખિલે
 કુંદર તિલ્લાતી કુંદરેતહા વ ખિલે
 કુંઝિંચતિલ્લાતી હંતમતહા વ હંકમ્તહા વ
 ગૌલખ્ત મને અંલયહે અજરયેતહા અને
 તહબ લી ફી હાઝંહિલે લયેલતે વ ફી

હાઝંહિસં સાઅંતે કુલ્લ જુરેમિને અજરેમ્તોહૂ
 વ કુલ્લ ઝંમંબિને અઝંનખ્તોહૂ વ કુલ્લ
 કુંબીહિંને અસ્રરેતોહૂ વ કુલ્લ જહલિને
 અંમિલેતોહૂ કતમતોહૂ અવે અઅંલેન્તોહૂ
 અખંફયેતોહૂ અવે અઝંહરેતોહૂ વ કુલ્લ
 સય્યેઅતિને અમરેત બેઇસંબાતેહલે કેરામલે
 કાતેબિનલ્લઝીન વકલ્લહુમં બેહિંફેઝં મા
 યકૂનો મિન્ની વ જઅંલ્લહુમં શોહૂદને અંલય્ય
 મઅં જવારેહીં વ કુન્ત અન્તરેરકીંબ અંલય્ય
 મિવ્વરોએહિમં વશશાહેદ લેમા ખંફેય અંનેહુમં
 વ બેરહૂંમતેક અખંફયેતહૂ વ બેફઝંલેક

સતરેતહૂ વ અને તોવફફેર હુંઝંઝી મિને
 કુલ્લે ખંચેરિને અનેઝલ્લહૂ અવે એહુંસાનિને
 ફઝંઝલેતહૂ અવે બિરેરિને નશરેતહૂ અવે
 રિઝકિમે બસતેતહૂ અવે ઝંમંબિને તઝંફેરોહૂ
 અવે ખંતંઈને તસ્તોરોહૂ યા રબ્બે યા રબ્બે
 યા રબ્બે, યા ઈલાહી વ સચ્ચેદી વ મવલાય
 વ માલેક રિકેકી, યા મમ બેયદેહી નાસેયતી,
 યા અંલીમમ બેઝુંરેરી વ મસકનતી યા
 ખંબીરમ બેફકેરી વ ફાકેતી યા રબ્બે યા
 રબ્બે યા રબ્બે અસ્અલોક બેહુંકેકેક વ
 કુંદેસેક વ અઅંઝંમે સિંફાતેક વ અસ્માએક

અને તજાંલ અવકાંતી મેનલ્લયલે વન્નહારે
 બેઝિંકરેક મઅંમૂરતવે વ બેઝિંદેમતેક
 મવેસુંલતવે વ અઅંમાલી ઈન્દક મકુંબુલતને
 હંત્તા તકૂન અઅંમાલી વ અવેરાદી કુલ્લોહા
 વિરેદંવે વાહુંદેવે વ હાંલી ફી ખિંદેમતેક
 સરેમદંયે યા સય્યેદી યા મને અંલયહે
 મોઅંવ્વલી યા મને એલયહે શકવેતો
 અહુંવાલી યા રબ્બે યા રબ્બે યા રબ્બે
 કુંવે અંલા ખિંદેમતેક જવારેહીં વશદુદે અંલલે
 અંઝીમતે જવાનેહીં વહબ્લેયલે જિદ ફી
 ખંશયતેક વદવામ ફિલે ઇત્તેસાંલે બે

ખિંદમતેક હુંતા અસરહું એલયેક ફી
 મયાદિનિસ્સાબેકીન વ ઉસરેઅં એલયેક ફિલે
 બારેઝીન વ અશતાકું એલા કુંરેબેક ફિલે
 મુશતાકીન વ અદનોવ મિન્ક દોનુવ્વલે
 મુખેલેસીન વ અખાંફક મખાંફતલે મૂકેનીન
 વ અજતમેઅં ફી જેવારેક મઅંલે મોઅમેનીન
 અલ્લાહુમ્મ વ મને અરાદની બેસૂઈને
 ફઅરિદેહો, વ મને કાદની ફકિદેહો,
 વજેઅંલ્ની મિને અહુંસને અંબીદેક નસીબન
 ઈન્દક, વ અકુંરેબેહિમ મનેઝેલતમ મિન્ક,
 વ અખંસેસોહિમ ઝુલ્ફતલે લદયેક ફઈન્નહૂ

લા યોનાલો ઝાંલેક ઇલ્લા બેફઝંલેક વ
 જુદેલી બેજુદેક વઅંતિફે અંલય્ય બે મજુદેક
 વહુફઝંની બે રહુમતેક વજુઅંલે લેસાની
 બેઝિંકરેક લહેજંવે વ કુંલ્બી બેહુંબ્બેક
 મોતય્યમંવે વ મુન્ન અંલય્ય બેહુંસ્ને ઇજાબતેક
 વ અકિંલ્ની અંસરતી વગંફિરે ઝલ્લતી ફઇન્નક
 કુંઝંયેત અંલા અંબાદેક બેઅંબાદતેક વ
 અમરેતહુમં બે દોઆંએક વ ઝંમિન્ત લહોમુલે
 એજાબત ફએલયેક યા રબ્બે નસંબ્તો વજુહી
 વ એલયેક યા રબ્બે મદદેતો યદી
 ફબેઈઝંઝતેકસે તજ્જબેલી દોઆંઈ વબલ્લિગંની

મોનાય વલા તંકેતંઝે મિને ફઝેલેક રજાઈ
 વકેકેની શરૂલે જીન્ને વલે ઇન્સે મિને અઝંદાઈ
 યા સરીઝંરેરેઝાં ઇઝેફિરે લેમલે લા યમલેકો
 ઇલ્લદોઝાંઝ, ફઈન્નક ફઝંઝાંલુલે લેમા
 તશાઓ યા મનિસ્મોહૂ દવાઉવે વ ઝિંકેરોહૂ
 શિફાઉં વ તાંઝંતોહૂ ગૈનને ઇરેહુંમ મરે
 રઝંસો માલેહિરે રજાઓ વસેલાહાહુલે
 બુકાઓ યા સાબેગૈન્નેઝંમે યા દાફેઝંને
 નેકંમે, યા નૂરલે મુસ્તવેહુંશીન ફિઝંઝાંલમે
 યા ઝાંલેમલે લા યોઝંલ્લમો, સંલ્લે ઝંલા
 મોહુંમ્મદિંવે વ આલે મોહુંમ્મદે, વફેઝંલેબી

મો અન્ત અહલોહૂ વ સંલલલાહો અંલા
 રસૂલેહી વલં અઇમ્મતિલં મયામીન મિનં
 આલેહી વ સલ્લમ તસ્લીમનં (કસીરનં)
 કસીરા.

બલા અને આફતોથી બચવાનો અમલ

બલા દુર થવા માટે, ઝાલિમો અને દુશ્મનોથી બચવા
 માટે, સખતી દુર થવા માટે, કરજ ભરપાઇ થવા માટે
 તેમજ દરેક હાજત પુરી થવા માટે આ દુઆ બહુજ
 અસરકારક છે:

અમ્મંય્યોજીબુલં મુઝંતંરેર એઝં
 દઝંહો વ યકશોકુસ્સૂઅ

أَمَّنْ يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ

“તે કોણ છે, જે જવાબ આપે છે નિરાધારને, જ્યારે તે તેને પોકારે છે અને આફતને દૂર કરે છે.”

આ મુબારક આયતને ગિરફતારીના સમયમાં પઢવી બહુજ ફાયદાકારક છે, ખાસ બાર હજાર (૧૨,૦૦૦) વખત એક મજલિસ (બેઠક)માં વઝુ કરી પઢવી જોઈએ. “એક જણ પઢે યા બધા મળી પઢે.” તેની છુટ છે કુલ બાર હજાર (૧૨,૦૦૦) વખત પઢવું જરૂરી છે. સ્ત્રીઓ અને પુરૂષો બંનેએ આ બાબતની કોશિશ કરવી જોઈએ.

અમલની રીત

૧. બે રકઅત નમાઝ હાજતની નિચ્યતથી પઢવી,
૨. સલવાત પઢવી,
૩. બાર હજાર (૧૨૦૦૦) વખત ઉપર જણાવેલ આયત પઢવી,
૪. સલવાત પઢવી,
૫. હદીસે કિસાઅ પઢવી

૬. છેવટે પરવરદિગારની બારગાહમાં દુઆ
ગુજરવી, ઇન્શાઅલ્લાહ બલા દૂર થશે.

માહે શાઅબાનની છેલ્લી તારીખોના

આ'માલ

આ મહિનાના છેલ્લા દિવસોમાં કેટલાક આ'માલ છે.

ઈમામ અલી રઝા (અ.સ.) ફરમાવે છે:

જે કોઈ માહે શાઅબાનમાં છેલ્લા ત્રણ દિવસ રોઝા રાખે અને માહે રમઝાન સાથે મેળવી આપે, તો ખુદાએ તઆલા તેને સતત બે મહિના સુધી રોઝા રાખવાનો સવાબ આપે.

અબુસલ્ત હરવીએ રિવાયત કરી છે કે માહે શાઅબાનના છેલ્લા જુમ્માના દિવસે હું ઇમામે અલી રઝા (અ.સ.)ની ખિદમતમાં ગયો.

તે વખતે ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું: અય અબુસલ્ત! આ મહિનાનો ઘણો ભાગ પસાર થઈ ગયો અને આ મહિનાનો આ છેલ્લો જુમ્મા છે. માટે ગુજરેલા

દિવસોનો બદલો કર અને ઇસ્તિગ્ફાર બહુજ કર, કુરઆને શરીફ ઘણું પઢ, ખુદાએ તઆલાની બારગાહમાં પોતાના ગુનાહની તૌબા કર કે જેથી કરીને માહે રમઝાન આવે ત્યાં સુધી તું ખુદાની ખુશી માટે પાક અને ખાલીસ થઈ જા, પોતાની ગરદન ઉપર કોઈનો હક તેમજ અમાનત રાખ નહીં. પોતાના દિલમાં કોઈનો કિનો પણ રાખ નહીં, ગુનાહ તર્ક કરી દે, ખુદાથી ડર, જાહેર તથા છુપા તમામ કામમાં તેના ઉપર તવક્કલ કર, કારણકે જે કોઈ ખુદા ઉપર તવક્કલ (ભરોસો) કરે છે, તેને માટે તે કાફી છે, અને આ મહિનાના છેલ્લા દિવસોમાં નીચેની દુઆ બહુ જ પઢ્યા કર:

બિસ્મિલ્લાહિરે રહુંમાનિરે રહીમ

અલ્લાહુમ્મ ઇનં લમં તકુનં ગંફરેત
લના ફીમા મઝાં મિન શઅંબાન ફગાંફિરેલના
ફીમા બકૈય મિન્હો.

આ મહિનામાં માહે રમઝાનની હૂરમત માટે હક તઆલા ઘણા બંદાઓને જહન્નમની આગથી આઝાદ કરે છે.

આ મહિનામાં હંમેશા રાત્રે પઢવાની નમાઝ મોઅતબર સનદ સાથે બયાન થયેલ છે, જે નીચે મુજબ છે:

પહેલી રાત્રે સો રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી એક વખત ફુલ્હોવલ્લાહનો સૂરો પઢે. સો રકઅત પઢી રહે પછી સિતેર (૭૦) વખત અલહમ્દનો સૂરો પઢે.

બીજી રાત્રે પચાસ રકઅત નમાઝ છે. સૂરે અલહમ્દ પછી દરેક રકઅતમાં એક-એક વખત ફુલ્હોવલ્લાહ, ફુલ અઉઝો બેરબ્બીન્નાસ અને ફુલ અઉઝોબેરબ્બીલ ફલકનો સૂરો પઢે.

ત્રીજી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી પચ્ચીસ-પચ્ચીસ વખત સૂરે ફુલ્હોવલ્લાહ પઢે.

ચોથી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં

સૂરે અલહમ્દ પછી પરચીસ વખત ફુલ્હોવલ્લાહનો સૂરો પઢે.

પાંચમી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી પાંચસો (૫૦૦) વખત ફુલ હો વલ્લાહનો સૂરો પઢે. બંને રકઅત પુરી થયા પછી સીતોર વખત સલવાત પઢે.

છઠ્ઠી રાત્રે ચાલીસ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરએ અલ્હમ્દ પછી દસ વખત ફુલ્હોવલ્લાહનો સૂરો પઢે.

સાતમી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી સો વખત સૂરે ફુલ્હોવલ્લાહનો સૂરો અને સો વખત આયતુલ ફુરસી પઢે.

આઠમી રાત્રે બે રકઅત નમાઝ છે. પહેલી રકઅતમાં સૂરે અલહમ્દ પછી ('આમનર રોસોલો'ની આયત (સૂરએ બકરહ, આયત નં. ૨૮૫, ૨૮૬) એક વખત અને) પંદર વખત સૂરે ફુલ્હોવલ્લાહ પઢે. બીજી રકઅતમાં સૂરએ

અલહમ્દ પછી એક વખત ‘કુલ ઇબ્નમા અના બશરમ’ની આયત (સૂરએ કહફ : ૧૧૦) અને પંદર વખત સૂરે કુલ્હોવલ્લાહ પઢે.

નવમી રાત્રે ચાર રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરએ અલહમ્દ પછી દસ વખત ‘એઝાજઅ નસરલ્લાહ’નો સૂરો (સૂરા નં : ૧૧૦, સૂરએ નસ્ર) પઢે.

દસમી રાત્રે ચાર રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી ત્રણ-ત્રણ વખત ‘આયતુલ કુરસી’ અને ‘ઇબ્ના અઅતયના’નો સૂરો પઢે.

અગિયારમી રાત્રે આઠ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી દસ વખત કુલ યા અય્યોહલ કાફેરૂનનો સૂરો પઢે.

બારમી રાત્રે બાર રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી દસ વખત ‘અલ્હાકોમુતકાસોરો’નો સૂરો (સૂરા નં. ૧૦૨, સૂરએ તકાસૂર) પઢે.

તેરમી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી એક વખત ‘વત્તીન’નો સૂરો (સૂરા નં. ૯૫, સૂરે તીન) પઢે.

ચૌદમી રાત્રે ચાર રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી પાંચ વખત ‘વલ અસર’નો સૂરો પઢે.

પંદરમી રાત્રે મગરિબ-ઇશાની વચ્ચે ચાર રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં દસ વખત કુલ હોવલ્લાહનો સૂરો પઢે અને ચારેય રકઅત પુરી થયા પછી દસ વખત કહે,

યા રબ્બિગૌફિરલના

અને દસ વખત કહે:

રબ્બિરુઝ્ઝિન્ના

અને દસ વખત કહે:

યા રબ્બે તુબ્બે અંલયના

અને એકવીસ વખત કુલ હો વલ્લાહનો સૂરો પઢે
અને દસ વખત આ દુઆ પઢે:

સુબહાંનલ્લાહી યોહૂંયિલે ભવતા વ
યોમીતુલે અહૂંયાઅ, વ હોવ અંલા કુલ્લે
શયેઈને કંદીર

સોળમી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં
સૂરએ અલહમ્દ પછી એક વખત ‘આયતુલ
કુરસી’ અને પંદર વખત ‘કુલ્હોવલ્લાહ’નો સૂરો
પઢે.

સત્તરમી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં
સૂરે અલહમ્દ પછી સિતોર વખત સૂરે
કુલ્હોવલ્લાહ પઢે અને બે રકઅત પછી સીતોર
વખત ઇસ્તીગ્ફાર કરે.

અઢારમી રાત્રે દસ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી પાંચ વખત 'કુલ્હોવલ્લાહ'નો સૂરો પઢે.

ઓગણીસમી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરઅે અલહમ્દ પછી પાંચ વખત 'કોલિલ્લાહુમ્મ માલેકલ મુલ્ક'ની પુરી આયત (સૂરે આલે ઈમરાન : આયત નં. ૨૬, ૨૭) પઢે.

વીસમી રાત્રે ચાર રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી પંદર વખત 'એઝાઝઅ નસરલ્લાહ'નો સૂરો (સૂરા નં. ૧૧૦, સૂરઅે નસ્ર) પઢે.

એકવીસમી રાત્રે આઠ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી એક એક વખત કુલ હો વલ્લાહ, કુલ અઉઝો બેરબ્બીન્નાસ અને કુલ અઉઝો બેરબ્બીલ ફલક પઢે.

બાવીસમી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી એક વખત કુલ યા અચ્ચોહલ

કાફરૂન અને પંદર વખત કુલ્હોવલ્લાહનો સૂરો પઢે.

ત્રેવીસમી રાત્રે ત્રીસ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી એક વખત 'એઝા મુલઝેલતીલ'નો સૂરો (સૂરા નં. ૯૯, સૂરએ ઝિલઝાલ) પઢે.

ચોવીસમી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી દસ વખત 'એઝાજઅ નસરૂલ્લાહ'નો સૂરો (સૂરા નં. ૧૧૦, સૂરએ નસ્ર) પઢે.

પચ્ચીસમી રાત્રે દસ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી એક વખત 'અલહાકોમુતકાસોરો'નો સૂરો (સૂરા : ૧૦૨, સૂરએ તકાસૂર) પઢે.

છવ્વીસમી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી દસ વખત 'આમનર રસૂલો'ની આયત (સૂરએ બકરહ, આયત નં.

૨૮૫, ૨૮૬) પઢે.

સત્યાવીસમી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી દસ વખત 'સબ્બે હીસ્મે રબ્બેકલ'નો સૂરો (સુરા નં. ૮૭, સૂરઅ અઅલા) પઢે.

અઠ્યાવીસમી રાત્રે ચાર રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી એક-એક વખત સૂરે કુલ્હોવલ્લાહ, સૂરે કુલ અઉઝો બેરબ્બીન્નાસ અને સૂરે કુલ અઉઝો બેરબ્બીલ ફલક પઢે.

ઓગણત્રીસમી રાત્રે દસ રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી દસ-દસ વખત સૂરે અલહાકોમુતકાસોરો, સૂરે કુલ્હોવલ્લાહ, સૂરે કુલ અઉઝો બેરબ્બીનાનસ અને કુલ અઉઝો બેરબ્બીલ ફલક પઢે.

ત્રીસમી રાત્રે બે રકઅત નમાઝ છે. દરેક રકઅતમાં સૂરે અલહમ્દ પછી દસ વખત 'સબ્બેહીસ્મ

રબ્બેકલ'નો સૂરો (સૂરા નં:૮૭, સૂરએ અઅલા) પઢે અને બે રકઅત નમાઝ પુરી થયા પછી સો વખત સલવાત પઢે.

દરેક મહિનામાં કરવાના આ'માલ

હઝરત ઇમામ જઅફરે સાદીક (અ.સ.) ફરમાવે છે:

કોઈ દરેક મહિનાની પહેલી રાત્રે બે રકઅત નમાઝ સુન્નતની નિચ્ચતથી પઢે અને દરેક રકઅતમાં અલહમ્દના સૂરા પછી એક વખત સૂરએ અનઆમ પઢે અને નમાઝ તમામ કર્યા પછી ખુદા પાસે દુઆ માંગે કે તેને દરેક ડર અને દરેક દરદથી બચાવે, તો તે મહિનામાં તેના માટે કોઈ પણ બાબત એવી નહીં થાય કે જેનાથી તે અણગમો રાખતો હોય.

હઝરત ઇમામે મોહમ્મદ તકી (અ.સ.) ફરમાવે છે:

દરેક મહિનાની પહેલી તારીખે સુન્નતની નિચ્ચતથી બે રકઅત નમાઝ પઢે. પહેલી રકાતમાં સૂરે અલ્હમ્દ પછી

ત્રીસ વખત કુલ્હોવલ્લાહ પઢે અને બીજી રકાતમાં સૂરે અલ્હમ્ પછી ત્રીસ વખત ઈન્ના અન્નલ્નાનો સૂરો પઢે. નમાઝ તમામ કર્યા પછી સદકો કરે, તો એ મહિનાની સલામતી ખુદા પાસેથી વેચાતી લીધી.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) દુનિયાથી ગયા ત્યાં સુધી દરેક મહિનામાં ત્રણ રોઝા રાખતા હતા. તે ત્રણ રોઝા વિષે મશહૂર છે કે મહિનાની પહેલી અને છેલ્લી જુમેરાત તથા બીજા દસકાના પહેલા બુધવારના રોઝા રાખવા તાકીદ ભરેલી સુન્નત છે. ત્રણ રોઝાનો સવાબ એક વર્ષના રોઝા રાખવા બરાબર છે. દરેક મહિનામાં “અય્યામુલ બીજ”ના રોઝા રાખવા સુન્નત છે. અને તે દરેક મહિનાની ૧૩, ૧૪ અને ૧૫-મી તારીખના રોઝા છે.

જે વખતે હઝરત જઅફરે તય્યાર હબશામાં જઈને પાછા આવ્યા, તે દિવસે હઝરત અલી (અ.સ.)ના હાથે ખૈબર ફતેહ થયો હતો. જ્યારે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ના ચહેરા ઉપર નજર પડી, ત્યારે દોડ્યા, હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ તેઓને બગલમાં લઈને તેઓની

ગરદનમાં હાથ નાખ્યો, પછી એક કલાક સુધી તેઓ સાથે વાત કરી, અને જનાબે જઅફરને પોતાની પાછળ બેસાડી લીધા. રસ્તામાં ફરમાવ્યું કે જઅફર બિરાદર! તું ચાહે છે કે તને મોટી બક્ષીશ આપું? ચાહે છે કે તને અમૂલ્ય હદિયો (ભેટ) આપું?

જઅફરે કહ્યું: મારા માં-બાપ આપ ઉપર ફીદા થઈ જાય, હા, હું ચાહું છું.

પછી હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ તેઓને “તરબીહાતે અરબાઅ”ની નમાઝ તાઅલીમ કરી.

બીજી મોઅતબર રિવાયત પ્રમાણે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું કે આ નમાઝ હંમેશા પઢો, તો તમામ દુનિયા અને જે કાંઈ દુનિયામાં છે, તેના કરતા તમારા માટે બેહતર છે.

હઝરત ઇમામે જઅફરે સાદીક (અ.સ.)એ નમાઝની રીત (નીચે મુજબ) બયાન ફરમાવી છે:

બે-બે રકઅત કરીને સુન્નતની નિચ્યતથી ચાર રકઅત નમાઝ પઢે, પહેલી રકઅતમાં અલહમ્દના સૂરા

પછી સૂરએ ઝિલઝાલ પઢે. બીજી રકઅતમાં અલહમ્દના સૂરા પછી સૂરએ અલ આદેયાત પઢે.

બીજી નમાઝની પહેલી રકઅતમાં અલહમ્દના સૂરા પછી સુરે એઝાજઅ નસરલ્લાહ (સૂરા નં. ૧૧૦, સૂરે નસ્ર) પઢે. બીજી રકઅતમાં અલહમ્દના સૂરા પછી સૂરે કુલ્હોવલ્લાહ પઢે અને દરેક રકઅતમાં સૂરે અલહમ્દ અને પછીનો સૂરો પઢ્યા પછી પંદર વખત ‘તરબીહાતે અરબાઅ’ પઢે.

سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ
سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ

તે જ પ્રમાણે “તરબીહાતે અરબાઅ” રકુઅમાં દસ વખત પઢે. રકુઅથી ઉભા થયા પછી એ જ પ્રમાણે દસ વખત પઢે. પહેલા સજદામાં એ જ પ્રમાણે દસ વખત પઢે. સજદામાંથી ઉઠીને બેસીને એજ પ્રમાણે દસ વખત પઢે. બીજા સજદામાં દસ વખત પઢે. બીજા સજદામાંથી ઉઠીને બેસીને દસ વખત પઢે કે એક રકઅતમાં કુલ પંચોતેર

(૭૫) વખત તસબીહાતે અરબાઅ છે. અને ચાર રકઅતમાં (૩૦૦) વખત તસબીહાતે અરબાઅ થાય છે.

ઘર બેઠા પઢવાની ઝિયારત અને અહદનામું

ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે:

જે કોઈ દૂરના શહેરમાં રહેતો હોય, તો ચાહે કે હજરત રસૂલે ખુદા (સ.અ.વ.), જનાબે અલીએ મુરતઝા (અ.સ.), જનાબે ફાતેમએ ઝહેરા (સ.અ.), જનાબે ઇમામે હસન (અ.સ.), ઇમામે હુસૈન (અ.સ.)ની તેમજ ખુદાની હુજ્જતો (ઇમામો)ની કબરોની ઝિયારત કરવા ચાહે, તો તે જ્યાં હોય ત્યાં જુમ્હાને દિવસે સુન્નત ગુરુલ કરી બે પાકીઝા કપડાં પહેરી ઘરની બહાર જંગલમાં જાય, પછી બે-બે રકઅત કરીને ચાર રકઅત નમાઝ સુન્નત પઢે અને દરેક રકઅતમાં ગમે તે સૂરા પઢે. પછી કિબ્લાની સામે ઉભા રહીને નીચે મુજબ ઝિયારત પઢે:

અસ્સલામો અંલયેક અય્યોહન્નબિય્યો

વ રહીંમતુલ્લાહે વ બરકાતોહૂ અસ્સલામો
 અંલયક અય્યોહન્નબિયુલ મુરેસલો વલ
 વસિંયુલ મુરેતઝો વસ સય્યેદતુલ કુબરા
 વસ સય્યદતુ ઝહરોઓ વસસિંબ્તોનિલ
 મુન્તજબાને વલઅવલાદુલ અઅલામો
 વલઓમનાઉલ મુન્તજબૂન જેઅતો નકેતોઅને
 ઈલયકુમ વ એલા આબાએકુમ વ વલદેકોમુલ
 ખંલફે અલા બરકતિલ હકકે ફકલ્બી લકુમ
 મોસલ્લેમુંવ વ નુસૈરતી લકુમ મોઅંદતુને
 હંતા યહકોમલ્લાહો બેદીનેહી ફમઅંકુમ
 મઅંકુમ લા મઅંઅંદુવ્વેકુમ ઇન્ની લમેનલ

કાંએલીન બે ફઝંલેકુમ મોકિરૂમ
 બેરજઅંતેકુમ લા ઉનેકેરો લિલ્લાહે કુંદેરતંવે
 વલા અઝઝામો ઇલ્લા માશાઅલ્લાહો
 સુબ્હાંનલ્લાહે ઝિલ્લે મુલ્કે વલે મલકૂતે
 યોસબ્બેહુંલ્લાહ બેઅસ્માએહી જમીઆ
 બંલેકેહી વસ્સલામો અંલા અરવાહેકુમ વ
 અજસાદેકુમ વસ્સલામો અંલયેકુમ
 વરહુંમતુલ્લાહે વબરકાતોહ

મોઅતબર સનદો સાથે સુદૈરે સર્ચફથી મનકુલ છે કે
 હઝરત ઇમામે જઅફરે સાદીક (અ.સ.)એ મને ફરમાવ્યું
 કે તું ઇમામે હુસૈન (અ.સ.)ની કબ્રની દર અઠવાડીયામાં
 પાંચ વખત અથવા હંમેશા ઝિયારત કરે તો શું હરકત
 (વાંધો) છે?

મેં અરજ કરી: આપ (અ.સ.) ઉપર ફિદા થાઉં.
મારી અને એ હઝરત વચ્ચે ઘણા ફરસખોનું અંતર છે.

આપ (અ.સ.)એ ફરમાવ્યું: તું પોતાના ઘરના કોઠા
(અગાસી) ઉપર જા અને પોતાની જમણી તથા ડાબી તરફ
ધ્યાન કર, પછી તારા માથાને આસ્માન તરફ ઊંચું કર.
પછી ઇમામે હુસૈન (અ.સ.)ની કબર તરફ મોઢું કર અને
નીચે મુજબ પઢ:

અસ્સલામો અંલયેક યા અબ્બા
અંબદિલ્લાહે અસ્સલામો અંલયેક યબ્ન
રસૂલિલ્લાહે અસ્સલામો અંલયેક વ
રહ્મતુલ્લાહે વ બરકાતોહે.

પછી આપ (અ.સ.)એ ફરમાવ્યું કે એ પ્રમાણે કરવાથી
તારા માટે એક હજ અને એક ઉમરાહનો સવાબ લખવામાં
આવશે.

સુદૈર કહે છે મોટે ભાગે એવું બને છે કે હંમેશા વીસ

વખત કરતા વધારે વખત ઝિયારત કરું છું.

સહી સનદમાં એ જ હઝરતથી મનકુલ છે કે જે કોઈ અમારાથી દૂર રહેતો હોય, તો પોતાના ઘરના કોઠા (અગાસી) ઉપર જઈ બે રકઝત નમાઝ પઢી અમારી કબરો તરફ ઇશારો કરી અમોને સલામ કરે, તો તે સલામ અમોને પહોંચે છે.

બીજી મોઅતબર હદીસમાં સુલયમાન બીન ઇસાથી મનકુલ છે કે તે કહે કે હું આપ (અ.સ.)ની ખિદમતમાં આવી ન શકું, તો આપની ઝિયારત કેવી રીતે કરું?

તો આપ (અ.સ.)એ ફરમાવ્યું કે ઇસા અગર તું આવી ન શકે, તો જુમ્હાના દિવસે અથવા ગમે ત્યારે વઝુ કરી ઘરના કોઠા (અગાસી) ઉપર જઈ બે રકઝત નમાઝ પઢીને મારા તરફ ખ્યાલ કર (ઝિયારત પઢ) કે જે કોઈ અમારી હયાતીમાં અમારી ઝિયારત કરે, તો એવું છે કે જાણે તેણે અમારી હયાતી બાદ અમારી ઝિયારત કરી.

મોઅતબર હદીસમાં મનકુલ છે કે હન્નાન બીન

સુદૈર ઇમામ જઅફર સાદીક (અ.સ.)ની ખિદમતમાં ગયા અને એ હઝરતની ખિદમતમાં આપના અસ્હાબોમાંના કેટલાક જણ બેઠા હતા. તે વખતે આપે ફરમાવ્યું કે અય હન્નાન! હઝરત ઇમામે હુસૈન (અ.સ.)ની ઝિયારત દરેક મહિનામાં એક વખત કરે છે?

તેણે કહ્યું નહીં.

આપ (અ.સ.)એ ફરમાવ્યું: દર બે મહિનામાં એક વખત ઝિયારત કરે છે?

તેણે કહ્યું: નહીં.

આપ (અ.સ.)એ ફરમાવ્યું: દર વર્ષે એક વખત ઝિયારત કરે છે?

તેણે કહ્યું, નહીં!

આ સાંભળીને આપ (અ.સ.)એ ફરમાવ્યું: પોતાના સૈયદ અને આકા ઉપર કેટલો મુલ્મ કરે છે?

તેણે અરજ કરી: યા રસૂલુલ્લાહના ફરઠંદ! હું ઝિયારત કરવા નથી જતો તેનું કારણ એ છે કે રસ્તો

ઘણો દૂર છે અને મારી પાસે એટલો ખર્ચ નથી.

આ સાંભળીને આપ (અ.સ.)એ ફરમાવ્યું કે તમો દૂરથી, પોતાની જગ્યાએથી ઝિયારત કરો, તો પણ ઝિયારત કબૂલ થાય એવી ઝિયારત ખતાવું?

તેણે અરજ કરી: ખતાવો.

આપ (અ.સ.)એ ફરમાવ્યું: જુમ્હાના દિવસે અથવા ગમે તે દિવસે ગુસ્લ કર અને પાક-સાફ કપડાં પહેર અને પોતાના ઘરની ઉપર ઊંચામાં ઊંચી જગ્યાએ જા અથવા જંગલમાં જા અને હજરતની કબ્ર તરફ મોઢું કરીને નીચે મુજબ ઝિયારત પઢ:

અસ્સલામો અંલયેક યા મવેલાય વબ્ન મવેલાય વ સય્યદી વબ્ન સય્યદી, અસૌલામો અંલયેક યા મવેલાય વલે કંતીલુબ્નુલે કંતીલે, શશહીદબ્ન શહીદે, અસૌલામો અંલયેક વ

રહુંમતુલ્લાહે વ બરકાતોહ, અના ઝાએરોક
 યબ્ન રસૂલિલ્લાહે બેકુંલ્બી વ લેસાની વ
 જવારેહી વ ઇન લમ અઝુરક બેનફસી
 વલ મોશાહદતે લેકુંબતેક ફઅંલયેક સલામો
 યા વારેસં આદમ સફવતિલ્લાહે વ વારેસં
 નૂહિને નબીયિલ્લાહે, વ વારેસં ઇબ્રાહીમ
 ખંલીલિલ્લાહે, વ વારેસં મૂસા કલીમિલ્લાહે
 વ વારેસં ઈસા રૂહિલ્લાહે, વ કલેમતેહી વ
 વારેસં મોહંમદિને હુંબીબિલ્લાહે વ નબીયેહી
 વ રસૂલેહી વ વારેસં અંલિયિને અમીરિલ
 મોઅમેનીન વ વસિંયે રસૂલિલ્લાહે વ

ખંલીફતેહી વ વારેસંલ હસંનિબને અંલિયિન
 વસિંચે અમીરિલ મોઅમેનીન, લઅંનલ્લાહો
 કાંતેલીક વજદ્ અંલયહેમુલ અંઝાબ ફી
 હાઝંહિસ્સાઅંતે વ ફી કુલ્લે સાઅંતિન અના
 યા સય્યેદી મોતકરેબુન અેલલ્લાહે જલ્લ
 વ અંઝ વ એલા જદ્દેક રસૂલિલ્લાહે વ
 એલા અબીક અમીરિલ મોઅમેનીન વ એલા
 અબીકલ હંસને વ એલયેક યા મવલાય
 અંલયેક સ્સલામ વ રહંમતોહૂ વ બરકાતોહૂ
 બે ઝેયારતી લક, બેકુંલ્બી વ લેસાની વ
 જમીએ જવારેહી ફકુન યા સય્યેદી શફીઈલે

કુંભૂલે ઝાંલેક મિન્ની વ અના બિલે બરોઅતે
 મિને અઅંદાએક વ લઅંનતે લહુમં વ
 અંલયેહિમં અતકુંરબો એલલાહે વ એલયકુમં
 અજમઈન ફઅંલયેક સંલવાતુલાહે વ
 રિઝવાનોહૂ વ રહૂમતોહૂ.

પછી જરા ડાબી તરફ જા અને હઝરત અલી અકબર
 (અ.સ.)ની કબર તરફ મોઢું કર કે તેઓ પોતાના પિતાના
 પગ પાસે દફન છે અને તેઓને ઉપર પ્રમાણે સલામ કર,
 પછી દુઆ કર અને દીન તથા દુનિયાની હાજત (જરૂરત)
 માંગ. પછી બે-બે રકઅત કરીને ચાર રકઅત નમાઝ
 પઢ, કારણકે ઝિયારતની નમાઝ આઠ રકઅત છે અથવા
 છ રકઅત અથવા ચાર રકઅત અથવા બે રકઅત છે
 અને બેહતર છે કે આઠ રકઅત નમાઝ પઢે. પછી ઇમામે
 હુસૈન (અ.સ.)ની કબર તરફ મોઢું કરીને નીચે મુજબ
 કહે:

અના મોવદેઓંક યા મલ્લાય વબ્ન
 મલ્લાય યા સય્યદી વબ્ન સય્યદી, વ
 મોવદેઓંક વ સય્યદી વબ્ન સય્યદી યા
 અંલી ચિબ્નીલે હુંસયેન વ મોવદેઓંકુમ
 યા સાદાતી, યા મઅંશર શશોહદાએ
 ફઅંલયકુમ સલામુલ્લાહે વ રહુંમતોહૂ વ
 બરકાતોહૂ વ રિઝુંવાનોહૂ

અને ઉપરની ઝિયારત હઝરત અલી અકબર
 (અ.સ.) માટે પણ પઢવાનું લખ્યું છે, તો એ ઝિયારતમાં
 જ્યાં ‘યા વારેસ’ શબ્દ આવે છે, ત્યાં ‘યબ્ન વારેસ’ પઢે
 અથવા વારીસથી ઘરાદો ઇમામત અને ખિલાફતનો વીરસો
 ન કરે, કારણકે તેઓ ઇમામ ન હતા.

અબુલ હસન ફારસીથી રિવાયત છે કે તે કહે છે કે એક રાતે સ્વપ્નમાં રસૂલે ખુદા (સ.અ.વ.)ને જોયા અને ઇમામે હસન (અ.સ.) અને ઇમામે હુસૈન (અ.સ.) આપની ખિદમતમાં હતાં. જ્યારે એ બુઝુર્ગવારોની નજીક પહોંચ્યો, ત્યારે ઇમામે હુસૈન (અ.સ.)એ કહ્યું:

યા રસૂલુલ્લાહ (સ.અ.વ.)! આ શખ્સ મારી ઝિયારત બહુજ કરતો હતો, પણ તેણે હવે ઝિયારત કરવાનું છોડી દીધું છે.

એ સાંભળીને રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું કે હુસૈન જેવાની ઝિયારત તર્ક કરી શકાય ખરી?

મેં અરજ કરી: યા રસૂલુલ્લાહ (સ.અ.વ.)! એક તો મારી પાસે માલ ઘણો થોડો છે. બીજું હું વૃદ્ધ થઈ ગયો છું. તેથી હું એ અઝીમ સવાબના કામથી મહેરૂમ રહું છું.

હઝરતે ફરમાવ્યું કે હંમેશા રાત્રે પોતાના ઘરમાં કોઠા (અગાસી) ઉપર જઈ ઇમામે હુસૈન (અ.સ.)ની કબ્ર તરફ ઇશારો કરીને નીચે મુજબ ઝિયારત પઢે:

અસ્સલામો અંલયક વ અંલા જદેક વ

અબીક, અસ્સલામો અંલયેક વ અંલા ઉમ્મેક
 વ અબીક, અસ્સલામો અંલયેક વ અંલલ
 અઇમ્મતે વ બનીક, અસ્સલામો અંલયેક
 યા સોહેબદે દમ્મં તિસ્સાકેબતે, અસ્સલામો
 અંલયેક યા સોહેબલે મુસીબતિરે રાતેબતે
 લકંદે અસંબહું કેતાબુલ્લાહે ફીક મહુજૂરને
 વ રસૂલુલ્લાહે ફીક મવતૂરને અસ્સલામો
 અંલયેક વ રહૂમતુલ્લાહે વ બરકાતોહ
 અસ્સલામો અંલા અન્સોરિલ્લાહે વ
 અહિંબ્બાએહી અસ્સલામો અંલા મહાલ્લે
 મઅરેફતિલ્લાહે વ મઅંદેને હિકમતિલ્લાહે

વ હુંફઝંતે સિરિલ્લાહે વ હુંમલતે કેતાબિલ્લાહે
 વઅવ્સોયોએ નબિયિલ્લાહે વ ઝુંરેરિચ્યતે
 રસૂલિલ્લાહે સંલ્લલ્લાહો અંલયહે વ આલેહી
 વ રહુંમતુલ્લાહે વબરકાતોહું.

હઝરત ઇમામે ઝમાના (અ.સ.)ની

ઝિયારત

હંમેશા સવારની નમાઝ પછી બારમા ઇમામ
 (અ.સ.)ની ઝિયારત પઢે.

અલ્લાહુમ્મ બલ્લિગું મવલાય સોહુંબઝું
 ઝમાને સંલવાતુલ્લાહે અંલયહે અંને જમીઈલું
 મોઅમેનીન વલું મોઅમેનાતે ફી મશારેકિલું
 અરેઝું, વ મગોરેબેહા વ બરેહા વ બહુંરેહા

વ સહલેહા વ જબલેહા, હૃય્યેહિમં વ
 મય્યેતેહિમં, વ અંનં વાલેદય્ય વ વુલદી વ
 અંન્ની મેનસંસંલવાતે વત્તહિય્યાતે ઝિનત
 અંશિલ્લાહે વ મેદાદ કલેમાતેહી વ મુન્તહા
 રેઝાહો વ અંદદ મા અહંસાહો કેતાબોહૂ
 વ અહાંતં બેહી ઈલ્મોહૂ અલ્લાહુમ્મ ઇન્ની
 ઓજદેદો લહૂ ફી હાઝંલે યવમે વ ફીકુલ્લે
 યવમિને અંહંદને વ અંકંદને વ બયઅંતલે
 લહૂ ફીરકંબતી અલ્લાહુમ્મ કમા શરફતની
 બેહાઝંત્તશરીફે વ ફઝીલતની બેહાઝંહિલે
 ફઝીલતે વ ખંસંસ્તની બે હાઝંહિન્નેઅંમતે.

ફસાંલો અંલા મવંલાય વ સયોદી
 સાંહોબીઝમાને વજોઅંની મિનં અન્સોરેહી
 વ અશ્યાઓહી વઝોઝાબીન અંહો વજોઅંની
 મેનલંમુસ્તશહદીન બયેન યદયેહો તોંએઅંને
 ગોંયેર મુકેરહીને ફિસંસંફે ફિલ્લગી નઅંત્ત
 અહલહૂ ફી કેતાબેક ફકુંલ્ત સંફેને કઅન્નહુમ
 બુન્યાનુમ મરેસૂંસુંને અંલા તોંઅંતેક વ તોંઅંતે
 રસૂલેક વ આલેહી અંલૈહેમુસ્સલામા
 અલ્લાહુમ્મ હાઝોહી બયેઅંતુલેલહૂ ફી
 ઓંનોકીં એલા યવેમિલે કૈયામતે.

આખે નયસાનના ફાયદાઓ

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું: ચાહો છો કે તમોને એ દુઆ તઅલીમ કરૂં, જે મને જિબ્રિલે તઅલીમ કરી છે કે તેના કારણે હકીમો (ડોક્ટરો)ની દવાના મોહતાજ ન રહો?

આ સાંભળીને અલી (અ.સ.), જનાબે સલમાન ફારસી (અ.ર.) અને બીજાઓએ અરજ કરી: એ દુઆ શું છે?

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ અલી (અ.સ.) તરફ ધ્યાન કરીને ફરમાવ્યું:

રૂમી મહિનાઓમાં “નયસાન” મહિનામાં વરસાદ પડે, તે લઈ લો અને તેના ઉપર “સૂરએ અલહમ્દ, આયતુલ કુરસી, સૂરએ કુલ્હોવલ્લાહ, સૂરએ કુલ અઉઝો બેરબ્બીલ ફલક, સૂરએ કુલ અઉઝો બેરબ્બીન્નાસ, સૂરએ કુલ યા અય્યોહલ કાફેરૂન, સુરે ઇન્ના અનઝલનાહો” એ સર્વે સિત્તેર (૭૦) વખત પઠો અને “અલ્લાહો અકબર, લાએલાહ ઇલ્લલ્લાહ” અને સલવાત

પણ સિત્તેર (૭૦) વખત પઢો. પછી તે પાણી (સવારના અને સાંજના સાત દિવસ) સુધી પીઓ, તો અંગમાંથી તમામ જાતની બીમારીને ખુદા દૂર કરે. (મફાતીમાં સૂરએ ઈશ્ના અન્નનાહોની જગ્યાએ સૂરએ સબ્બેહિસ્મે રબ્બેક છે અને છેલ્લે તસ્બીહે અરબાઅ ૭૦ વખત છે.)

અકીકાનું બયાન

બાબકનો અકીકો સાહેબે મકદૂર (કુદરત ધરાવનાર) ઉપર ‘સુન્નતે મોવકકેદા’ છે, બલ્કે કેટલાક ઓલમા પાસે વાજિબ સાબિત છે. બેહતર છે કે સાતમે દિવસે અકીકો કરે અને જો સાત દિવસ કરતાં વધારે વાર લાગે તો બાબક બાલીગ થાય ત્યાં સુધી તેના પિતા ઉપર સુન્નત છે, અને તે પછી પોતાની આખી ઉંમર સુધી પોતાની ઉપર સુન્નત છે.

હઝરત ઇમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

પૈસાવાળા ઉપર અકીકો કરવો વાજિબ છે અને જે

ગરીબ હોય અને તેને (માલ) મળે, તે વખતે અડીકો કરે, અને ન મળે તો કાંઈ હરકત (વાંધો) નથી અને કોઈએ અડીકો કર્યો ન હોય અને તેના માટે કુરબાની કરે, તો અડીકાના બદલામાં પૂરતું છે.

હદીસમાં છે કે ફરજાંદનો અડીકો સાતમે દિવસે કરવો અને નામ પણ સાતમે દિવસે રાખવું અને સાતમે દિવસે માથાના વાળ ઉતરાવી, તે વાળ રૂપાની ભારોભાર તોળીને તેટલું રૂપું સદકો કરવું અને અડીકાની એક રાત મદદગાર સુયાણીને આપવી અને બાકીનું ગોશ્ત લોકોને ખવરાવો. સદકો કરવો અને પોતે અડીકાનું ગોશ્ત ખાય નહીં અને સુયાણી ચહુદી વિગેરે હોય તો ગોશ્ત ન આપતા તેની કિંમત થાય તે આપવી.

ઈમામે અલી રઝા (અ.સ.) ફરમાવે છે:

રસૂલે ખુદા (સ.અ.વ.)એ ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)નો જન્મ થયા પછી કાનમાં અઝાન આપી અને જનાબે ફાતેમા (સ.અ.)એ સાતમે દિવસે અડીકો કર્યો અને સુયાણીને એક રાત અને એક

અશરફી આપી.

અકીકા માટે જો ઊંટ હોય, તો પાંચ વર્ષ અથવા તેથી વધારાનું હોય અને બકરૂં હોય, તો એક વર્ષ અથવા તેથી વધારાનું હોય અને ઘેટું હોય, તો છ મહિના અથવા તેથી વધારાનું હોય. અકીકાનું જનાવર બેહતર છે કે ખસી, સીંગ તુટેલું કે કાન છાપેલું ન હોય.

છોકરાના અકીકા માટે સુન્નત છે કે નર હોય અને છોકરીના અકીકા માટે માદા હોય. સુન્નત છે કે અકીકાનું ગોશ્ત માં-બાપ ન ખાય.

સુન્નત છે કે પહેલા બાળકના વાળ ઉતરાવે પછી અકીકાનું જાનવર ઝખ્હ કરે.

હદીસમાં છે કે માથાના વાળ ઉતરાવવા, અકીકાનું જાનવર ઝખ્હ કરવું, વાળ સોના યા રૂપાના ભારો ભાર તોળવા અને સદકો કરવો તે તમામ એક વખતે એક ઠેકાણે કરે.

અકીકાનું જાનવર ઝખ્હ કરતી વખતે આ મુજબ પઢે:

બિસ્મિલ્લાહે વબિલ્લાહે અલ્લાહુમ્મ
હાઝંહી અંકીકંતુને અંને

છોકરાનું અને તેના પિતાનું નામ

લહ્મોહા બેલહ્મોહી, વ દમોહા બે
દમોહી, વ અંઝંમોહા બેઅંઝંમોહી,
વશઅરોહા બેશઅરેહી વજહોહા બે
જહોહી અલ્લાહુમ્મજે અંલ્લા વેકાંઅંને લેઆલે
મોહમ્મદિને અંલયહે વ આલેહિસ્સલામ.

અને જો દીકરીનો અકીકો હોય, તો બીજી દુઆમાં
કેટલાક શબ્દોમાં ફરક છે માટે પહેલે તે નાની દુઆ પઠી
છોકરીનું નામ તથા તેણીના બાપનું નામ લઈ આ મુજબ
પઠવું:

લહૈંમોહા બેલહૈંમેહા, વ દમોહા બેદમેહા
વ અંઝૈંમોહા બે અંઝૈંમેહા અલ્લાહુમ્મૈંજ
અંલ્હા વેકાંઅલે લેઆલે મોહૈંમદિને અંલયહે
વ આલેહિસ્સલામ.

ખત્તા કરવાનું ખયાન

છોકરાની 'ખત્તા' (સુન્નતા) કરાવવી સાતમે દિવસે તાકીદ ભરેલી સુન્નત છે, અને તે પછી 'ખત્તા' કરે તો ચાલે અને તે બાલીગ થયા પછી તો પોતાના ઉપર વાજિબ થઈ જાય છે. 'ખત્તા' કરાવતી વખતે આ નીચેની દુઆ પઢવી :-

મનકૂલ છે કે આ દુઆ પઢવાથી ખચ્ચું કતલ થવાથી બચે.

અલ્લાહુમ્મ હાઝૈંહી સુન્નતોક, વ સુન્નતો

નબીય્યેક સંલવાતોક અંલયેહે વ આલેહી
 વ ઇત્તબાઉ મિન્ના લક વલે નબીય્યેક બે
 મશિય્યિતેક, વ ઇરાદતેક, વ કંઝાએક, લે
 અમિરને અરદતહૂ વ કંઝાઈને હંતમતહૂ,
 વ અમિરને અન્ફઝંતહૂ વ અઝંકંતહુ હંરેરલે
 હંદીદ, ફી ખૈતાનેહી, વ હેજામતેહી,
 બેઅમિરને, અન્ત અઅરફો બેહી મિન્ની,
 અલ્લાહુમ્મ ફતંહિહિરેહો મેનઝં ઝાનૂબે વ
 ઝિદની ફી ઉંમરેહી, વદફઈલે આફાતે અંને
 બદનેહી, વલે અવજાઅં, અંને જુસ્મેહી,
 વઝિદેહો મેનલે ગૈના, વદફઅં અંનેહુલ
 ફકરે, ફઈન્નક તઅંલમો વલા નઅંલમો.

નવરોઝની તારીખ, ફઝીલત

ક્યુમરસ ઘરાનનો પ્રથમ રાજા હતો. તેણે મહાન તત્વજ્ઞાનીઓને ભેગા કરી ઋતુ વગેરેનો હિસાબ કર્યો. વર્ષનો પહેલો દિન (દિવસ) નિર્માણ કર્યો. સનનો આરંભ થયો અને એ તારીખથી શુભ કાર્યની શરૂઆત થઈ. તે શાહ (રાજા) પછી જમશેદ બાદશાહ થયો અને તેણે “નવરોઝ”ને નામ સાથે ખુબ જ ખ્યાતિ આપી.

જો કે કુરઆને શરીફની એક આયતના જાહેરી અર્થમાં છે કે:

“અલ્લાહ પાસે મહિનાની સંખ્યા તેની કિતાબમાં તે દિવસથી બાર છે, જે દિવસે તેણે આસમાનો અને જમીન પેદા કર્યા.”

અત્રે તો જાહેરી આયત પર નજર કરતા એ વસ્તુ સિદ્ધ થાય છે કે જુદા જુદા બાર મહિનાઓ છે અને વૈજ્ઞાનિકોએ શોધખોળ કરી વર્ષને બાર મહિનાઓમાં તકસીમ કર્યા છે અને તે પ્રત્યેકને બુર્જ (ગ્રહ) કહે છે,

તેના નામ જુદી-જુદી રીતે આપેલા છે. જેમકે હમલ, સોર, જવઝ, સરતાન, અસદ, સુમ્બુલા, મિઝાન, અકરબ, ક્વસ, જદી, દલવ, હુત જ્યારે જ્યારે આખરી બુર્જમાંથી પસાર થાય છે ત્યારે હમલમાં પ્રવેશ થાય છે અને લગભગ ૨૧-મી માર્ચનો દિવસ હોય છે, જો ફેબ્રુઆરી-૨૯ દિવસનો થાય તો ૨૦-મી માર્ચના આવે છે. એ હિસાબે એપ્રિલ મહિનાની બાર અથવા તેરમી તારીખથી ૩૦-દિવસ સુધીમાં જે વરસાદ આવે, તે “આબે નયસાન” કહેવાય છે.

ઇસ્મે હેયત (ખગોળ શાસ્ત્ર)ના જાણકારો માન્યતા છે કે હમલના ગ્રહમાં પ્રવેશ થયા પછી વર્ષની પૂર્ણાહુતી (રાત-દિવસ મળી) ૩૬૫ દિવસ પાંચ કલાક ૨૮ મિનિટ થોડી સેંકડો લાગે છે. જે “તહવીલ”નો સમય સૂર્ય માટે કહે છે.

ઇમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

અય મોઅલ્લા! નવરોઝ એ દિવસ છે, ખુદાએ પ્રત્યેક પાસેથી પોતાની એકતા (વહદાનીયત)નો અને તેની જાતમાં

કોઇને શરીક ન માને તેનો અહદ લીધો છે. પયગમ્બરો, અવલીયાઓ, ઇમામો (અ.મુ.સ.) ઉપર ઇમાન લાવવાનો અહદ લીધો છે. તે દિવસે સૂર્ય પ્રકાશ્યો છે. ઝાડ-પાન, ફળફળાદી ઉત્પન્ન થયા છે. નવરોઝના દિવસે “જુદી” નામના પર્વત ઉપર હઝરત નૂહ (અ.સ.)ની કિશ્તી તોફાન પછી ઠેહરી હતી. ઇતિહાસકારો વર્ણવે છે કે હીજરી સન પૂર્વે ૪૪૬૧ વર્ષનો આ બનાવ છે.

● હજારો ઇન્સાનોનું સજીવન થવું:

બતાવે છે કે ઇરાકની સરઝમીન પર એક ગામડું હતું, ત્યાં મરકી (પ્લેગ)નો રોગ બહુ જ ફાટી નીકળતો. પહોંચતા (ધનવાન) (તવંગર) માણસો ગામ છોડી ચાલ્યા જતા હતાં પણ બિચારા નિર્ધન (ગરીબ) લોકો ક્યાંય જઇ શકતા ન હતા, તેથી અનેક માણસો મરકી (પ્લેગ)માં મરણ પામતા. એક વખત એવી તો મરકી ફાટી નીકળી કે બધા ગામ છોડીને ભાગવા લાગ્યા, ત્યાં અલ્લાહના હુકમથી બે મલક (ફરિશ્તા) આવ્યા અને એક એવી અવાજ આપી કે ખુદાના હુકમથી તેઓ બધા મરણ પામ્યા.

વર્ષો પછી જ્યારે તેઓના શરીર સડી ગયા ત્યારે એક પયગમ્બર ત્યાંથી પસાર થયા અને સડી ગયેલા હાડકાઓ જોઈને કહ્યું:

બારે ઇલાહા! તું આ નાશ પામેલા ઇન્સાનોને કેવી રીતે સજીવન કરીશ, તે જોવા ચાહું છું.

હઝરત પયગમ્બરની દુઆ કબૂલ થઈ. વહી આવી કે તેના પર પાણી છાંટો, પયગમ્બરે પાણી છાંટ્યું તો તમામ સજીવન થઈ ગયા. એ દિવસ “નવરોઝ”નો હતો. આ કિસ્સો કુરઆને શરીફમાં છે. તફ્સીરકર્તાઓએ તેમનું નામ ‘હીઝકીલ’ પયગમ્બર વર્ણવેલ છે.

‘નવરોઝ’ના દિવસે ઇબ્રાહીમ (અ.સ.)એ ખુતો તોડ્યા. પયગમ્બરે ખુદા મોહમ્મદે મુસ્તુફા (સ.અ.વ.)ને (૨૭-મી ૨૪૭ના) પયગમ્બરી મળી. હઝરતે ખાનઅે ખુદામાંથી ખુતોનું ખંડન કર્યું. પોતાના મુબારક ખભા પર અલી (અ.સ.)ને ઉભા કરી ખુતો (મૂર્તિઓ)નો નાશ કર્યો. આ ઉપરાંત “નવરોઝ”ના દિવસે ગદીરે ખુમ નામની જગ્યા પર પયગમ્બરે ઇસ્લામે પોતાના વસી

ખલીફા (૧૮-મી ઝીલ્હજના) અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને લાખોના મજમાની અંદર બધાની બચઅત લઇને નિયુક્ત કર્યા. રસૂલે ખુદા (સ.અ.વ.)ની આજ્ઞાથી અલી (અ.સ.)એ જિન્નાતોની બચઅત લીધી તે પણ આજ મુબારક દિવસ હતો. એ સિવાય બારમા ઇમામ મહદી (અ.સ.) દજ્જાલ પર વિજય મેળવી કુફ્રામાં કનાસાતના મોહલ્લામાં તે મલઉનને શૂળીએ ચડાવશે અને બીજા ઇમામો (અ.મુ.સ.) પણ રજઅત કરશે, તે આજ “નવરોઝ”નો દિવસ હશે.

● નવરોઝના આ'માલ:

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું કે “નવરોઝ” હોય તે દિવસે પાક સાફ કપડાં પહેરવા, ખુશ્ખુ લગાવવી, સુન્નત રોઝો રાખવો, ઝોહર અને અસરની નમાઝ પછી ચાર રકઅત નમાઝ બે-બે રકઅત કરીને સુન્નતની નિચ્ચતથી પઢવી. પહેલી રકઅતમાં સૂરએ અલહમ્દ પછી દસ વખત સૂરે ઇન્નાઅન્ના અને બીજી રકઅતમાં સૂરે અલહમ્દ પછી દસ વખત કુલ યા અય્યોહલ કાફેરૂનનો સૂરો પઢી

નમાઝ પૂરી કરે. ત્યારબાદ બીજી નમાઝની પહેલી રકઅતમાં સૂરે અલહમ્દ પછી દસ વખત સૂરે કુલ્હોવલ્લાહો અહદ, બીજી રકઅતમાં સૂરે અલહમ્દ પછી દસ-દસ વખત કુલ અઉઝો બેરબ્બીન્નાસ તથા કુલ અઉઝો બેરબ્બીલ ફલકનો સૂરો પઢી નમાઝ તમામ કરે. પછી શુક્રના સજદામાં નીચેની દુઆ પઢે:

અલ્લાહુમ્મ સંલ્લે અંલા મોહુંમ્મદિંવે
 વ આલે મોહુંમ્મદેનિલે અવેસૌયાઇલે
 મરેઝીયીન, વ અંલા જમીર્એ અમ્બેયાએક
 વ રોસોલેક, બેઅફઝંલે સંલવાતેક વ બારિકે
 અંલયહિમ, બેઅફઝંલે બરકાતેક વ સંલ્લે
 અંલો અરવાહૈહિમ, વ અજસાદેહિમ,
 અલ્લાહુમ્મ બારિકે અંલા મોહુંમ્મદિંવે વ

આલે મોહુંમદ, વ બારિક લના ફી યવમેના
 હાઝંલગી ફઝંઝંલહૂ વ કરમ્મહૂ વ શરફેતહૂ
 વ અંઝંઝંમ્ત ખંતંરહૂ અલ્લાહુમ્મ બારિક
 લી ફીમા અનઅંમ્ત બેહી અંલય્ય હંત્તા
 લા અશકોર અહુંદન ગંયેરક વ વસ્સેઅં
 અંલય્ય ફી રિઝકી, યા ઝંલેજલાલે વલે
 ઇક્રામ, અલ્લાહુમ્મ મા ગાંબ અંની ફલા
 યગીબન્ન અંની અંવેનોક વ હિંફેઝોક વ
 મા ફકંત્તો મિને શયઇને ફલા તુફકિદેની
 અંવેનક અંલયેહે હંત્તા લા અતકલ્લફ મા
 લા અહુંતાજો એલયેહે, યા ઝંલેજલાલે વલે

ઈકરમ

જો એ મુજબ અમલ કરીશ, તો પચાસ વર્ષના ગુનાહ ખુદા માફ કરી આપશે અને નવરોઝને દિવસે નીચે મુજબ બહુજ પઢવું:

યા ઝંલેજલાલે વલેઈકરમ.

અલ્લામા મજલીસી અલયહીર્રહમા લખે છે કે ગેરમશહૂર કિતાબોમાં લખેલ છે કે 'તહવીલ'ના સમયે આ દુઆ બહુજ પઢે અને કેટલાક આલીમોએ કહ્યું છે કે ૩૬૬ વખત પઢે. તે દુઆ નીચે મુજબ છે:

યા મોહુંવેલેલે હુંવેલે વલે અહુંવાલે
હુંવેવિલે હુંલના એલ્લા અહુંસનિલે હુંલ.

નવરોઝના દિવસે નીચેની દુઆ ૩૬૬ વખત પઢે:

યા મોકુંલેબલે કૌલૂબે વલે અબ્સૌર,

યા મોદબ્બેરલે લયલે વન્નહારે, યા
મોહુંવેલલે હુંવેલે વલે અહુંવાલે, હુંવેવિલે
હુંલના એલો અહુંસનિલે હુંલ.

નીચે મુજબના સાત સુરાને નવરોઝના દિવસે
પઢે, તો ખુદાવંદે કરીમ તેને આવતા વર્ષ સુધી આફત
અને બલાઓથી બચાવે છે:

(૧) સૂરએ બની ઇસરાઇલ (૨) સૂરએ

નૂર

(૩) સૂરએ હદીદ (૪) સૂરએ હશ્ર (૫) સૂરએ

સફ

(૬) સૂરએ મઆરેજ (૭) સૂરએ

અઅલા

જે કોઈ આ દિવસે નીચેની આયતોને ગુલાબ, કસ્તુરી
અને કેસરથી ચીનીના વાસણમાં લખી તેને પાણીમાં મીક્સ
કરીને પી જાય, તો ખુદા તેને એક વર્ષ સુધી બલાઓથી

બચાવે છે અને તે આચતો આ છે:

સલામુન કુંલમ મિર ૨બ્બીર ૨હીમ,
સલામુન અંલા નૂહિન ફીલ અંલમીન,
સલામુન અંલા ઇબ્રાહીમ, સલામુન અંલા
મૂસા વ હારૂન, સલામુન અંલા ઇલ
યાસીન, સલામુન અંલયકુમ તિબતુન
ફદ ખોલૂહા ખોલેદીન, સલામુન હેય
હતા મતોલઈલા ફજર, સલામુન
અંલયકુમ બેમા સંબરતુમ ફનેઅમ
ઉકબદદાર.

‘તહવીલ’ના દિવસે દાડમ ઉપર સૂરએ યાસીન પઠીને
ખાવું ફાયદાકારક છે.

નમાઝે આયાત

ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ, કાળી કે લાલ આંધી આવે
યા ખોફનાક બનાવ બને, ઘરતીકંપ થાય ત્યારે નમાઝે
આયાત પઢવી વાજિબ છે. આ નમાઝ બે રકઅત છે,
દરેક રકઅતમાં પાંચ રૂકૂઅ અને બે સજદા છે.

નિયત પછી ‘તકબીરતુલ એહરામ’ કહીને સૂરએ
અલહમ્દ અને બીજો સૂરો પઢે અને રૂકૂઅમાં જાય.

અને રૂકૂઅથી સીધો ઉભો થઈને સૂરએ અલહમ્દ
અને બીજો સૂરો પઢે અને રૂકૂઅમાં જાય.

અને રૂકૂઅમાંથી સીધો ઉભો થઈને સૂરે અલહમ્દ
અને બીજો સૂરો પઢે અને રૂકૂઅમાં જાય.

પછી રૂકૂઅમાંથી ઉભો થઈને સૂરએ અલહમ્દ અને
સૂરો પઢે અને રૂકૂઅમાં જાય.

અને ફરી ઉભા થઈને સૂરે અલહમ્દ અને બીજો
સૂરો પઢે અને રૂકૂઅમાં જાય.

અને પછી ઉભો થાય અને “સમેઅલ્લાહો લેમન

હમેદાહ” કહીને બંને સજદા કરીને પહેલાની જેમ બીજી રક્ષત બજાવી લાવીને તશહહુદ અને સલામ પઢે.

નમાઝે આયાતમાં કુલ દસ રૂકૂઅ છે, પણ બીજા, ચોથા, છઠ્ઠા અને આઠમા રૂકૂઅની પહેલાં કુનૂત પઢે અને દરેક રૂકૂઅ અને સજદામાં ઝિક્ર પઢવો વાજિબ છે.

નોંધ: નમાઝે આયાત સંબંધિત વિગતવાર માહિતિ માટે તવઝીહુલ મસાઈલનો અભ્યાસ કરવો.

જવશને કબીર

“જવશને કબીર” પઢનારને સીતેર હજાર એવા ફરિશ્તાઓ મળશે કે જેઓ ‘બયતુલ માઅમુર’માં આવે છે અને પછી બહાર જાય છે. ફરી કોઈ વાર આવતા નથી. દરરોજ નવા ફરિશ્તા જ આવે છે, અને ક્યામત સુધી આવતા રહેશે અને જેટલા મોઅમીન સ્ત્રી-પુરૂષ પૈદા કર્યો છે અને ક્યામત સુધી જેટલા પૈદા થશે તે સર્વેના સવાબ જેટલો સવાબ મળશે અને મરનારને બદ્રના શહીદોમાંના એક શહીદનો સવાબ મળશે.

જે ઘરમાં આ દુઆ હશે, તે ઘર ચોરી થવાથી અને બળી જવાથી મહફૂઝ રહેશે. આ દુઆ પઢનારની બંને જહાનની હાજતો પુરી થશે. ગમે તેવી બીમારી ઉપર ખાલીસ નિચ્યતથી આ દુઆ પઢવાથી ખુદાના હુકમથી શિફા મળશે, ભલે તે બીમારી કોઢની હોય.

કફન ઉપર આ દુઆ લખાવનાર ઉપર જહન્નમનો અઝાબ કરવાથી ખુદા શરમ કરશે. માહે રમઝાનની પહેલી તારીખે આ દુઆ પઢનારને ખુદાએ તઆલા શબે કદ્રની ફઝીલત અતા કરશે અને સિતેર હજાર ફરિશતાઓ પૈદા કરશે કે તેઓ ખુદાની તરખીહ અને તકદીસ કરે અને તેનો સવાબ આ દુઆ પઢનારને મળે, અને જ્યારે તે કબ્રમાંથી બહાર નીકળશે, ત્યારે તેના માટે સીતેર હજાર ફરિશતા મોકલશે. તે દરેકની સાથે નૂરની એક સાંઢણી હશે. બીજા સીતેર હજાર ફરીશતા આવશે. તે દરેકના હાથમાં મોતીનો એક જામ હશે. તેમાં બેહિશ્તનો શરાબ ભર્યો હશે અને તે દરેક જામ ઉપર **“લા એલાહ ઇલ્લલ્લાહ વહદહુ લા શરીક લહુ”** લખ્યું હશે અને એ પણ લખ્યું

હશે કે આ હદિયો ખુદાએ તઆલા તરફથી ફલાણા બીન ફલાણા માટે છે.

માહે રમઝાનમાં આ દુઆ પઢનાર ઉપર જહન્નમની આગ હરામ થાય અને રસૂલે ખુદા (સ.અ.વ.)ને હુકમ થયો કે “અય મોહમ્મદ (સ.અ.વ.)! આ દુઆ મોઅમીન પરહેઝગાર સિવાય બીજાને તઅલીમ કરવી નહીં.”

ઇમામે હુસૈન (અ.સ.) ફરમાવે મરવી છે: મારા વાલીદ અલી ઈબ્ને અબીતાલીબ (અ.સ.)એ મને વસીયત કરી છે કે “આ દુઆને સાચવો, તેની તાઅઝીમ કરો, મારા કફન ઉપર લખજો અને લોકોને તાઅલીમ કરો.”

આ દુઆમાં ખુદાના એક હજાર એક (૧૦૦૧) ઈસ્મ (નામ) છે અને તેમાં ‘ઇસ્મે ઓઝમ’ છે. આની અંદર ૧૦૦ ફસ્લ છે, દરેક ફસ્લમાં ખુદાના દસ-દસ નામ છે. પંચાવનમી ફસલમાં ૧૧ નામ છે. દરેક ફસ્લ પુરી થયા પછી, પહેલી ફસ્લ પુરી થયા પછી જે દુઆ લખી છે તે **“સુબ્હાનક યા લા એલાહ ઇલ્લા અન્તલ ગવ્સલ ગવ્સ, ખલ્લીસના મેનન્નારે યા રબ”** પઢવી

જોઈએ.

અમુક કિતાબમાં ખુદાના નામ આગળ પાછળ છે. કોઈ સ્થળે કંઈક ફરક છે. અસલ કિતાબોમાં પણ તે પ્રમાણે જ છે, માટે ભૂલ ન સમજવી. આ “જવશને કબીર” ઇરાનમાં છપાયેલ મોઅતબર કિતાબ સાથે મેળવીને બરાબર સહીહ છાપેલ છે.

દરેક ફસ્લની ઉપર ખાસીયત લખી છે. તે “મફ્તીહુલ જિનાન” વગેરે કિતાબોમાં પણ છે, પણ કેટલી વખત પઢવી તે લખેલ નથી. તેથી મતલબ પૂરો થાય ત્યાં સુધી પઢ્યા કરવી.

લિ. મ. અલ્લામા અલ્હાજ ગુલામેઅલી હાજી ઇસ્માઇલ અ.મ.

બિસ્મિલ્લાહિરે રહ્માનિરે રહીમ

રહમાન અને રહીમ અલ્લાહના નામથી શરૂ કરું છું.

(૧) ગમ દૂર થવા માટે પઢે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મોક

या अल्लाहो या रहुँमानो या रहुँमो या
करीमो या मोक़ीमो या अँज़ीमो या कुँदीमो
या अँलीमो या हुँलीमो या हुँकीम

जुदावंदा जरेजर हुं सवाल करुं छुं तारी पासै
तारा नाम साथै अय अल्लाह अय जक्षनार, अय
दया करनार, अय महेरजानी करनार, अय
कायम करनार, अय महान, अय हंमेशाथी
रहेनार, अय ज्ञानी, अय सहनशील, अय हकीम,

सुब्हानक या लाअेलाहु ईल्ला अन्तलै
गँव्सँल गँव्सँ जँदिलेइंना मेनन्नारे या रज.

पाक छो तुं जीजे कोष जुदा नथी पण तुंज छो
इरियादे पहोंयनार इरियादे पहोंयनारनो, मुक्त
कर अमोने आगथी अय रज.

(आ वाक्य दरेक इस्ल पछी पढवुं.)

(૨) મદદ મળવા માટે પઢે

યા સચ્ચેદસં સાદાતે યા મોજીબદઅંવાતે
યા રાફેઅં દૂરજાતે યા વલિચ્ચલે હંસનાતે
યા ગાંફેરલે ખંતીંઆતે યા મોઅંતેંયલે
મસ્અલાતે યા કાંબેલતે તવેબાતે યા સામેઅંલે
અસ્વાતે યા આંલેમલે ખંફિચ્ચાતે યા દાફેઅંલે
બલિચ્ચાત

અય સરદારોના સરદાર, અય કબૂલ કરનાર
દુઆઓના, અય બુલંદ કરનાર દરબજાના, અય
માલિક નેકીઓના, અય માફ કરનાર ગુનાહોના,
અય આપનાર માંગનારને, અય કબૂલ કરનાર
તવબાના, અય સાંભળનાર અવાજોના, અય
જાણનાર છુપી વાતોના, અય દફે કરનાર

બલાઓના.

(૩) ઇચ્છત મળવા માટે પટે

યા ખંચેરલે ગાંકેરીન યા ખંચેરલે
ફાતેહીન યા ખંચેરન્નાસેરીન યા ખંચેરલે
હાંકેમીન યા ખંચેરરે રાઝેકીન યા ખંચેરલે
વારેસીન યા ખંચેરલે હાંમેદીન યા ખંચેર
ઝાંકેરીન યા ખંચેરલે મુન્ઝેલીન યા ખંચેરલે
મોહંસેનીન.

અય બક્ષનારાઓમાં ઉત્તમ, અય ફતેહ
કરનારાઓમાં ઉત્તમ, અય મદદ કરનારાઓમાં
ઉત્તમ, અય હુકમ કરનારાઓમાં ઉત્તમ, અય રોઝી
આપનારઓમાં ઉત્તમ, અય વારેસોમાં ઉત્તમ, અય
વખાણ કરનારાઓમાં ઉત્તમ, અય ઝિફ

કરનારાઓમાં ઉત્તમ, અય નાઝિલ કરનારાઓમાં
ઉત્તમ, અય એહસાન કરનારાઓમાં ઉત્તમ.

(૪) બુઝુર્ગી મળવા માટે પઢે

યા મલે લહુલે ઈંઝેઝતો વલ્જમાલો યા
મલે લહુલે કુંદેરતો વલે કમાલો યા મલે
લહુલે મુલ્કો વલે જલાલો યા મને હોવલે
કબીરુલે મોતઅંલે યા મુન્શેઅસે સહાંબિસે
સેકાંલે યા મને હોવ શદીદુલે મેહાંલે યા
મને હોવ સરીઉલે હૈસાબે યા મને હોવ
શદીદુલે એકાંબે યા મને ઈંન્દહૂ હુંસ્નુસ્સંવાબે
યા મને ઈંન્દહૂ ઉમ્મુલે કિતાબ

અય એ કે તારી માટે ઇઝઝત અને નેકી (ખુબસુરતી)

છે, અય એ કે વાસ્તે તારી છે કુદરત અને કમાલ, અય એ કે વાસ્તે તારી છે મૂલ્ક અને બુઝુર્ગી, અય એ કે તું બુઝુર્ગ (અને) મોટા મરતબાવાળો છે, અય પેદા કરનાર ભારે વાદળના, અય એ કે જે સર્વેથી બહુ જ તાકતવાળો છે. અય એ કે જે ઝડપથી હિસાબ લેનાર છે. અય એ કે જે સખ્ત અઝાબ કરનાર છે, અય એ કે જેની પાસે ઉમદામાં ઉમદા સવાબ છે. અય એ કે જેની પાસે ઉમ્મુલ (અસલ) કિતાબ છે.

(૫) કુવ્વત માટે પટે

અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બિસ્મોક
 યા હૈન્નાનો યા મન્નાનો યા દય્યાનો યા
 બુરહાનો યા સુલ્તાનો યા રિઝ્વાનો યા
 ગુંફરાનો યા સુબ્હાનો યા મુસ્તઝાનો યા

ઝંલે મન્ને વલે બયાન

અય અલ્લાહ! બેશક હું સવાલ કરું છું તારી પાસે તારા નામ સાથે, અય મહેરબાન, અય એહસાન કરનાર, અય બદલો આપનાર, અય સ્પષ્ટ દલીલ, અય બાદશાહ, અય ખુશ કરનાર, અય બક્ષનાર, અય પાક, અય સહાયક, અય નેઅમત અને બયાનના સાહેબ.

(૬) બલાઓ દૂર થવા માટે પઢે

યા મનૈ તવાઝંઝં કુલ્લો શયૈઈલૈ
લેઝંઝંમતેહી યા મનિસૈ તસ્લમ કુલ્લો શયૈઈલૈ
લેકુંદૈરતેહી યા મનૈ ઝંલ્લ કુલ્લો શયૈઈલૈ લે
ઈઝંઝંતેહી યા મનૈ ખંઝંઝં કુલ્લો શયૈઈલૈ
લેહયૈબતેહી યા મનિનૈ કૌદ કુલ્લો શયૈઈમૈ

મિનં બંશ્યતેહી યા મનં તશકંકંકંતિલં જેબાલો
 મિમં મખાંફતેહી યા મનં કાંમતિસં સમાવાતો
 બેઅમ્રેહી યા મનિસં તકંરંતિલ અરંઝુન
 બેઈઝંનેહી યા મંયં યોસબ્બેહુંરંરંઅંદો બેહુંમ્દેહી
 યા મલં લા યઅંતદી અંલો અહલે મમ્લકતેહું

અય એ કે સત્તા છે તમામ ચીઝ ઉપર તારી
 બુઝુર્ગાના સબબથી, અય એ કે સલામતી આપે છે
 દરેક પોતાની કુદરતથી, અય એ કે તુચ્છ છે
 દરેક ચીઝ તારી બુઝુર્ગાના કારણે, અય એ કે
 નમ્રતા કરે છે દરેક ચીઝ તારી હયબતથી, અય
 એ કે તાબે છે દરેક ચીઝ તારી હયબતથી, અય
 એ કે ફાટી જાય છે પહાડ તારા ખૌફથી, અય એ
 કે કાયમ છે આસમાનો તારા હુકમથી, અય એ કે
 સ્થિર છે જમીનો તારા હુકમથી, અય એ કે તરબીહ
 કરે છે રઅદ (ફરિશ્તો) તારી તારીફથી, અય એ

કે (જે) નથી મુલ્મ કરતો પોતાના બંદાઓ ઉપર.

(૭) ગમ દૂર થવા માટે પટે

યા ગાંફેરલે ખંતીયા યા કાશેફલે બલાયા
યા મુન્તહરે રજાયા યા મુજેલેલે અંતીયા
યા વાહેબલે હદાયા યા રાઝેકેલે બરાયા
યા કાંઝેયલે મનાયા યા સામેઅંશકાયા
યા બાએસંલે બરાયા યા મુત્લેકેલે ઓસારા

અય માફ કરનાર ખતાના, અય દૂર કરનાર
બલાના, અય થડ ઉમ્મીદોના, અય પુરી કરનાર
બક્ષીશોના, અય બક્ષવાવાળા નેઅમતોના, અય રોઝી
આપનાર ખલકતના, અય હુકમ કરનાર લોકોમાં,
અય સાંભળનાર શીકાયતોના, અય જીવતા કરનાર
ખલાએકના, અય મુક્ત કરનાર કેદીઓના.

(૮) માન મેળવવા માટે પઢે

યા ઝંલે હુંમ્દે વસંસનાએ યા ઝંલે ફખરે
વલે બહાએ યા ઝંલે મજદે વસસનાએ યા
ઝંલે અંહુદે વલે વફાએ યા ઝંલે અંફેવે વરે
રેઝાએ યા ઝંલે મન્ને વલે અંતાએ યા ઝંલે
ફસેલે વલે કંઝાએ યા ઝંલે ઈંઝે વલેબકાએ
યા ઝંલે જૂદે વસસખાએ યા ઝંલે આલાએ
વન્નઅંમાએ

અય સાહેબ વખાણ અને તારીફના, અય
સાહેબ ફખર અને બુઝુર્ગીના, અય સાહેબ
બુઝુર્ગી અને ઊંચાઈના, અય સાહેબ વચન અને
વફાના, અય સાહેબ ક્ષમા અને રઝામંદીના,
અય સાહેબ એહસાન અને બક્ષીશના, અય

સાહેબ ન્યાય અને હુકમના, અય સાહેબ ઇઝઝત અને હુકમના, અય સાહેબ બક્ષીશ અને સખાવતના, અય સાહેબ નેઅમતના.

(૯) બરકત થવા માટે પટે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મેક
યા માનેઓં યા દાફેઓં યા રાફેઓં યા
સૌનેઓં યા નાફેઓં યા સામેઓં યા જામેઓં
યા શાફેઓં યા વાસેઓં યા મૂસેઓં

અય અલ્લાહ! ખરેખર હું સવાલ કરું છું તારી પાસે તારા નામ સાથે અય (આફતોને) રોકનાર, અય દફે કરનાર, અય બુલંદ કરનાર, અય બનાવનાર, અય નફો આપનાર, અય સાંભળનાર, અય ભેગા કરનાર, અય શફાઅત કરનાર, અય બહોળી બક્ષીશ કરનાર, અય

બહોળી નેઅમત કરનાર.

(૧૦) ઇમાન સલામત રહેવા માટે

યા સાંનેઅં કુલ્લે મરૈનૂઈયે યા ખાલેક
કુલ્લે મખ્લૂકિયે યા રાઝેકે કુલ્લે મરૈઝૂકિયે
યા માલેક કુલ્લે મમ્લૂકિયે યા કાશેફ કુલ્લે
મકરૂબિયે યા ફારેજ કુલ્લે મહૂમૂમિયે
યા રાહૂમ કુલ્લે મરહૂમિયે યા નાસૈર
કુલ્લે મખ્મૂલિયે યા સાતેર કુલ્લે મઅ્યૂબિયે
યા મલૈજાઅ કુલ્લે મતૈરૂદ

અય બનાવનાર દરેક બનેલી ચીઝના, અય
પેદા કરનાર દરેક પેદા થયેલાના, અય રોઝી
આપનાર દરેક રોઝી ખાનારના, અય માલિક

દરેક બંદાના, અય દફે કરનાર દરેક સપ્તીના,
 અય ખુશ કરનાર દરેક ગમગીનને, અય રહેમત
 કરનાર દરેક રહેમતના લાયક પર, અય
 મદદગાર દરેક ઝલીલના, અય ઢાંકનાર દરેક
 અયબના, અય પનાહની જગ્યા દરેક કાઠી
 મુકેલાના.

(૧૧) નસીબ સારા થવા માટે પટે

યા ઉદ્દતી ઈન્દ શિદતી યા રજાઈ ઈન્દ
 મોસીબતી યા મૂનેસી ઈન્દ વહુશતી યા
 સૌહીબી ઈન્દ ગુરુબતી યા વલિયી ઈન્દ
 નેઅંમતી યા ગૈયાસી ઈન્દ કુરુબતી યા
 દલીલી ઈન્દ હુયરતી યા ગૈનાઈ
 ઈન્દ ફતેકૌરી યા મલજઈ ઈન્દ ઝતૌરારી

યા મોઈની ઈન્દ મફ્ઝઈ

અય મારા આધાર સપ્તીમાં, અય મારી ઉમ્મદની
જગ્યા મારી મુસીબતમાં, અય મારા મુનીસ
એકલતામાં, અય મારા સથવારા મારી મુસાફરીમાં,
અય મારા દોસ્ત મારી નેઅમતમાં, અય મારી
ફરીયાદે પહોંચનાર મારી સપ્તીમાં, અય મારા
રહેનુમા મારી હયરાનીમાં, અય મારી તવંગરી
મારી ફકીરીમાં, અય મારી પનાહની જગ્યા મારા
ગભરાટમાં, અય મારા મદદગાર મારી બીકમાં.

(૧૨) દવલત બાકી રહેવા માટે પટે

યા અંલ્લામલે ગૌયૂબે યા ગૌંફૌરઝં
ઝૌનૂબે યા સત્તારલે ઝૌયૂબે યા કાશેફલે
કોરૂબે યા મોકલ્લેબલે કૌલૂબે યા તંબીબલે
કૌલૂબે યા મોનવ્વેરલે કૌલૂબે યા અનીસલે

કૌલૂબે યા મોફરૈજલે હોમૂમે યા
મોનફેસલે ગૌમૂમે

અય જાણનાર છુપી બાબતોના, અય માફ
કરનાર ગુનાહોના, અય ટાંકનાર અયબના,
અય ગમગીની દફે કરનાર, અય ફેરવવાવાળા
દિલોના, અય દવા કરનાર દિલોના, અય નૂરાની
કરનાર દિલોના, અય અનીસ દિલોના, અય
દૂર કરનાર રંજના, અય દુર કરનાર ગમના.

(૧૩) રાજ્ય મળવા માટે પટે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બે ઈસ્મેક
યા જલીલો યા જમીલો યા વકીલો યા
કફીલો યા દલીલો યા કુંબીલો યા મોદીલો
યા મોનીલો યા મોકીલો યા મોહીલ

અય અલ્લાહ ખરેખર હું સવાલ કરું છું તારી પાસે તારા નામ સાથે અય બુઝુર્ગવાર, અય નેકોકાર, અય રક્ષણ કરનાર, અય સરપરસ્ત કરનાર, અય રસ્તો બતાવનાર, અય કબૂલ કરનાર, અય ફેરવનાર, અય બક્ષનાર, અય માફ કરનાર, અય જગ્યા ફેરવનાર.

(૧૪) નેઅમત વધારે મેળવવા માટે પઢે

યા દલિલલે મોતહુંયોરીન યા
 ગોંયાસંલે મુસ્તગીંસીન યા સંરીખંલે
 મુસ્તસંરેખીંન યા જારલે મુસ્તજીરીન યા
 અમાનલે ખાંએફીન યા અંવેનલે
 મોઅંમેનીન યા રાહુમલે મસાકીન યા
 મલજઅલે આંસીંન યા ગોંફેરલે મુઝંનેબીન

યા મોજીબ દઝવતિલે મુઝતૈરેરીન

અય રસ્તો ખતાવનાર ભટકેલાને, અય દાદ આપનાર દાદ માંગનારને, અય ફરિયાદે પહોંચનાર ફરિયાદ કરનારના, અય મદદ કરનાર મદદ માંગનારને, અય અમાન આપનાર ડરવાવાળાને, અય મદદગાર મોઅમીનોના, અય રહેમ કરનાર મિસ્કીનોના, અય પનાહની જગ્યા ગુનેહગારોના, અય બક્ષનાર ગુનેહગારોના, અય કબૂલ કરનાર દુઆના ગભરાયેલાઓની.

(૧૫) મુશ્કિલો દૂર થવા માટે પઢે

યા ઝંલેજૂદે વલે એહુસાને યા ઝંલે ફઝીલે વલે ઇમ્તેનાને, યા ઝંલે અમ્ને વલે અમાને યા ઝંલેકુંદેસે વસ્સુબુહાને યા ઝંલે

હિંકમતે વલ્લ બયાને યા ઝંરે રહ્મતે
વરરિઝવાને યા ઝંલે હુજ્જતે વલ્લ બુરહાને
યા ઝંલે અંઝમતે વસ્સુલ્તાને યા ઝંરે રઅફતે
વલ્લ મુસ્તઅાનો યા ઝંલેઅંફવે વલ્લ ગુંફરાન.

અય સાહેબ બક્ષિશ અને એહસાનના, અય સાહેબ ફઝલ અને નેઅમત આપવાના, અય સાહેબ અમન અને અમાનના, અય સાહેબ પાક અને પાકીઝગીના, અય સાહેબ હીકમત અને બયાનના, અય સાહેબ રહેમત અને ખુશનુદીના, અય સાહેબ હુબ્બત અને દલીલના, અય સાહેબ બુઝુર્ગી અને બાદશાહીના અય સાહેબ રહેમત અને મદદના, અય સાહેબ માફ કરવાના અને બક્ષવાના.

(૧૬) હાજતો પુરી થવા માટે પટે

યા મન હોવ રબ્બો કુલ્લે શયેઈયે યા
મન હોવ એલાહો કુલ્લે શયેઈયે યા મન
હોવ ખાલેકૌ કુલ્લે શયેઈયે યા મન હોવ
સાનેઆ કુલ્લે શયેઈયે યા મન હોવ કબ્લ
કુલ્લે શયેઈન યા મન હોવ બઅંદ કુલ્લે
શયેઈયે યા મન હોવ ફક્કે કુલ્લે શયેઈયે
યા મન હોવ આલેમુમ્ બેકુલ્લે શયેઈયે યા
મન હોવ કોદેરુન અંલા કુલ્લે શયેઈયે યા
મન હોવ યબ્કૌ વ યફના કુલ્લો શય્અ.

અય એ કે રબ દરેક ચીજનો છે. અય એ કે

ખુદા દરેક ચીજનો છે, અય એ કે પૈદા કરનાર
 દરેક ચીજનો છે, અય એ કે બનાવનાર દરેક
 ચીજનો છે, અય એ કે આગળ સર્વે ચીજની છે,
 અય એ કે પાછળ સર્વે ચીજથી છે, અય એ કે
 બરતર સર્વે ચીજની છે, અય એ કે જાણનાર દરેક
 ચીજનો છે, અય એ કે દરેક ચીજ પર કુદરત
 ધરાવનાર છે અય એ કે તે જ બાકી છે ફના
 થનાર છે દરેક ચીજ.

(૧૭) બરકત થવા માટે પઢે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મોક
 યા મોઅમેનો યા મોહયમેનો યા મોકવ્વેનો
 યા મોલકકેનો યા મોબય્યેનો યા મોહવ્વેનો
 યા મોમકકેનો યા મોઝય્યેનો યા મોઅલેનો
 યા મોકસ્સેમ.

ખુદાવંદા ખરેખર હું સવાલ કરું છું તારી પાસે તારા નામ સાથે અય અમાન આપનાર, અય રક્ષક, અય પેદા કરનાર, અય ઈલ્મ આપનાર, અય જાહેર કરનાર, અય આસાન કરનાર, અય જગ્યા આપનાર, અય શોભા આપનાર, અય જાહેર કરનાર, અય વહેંચનાર.

(૧૮) કામો આસાન થવા માટે પઢે

યા મન હોવ ફી મુલ્કેહી મોકીમુંયે યા
મન હોવ ફી સુલ્તાનેહી કંદીમુંયે યા મન
હોવ ફી જલાલેહી અંઝીમુંયે યા મન હોવ
અંલા અંબાદેહી રહીમુંયે યા મન હોવ
બેકુલ્લે શયેઈને અંલીમુંયે યા મન હોવ
બેમને અંસાહો હંલીમુંયે યા મન હોવ બેમરે

રજાહો કરીમુંયે યા મનં હોવ ફીસું-ઝેહી
હુંકીમુંયે યા મનં હોવ ફી હિંકેમતેહી લતીંકુંયે
યા મનં હોવ ફી લુત્તેહી કંદીમ

અય એ કે જે પોતાના મુલ્કમાં ઠહેરનાર છે,
અય એ કે જે પોતાની બાદશાહીમાં કદીમ છે,
અય એ કે જે પોતાની બુઝુર્ગીમાં મોટો છે. અય
એ કે જે પોતાના બંદા ઉપર રહીમ છે, અય એ કે
જે દરેક ચીજને જાણનાર છે, અય એ કે જે
ગુનેહગારો સાથે ધીરજવાન છે. અય એ કે જે
ઉમેદવારો ઉપર કરમ કરનાર છે, અય એ કે જે
પોતાની કારીગરીમાં હકીમ છે, અય એ કે જે
પોતાની હીકમતમાં લુલ્હ કરનાર છે, અય એ કે
જે લુલ્હ હંમેશાથી છે.

(૧૯) ગમ દૂર થવા માટે પટે

યા મલે લા યુરેજા ઇલ્લા ફૌલોહૂ યા
મલે લા યુસ્અલો ઇલ્લા અંફૌવોહૂ યા મલ્લા
યુન્ઝૌરો ઇલ્લા બિરોહૂ યા મલે લા યોખૌફો
ઇલ્લા અંદૌલોહૂ યા મલે લા યદૂમો ઇલ્લા
મુલ્કોહુ યા મલે લા સુલ્તૌન ઇલ્લા સુલ્તૌનોહૂ
યા મને વસેઅંતે કુલ્લ શયેઇરે રહૂમતોહૂ
યા મને સબકૌતે રહૂમતોહૂ ગૌઝૌબહૂ યા
મને અહૌતે બેકુલ્લે શયેઇને ઇલ્મોહૂ યા
મલે લયેસ અહૂંદુને મિસ્લહૂ.

અય એ કે ઉમ્મીદ કરવામાં નથી આવતી
 પણ તેના ફળલથી, અય એ કે સવાલ નથી
 કરવામાં આવતો પણ તેની માફીનો, અય એ
 કે જોવાતી નથી પણ તેની ભલાઈ, અય એ કે
 નથી ડરવાનું પણ તેના અદલથી, અય એ કે
 નથી પરંપરા પણ તેની બાદશાહી, અય એ કે
 નથી બાદશાહી પણ તેની જ બાદશાહી, અય
 એ કે બોહળી છે દરેક ચીજ માટે તેની રહેમત,
 અય એ કે વધે છે રહેમત તેના ગળબ ઉપર,
 અય એ કે ઘેરી લીધેલ છે દરેક ચીજને તેના
 ઇલ્મે, અય એ કે નથી કોઈ તેની સમાન.

(૨૦) સપ્તી દૂર થવા માટે પટે

યા ફારેજલે હમ્મે યા કાશેફલે ગમ્મે યા
 ગાંફેરઝં ઝંબે યા કાંબેલત્તવબે યા ખાંલેકંલે
 ખાંલકે યા સાંદેકંલે વઅંદે યા મૂફેયલે અંહુદે

યા ઑંલેમસં સિરે યા ફાલેકુંલે હુંબ્બે યા
રાઝેકુંલે અનામ.

અય ટાળવાવાળા ગમના, અય દુર કરનાર
ગમના, અય માફ કરનાર ગુનાહના, અય કબૂલ
કરનાર તૌબાના, અય પેદા કરનાર ખલ્કના,
અય સાચા વાચદાના, અય વફા કરનાર અહદના,
અય જાણનાર ભેદના, અય કાઢનાર દાણાના,
અય રોઝી આપનાર લોકોના.

(૨૧) ગુનાહ માફ થવા માટે પટે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મોક
યા ઑંલિય્યો યા વફિય્યો યા ગંનિય્યો યા
મલિય્યો યા હુંફિય્યો યા રઝિંય્યો યા ઝકિય્યો
યા બદિય્યો યા કુંવિય્યો યા વલિય્યો.

ખુદાવંદા ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા નામ સાથે, અય બલંદ, અય વફા કરનાર, અય ગની, અય મેહરબાન, અય છુપી બાબતોના જાણકાર, અય પસંદીદાહ, અય પેદા કરનાર, અય હંમેશા રહેનાર, અય જબરદસ્ત, અય દોસ્ત.

(૨૨) તોફાન દૂર થવા માટે પઢે

યા મન અઝ્ઝહરલ જમીલ યા મન સતરલ કુંબીહું યા મલ લમ યોઆબિઝ્ઝ બિલ જરીરતે યા મલ લમ યહતેકિસ સિતર યા અઝ્ઝીમલ અંફેવે યા હુંસનતજાવોઝે યા વાસેઅંલ મગંફેરતે યા બાસેતંલ યદયને બિરેરહુંમતે યા સૌહુંબ કુલ્લે નજવા યા મુન્તહા કુલ્લે શકવા.

અય જાહેર કરનાર ખુબીના, અય છુપાવનાર
 ખૂરાઈના, અય તે કે જે નથી બદલો લેતો ગુનાહનો,
 અય એ કે નથી ફાડતો (ખંદાનો) પરદો, અય
 બહુજ માફ કરનાર, અય ઉત્તમ ક્ષમા કરનાર,
 અય બોહળી બક્ષીશવાળા, અય ખોલનાર ખંને
 હાથના રહેમત વડે, અય સાહેબ દરેક ભેદના,
 અય અંત દરેક શિકાયતના.

(૨૩) રોઝીમાં વધારો થવા માટે પટે

યા ઝંનેઝંમતિસં સાબેગંતે યા ઝંરે
 રહંમતિલે વાસેઝંતે યા ઝંલે મિન્નતિસં
 સાબેકંતે યા ઝંલે હિંકેમતિલે બાલેગંતે યા
 ઝંલે કુંદેરતિલે કામેલતે યા ઝંલે હુંજૂતિલે
 કાંતેઝંતે યા ઝંલે કરામતિઝંઝાહેરતે યા

ઝંલે ઈઝંતિ દ્વએમતે યા ઝંલે કુંવ્વતિલે
મતીનતે યા ઝંલે ઐઝંમતિલે મનીઐહં.

અય સાહેબ બેશુમાર નેઅમતોના, અય વિશાળ
સાહેબ રહેમતના, અય સાહેબ એહસાન
પહેલાના, અય સાહેબ હિકમત કામીલના, અય
સાહેબ કુદરતે કામીલના, અય સાહેબ હુબજતે
મજબુતના, અય સાહેબ કરામતે ઝાહેરના, અય
સાહેબ હંમેશાની ઇઝ્ઝતના, અય સાહેબ મજબુત
કુવ્વતના, અય સાહેબ બુઝુર્ગી અને બુલંદીના.

(૨૪) બલાઓ દૂર થવા માટે પઢે

યા બદીઐસ્સમાવાતે યા
જાઐલઝંઝોલોમાતે યા રાહઐમલે ઐબરાતે
યા મોકીલલે ઐસંરાતે યા સાતેરલે ઐવેરાતે

યા મોહૈયેયલ અમ્વાતે યા મુન્નેલલ આયાતે
યા મોઝંઝંઝેફલ હંસનાતે યા માહૈયસ
સય્યેઆતે યા શદીદનં નકૈમાત

અય પેદા કરનાર આસમાનોના, અય પૈદા
કરનાર અંધારાના, અય રહેમ કરનાર આંસુ
પર (રડનાર પર), અય દરગુજર કરનાર ભૂલના,
અય અયબોના છુપાવનાર, અય મુરદાના સજીવન
કરનાર, અય નાઝિલ કરનાર નિશાનીઓના,
અય વધારે કરનાર નેકીયોના, અય ગુનાહોને
ભૂસી નાખનાર, અય સખત બદલો લેનાર.

(૨૫) ખુદા રાજી થાય તે માટે પટે

અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બિસ્મોક
યા મોસૈવ્વેરો યા મોકૈદેરો યા મોદબ્બેરો

યા મોતૃહૃરો યા મોનવ્વેરો યા મોયસ્સેરો
યા મોબશ્શેરો યા મુનેઝેરો યા મોકુંદેમો
યા મોઅબ્બૈર.

ખુદાવંદા ખરેખર હું સવાલ કરું છું તારી પાસે
તારા નામ સાથે, અય સુરત બનાવનાર, અય
નિમણૂક કરનાર, અય તદબીર કરનાર, અય
પાકીઝા, અય રવશન કરનાર, અય આસાન
કરનાર, અય બશારત દેનાર, અય ડરાવનાર,
અય પહેલ કરનાર, અય ઢીલ કરનાર.

(૨૬) લોકોમાં માનવંત થવા માટે પઢે

યા રબ્બલે બયતિલેહુંરામે યા
રબ્બશ્શહૃરિલે હુંરામે યા રબ્બલે બલદિલે
હુંરામે યા રબ્બરૂકને વલ્મકાંમે યા રબ્બલે

મશઅંરિલે હુંરામે યા રબ્બલે મસ્જેદિલેહુંરામે
યા રબ્બલે હિંલ્લે વલ્હુંરામે યા રબ્બન્નૂરે
વઝંઝલામે યા રબ્બતે તહિય્યતે વસ્સલામે
યા રબ્બલે કુંદરતે ફિલઅનામ.

અય રબ હુરમતવાળા ઘરના, અય રબ
હુરમતવાળા મહિનાના, અય રબ હુરમતવાળા
શહેરના, અય રબ રૂકન અને મકાનના, અય
રબ હુરમતવાળા મશઅરના, અય રબ
હુરમતવાળી મસ્જિદના, અય રબ હીલ
(એહરામની હદ બહાર)ના અને હરમના, અય
રબ નૂર અને અંધકારના, અય રબ દોરૂદ
અને સલામના, અય કુદરત ધરાવનાર લોકોના
રબ.

(૨૭) બાદશાહો પાસે જતી વખતે પટે

યા અહંકમલે હાંકેમીન યા અઅંદલલે
આંદેલીન યા અસ્દકંસ્સાંદેકીંન યા અત્હરત્તે
તોહેરીન યા અહંસનલે ખાંલેકીંન યા
અસ્રઅંલે હાંસેખીન યા અસ્મઅંસ્સામેઈન
યા અબ્સૈરન્નાઝીરીન યા અશફઅંશશાફેઈન
યા અકરમલે અકરમીન.

અય હુકમ કરનારાઓમાં સર્વોત્તમ હુકમ
કરનાર, અય ઇન્સાફ કરનારાઓમાં સર્વોત્તમ
અદલ કરનાર, અય સાચું બોલનારાઓમાં સર્વોત્તમ
સાચું બોલનાર, અય પાકમાં સર્વોત્તમ પાક, અય
પેદા કરનારાઓમાં સર્વોત્તમ પેદા કરનાર, અય
હિસાબ લેનારાઓમાં બહુજ જલ્દી હિસાબ લેનાર,

અય સાંભળનારાઓમાં વધારે સાંભળનાર, અય જોનારાઓમાં સર્વોત્તમ જોનાર, અય શફાઅત કબૂલ કરનારાઓમાં સર્વોત્તમ શફાઅત કબૂલ કરનાર, અય મહેરબાની કરનારાઓમાં વધુ મહેરબાની કરનાર.

(૨૮) તીર ફેંકવા કમાન ખેંચતી વખતે પટે

યા ઐમાદ મલે લા ઐમાદ લહૂ યા
 સનદ મલે લા સનદ લહૂ યા ઝુંબેર મલે
 લા ઝુંબેર લહૂ યા હિઝ્મ મલે લા હિઝ્મ લહૂ
 યા ગૈયાસં મલે લા ગૈયાસં લહૂ યા ફખેર
 મલે લા ફખેર લહૂ યા ઈઝ્મ મલે લા ઈઝ્મ
 લહૂ યા મોઈન મલે લા મોઈન લહૂ યા
 અનીસ મને લા અનીસ લહૂ યા અમાન

મન લા અમાન લઈ.

અય અશક્તોને શક્તિ આપનાર, અય એના આધાર કે જેનો આધાર ન હોય, અય એના રક્ષક કે જેનો રક્ષક નથી, અય એની પનાહની જગ્યા જેને પનાહની જગ્યા નથી, અય એની ફરિયાદે પહોંચનાર જેને ફરિયાદે પહોંચનાર નથી, અય એની બુઝુર્ગી કે જેને બુઝુર્ગી નથી, અય એની ઇઝઝત કે જેની ઇઝઝત નથી, અય સહાય કે જેને સહાયક નથી, અય મુનીસ એના કે જેને મુનીસ નથી, અય રક્ષણ એના કે જેને રક્ષણ નથી.

(૨૯) તીર ફેંકતી વખતે પટે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મોક
યા ઔસેમો યા કૌએમો યા દૌએમો યા

રાહૈમો યા સાલેમો યા હાંકેમો યા ઔલેમો
યા કૌસેમો યા કૌબેઝૌ યા બાસેતૌ.

ખુદાવંદા ખરેખર હું તારી પાસે સવાલ કરું છું
તારા નામ સાથે, અય હિફાઝતમાં રાખનાર, અય
કાએમ, અય દાએમ, અય રહીમ, અય સલામતી,
અય હાકીમ, અય આલિમ, અય વહેંચનાર, અય
પકડનાર, અય ખોલનાર.

(30) જંગ કરતી વખતે પઢે

યા ઔસૈમ મનિસૈ તઅૈસૈમહૂ યા રાહૈમ
મનિસૈ તરૈહૈમહૂ યા ગૌફૈર મનિસૈ તૌફૈરહૂ
યા નાસૈર મનિસૈ તન્સૈરહૂ યા હૌફૈઝૌ મનિસૈ
તહૈફૈઝૌહૂ યા મુકૈરેમ મનિસૈ તકૈરમહૂ યા

મુરશોદ મનિસં તરશદહૂ યા સંરીખં મનિસં
તસંરખંહૂ યા મોઈંન મનિસં તઓંનહૂ યા
મોગીંસં મનિસં તગોંસંહૂ.

અય રક્ષણ ઇચ્છનારને રક્ષણ આપનાર, અય
રહેમત ચાહનાર પર રહેમ કરનાર, અય ક્ષમાના
ચાયકને ક્ષમા આપનાર, અય સહાય માંગનારની
સહાય કરનાર, અય હિફાઝત ઇચ્છનારની
હિફાઝત કરનાર, અય મહેરબાની માંગનાર પર
મહેરબાની કરનાર, અય હિદાયત માંગનારની
હિદાયત કરનાર, અય દાદ માંગનારને દાદ
આપનાર, અય મદદ ચાહનારની મદદ કરનાર,
અય ફરિયાદ કરનારની ફરિયાદે પહોંચનાર.

(૩૧) માનવંત થવા માટે પટે
યા અંઝીઝલે લા યોઝાંમો યા લતીંફલે

લા યોરામો યા કુંચ્યુમલ્ લા યનામો યા
 દાએમલ્ લા યફૂતો યા હુંચ્યલ્ લા યમૂતો
 યા મલેકલ્ લા યઝૂલો યા બાર્કેયલ્ લા
 યફેના યા ઑલેમલ્ લા યજેહલો યા સંમદલ્
 લા યુત્તંઓમો યા કુંવિચ્યનં લા યઝંઓફે.

અય એ ઝખરદસ્ત કે જે ઝુલ્મ નથી કરતો,
 અય એ લતીફ કે તેની કુનેહ કોઈ જાણતું નથી,
 અય એવા કાયમ કે સુતો નથી, અય એવા દાયમ
 કે જેને ફના નથી, અય જીવંત કે જેને મોત નથી.
 અય બાદશાહ કે જેની બાદશાહી જનાર નથી.
 અય એ બાકી કે જેને ફના નથી, અય એ આલિમ
 કે જે જાહિલ નથી. અય બેનિયાઝ કે જે ખાતો
 નથી. અય શક્તિશાળી કે જે અશક્ત થતો નથી.

(૩૨) નિર્ભય થવા માટે પઢે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મેક
યા અહંદો યા વાહંદો યા શાહેદો યા માજેદો
યા હાંમેદો યા રાશેદો યા બાઅેસો યા
વારેસો યા ઝાેરો યા નાફેઅે.

ખુદાવંદા ખરેખર હું સવાલ કરું છું તારી પાસે
તારા નામ સાથે, અય એકજ, અય એકતા, અય
હાજુર, અય મહાન, અય વખાણને પાત્ર, અય
રહનુમા, અય ઉઠાડનાર, અય વારિસ, અય
નૂકસાન કરનાર, અય નફો આપનાર. (અય
નફા તથા નુકશાનના માલિક)

(33) पोताना पऽछायाथी ऽरतो होय तो
पढे

या अअँळंम भिनं कुल्ले अँळींभियं या
अकँरम भिनं कुल्ले करीभियं या अरँळंम
भिनं कुल्ले रळींभियं या अअँलम भिनं
कुल्ले अँलीभियं या अळँकम भिनं कुल्ले
ळँकीभियं या अकँदम भिनं कुल्ले कँदीभियं
या अकँभर भिनं कुल्ले कभीरियं या अस्तँङ्ग
भिनं कुल्ले लतींङ्गियं या अजल्ल भिनं कुल्ले
जलीलियं या अअँळंळ भिनं कुल्ले अँळीळ

अथ सर्वे षुशुर्गोमां वधारे षुशुर्ग, अथ
महेरजानी करनाराओमां सर्वथी वधारे

મહેરબાની કરનાર, અય રહેમ કરનારાઓમાં
 સર્વથી વધારે રહેમ કરનાર, અય
 જાણનારાઓમાં સર્વથી વધારે જાણનાર, અય
 હુકમ કરવાવાળાઓમાં ઉત્તમ હુકમ કરનાર,
 અય કદીમોમાં સર્વથી કદીમ, અય મોટાઓમાં
 સર્વથી વધારે મોટા, અય પાક સર્વથી વધારે
 પાક, અય બુઝુર્ગોમાં સર્વથી વધારે બુઝુર્ગ, અય
 માનવંતાઓમાં સર્વથી વધારે માનવંતા.

(૩૪) દર્દો દૂર થવા માટે પઢે

યા કરીમસુંફેહો યા અંઝીમલે મન્ને
 યા કસીરલે ખંચરે યા કંદીમલે ફઝલે
 યા દાએમલે લુત્ફે યા લતીફ સંસુન્એ
 યા મોનફફેસલે કરબે યા કાશેફઝં ઝુરે
 યા માલેકલે મુલકે યા કૌઝયલે હુકુકે

અય મહેરબાન દરગુઝર કરનાર, અય મહાન ઉપકાર કરનાર, અય ખુબજ ખયરવાળા, અય હંમેશાથી ફઝલવાળા, અય કાએમ લુલ્હવાળા, અય લુલ્હ પેદા કરનાર, અય દુઃખ દૂર કરનાર, અય દૂર કરનાર નૂકસાનના, અય માલિક મુલ્કના, અય હક સાથે હુકમ કરનાર.

(૩૫) દેવ પરીથી ખયવા માટે પટે

યા મન હોવ ફી અંહુદેહી વફિયુય યા
 મન હોવ ફી વફાએહી કંવિયુય યા મન
 હોવ ફી કુંવતેહી અંલીયુય યા મન હોવ
 ફી ઔલુવ્વેહી કંરીબુંય યા મન હોવ ફી
 કુંરબેહી લતીફુય યા મન હોવ ફી લુત્ફેહી
 શરીફુય યા મન હોવ ફી શરફેહી અંઝીઝુંય

યા મન હોવ ફી ઈંઝંઝેહી અંઝીમુયં યા
મન હોવ ફી અંઝંમતેહી મજ્જુયં યા મન
હોવ ફી મજ્જેહી હંમીદ.

અય એ કે જે પોતાના અહદમાં વફાદાર છે.
અય એ કે જે પોતાની વફામાં મજબૂત છે. અય
એ કે જે પોતાની કુવ્વત સર્વેથી વધારે છે, અય
એ કે જે પોતાની મોટાઈમાં નજીક છે. અય એ કે
જે પોતાની નજીકમાં લતીફ છે. અય એ કે જે
પોતાના લુલ્હમાં શ્રેષ્ઠ છે, અય એ કે જે પોતાની
બુલંદીમાં જબરદસ્ત છે, અય એ કે જે પોતાની
શક્તિમાં મહાન છે, અય એ કે જે પોતાની
મહાનતામાં બુઝુર્ગ છે, અય એ કે જે પોતાની
મહત્તામાં તારીફ થયેલો છે.

(૩૬) દુશ્મનની ઇજાથી બચવા માટે પટે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મેક
યા કાફી યા શાફી યા વાફી યા મોઝાંફી
યા હાદી યા દાઈ યા કાંઝી યા રાઝી યા
ઝાંલી યા બાકી.

ખુદાવંદા ખરેખર હું સવાલ કરું છું તારી પાસે
તારા નામ સાથે અય કાફી, અય શાફા આપનાર,
અય વફાદાર, અય ક્ષમાશીલ, અય હાદી, અય
બોલાવનાર, અય કરમ કરનાર, અય રાજી
કરનાર, અય બલંદ, અય બાકી.

(૩૭) લોહીની ખરાબી દુર થવા માટે પટે

યા મન કુલ્લો શયઈન ખાંઝેઉલે લહૂ
યા મન કુલ્લો શયઈન ખાંશેઉલે લહૂ યા

મન કુલ્લો શયંઈન કાંએનુલ લહૂ યા મન
 કુલ્લો શયંઈમ મવજૂદુમ બેહી યા મન
 કુલ્લો શયંઈમ મોનીબુન એલયહે યા મન
 કુલ્લો શયંઈન ખાંએકુમ મીન્હો યા મન
 કુલ્લો શયંઈન કાંએમુમ બેહી યા મન કુલ્લો
 શયંઈન સાંએરુન એલયહે યા મન કુલ્લો
 શયંઈય યોસબ્બેહો બેહુંમ્દેહી યા મલ કુલ્લો
 શયંઈન હાલેકુન ઇલ્લા વજૂહહ.

અય એ કે જે જેના માટે દરેક ચીજ નમ્ર બની
 જાય છે. અય એ કે જેનાથી દરેક ચીજ ડરે છે.
 અય એ કે જેના માટે દરેક ચીજ સાબિત છે. અય
 એ કે જેના માટે દરેક ચીજ મવજૂદ છે, અય એ

કે જેના માટે સર્વ ચીજ તેના પ્રતિ રજુ થવાવાળી છે. અય એ કે સર્વે ચીજ તેનાથી ડરે છે, અય એ કે સર્વે ચીજ તેનાથી કાયમ છે, અય એ કે સર્વે ચીજ તેની તરફ રજુ છે, અય એ કે સર્વે ચીજ તેની તારીફની તસખીહ કરે છે, અય એ કે સર્વે ચીજ હલાક થનારી છે તેના સિવાય.

(૩૮) દિલના ઘખકારા દૂર થવા માટે પટે

યા મલે લા મફર^૨ ઇલ્લા એલયેહે યા
 મલે લા મફર^૩અં ઇલ્લા એલયેહે યા મલે
 લા મફર^૪સંદ ઇલ્લા એલયેહે યા મલે લા
 મન્જા મિન્હો ઇલ્લા એલયેહે યા મલે લા
 યુર^૫ગૌબો ઇલ્લા એલયેહે યા મલે લા હુંવેલ
 વલા કુંવત ઇલ્લા બેહી યા મલે લા

યુસ્તઝાંનો ઇલ્લા બેહી યા મલ્ લા
યોતવકકલો ઇલ્લા ઝંલયેહે યા મલ્ લા
યુરેજા ઇલ્લા હોવ યા મલ્ લા યુઝંબદો
ઇલ્લા હોવ.

અય એ કે ભાગવાનું નથી પણ તેની તરફ,
અય એ કે પનાહની જગ્યા નથી પણ તેની તરફ,
અય એ કે સાચી રાહ નથી પણ તેની તરફ,
અય એ કે તેનાથી ભાગી પનાહનું સ્થાન નથી
પણ તેની તરફ, અય એ કે નથી વલણ કરવામાં
આવતું પણ તેની તરફ, અય એ કે નથી કુવ્વત
અને શક્તિ પણ તેનાથીજ, અય એ કે નથી
માગતા પણ તેનાથીજ, અય એ કે નથી તવક્કલ
કરતા પણ તેની ઉપરજ, અય એ કે નથી ઉમ્મીદ
રાખતા પણ તેની પાસે, અય એ કે નથી ઇબાદત

કરવામાં આવતી પણ તેનીજ.

(૩૯) ક્રોધ પણ બીમારી દૂર થવા માટે પટે

યા ખંચરલે મરેહૂબીન યા ખંચરલે
મરેગૂંબીન યા ખંચરલે મત્લૂબીન યા ખંચરલે
મસ્તીલીન યા ખંચરલે મકુંસૂંદીન યા ખંચરલે
મઝંકૂરીન યા ખંચરલે મશકૂરીન યા ખંચરલે
મહુંબૂબીન યા ખંચરલે મદેઉવેવીને યા
ખંચરલે મુસ્તઅનેસીન.

અય જેનાથી ડરે છે તેઓમાંના ઉત્તમ, અય
જેઓથી રગબત કરે છે તેઓમાંના ઉત્તમ, અય
જેની પાસે માગે છે તેઓમાંના ઉત્તમ, અય જેનાથી
સવાલ કરે તેઓમાંના ઉત્તમ, અય જેઓથી ઉમ્મીદ
રાખે છે તેઓમાંના ઉત્તમ, અય જેઓને યાદ કરે

છે તેઓમાંના ઉત્તમ, અય જેઓનો શુક્ર કરે છે
તેઓમાંના ઉત્તમ, અય જેની સાથે દોસ્તી કરે છે
તેઓમાંના ઉત્તમ, અય જેઓથી દુઆ કરે છે
તેઓમાંના ઉત્તમ, અય જેઓથી માયા રાખે છે
તેઓમાંના ઉત્તમ.

(૪૦) આંખોનો દુખાવો દૂર થવા માટે પઢે

અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બિસ્મોક
યા ગૌફેરો યા સાતેરો યા કાંદેરો યા કાંહેરો
યા ફાતેરો યા કાસેરો યા જાબેરો યા ઝાંકેરો
યા નાઝેરો યા નાસેર

ખુદાવંદા ખરેખર હું સવાલ કરું છું તારી પાસે
તારા નામ સાથે, અય માફ કરનાર, અય
ઢાંકનાર, અય કુદરતવાળા, અય કહર કરનાર,
અય પેદા કરનાર, અય ભાંગનાર, અય

સમારનાર, અય ઝાકિર, અય જોનાર, અય
સહાયક.

(૪૧) બાબકોની બીમારી દૂર થવા માટે પટે

યા મનં બંલક ફસવા યા મનં કંદર
ફહદા યા મંયે યકશેફુલે બલ્વા યા મંયે
યસ્મઉન્નજવા યા મનં યુન્કેઝુંલે ગંરેકાં યા
મંયે યુન્જલે હલ્કા યા મંયે યશફિલે મરઝાં
યા મનં અઝંહુંક વ અબ્કા યા મનં અમાત
વ અહુંયા યા મનં બંલકંઝે ઝવેજયંનિઝં
ઝંકર વલે ઉન્સાં.

અય તે કે જેણે ખલ્ક કરી બરાબર કર્યા, અય

તે કે જેણે નિર્માણ કર્યું અને હિદાયત કરી, અય એ કે દૂર કરે છે બલા, અય એ કે સાંભળે છે ભેદને, અય એ કે બચાવે છે દુખતાને, અય એ કે નજાત આપે છે હલાકતમાં પડેલાને, અય એ કે શિક્ષા આપે છે બીમારને, અય એ કે હસાવે છે અને રોવરાવે છે, અય એ કે મારે છે અને જીવાડે છે, અય એ કે પેદા કર્યા જોડા નર અને માદાના.

(૪૨) બામુનો દુઃખાવો દૂર થવા માટે પટે

યા મન ફિલ્બરે વલ બહરે સબીલોહૂ
 યા મન ફિલ આફકે આયાતોહૂ યા મન
 ફિલ આયાતે બુરહાનોહૂ યા મન ફિલ
 મમાતે કુંદરતોહૂ યા મન ફિલ કૌબૂરે

ઈંબેરતોહૂ યા મનં ફિલં કૈંયામતે મુલ્કોહૂ
 યા મનં ફિલં હિંસાબે હયંબતોહૂ યા મનં
 ફિલં મીઝાને કૈંઝાંઓહૂ યા મનં ફિલં જન્નતે
 સંવાબોહૂ યા મનં ફિન્નારે ઐકૈંબોહૂ.

અય એ કે સુકામાં તેમજ દરિયામાં તેનોજ રસ્તો
 છે, અય એ કે ક્ષિતિજમાં તેની નિશાનીઓ છે,
 અય એ કે નિશાનીઓમાં તેની રવશન દલીલ છે,
 અય એ કે મુરદામાં તેની કુદરત છે, અય એ કે
 કબરોમાં તેની બીક છે, અય એ કે કયામતમાં
 તેનો મુલ્ક છે, અય એ કે હિસાબમાં તેની હયબત
 છે, અય એ કે ત્રાજવામાં હુકમ તેનો છે, અય એ
 કે જન્નતમાં તેનો સવાબ છે, અય એ કે આગમાં
 અઝાબ તેનો છે.

(૪૩) નિર્ભય થવા માટે પઢે

યા મન ઁલયેહે યહરબુલે ખાંએફૂન
યા મન ઁલયેહે યફઝઉલે મુઝનેબૂન યા
મન ઁલયેહે યકસેદુલે મોનીબૂન યા મન
એલયેહે યરગંબુઝ ઝાહેદૂન યા મન ઁલયેહે
યલેજ ઉલે મોતહંયેરૂન યા મમ બેહી
યસ્તઅનેસુલે મોરીદૂન યા મમ બેહી
યફતખેરૂલે મોહિબૂન યા મન ફી અંફેવેહી
યતેમઉલે ખાંતેઉન યા મન ઁલયેહે યસ્કોનુલે
મૂકેનૂન યા મન ઁલયેહે યતવકકલુલે
મોતવકકેલૂન.

અય એ કે તેની જ તરફ ડરવાવાળા ભાગે છે, અય એ કે તેની તરફ ગુનેહગારો પનાહ લઈ જાય છે. અય એ કે તેની તરફ ઉમ્મીદ રાખે છે તલબ કરનાર, અય એ કે તેની તરફ વલણ કરે છે પરહેઝગાર, અય એ કે તેની તરફ હયરાન હોય તે પનાહ લઈ જાય છે, અય એ કે તેની સાથે મોહબ્બત કરે છે ઘરાદો કરનારા, અય એ કે તેના સબબથી ફખ્ર કરે છે મોહબ્બતવાળા, અય એ કે તેની બક્ષીશની ઉમ્મીદ રાખે છે ખતાકાર, અય એ કે તેનાથી દિલાસો પામે છે ચક્કીન કરનાર, અય એ કે તેની ઉપર તવક્કલ કરે છે તવક્કલ કરનારા.

(૪૪) ખરડાનો દુઃખાવો દૂર થવા માટે પટે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મેક

યા હુંબીબો યા તુંબીબો યા કુંરીબો યા

રકીંબો યા હુંસીબો યા મોહીબો યા મોસીંબો
યા મોજીબો યા ખંબીરો યા બસીંર.

ખુદાવંદા ખરેખર હું સવાલ કરું છું તારી પાસે
તારા નામ સાથે, અય દોસ્ત, અય હકીમ, અય
નજીક, અય રક્ષક, અય હિસાબ લેનાર, અય
ડરાવનાર, અય બદલો આપનાર, અય કબૂલ
કરનાર, અય જાણકાર, અય જોનાર.

(૪૫) દરિયામાંથી સલામતીથી પસાર થવા
પટે

યા અકુંરબ મિનં કુલ્લો કુંરીબિંયં
યા અહુંબબ મિનંકુલ્લો હુંબીબિંયં યા
અબસીંર મિનં કુલ્લો બસીંરિંયં યા અખંબર
મિનં કુલ્લો ખંબીરિંયં યા અશરફ મિન

કુલ્લો શરીરિનં યા અરેફઅં મિન કુલ્લો
 રફીઈયં યા અકંવા મિનં કુલ્લો કંવિચિયં
 યા અઁના મિનં કુલ્લો ગંનિચિયં યા
 અજવદ મિન કુલ્લો જવાદિયં યા અરેઅફ
 મિનં કુલ્લો રઉફ.

અય સર્વે નજુકવાળાથી વધારે નજુક, અય
 સર્વે દોસ્તથી વધારે દોસ્ત, અય સર્વે જોનારથી
 વધારે જોનાર, અય સર્વે ખબરદારથી વધારે
 ખબરદાર, અય સર્વે બુઝુર્ગથી વધારે બુઝુર્ગ,
 અય સર્વે બુલંદથી વધારે બુલંદ, અય સર્વે
 શક્તિમાનથી વધારે શક્તિમાન, અય સર્વે ગનીથી
 વધારે ગની, અય સર્વે સખીથી વધારે સખી,
 અય સર્વે મહેરબાનોથી વધારે મહેરબાન.

(૪૬) ખભાનો દુઃખાવો દૂર થવા માટે પટે

યા ગાંલેબનં ગંયેર મઁલૂબિયં યા
સાંનેઅંને ગંયેર મસેનૂઈયં યા ખાંલેકંને
ગંયેર મખેલૂકિંયુ યા માલેકનં ગંયેર
મમ્લૂકિંયં યા કાંહેરનં ગંયેર મકેહૂરિંયં
યા રાફેઅંને ગંયેર મરેફૂઈયં યા હાંફેઝંને
ગંયેર મહૂફૂઝિંયં યા નાસેરનં ગંયેર
મન્સૂરિંયં યા શાહેદનં ગંયેર ગાંએબિયં
યા કંરિબનં ગંયેર બઈદ.

અય ગાલીબ જે હારતો નથી, અય ખનાવનાર
જેને કોઈએ ખનાવ્યો નથી, અય ખાલીક કે જેને
કોઈએ ખલ્લ નથી કર્યો, અય માલિક કે જે કોઈને

તાબે નથી, અય કહર કરનાર જેના ઉપર કોઇ
 કહર નથી કરતું, અય બુલંદ જેને કોઈએ બુલંદ
 નથી કર્યો, અય હિફાઝત કરનાર જે હિફાઝતનો
 મોહતાબ નથી. અય મદદ કરનાર જે મદદનો
 મોહતાબ નથી, અય હાજર જે ગાએબ નથી,
 અય નજીક કે દૂર નથી.

(૪૭) ગોઠણનો દુઃખાવો દૂર થવા પટે

યા નૂર નૂરે યા મોનવ્વેર નૂરે યા
 ખાંલેકેંનૂરે યા મોદબ્બેર નૂરે યા મોકેંદેર નૂરે
 યા નૂર કુલ્લે નૂરિંયે યા નૂરને કુંબલ કુલ્લે
 નૂરિને યા નૂરમે બઅંદ કુલ્લે નૂરિને યા
 નૂરને ફવકેં કુલ્લે નૂરિને યા નૂરને લયેસ
 કમિસ્લેહી નૂર.

અય નૂરના નૂર, અય નૂરાની કરનાર નૂરના,
 અય પેદા કરનાર નૂરના, અય તદબીર કરનાર
 નૂરના, અય નિર્માણ કરનાર નૂરના, અય નૂર
 દરેક નૂરના, અય સર્વે નૂરની પહેલે નૂર, અય
 સર્વે નૂરની પાછળ નૂર, અય સર્વ નૂરની ઉપર
 નૂર, અય એવું નૂર કે જેની સમાન કોઈ નૂર
 નથી.

(૪૮) કાંડાનું દર્દ દૂર થવા પટે

યા મન અંતોઓહૂ શરીક્યુ યા મન
 ફેઅંલોહૂ લતીક્યુ યા મન લુત્ફોહૂ મોકીમુયે
 યા મન એહસાનોહૂ કંદીમુયે યા મન કંલોહૂ
 હુંકંક્યુ યા મન વઅંદોહૂ સિંદકુંવે યા મન
 અંફવોહૂ ફઝલુયે યા મન અંઝાબોહૂ અંદલુયે
 યા મન ઝિંકરોહૂ હુંલ્વુયે યા મન ફઝલોહૂ

અંમીમ.

અય એ કે બક્ષિશ તેની બુઝુર્ગ છે, અય એ કે ફેઅલ તેનો લતીફ છે, અય એ કે મહેરબાની તેની હંમેશાની છે, અય એ કે એહસાન તેનું હંમેશનું છે, અય એ કે વાત તેની હક છે, અય એ કે વાયદો તેનો ખરો છે. અય એ કે માફ કરવું તેનો ફઝલ છે, અય એ કે અઝાબ તેનો અદલ છે, અય એ કે તેને યાદ કરવામાં મીઠાશ છે, અય એ કે ફઝલ તેનો સામાન્ય છે. (બધા માટે છે)

(૪૯) વાસાનો દુઃખાવો દૂર થવા માટે પઢે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મોક
યા મોસહિહેલો યા મોફસિલો યા મોબદેલો
યા મોઝલ્લેલો યા મોનઝઝેલો યા મોનવ્વેલો
યા મુફઝેલો યા મુજઝેલો યા મુમહેલો યા

મુજૃંભેલ.

ખુદાવંદા ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા નામ સાથે અય આસાન કરનાર, અય જુદુ કરનાર, અય ખદલી નાખનાર, અય હલ્કો કરનાર, અય ઉતારનાર, અય એહસાન કરનાર, અય ફઝલ કરનાર, અય આભાર કરનાર, અય મોહલત દેનાર, અય નેકી કરનાર.

(૫૦) પડખાનો દુઃખાવો દૂર થવા માટે પટે

યા મંચે યરા વલા યોરા યા મંચે યખ્લોકો
વલા યુખ્લોકો યા મંચે યહૃદી વલા યોહૃદા
યા મંચે યોહૃંચી વલા યુહૃંચા યા મંચે યસંઅલો
વલા યુસ્અલો યા મંચે યુત્તંએમો વલા યુત્તંએમો
યા મંચે યોજરો વલા યોજરો અંલયહે યા

મંચે યકુંઝી વલા યુકુંઝી અંલયેહે યા મંચે
યહુંકોમો વલા યુહુંકમો અંલયેહે યા મન
લમં યલિદ વલમં યૂલદ વલમં યકુલ લહૂ
કોફોવન અહુંદ.

અય એ કે જોવે છે અને તેને જોવામાં નથી
આવતો, અય એ કે પેદા કરે છે અને તેને કોઈએ
પેદા કરેલ નથી, એ હિદાયત કરે છે તેને કોઈએ
હિદાયત કરી નથી, અય એ કે જીવતા કરે છે
અને કોઈએ જીવતો કરેલ નથી. અય એ કે તે
પૂછે છે અને તેને પૂછવામાં આવતું નથી, અય એ
કે ખવરાવે છે અને તેને ખવડાવવામાં આવતું નથી,
અય એ કે પનાહ આપે છે અને તે પનાહ લેતો
નથી. અય એ કે ફેસલો કરે છે અને તેના ઉપર
કોઈ હાકીમ નથી, અય એ કે હુકમ કરે છે અને
તેના ઉપર કોઈ હાકીમ નથી, અય એ કે કોઈને

જન્મ આપતો નથી અને તેને કોઈએ જન્મ આપ્યો
નથી અને તેની સમાન કોઈ નથી.

(૫૧) કમરનો દુઃખાવો દૂર થવા પટે

યા નેઝંમલે હુંસીબો યા નેઝંમત્તંબીબો
યા નેઝંમરે રકીંબો યા નેઝંમલે કુંરીબો
યા નેઝંમલે મોજીબો યા નેઝંમલે હુંબીબો
યા નેઝંમલે કફીલો યા નેઝંમલે વકીલો
યા નેઝંમલે મવેલા યા નેઝંમને નસીર

અય હિસાબ કરનારામાં ઉત્તમ, અય હકીમોમાં
શ્રેષ્ઠ, અય દેખરેખ રાખનારમાં ઉત્તમ, અય
નજીકવાળાઓમાં શ્રેષ્ઠ, અય દોસ્તોમાં ઉત્તમ, અય
હબીબોમાં શ્રેષ્ઠ, અય જામીનોમાં ઉત્તમ, અય
વકીલોમાં શ્રેષ્ઠ, અય માલિકોમાં શ્રેષ્ઠ, અય

મદદગારોમાં ઉત્તમ.

(૫૨) હાડકાનો દુઃખાવો દૂર કરવા પટે

યા સોરૂરલે ઔરેફીન યા મોનલે
મોહિબ્બીન યા અનીસલે મોરીદીન યા
હુંબીબત્તવ્વાબીન યા રાઝેકુંલે મોકુંલ્લીન
યા રજાઅલે મુઝુંનેબીન યા કુંરૂત અંચોનિલે
ઔબેદીન યા મોનફફેસ અંનિલે મકરૂબીન
યા મોફરૂજ અંનિલે મગુંમૂમીન યા એલાહલે
અવ્વલીન વલે આખેરીન.

અય આરીફોની ખુશી, અય ચાહત મોહિબ્બોની,
અય મુનીસ ચાહનારાઓના, અય દોસ્ત તોબા
કનારાઓના, અય રોઝી આપનાર ફકીરોના,

અય ગુનેહગારોની ઉમ્મદીની જગ્યા, અય આંખની ઠંડક ઘબાદત કરનારાઓની, અય દૂર કરનાર સપ્તીઓના, અય ખુશ કરનાર ગમગીનોના, અય ખુદા પહેલાં અને છેલ્લાઓના.

(૫૩) પેટનો દુઃખાવો દૂર થવા માટે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મોક

યા રબ્બના યા એલાહના યા સય્યેદના યા
મવેલાના યા નાસૈરના યા હૈફેઝના યા
દલીલના યા મોઈનના યા હુંબીબના યા
તુંબીબના

ખુદાવંદા ખરેખર હું સવાલ કરું છું તારી પાસે
તારા નામ સાથે અય અમારા રબ, અય અમારા
ખુદા, અય અમારા સરદાર, અય અમારા આકા,
અય અમારા મદદગાર, અય અમોને સાચવનાર,

अथ अमोने रस्तो षतावनार, अथ अमारा
सहायक, अथ अमारा हणीष, अथ अमारा
हकीम.

(प४) मरुडो दूर थवा पढे

या रब्बनं नबियीन वलं अबरारे
या रब्बसंसिदीकींन वलं अब्यारे या
रब्बलं जन्नते वन्नारे या रब्बसंसैंगारे
वलं केभारे या रब्बलं होंभूभे वसंसैभारे
या रब्बलं अन्डारे वलं अश्जारे या
रब्बसंसैहँारी वलं कँइारे या रब्बलं
भरारी वलं भेहँारे या रब्बलं लयले
वन्नडारे या रब्बलं अअँलाने वलं अस्सारे

અય નબી અને નેક લોકોના રબ, અય સાચાઓ
અને નેક લોકોના રબ, અય જન્નત અને
જહન્નમના રબ, અય નાના અને મોટાઓના
રબ, અય દાણા અને મેવાના રબ, અય નેહરો
અને ઝાડના રબ, અય આબાદ જંગલો અને
ઉજ્જડ રણના રબ, અય બિયાબાન અને
દરિયાના રબ, અય રાત અને દિવસના રબ,
અય જાહેર અને છુપી ચીજોના રબ.

(૫૫) ગુનાહો માફ થવા પટે

યા મને નફઝં ફી કુલ્લે શયેઈને અમરોહુ
યા મલે લહૈકે બેકુલ્લે શયેઈને ઈલ્મોહૂ યા
મમે બલગૈતે એલા કુલ્લે શયેઈને કુંદરતોહૂ
યા મલે લા તોહૈસિલે ઐબાદો નેઅંમહૂ

યા મલં લાતબ્લોગુંલં ખંલોએકોં શુકરેહૂ
 યા મલં લા તુદરેકુલં અફહામો જલાલોહૂ
 યા મલં લા તનાલુલં અવહામો કુન્હહૂ યા
 મનિલં અંઝંમતો વલં કિબ્રીયાઓ રેદાઓહૂ
 યા મલં લાતરુદુલં અંબાદો કંઝાંઅહૂ યા
 મલં લા મુલ્ક ઇલ્લા મુલ્કોહૂ યા મલં લા
 અંતાંઅ ઇલ્લા અંતાંઓહૂ.

અય એ કે દરેક ચીજમાં તેનો હુકમ જારી છે,
 અય એ કે ઘેરેલ છે તેના ઇલ્મે દરેક ચીજને, અય
 એ કે તેની કુદરત દરેક ચીજ તરફ પહોંચી છે,
 અય એ કે તેની નેઅમતોને તેના ખંદા ગણી શકતા
 નથી, અય એ કે નથી કરી શકતી ખલાએક તેનો
 શુક, અય એ કે જેની બુઝુર્ગીને નથી સમજી શકતી

કોઈ સમજ, અય એ કે તેની હકીકતે ખ્યાલ પણ પામી શકતો નથી, અય એ કે અઝમત અને મોટાઈ તેની રીદા છે, અય એ કે તેનો ફેંસલો બંદાઓ રદ કરી શકતા નથી, અય એ કે નથી બાદશાહી પણ તેની જ, અય એ કે નથી બક્ષિશ પણ બક્ષિશ તેની.

(૫૬) બાદશાહો પાસે જતી વખતે પઢે

યા મલે લહુલ મસંલુલે અઅંલા યા
 મલે લહુસેફાતુલે ઉલ્યા યા મલે લહુલે
 આખેરતો વલે ઊલા યા મલે લહુલે જન્નતુલે
 મઅવા યા મલે લહુલે આયાતુલે કુબ્રા યા
 મલે લહુલે અસ્માઉલે હુસ્ના યા મલે લહુલે
 હુકેમો વલકેઝાઓ યા મલે લહુલે હવાઓ

વલ્કઝાઓ યા મલે લહુલે અર્શોવસંસંરા યા
મને લહુસ્સમાવાતુલે ઔલા

અય એ કે તેની મહાન મિસાલો છે, અય એ
કે વાસ્તે તેની છે શ્રેષ્ઠ ગુણ, અય એ કે વાસ્તે
તેની છે અંતિમ અને આદિ, અય એ કે તેની જ
છે જન્નતે મઅવા, અય એ કે વાસ્તે તેની છે
નિશાનીઓ મહાન, અય એ કે વાસ્તે તેની છે
નેક કામો, અય એ કે વાસ્તે તેની છે હુકમ અને
કઝા (ફેસલો), અય એ કે વાસ્તે તેની છે હવા
અને હવાની જગ્યા, અય એ કે વાસ્તે તેની છે
અર્શ અને જમીન, અય એ કે વાસ્તે તેની છે
બલંદ આસમાન.

(૫૭) ગુનાહોની બક્ષિશ માટે પટે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મોક

યા અંકુવો યા ગંકૂરો યા સંબૂરો યા શકૂરો
યા રઊફો યા અંતૂંફો યા મસ્ઊલો યા વદૂદો
યા સુબ્બૂહો યા કુંદૂસ.

ખુદાવંદા ખરેખર હું સવાલ કરું છું તારી પાસે
તારા નામ સાથે અય ક્ષમા કરનાર, અય બક્ષનાર,
અય સખર (દેનાર), અય શુક્ર કરનાર, અય
મહેરબાન, અય દયા કરનાર, અય એ કે સવાલ
કરાય છે તારાથી, અય દોસ્ત, અય ખામી વિનાના,
અય સર્વેથી પાક.

(૫૮) દુશ્મનોની જીભ બંધ કરવા પટે

યા મન ફિસ્સમાએ અંઝંમતોહૂ યા મન
ફિલ્અરઝં આયાતોહૂ યા મન ફી કુલ્લે
શય્ઈન દલ્લાએલોહૂ યા મન ફિલ્ બેહારે

અંજાએબોહૂ યા મન ફિલ્જેબાલે ખંઝાએનોહૂ
 યા મંયે યબ્દઉલે ખંલકું સુંમ્મ યોઈંદોહૂ યા
 મને એલચ્હે યરજેઉલે અમરો કુલ્લોહૂ યા
 મને અઝૂર ફી કુલ્લે શયેઈલે લુત્તંફહૂ યા
 મને અહૂસન કુલ્લ શયેઈને ખંલકહૂ યા
 મને તસંરૂફ ફિલે ખંલાએકે કુંદરતોહૂ

અય એ કે આસમાનમાં છે બુઝુર્ગી તેની, અય
 એ કે જમીનમાં છે નિશાનીઓ તેની, અય એ કે
 તે હોવાની દરેક ચીજમાં દલીલ છે, અય એ કે
 દરિયામાં છે તેની અજાયબીઓ, અય એ કે
 પહાડમાં છે ખજાના તેના, અય એ કે પેદા કરી છે
 ખલ્કને પછી જીવતા કરશે. અય એ કે તેની તરફ
 તમામ કામ ફરશે, અય એ કે જાહેર છે તમામ

ચીજમાં લુલ્હ તેનું, અય એ કે સારી છે દરેક ચીજ
તેની પેદા કરેલી, અય એ કે સતા રાખે છે
ખલાએકમાં તેની કુદરત.

(૫૯) કાનનો દુઃખાવો દૂર થવા પટે

યા હુંબીબ મને લા હુંબીબ લહૂ યા
તંબીબ મલ્લા તંબીબ લહૂ યા મોજીબ મલે
લા મોજીબ લહૂ યા શફીકે મલે લા શફીકે
લહૂ યા રફીકે મલે લા રફીકે લહૂ યા
મોગીસં મલે લા મોગીસં લહૂ યા દલીલ
મલે લા દલીલહૂ યા અનીસ મલે લા
અનીસલહૂ યા રાહુંમ મલે લા રાહુંમ લહૂ
યા સોહુંબ મને લા સોહુંબ લહૂ.

અય એના દોસ્ત જેના માટે દોસ્ત નથી, અય એના હકીમ જેના માટે હકીમ નથી, અય એના કબૂલ કરનાર જેના માટે કબૂલ કરનાર નથી, અય એના મહેરબાન જેના માટે મહેરબાન નથી, અય એના રફીક જેના માટે રફીક નથી, અય એની ફરિયાદે પહોંચનાર જેની ફરિયાદે પહોંચનાર નથી, અય એના રહનુમા કે જેને રહનુમા નથી. અય એના દોસ્ત કે જેના માટે દોસ્ત નથી, અય એના માટે રહેમ કરનાર જેના પર રહેમ કરનાર નથી, અય એના સાથી જેના માટે સાથી નથી.

(૬૦) કાનની પાછળનો દુઃખાવો દૂર થવા
પટે

યા કાફેય મનિસં તકફાહો યા હાદેય
મનિસં તહદાહો યા કાલેયમનિસં તકલાહો

या राअ्येयं मनिसं तरंआंढो या शाङ्गेय
मनिसं तश्ङाढो या कंअ्येयं मनिसं तर्कंआंढो
या मुग्नेयं मनिसं तग्नाढो या भूङ्गेयं मनिसं
तष्ङाढो या भोर्कंवेयं मनिसं तर्कंवाढो या
वलिय्यं मनिसं तव्वाढ.

अयं किङ्गायतं करुणारं किङ्गायतं याहणारं माटे,
अयं हिंदायतं करुणारं हिंदायतं याहणारं माटे,
अयं हिंङ्गायतं करुणारं हिंङ्गायतं याहणारनां माटे,
अयं रीआयतं करुणारं रीआयतं याहणारआओना,
अयं शङ्गा आपणारं शङ्गा याहणारना, अयं हुङ्कम
करुणारं हुङ्कम याहणारना, अयं तवंगरी आपणारं
तवंगरी याहणारना, अयं पुङ्गं करुणारं
याहणारना, अयं कुव्वतं आपणारं कुव्वतं
याहणारना, अयं मङ्क करुणारं मङ्क याहणारना.

(૬૧) કાનની સામેનો દુઃખાવો દૂર થવા પટે

અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બિસ્મેક
યા ખૌલેકૌ યા રાઝેકૌ યા નાતૌકૌ યા
સૌદેકૌ યા ફાલેકૌ યા ફારેકૌ યા ફાતેકૌ
યા રાતેકૌ યા સાબેકૌ યા સામીકૌ

ખુદાવંદા ખરેખર હું સવાલ કરૂ છું તારી પાસે
તારા નામ સાથે અય પેદા કરનાર, અય રોઝી
આપનાર, અય બોલનાર, અય સાચા, અય
ફાડનાર, અય જુદું કરનાર, અય અલગ
કરનાર, અય મેળવનાર, અય પહેલા, અય
બુલંદ.

(૬૨) ગરદનનો દુઃખાવો દૂર થવા પટે

યા મય યોકૌલ્લેબુલ લયલ વન્નહાર

યા મનં જાંલઝંઝોલોમાતે વલંઅન્વાર યા
 મનં ખંલકંઝં ઝિલ્લ વલ્હંરૂર યા મનં
 સખંખંરશં શમ્સ વલં કંમર યા મનં કંદરલં
 ખંચેર વશશર યા મનં ખંલકંલં મત્ત વલં
 હંયાત યા મલં લહુલં ખંલકોં વલં અમ્રો
 યા મલં લમં યત્તખિંઝં સોહેબતંવં વલા
 વલદંયં યા મલં લય્સ લહૂ શરીકુનં ફિલં
 મુલ્કે યા મલં લમં યકુલ્લહૂ વલિયુમં
 મેનઝંઝુંલ્લ

અય એ કે જે ફેરવે છે રાતને અને દિવસને,
 અય એ કે પેદા કર્યું અંધારું અને અજવાળું અય
 એ કે પેદા કર્યો છાંયો અને તડકો, અય એ કે

તાબે છે સૂર્ય અને ચંદ્ર, અય એ કે નિર્માણ કર્યું
ભલાઈ અને બૂરાઈ, અય એ કે પેદા કર્યું મૃત્યુ
અને જીવન, અય એ કે વાસ્તે તેની છે ખલ્ક અને
અમ્ર, અય એ કે નથી કરતો ઔરત અને ન
અવલાદ, અય એ કે નથી વાસ્તે તેની ભાગીદાર
બાદશાહીમાં, અય એ કે નથી વાસ્તે તેની મદદગાર
કે તે આજીઠા હોય.

(૬૩) ગળાનો દુઃખાવો દૂર થવા પટે

યા મંયં યઅંલમો મોરાદલ મોરીદીન
યા મંયં યઅંલમો ઝંમીરસં સૌમેતીન યા
મંયં યસ્મઓ અનિનલ વાહેનીન યા મંયં
યરા બુકાઅલ ખાંએફીન યા મંયં યમ્લેકો
હુંવાએજસં સાએલીન યા મનં યકુંબલો

ઉઝરત તાએબીન યા મન લા યુસ્લેહો
 અંમલલ મુફ્સેદીન યા મન લા યોઝીઓ
 અજરલ મોહુસેનીન યા મન લા યબ્આદો
 અન્કૌલૂબિલ અરફીન યા અજવદલ
 અજવદીન

અય એ કે જાણે છે ઘરાદા કરવાળાઓની
 મુરાદને, અય એ કે જાણે છે ભેદ ચુપ
 રહેનારના, અય એ કે સાંભળે છે કરગરવું
 આજીઝોનું, અય એ કે જુવે છે રોવું
 ડરવાવાળાઓનું, અય એ કે પુરી કરનાર છે
 હાજતો સવાલ કરનારાઓની, અય એ કે કબૂલ
 કરે છે ઉઝર તોબા કરનારાઓનો, અય એ કે
 નથી દુરસ્ત કરતો આ'માલ ફસાદ
 કરનારાઓના, અય એ કે નથી બરબાદ કરતો

અજર એહસાન કરનારાઓનો, અય એ કે જે દૂર નથી આરેફોના દિલથી, અય બક્ષીશ કરનારાઓમાં વધારે બક્ષીશ કરનાર.

(૬૪) લકવો દૂર થવા પટે

યા દાએમલે બકાએ યા સામેઅંદોઆએ
યા વાસેઅંલે અંતાએ યા ગાંફેરલે બંતાએ
યા બદીઅંસ્સમાએ યા હુંસનલે બલાએ યા
જમીલસંનાએ યા કુંદીમસ્સનાએ યા કસીરલે
વફાએ યા શરીફલે જઝાઅ

અય હંમેશા બાકી રહેનાર, અય દુઆના સાંભળનાર, અય બહોળી બક્ષીશવાળા, અય બક્ષનાર ખતાના, અય પેદા કરનાર આસમાનોના, અય ઉત્તમ અજમાઇશ કરનાર,

અય નેક તારીફને લાયક, અય હંમેશથી બુઝુર્ગ,
અય બહુજ વફા કરનાર, અય ઉચ્ચ બદલો
આપનાર.

(૬૫) બદનઝર દૂર થવા પટે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મોક
યા સત્તારો યા ગૌંફારો યા કૌંહારો યા જબ્બારો
યા સંબ્બારો યા બારો યા મુખ્તારો યા
ફત્તાહો યા નફાહો યા મુરતાહો

ખુદાવંદા ખરેખર હું તારી પાસે સવાલ કરું છું
તારા નામ સાથે અય ઢાંકનાર, અય માફ કરનાર,
અય કહર કરનાર, અય બદલો દેનાર, અય
સખર કરનાર, અય નેકી કરનાર, અય મુખ્તાર,
અય ફતેહ કરનાર, અય ફાયદો આપનાર, અય
રાહત દેનાર.

(૬૬) છાતીનો દુઃખાવો દૂર થવા પટે

યા મનં ખંલકંની વ સવ્વાની યા મનં
રઝકંની વ રબ્બાની યા મનં અત્તંમની વ
સકાંની યા મનં કંરંબની વ અદનાની યા
મનં અંસંમની વ કફાની યા મનં હંફેઝંની
વ કલાની યા મનં અઅંઝંની વ અઁનાની
યા મનં વફંકંની વ હદાની યા મનં આનસની
વ આવાની યા મનં અમાતની વ અહુંયાની

અય એ કે પેદા કર્યો અને મને દુરસ્ત કર્યો,
અય એ કે મને રોઝી આપી અને મને પાળ્યો,
અય એ કે ખવરાવ્યું મને અને પીવરાવ્યું મને,
અય એ કે મને નજીકી અને કરામત આપી, અય
એ કે મને મહફૂઝ રાખ્યો અને મારા માટે કાફી

(પૂરતો) થયો, અય એ કે મારી હિંજાઝત કરી
 અને મને સાચવ્યો, અય એ કે મને માનવંત કર્યો
 અને તવંગર બનાવ્યો, અય એ કે મને તવફીક
 આપી અને હિદાયત કરી, અય એ કે મારો સંગાથ
 કરી અને મને પનાહ આપી, અય મને મારનાર
 અને મને જીવાડનાર.

(૬૭) સોજો દૂર થવા પટે

યા મયે યોહિકુંકુંલે હુંકુંકું બેકલેમાતેહી
 યા મને યકુંબલુતે તવેબત અંને અંબાદેહી
 યા મને યહુંલો બયનેલે મરેએ વ કુંલેહી
 યા મને લાતન્ફઉશ્શફાઅંતો ઇલ્લા બેઇઝનેહી
 યા મને હોવ અઅંલમો બેમને ઝંલ્લ અંને
 સબીલેહી યા મલે લા મોઅંકુંકુંબ લેહુંકુંમેહી

યા મલે લારોદ લેકેઝાએહી યા મનિન
 કોદ કુલ્લો શયેઈલે લેઅમરેહી યા
 મનિસ્સમાવાતો મતેવીચ્યાતુમ બેયમીનેહી
 યા મંયે યુરેસેલુરેયાહું બુશર મે બયેન યદયે
 રહુંમતેહી

અય એ કે હકને પોતાના કલામથી કાયમ કરે
 છે, અય એ કે કબૂલ કરે છે તોબા પોતાના
 બંદાઓની, અય એ કે આડ (પરદો) નાખે છે
 દરમિયાન માણસ અને તેના દિલની, અય એ કે
 નથી ફાયદો કરતી શફાઅત પણ તેની રજાથી,
 અય એ કે તેજ વધારે જાણે છે એ શખ્સને કે જે
 ગુમરાહ થયો તેના રસ્તાથી, અય એ કે કોઈ
 બદલી શકતું નથી તેના હુકમને, અય એ કે કોઈ
 રદ કરી શકતું નથી તેની (ફેસ્લા) કઠાને, અય

એ કે તાબેદાર છે તમામ ચીઝ તેના હુકમની,
 અય એ કે આસમાન વીંટળાયેલ છે તેની કુદરતથી,
 અય એ કે મોકલે છે હવાઓ ખુશખબરી આપનાર
 તેની રહેમતની.

(૬૮) લકવો દૂર થવા પટે

યા મન જાંલલે અરેઝે મેહાદંયે યા
 મન જાંલલે જેબાલ અવેતાદંયે યા મન
 જાંલલે શમ્સ સેરાજંયે યા મન જાંલલે
 કુંમર નૂરંયે યા મન જાંલલે લયેલ લેબાસયે
 યા મન જાંલલે ન્નહાર મઝાંશયે યા મન
 જાંલલે નવેમ સોબાતંયે યા મન જાંલલે
 સમોઅ બેનોઅંયે યા મન જાંલલે અશ્યાઅ

અઝવાજંયે યા મનં જઅંલન્નાર મિરેસાંદા.

અય એ કે કરી જમીનને બીછાનું, અય એ કે કર્યા પહાડને ખીલા, અય એ કે કર્યો સૂર્યને દીવો, અય એ કે બનાવ્યો ચંદ્રને નૂર, અય એ કે કરી રાતને લિખાસ (આરામ), અય એ કે કર્યો દિવસને કામધંધાનું સાધન, અય એ કે બનાવી નિંદ્રાને મજબૂતીનું કારણ, અય એ કે કર્યા આસમાનને કાયમ, અય એ કે કરી તમામ ચીજોને જોડું, અય એ કે કરી આગને (સજાની) જગ્યા.

(૬૯) છાતીનું દર્દ મટવા માટે પટે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મેક
યા સમીઓં યા શફીઓં યા રફીઓં યા
મનીઓં યા સરીઓં યા બદીઓં યા કબીરો
યા કુંદીરો યા ખુંબીરો યા મોજ્જર.

ખુદાવંદા ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા નામ સાથે. અય સાંભળનાર, અય શફાઅત કરનાર, અય બલંદ મરતબાવાળા, અય મના કરનાર, અય જલ્દી કરનાર, અય નવું પેદા કરનાર, અય મહાન, અય કુદરતવાળા, અય જાણકાર, અય પનાહ આપનાર.

(૭૦) ખદ નઝર દૂર થવા પટે

યા હુંચ્યને કુંબલ કુલ્લે હુંચ્યને યા
હુંચ્યંયે બઅંદ કુલ્લે હુંચ્યિયે યા હુંચ્યુલ્લર્ની
લયેસ કમિસ્લેહી હુંચ્યુયે યા હુંચ્યુલ્લર્ની
લા યોશારેકોહૂ હુંચ્યુયે યા હુંચ્યુલ્લર્ની
લા યહૂંતાજો એલા હુંચ્યિયે યા હુંચ્યુલ્લર્ની
યોમીતો કુલ્લ હુંચ્યિયે યા હુંચ્યુલ્લર્ની

યરેઝોકો કુલ્લ હંચિન યા હંચલે લમ
 યરેસિલે હંયાત મિન હંચિયે યા હંચુલ્લઝી
 યોહંચિલે મલ્તા યા હંચ્યો યા કંચ્યૂમો લા
 તેઅખાઝીહૂ સેનતુંવે વલા નલ્મ.

અય જીવતા પહેલે સર્વે જીવતાની, અય જીવતા
 પાછળ સર્વે જીવતાની, અય એવા જીવતા કે નથી
 તેના જેવું કોઈ જીવતું, અય એવા જીવંત કે નથી
 તેમાં શરીક કોઈ જીવતું, અય એવા જીવતા કે
 નથી મોહતાજ કોઈ જીવતાના, અય એવા જીવતા
 કે મોત આપે છે દરેક જીવતાને, અય એવા જીવતા
 કે રોઝી આપે છે દરેક જીવતાને, અય એવા
 જીવતા કે કદી કોઈ જીવતાથી નથી જિંદગી પામી,
 અય એવા જીવતા કે સજીવન કરે છે મુદાને,
 અય જીવતા, અય કાયમ જેને ઝોલુ અને નિંદ્રા
 નથી આવતી.

(૭૧) દિલનું દર્દ મટવા માટે પટે

યા મલેલહૂ ઝિંકરૂલે લા યુન્સા યા
મલે લહૂ નુરૂલે લા યુત્તેફા યા મલે લહૂ
નેઅંમુલે લા તોઅંદો યા મલેલહૂ મુલ્કુલે
લા યઝૂલો યા મલેલહૂ સંનાઉલે લા યુહુસો
યા મલેલહૂ જલાલુલે લા યોકય્યફો યા
મલેલહૂ કમાલુલે લા યુદરકો યા મલેલહૂ
કંઝાઉલે લા યોરદો યા મલેલહૂ સેફાતુલે
લા તોબદલો યા મલેલહૂ નોઊતુલે લા
તોગૈયરે.

અય એ કે જેનો ઝિંક ભુલાતો નથી, અય એ
કે તેના માટે એવું નૂર છે કે ઓલવાતું નથી,

અય એ કે તેની નેઅમતો બેશુમાર છે, અય એ
 કે તેની બાદશાહી છે કે તેનો ઝવાલ નથી.
 અય એ કે જેની તારીફની હદ નથી, અય એ
 કે જેની બુઝુર્ગીનો સમજી શકાતી નથી, અય
 એ કે તેના કમાલને સમજી શકતા નથી, અય
 એ કે તેના હુકમને રદ કરી શકતા નથી, અય
 એ કે તેની સિફાતો બદલાતી નથી, અય એ કે
 તેની તારીફમાં ફેરફાર થતો નથી.

(૭૨) સ્તનનું દર્દ મટવા પટે

યા રબ્બલે ઔલમીન યા માલેકે
 યવેમીદીન યા ગૌયતતે તૌલેબીન યા
 ઝૈરુલ્લાજીન યા મુદરેકલ હારેબીન
 યા મયે યોહિબ્બુસૌ સૌબેરીન યા મયે

યોહિંબુત તવ્વાબીન યા મંચે યોહીંબુલે
મોતતુંહેરીન યા મચે યોહિંબુલ
મોહુંસેનીન યા મને હોવ અઅંલમો
બિલ્મોહૃતદીન.

અય રબ આખી સૃષ્ટિના અય માલિક
ક્યામતના દિવસના, અય ચાહનારના અંત, અય
પનાહ માંગનારના ટેકા, અય પામનાર
ભાગેલાઓના, અય મોહિબ સખર
કરનારાઓના, અય મોહિબ તોબા
કરનારાઓના, અય મોહિબ પાકીઝા લોકોના,
અય મોહિબ એહસાન કરવાવાળાઓના, અય
વધારે જાણનાર હિદાયત પામેલાઓના.

(93) બુઝુગી મેળવવા પટે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મોક
યા શફીકોં યા રફીકોં યા હંફીઝોં યા મોહીતોં
યા મોકીતો યા મોગીસો યા મોઈઝો યા
મોઝિલ્લો યા મુબ્દેઓ યા મોઈદ

બુદાવંદા ખરેખર હું તારી પાસે સવાલ કરું છું
તારા નામ સાથે અય મહેરબાન, અય રફીક,
અય રક્ષક, અય ઘેરી લેનાર, અય શક્તિ દેનાર,
અય ફરિયાદે પહોંચનાર, અય ઇબ્જત દેનાર,
અય ઝિલ્લત દેનાર, અય પેદા કરનાર, અય
પાછા લાવનાર.

(94) બાઝુનું દર્દ મટવા પટે

યા મન હોવ અહંદુમ બેલાઝિદિયે યા

મન હોવ ફરેદુમ બેલાનિદિન યા મન હોવ
 સંમદુમ બેલા અંયેબિયે યા મન હોવ વિત્તુમ
 બેલા કયેફિયે યા મન હોવ કૌઝિમ
 બેલાહંયેફિયે યા મન હોવ રબ્બુમ બેલા
 વઝીરિયે યા મન હોવ અંઝીઝુમ બેલાઝુંલિયે
 યા મન હોવ ગંનિયુમ બેલાફકૌરિયે યા
 મન હોવ મલેકુમ બેલાઅંઝલિયે યા મન
 હોવ મસ્ફૂમ બેલાશબીહ

અય એ કે એક જ છે કોઈ સમોવડીયો નથી,
 અય એ કે એક જ છે તેની સમાન કોઈ નથી,
 અય એ કે બેનિયાઝ એબ વિનાનો છે, અય એ
 કે એકજ છે તેની એકતા સમજી શકાતી નથી,
 અય એ કે હુકમ કરે છે ઝુલ્મ કર્યા વિના, અય

એ કે પરવરદિગાર છે વઝીર વિનાનો, અય એ
 કે માનવંતો છે અપમાન વિનાનો, અય એ કે
 તવંગર છે ફકીરી વિનાનો, અય એ કે બાદશાહ
 છે ઝવાલ વિનાનો, અય એ કે જેની સિફાત
 સમાનતા વિનાની છે.

(૭૫) દૂંટીનું દર્દ મટવા પટે

યા મનં ઝિંકરોહૂ શરફુલ લિઝાકેરીન
 યા મનં શુકરોહૂ ફઝુલ લિશશાકેરીન યા
 મનં હંમદોહૂ ઈઝઝુલ લિહહાંમેદીન યા મનં
 તોઅંતોહૂ નજાતુલ લિહમોતીઈન યા મમ
 બાબોહૂ મફતૂહૂલ લિત્તાંલેબીન યા મનં
 સબીલોહૂ વાઝેહૂલ લીલ મોનીબીન યા
 મનં આયાતોહૂ બુરહાનુલ લિન્નાઝરીન

યા મનં કેતાબોહૂ તઝંકેર તુલં લિલ્મુત્તકીન
 યા મરે રિઝકોહૂ ઓમૂમુલં લિલ્તોએઈન
 વલ્ઓસીન યા મરે રહૂમતોહૂ કંરીબુમ
 મેનલં મોહૂસેનીન

અય એ કે ઝિઝ તેનો શરફ છે ઝિઝ કરનારાઓ
 માટે, અય એ કે તે શુક્ર તેનો નજાતનું કારણ છે
 શુક્ર કરનારાઓ માટે, અય એ કે વખાણ તેની
 ઇજ્જત છે વખાણ કરનારાઓ માટે, અય એ કે
 ઈતાઅત તેની નજાત છે ઈતાઅત કરનારાઓ
 માટે, અય એ કે દરવાજો તેનો ખુલ્લો છે
 માંગવાવાળાઓ માટે, અય એ કે રસ્તો તેનો
 ખુલ્લો છે તોબા કરનારાઓ માટે, અય એ કે
 નિશાનીઓ તેની દલીલ છે જોનારાઓ માટે, અય
 એ કે કિતાબ તેની નસીહત છે પરહેઝગારો માટે,
 અય એ કે રિઝક તેનું સામાન્ય (બધા માટે) છે

ફરમાબરદારો અને ગુનેહગારો માટે, અથ એ
કે રહેમત તેની નજુક છે એહસાન
કરનારાઓની.

(૭૬) ગરદનનું દર્દ મટવા પટે

યા મનૌ તબાર કસ્મોહૂ યા મનૌ
તઓલા જદોહૂ યા મલેલા એલાહ ગંચરોહૂ
યા મનૌ જલ્લ સંનાઓહૂ યા મનૌ તકદસત
અસ્માઓહૂ યા મયૌ યદૂમો બકાઓહૂ
યા મનિલૌ અંઝમતો બહાઓહૂ યા મનિલૌ
કિહ્રિયાઓ રેદાઓહૂ યા મલૌ લા તોહૂસૌ
આલાઓહૂ યા મલૌ લા તોઅંદો
નઅંમાઓહૂ

અય એ કે બરકતવાળું છે નામ તેનું, અય એ કે મોટી ઇજ્જત છે તેની, અય એ કે નથી ખુદા તેની સિવાય, અય એ કે બુઝુર્ગ છે તારીફ તેની, અય એ કે પાક છે નામ તેનું, અય એ કે હંમેશા છે બાકીપણું તેનું, અય એ કે બુઝુર્ગી છે શોભા તેની, અય એ કે બડાઇ છે રિદા તેની, અય એ કે નથી ગણી શકતા નેઅમતો તેની, અય એ કે નથી ગણી શકતા કરામતો તેની.

(૭૭) દાંતનું દર્દ મટવા પટે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મેક
 યા મોઈનો યા અમીનો યા મોબીનો યા
 મતીનો યા મકીનો યા રશીદો યા હુંમીદો
 યા મજીદો યા શદીદો યા શહીદ

જુદાવંદા ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા નામ સાથે અય મદદગાર, અય અમાનતદાર, અય રવશન, અય મજબૂત, અય બુઝુર્ગવાર, અય સત્તાધિશ, અય તારીફને લાયક, અય બુઝુર્ગીલાયક, અય સખ્તી કરનાર, અય શહાદત આપવાવાળા.

(૭૮) વાસાનું દર્દ મટવા પટે

યા ઝંલે ઐરશિલે મજીદે યા ઝંલે કુંવેલિસ્સદીદે યા ઝંલે ફેઐલિરે રશીદે યા ઝંલે બત્શીશે શદીદે યા ઝંલે વઐદે વલે વઈદે યા મને હોવલે વલિયુલે હુંમીદો યા મને હોવ ફઐલુલે લેમા યોરીદો યા મને હોવ કુંરીબુને ગંચરો બઈદિને યા મને હોવ

ઝંલા કુલ્લે શય્ઠનં શહીદુનં યા મનં હોવ
લય્સ બેઝંલામિનં લિલ્ઝંબીદ

અય મહાન અર્શના માલિક, અય સાચી વાત
કરનાર, અય પાકટ (પુખ્ત) કાર્ય કરનાર, અય
સપ્ત અઝાબ કરનાર, અય રહેમત અને
અઝાબનો વાયદો કરનાર, અય વખાણયેલ
માલિક, અય ઈરાદા પર અમલ કરનાર, અય
નજદીક દૂર નથી, અય એ કે તમામ ચીજો પર
ગવાહ છે, અય એ કે પોતાના બંદાઓ પર મુલ્મ
નથી કરતો.

(૭૯) દિલનું દર્દ મટવા માટે પઢે

યા મનં લા શરીક લહૂ વલા વઝીર યા
મનં લા શબીહ લહૂ વલા નઝીર યા

ખાંલેકુંશશમ્સે વલં કુંમરિલં મોનીરે યા
 મુઁનેયલં બાએસિલં ફકીરે યા રાઝેકુંતે
 તિફેલિસ્સંગીરે યા રાહુંમશં શયોખિલં કબીરે
 યા જાબેરલં અંઝુંમિલં કસીરે યા ઈસ્મતલં
 ખાંએફિલં મુસ્તજીરે યા મનં હોવ બેએબાદેહી
 ખંબીરૂનં બસીરૂનં યા મનં હોવ અંલા કુલ્લે
 શયેઈનં કુંદીર

અય એ કે નથી (કોઈ) શરીક તેના માટે
 અને (કોઈ) વઝીર, અય એ કે નથી જેવો
 તેની અને સમાન તેની, અય પેદા કરનાર સૂર્ય
 અને ચંદ્ર નૂરાનીના, અય તવંગર કરનાર
 મોહતાજ ફકીરના, અય રોઝી આપનાર નાના
 બચ્યાના, અય રહેમ કરનાર ઝઘફ બુટા ઉપર,

અય દુરુસ્ત કરનાર ભાંગેલા હાડકાના, અય
 એવાને સાચવનાર જે તારાથી પનાહ ચાહે છે,
 અય એ કે પોતાના બંદાઓના હાલથી ખબરદાર
 અને જોનાર છે, અય એ કે તમામ ચીજો પર
 શક્તિવાન છે.

(૮૦) તિલ્લીનો દુઃખાવો મટવા માટે પટે

યા ઝંજૂદે વન્નેઅંમે યા ઝંજૂઝંલે વલે
 કરમે યા ખાંલેકંલે લલ્હે વલે કંલમે યા
 બારેઅઝંઝરે વન્નસમે યા ઝંલે બઅસે
 વન્નેકંમે યા મુલ્હેમલે અંરબે વલે અંજમે
 યા કાંશેફઝૂરે વલ્અલમે યા આંલેમસ્સિરે
 વલ્હેમમે યા રબ્બલે બય્તે વલે હુરમે યા
 મને ખંલકંલે અશ્યાઅ મેનલે અંદમે.

અય સાહેબ બક્ષીશ અને નેઅમતના, અય સાહેબ ફઝલ અને કરમના, અય પેદા કરનાર લલ્હ અને તપ્તીના, અય પેદા કરનાર કીડી અને ઇન્સાનના, અય સાહેબ અઝાબ અને બદલો લેવાના, અય ઇલ્હામ કરનાર અરબ અને અજમના, અય દૂર કરનાર સપ્તી અને ગમીના, અય જાણનાર છુપું અને ઈરાદાના, અય રબ ઘર અને હરમના, અય એ કે પેદા કરી ચીજોને શૂન્યમાંથી.

(૮૧) ગુરદાનો દુઃખાવો મટવા પઢે

અલ્લાહુમ ઈન્ની અસ્અલોક બિસ્મોક
 યા ફાર્એલો યા જાર્એલો યા કાંબેલો યા
 કામેલો યા ફાર્સેલો યા વાર્સેલો યા આંદેલો
 યા ગાંલેબો યા તાંલેબો યા વાહેબે

ખુદાવંદા ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા નામ સાથે અય કરાર દેનાર (રાખનાર), અય કબૂલ કરનાર, અય કામિલ, અય જુદુ કરનાર, અય જોડનાર, અય ખુઝુર્ગા, અય આદિલ, અય સત્તાવાન, અય હિસાબ લેનાર, અય બક્ષીશ કરનાર.

(૮૨) પડખાનો દુઃખાવો મટવા માટે પટે

યા મનં અન્અંમ બેતૈંલેહી યા મનં
અકરમ બેજૂદેહી યા મન્જાદ બેલુત્તૈંહી
યા મનં તઅંઝઝ બેકુંદરતેહી યા મનં
કુંદર બેહિંકમતેહી યા મનં હુંકમ
બેતદબીરેહી યા મનં દબ્બર બેઈંલમેહી
યા મનં તજાવઝ બેહિંલમેહી યા મનં દના

ફી ઔલુવ્વેહી યા મનં અંલા ફી દોનુવ્વેહ

અય એ કે જેણે નેઅમતો આપી પોતાના ફઝલથી, અય એ કે મહેરબાની કરી પોતાની બક્ષીશથી, અય એ કે ઇનામ આપ્યું પોતાના ફઝલથી, અય એ કે ઇજાજત આપી પોતાની કુદરતથી, અય એ કે તકદીર કરે છે પોતાની હિક્મતથી, અય એ કે હુકમ કરે છે પોતાની તદબીરથી, અય એ કે તદબીર કરી પોતાના ઇલ્મથી, અય એ કે દરગુજર કરે છે પોતાની સહનશીલતાથી, અય એ કે નજીક છે પોતાની બલંદીમાં પણ અય એ કે બલંદ છે નજદીક હોવા છતાંપણ.

(૮૩) કમરનો દુઃખાવો મટવા માટે પટે

યા મંચ્યજ્જેલોકો મા યશ્ઠાઓ યા
મંચ્યફ્ઝેલો મા યશ્ઠાઓ યા મંચ્યહ્ઝેદી

મંચશાઓ યા મંચોઝિંલો મંચશાઓ યા
 મંચોઝંઝંઝંબો મંચશાઓ યા મંચોંકેરો
 લેમંચશાઓ યા મંચોઈંઝંઝો મંચશાઓ
 યા મંચોઝિંલો મંચશાઓ યા મંચોસંવેરો
 ફિલ અરહાંમે મા યશાઓ યા મંચખંતસંસો
 બેરહંમતેહી મંચશાઓ

અય એ કે પેદા કરે છે જે ચાહે છે, અય એ
 કે કરે છે જે ચાહે છે, અય એ કે હિદાયત કરે
 છે જેને ચાહે છે, અય એ કે ગુમરાહીમાં મુકી
 આપે છે જેને ચાહે છે, અય એ કે અઝાબ કરે
 છે જેને ચાહે છે, અય એ કે બક્ષીશ આપે છે
 જેને ચાહે છે, અય એ કે ઇજ્જત આપે છે જેને
 ચાહે છે, અય એ કે બેઇજ્જત કરે છે જેને
 ચાહે છે, અય એ કે સૂરત બનાવે છે ગર્ભ

સ્થાનમાં જેવી ચાહે છે, અય એ કે ખાસ કરે
છે પોતાની રહેમતથી જેને ચાહે છે.

(૮૪) હાથના કાંડાનો દુઃખાવો મટવા માટે
પઢે

યા મનં લમં યત્તખિંઝં સોહંબતનં
વલા વલદનં યા મનં જઅંલ લેકુલ્લે શયેઠનં
કંદરનં યા મનં લા યુશરેકો ફીહુંકમેહી
અહુંદનં યા મનં જઅંલલે મલોએકતે
રોસોલનં યા મનં જઅંલ ફિસ્સમાએ
બોરૂજનં યા મનં જઅંલલે અરેઝં કંરારનં
યા મનં ખંલકું મેનલ્માએ બશરનં યા
મનં જઅંલ લેકુલ્લે શયેઠનં અમદનં યા

મન અહીંતે બેકુલ્લે શયેઈન ઈલ્મન યા
મન અહીંસો કુલ્લ શયેઈન અંદદા.

અય એ કે નથી રાખતો સ્ત્રી અને ન અવલાદ,
અય એ કે કર્યુ તમામ ચીજનું નિર્માણ, અય એ કે
નથી ભાગીદાર કરતો પોતાના હુકમમાં કોઈને, અય
એ કે બનાવ્યા મલાએકાઓને સંદેશાવાહક, અય
એ કે કર્યા આસમાનોમાં બુરૂજ, અય એ કે કરી
જમીનને આરામની જગ્યા, અય એ કે પેદા કર્યા
પાણીથી ઇન્સાનને, અય એ કે નક્કી કરી દરેક
ચીજ માટે મુદત, અય એ કે ઘેરી લીધેલ છે તમામ
ચીજને તેના ઇલ્મે, અય એ કે જાણે છે તમામ ચીજની
સંખ્યા.

(૮૫) પગની પીંડીનું દર્દ દૂર થવા પટે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મોક

યા અવ્વલો યા આર્ખેરો યા ઝાંહેરો યા
બાર્તેનો યા બરેરો યા હુંકુંકો યા ફરેદો યા
વિત્રો યા સંમદો યા સરેમદ

ખુદાવંદા ખરેખર હું તારી પાસે સવાલ કરું છું
તારા નામ સાથે અય પહેલા, અય છેલ્લા, અય
જાહેર, અય છુપા, યા નેકોકાર, અય હક, અય
એકતા, અય એકજ, અય બેનિયાઝ, અય
બેઝવાલ. (હંમેશા)

(૮૬) તિલ્લીનું દર્દ દૂર થવા પટે

યા ખંયેર મઅંરૂફિને ઔરેફ યા અફઝલ
મઅંબૂદિને ઔબેદ યા અજલ્લ મશકૂરિને
શોકેર યા અઅંઝઝ મઝંકૂરિને ઝાંકેર યા

અઝાલા મહૂંમૂદિનું હૌમેદ યા અકુંદમ
 મવજૂદિનું તૌલેબ યા અરફઅં મવ્સૂંફિનું
 વોસૂંફ યા અકુંબર મકુંસૂંદિનું કૌસૂંદ યા
 અકુંરમ મસ્તિલિનું સોએલ યા અશરફ
 મહૂંબૂબિનું ઔલેમ

અય ઓળખવામાં આવેલાઓમાં શ્રેષ્ઠ, અય
 એવા અફઝલ કે તેની ઘખાદત કરવી જોઈએ,
 અય શુક્ર કરવો જોઈએ તેઓમાંના ઉત્તમ, અય
 યાદ કરવા જોઈએ તેઓમાંના ઉત્તમ, અય બલંદ
 તેઓમાંના કે જેઓની તારીફ કરવામાં આવે
 છે, અય સર્વેથી કદીમ મૌજુદ જેને તલબ
 કરવામાં આવે છે, અય જેના વખાણ કરવામાં
 આવે છે તેમાંના ઉત્તમ, અય જેની તરફ ઘરાદો
 કરે તેઓમાંના ઉચ્ચ, અય જેઓ પાસે માંગવામાં

આવે છે તેઓમાંના ઉચ્ચ, અથ જેઓને જાણે
છે તેઓમાંના વધારે દોસ્ત.

(૮૭) ખરોળની પીડા દૂર થવા પટે

યા હુંબીબલ્બાકીન યા સય્યદ લે
મોતવકકેલીન યા હાદેયલે મોઝિંલીન યા
વલિયલે મોઅંમેનીન યા અનીસઝં ઝાંકેરીન
યા મફ્ઝઅંલે મલ્હૂફીન યા મન્જેયસે સોદેકીન
યા અકુંદરલે કોંદેરીન યા અઅંલમલે
ઝાંલેમીન યા એલાહલે ખુંદકે અજમઈન

અથ દોસ્ત રોવાવાળાના, અથ સરદાર તવક્કલ
કરનારાઓના, અથ હિદાયત કરનાર
ગુમરાહોના, અથ દોસ્ત ઇમાનદારોના, અથ મુનિસ
યાદ કરનારાઓના, અથ પનાહની જગ્યા

લાચારોની, અય નજાત આપનાર સાચાઓના,
અય સતા ધરાવનારામાં વધારે સત્તાવાન, અય
જાણનારાઓમાં વધારે જાણનારા, અય ખુદા તમામ
ખલકતના.

(૮૮) મોટા માણસ પાસે જતી વખતે પઢે

યા મન ઐલા ફકુંદર યા મન મલક
ફકુંદર યા મન બતૈન ફખુંબર યા મન
ઐબેદ ફશકર યા મન ઐસૈય ફગુંફર યા
મન લા તહૂવીહિલ ફેકરો યા મન લા
યુદરેકોહૂ બસંરૂન યા મન લા યખુંફા ઐલખ્ડે
અસંરૂન યા રાઝેકુંલે બશરે યા મોકુંદેર
કુલ્લે કુંદર

અય બલંદ મરતબાવાળા, કહરવાળા, અય બાદશાહ, ઇખ્તિયારવાળા, અય એ કે છુપી વાતને જાણનાર છે, અય ઇબાદતને લાયક તે છતાં એહસાન માનનાર, અય એ કે તેની નાફરમાની કરે છે છતાં માફ કરનાર, અય એ કે નથી જાણી શકતી તેને અક્કલ, અય એ કે નથી જોઈ શકતી તેને આંખો, અય એ કે નથી છુપી તેનાથી કોઈ ચીજ, અય રોઝી આપનાર ઇન્સાનોના, અય અંદાઝો કરનાર દરેક અંદાઝના.

(૮૯) કાનની પીડા દૂર થવા પટે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મોક
 યા હાંફેઝા યા બારેઓ યા ઝારેઓ યા
 બાર્ઝાઓ યા ફારેજો યા ફાતેહો યા કાશેફો
 યા ઝાંમેનો યા આમેરો યા નાહી

જુદાવંદા ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા નામ સાથે અય હિફાઝત કરનાર, અય પેદા કરનાર, અય ખલ્ક કરનાર, અય બુઝુર્ગવાર, અય ખુશ કરનાર, અય ફતેહ કરનાર, અય ખોલનાર અય ઝામીન, અય હુકમ કરનાર, અય મના કરનાર.

(૯૦) દૂંટીની પીડા દૂર થવા પટે

યા મનૈ લા યઅલમુલૈ ગૈરબ ઇલ્લા
હોવ યા મનૈ લા યસૈરેફુસૈ સૂઅ ઇલ્લા
હોવ યા મનૈ લા યખંલોકુંલૈ ખંલકૈ ઇલ્લા
હોવ યા મનૈ લા યગૈફેરૂઝૈ ઝંબ ઇલ્લા
હોવ યા મનૈ લા યોતિમ્મુનૈ નેઅમત
ઇલ્લા હોવ યા મનૈ લા યોકૈલ્લેબુલૈ

કૌલૂબ ઇલ્લા હોવ યા મનં લા યોદબ્બેરૂલ
 અમર ઇલ્લા હોવ યા મનં લા યોનઝંઝેલુલ
 ગૌચ્સં ઇલ્લા હોવ યા મનં લા યબ્સોતુંરે
 રિઝંકં ઇલ્લા હોવ યા મનં લા યોહંચિલ
 મત્તા ઇલ્લા હૂ

અય એ કે નથી જાણતું કોઈ ગેબને પણ તે જ,
 અય એ કે નથી ફેરવી શકતું બદીને કોઈ, પણ
 તે જ, અય એ કે નથી પેદા કરી મખ્લૂકને કોઈએ
 પણ તેણે જ, અય એ કે નથી માફ કરતો ગુનાહને
 કોઈ પણ તે જ, અય એ કે નથી પુરી કરતો
 નેઅમતોને, પણ તેજ. અય એ કે નથી ફેરવતું
 દિલને કોઈ, પણ તે જ, અય એ કે નથી તદબીર
 કરતું કામની કોઈ પણ તે જ, અય એ કે નથી

વરસાવતો વરસાદને કોઈ, પણ તે જ, અથ એ
 કે નથી બોલું કરતું (વધારતું) રિઝકને પણ તે
 જ, અથ એ કે નથી સજીવન કરતું મુરદાને કોઈ
 પણ તે જ.

(૯૧) કપાળની તક્લીફ દૂર થવા પટે

યા મોઈનઝં ઝાંઈએ યા સોહૈબલ
 ગૌરબાએ યા નાસૌરલ અલ્લેયાએ યા
 કૌહેરલ અઈદાએ યા રાફેઅંસ્સમાએ યા
 અનીસલ અસૌફેયાએ યા હુબીબલ
 અત્કેયાએ યા કન્ઝલ્ફોકંરાએ યા એલાહલ
 અઁનેયાએ યા અકૌરમલ કોરમાઅ

અથ અશક્તોના મદદગાર, અથ પરદેશીના
 સાથી, અથ મદદગાર દોસ્તોના, અથ કહર

કરનાર દુશ્મનોના, અય ઊંચા કરનાર
 આસમાનોના, અય દોસ્ત માનવંતાઓના, અય
 દોસ્ત પરહેઝગારોના, અય ખજાના ફકીરોના,
 અય ખુદા તવંગારોના, અય મહેરબાનોમાં ઉત્તમ
 મહેરબાન.

(૯૨) છુપા ભાગની બીમારી દૂર થવા પટે

યા કાફેયને મિને કુલ્લે શયેઈને યા
 કાંએમને અંલા કુલ્લે શયેઈને યા મને લા
 યુશ્બેહોહૂ શયેઈને યા મને લા યઝીદો ફી
 મુલ્કેહી શયેઈને યા મને લા યબ્દેશ અંલય્હે
 શયેઈને યા મને લા યન્કાંસો મિને ખંઝાએનેહી
 શયેઈને યા મને લય્સ કમિસ્લેહી શયેઈને
 યા મને લા યઅંઝોબો અંને ઇલ્મેહી શયેઈને

યા મન હોવ ખંબીરૂમ બેકુલ્લે શયેઈને યા
મન વસેઅંતે રહુંમતોહૂ કુલ્લ શય્અ

અય કાફી દરેક ચીજ માટે, અય કાયમ દરેક
ચીજની ઉપર, અય એ કે નથી તેની સમાન
કોઈ ચીજ, અય એ કે નથી વધારો કરતી તેની
બાદશાહીમાં કોઈ ચીજ, અય એ કે નથી છુપી
કોઈ ચીજ તેની ઉપર, અય એ કે નથી ઓછી
થતી તેના ખજાનામાં કોઈ ચીજ, અય એ કે
નથી તેના જેવી કોઈ ચીજ, અય એ કે નથી
છુપી તેના ઘભથી કોઈ ચીજ, અય એ કે તેજ
જાણનાર છે દરેક ચીજથી, અય એ કે બોહળી
છે રહેમત તેની તમામ ચીજથી.

(૯૩) આધાશીશીની તકલીફ મટવા પટે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મેક

યા મુકરેમો યા મુર્એમો યા મુન્એમો યા
 મોઅંતી યા મુઁની યા મુકંની યા મુફની
 યા મોહંચી યા મુરેઝી યા મુન્જી

ખુદાવંદા ખરેખર હું સવાલ કરું છું તારી પાસે
 તારા નામ સાથે, અય મહેરબાન, અય
 ખવરાવનાર, અય નેઅમત દેનાર, અય બક્ષિશ
 કરનાર, અય ગની કરનાર, અય માલ દેનાર,
 અય ફના કરનાર, અય સજીવન કરનાર, અય
 ખુશ કરનાર, અય નજાત દેનાર.

(૯૪) પગની બીમારી મટવા માટે પઢે

યા અવ્વલ કુલ્લે શયેઈનં વ આર્ખેરહૂ
 યા એલાહ કુલ્લે શયેઈનં વ મલીકહૂ યા
 રબ્બ કુલ્લે શયેઈનં વ સૌનેઅંહૂ યા બારેઅ

કુલ્લે શયેઈને વ ખાંલેકુંહૂ યા કાંબેઝં કુલ્લે
 શયેઈને વ બાસેતુંહૂ યા મુબ્દેઓ કુલ્લે શયેઈને
 વ મોઈંદહૂ યા મુન્શોઅ કુલ્લે શયેઈને વ
 મોકુંદેરહૂ યા મોકવ્વેન કુલ્લે શયેઈને વ
 મોહુંવ્વેલહૂ યા મોહુંયેય કુલ્લે શયેઈને વ
 મોમીતહૂ યા ખાંલેકું કુલ્લે શયેઈને વ વારેસંહૂ

અય દરેક ચીજથી પહેલા અને છેલ્લા, અય
 ખુદા દરેક ચીજના અને બાદશાહ તેના, અય
 રબ તમામ ચીજના અને બનાવનાર તેના, અય
 પેદા કરનાર દરેક ચીજના અને ખાલીક તેના,
 અય સંકોચનાર દરેક ચીજના અને ખોલનાર તેના,
 અય શરૂ કરનાર દરેક ચીજના અને પાછી
 લાવનાર તેના, અય બનાવનાર દરેક ચીજના

અને નિર્માણ કરનાર તેના, અથ મૌજુદ કરનાર દરેક ચીજના અને બદલી નાખનાર તેના, અથ સજીવન કરનાર દરેક ચીજના અને મારનાર તેના, અથ પેદા કરનાર દરેક ચીજના અને વારીસ તેના.

(૯૫) નાકની બીમારી દૂર થવા પટે

યા ખંચેર ઝાંકેરિને વ મઝંકૂરિને યા
 ખંચેર શાકેરિને વ મશકૂરિને યા ખંચેર
 હાંમેદિને વ મહુંમુદિને યા ખંચેર શાહેદિને
 વ મશહૂદિને યા ખંચેર દાઈને વ મદેઉંવ્વિને
 યા ખંચેર મોજાબિને વ મોજાબિને યા
 ખંચેર મૂનેસિને વ અનીસિને યા ખંચેર

સાંહુંબિને વ જલીસિને યા ખંર મકુંસૂંદિને
વ મંત્લૂબિને યા ખંર હુંબીબિને વ મહુંબૂબ

અય ઉત્તમ યાદ કરનાર અને યાદ કરવામાં
આવેલા, અય ઉત્તમ શુકની કદર કરનાર અને
શુક કરવામાં આવેલા, અય ઉત્તમ તારીફ
કરનાર અને તારીફ થયેલ, અય ઉત્તમ ગવાહ
અને ગવાહી અપાએલમાં, અય ઉત્તમ
પુકારનાર અને પુકારવામાં આવેલાઓમાં, અય
ઉત્તમ કબૂલ કરનાર અને મકબૂલ થયેલામાં,
અય ઉત્તમ મુસાહેબો અને દોસ્તોમાં, અય ઉત્તમ
મુસાહેબો અને સોહબત રાખનારાઓમાં, અય
શ્રેષ્ઠ મકસૂદ અને મતલબમાં ઉત્તમ અય દોસ્ત
અને દોસ્તી થયેલમાં.

(૯૬) મોટાની બીમારી દૂર થવા પટે

યા મન હોવ લેમન દાંહો મોજીબુને
યા મન હોવ લેમન અતોંહો હુંબીબુને
યા મન હોવ એલા મન અહુંબહૂ કુંરીબુને
યા મન હોવ બેમનિસ્તહુંફઝહૂ રકીંબુને
યા મન હોવ બેમન રજાહો કરીમુને યા
મન હોવ બેમન અંસોંહો હુંલીમુને યા મન
હોવ ફી અંઝમતેહી રહીંમુને યા મન હોવ
ફી હિંકમતેહી અંઝીમુને યા મન હોવ ફી
એહુંસાનેહી કુંદીમુને યા મન હોવ બેમન
અરાદહૂ અંલીમ

અય એ કે જે કબૂલ કરે છે દુઆ કરનારની,
 અય એ કે જે પોતાની ફરમાબરદારોનો દોસ્ત
 છે, અય એ કે તેની સાથે મોહબ્બત રાખે છે
 તેની નજીક છે, અય એ કે જે તેની હિફાઝતમાં
 રહેવા માંગે છે તેને સાચવે છે, અય એ કે જે
 તેની પાસે ઉમ્મીદ રાખે છે તેના માટે મહેરબાન
 છે, અય એ કે જે તેની નાફરમાની કરે છે
 તેના માટે સહનશીલ છે, અય એ કે જે પોતે
 બુઝુર્ગ હોવા છતાં રહીમ છે, અય એ કે પોતાની
 હિકમતમાં મોટો છે, અય એ કે જે પોતાના
 એહસાનમાં કદીમ છે, અય એ કે જે તેનો ઇરાદો
 કરે છે તેને જાણનાર છે.

(૯૭) ગળાની બીમારી દૂર થવા પટે

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બિસ્મોક

યા મોસબ્બોબો યા મોરૅૅૅબો યા

મોકુંલેલેબો યા મોઝુંકુંકુંબો યા મોરત્તેબો
યા મોખુંવેફો યા મોહુંઝુંઝુંરો યા
મોઝુંકુંકુંરો યા મોસખુંખુંરો યા મોગુંચેર

ખુદાવંદા ખરેખર હું સવાલ કરું છું તારી પાસે
તારા નામ સાથે અય સખખ પેદા કરનાર, અય
ચાહના અપાવનાર, અય દિલને ફેરવનાર, અય
શિક્ષા કરનાર, અય તરબીયત કરનાર, અય
ડરાવનાર, અય ખચાવનાર, અય યાદ
અપાવનાર, અય તાબે કરનાર, અય બદલી
નાખનાર.

(૯૮) પીંડીની બીમારી દૂર થવા પટે

યા મનં ઈંદમોહૂ સાબેકુંનં યા મનં
વઅંદોહૂ સોંદેકુંન યા મનં લુત્તંફોહુ ઝોંહેરૂનં

યા મનં અમ્રોહૂ ગૌલેબુન યા મનં કેતાબોહૂ
 મોહકમુનં યા મનં કંઝાઓહૂ કાએનુનં યા
 મનં કુંરેઆનોહૂ મજ્જુનં યા મનં મુલ્કોહૂ
 કંદીમુનં યા મનં ફઝલોહૂ અંમીમુનં યા
 મનં અંરેશોહૂ અંઝીમ

અય એ કે ઇલ્મ તેનું પહેલેથી જ છે, અય એ
 કે વાયદો તેનો ખરો છે, અય એ કે મેહરબાની
 તેની જાહેર છે, અય એ કે હુકમ તેનો ગાલીબ
 છે, અય એ કે કિતાબ તેની મજબૂત છે, અય એ
 કે હુકમ તેનો થનાર જ છે, અય એ કે કુરઆન
 તેનું બુઝુર્ગ છે, અય એ કે બાદશાહી તેની કદીમ
 છે, અય એ કે ફઝલ તેનો (બધા માટે) સામાન્ય
 છે, અય એ કે અર્શ તેનું બુઝુર્ગ છે.

(૯૯) દાંતનો દુઃખાવો દૂર થવા પટે

યા મનં લા યશ્ગંલોહૂ સમ્હંનં અંનં
સમ્હંનં યા મનં લા યમ્નઓહૂ ફેઅંલુન
અંનં ફેઅંલિનં યા મનં લા યુલ્હીહે કુંલ્લુનં
અંનં કુંલ્લીનં યા મનં લા યોગંલ્લેતોહૂ
સોઆલુનં અંનં સોઆલિનં યા મનં લા
યહ્જોબોહૂ શયંઉનં અંનં શયંઇનં યા
મનં લા યુબ્રેમોહૂ ઇલ્હોહુંલં મુલેહ્હીન
યા મનં હોવ ગોયતો મોરાદિલં મોરીદીનં
યા મનં હોવ મુન્તહા હેમમિલં આંરેફીન
યા મનં હોવ મુન્તહા તંલબિતં તંલેબીન

યા મને લા યજ્ઞે અંલય્હે ઝંરુતુને ફિલે
ઔલમીન.

અય એ કે મશગૂલ નથી કરતું તેને સાંભળવું
તેને કાંઈ સાંભળવાથી, અય એ કે નથી
અટકાવતું કોઈ કામ તેને કોઈ કામથી, અય
એ કે ગાફીલ નથી કરતી કોઈ વાત તેને કોઈ
વાતથી, અય એ કે નથી ભુલવાડતો કોઈ સવાલ
તેને કોઈ સવાલથી, અય એ કે તેને આડી
આવતી નથી કોઈ ચીજ કોઈ ચીજથી, અય એ
કે નથી આજુઝ કરતું તેને કરગરવું
કરગરવાવાળાઓનું, અય એ કે તેજ અંત છે
મુરાદનો માગનારાઓને, અય એ કે તેજ મક્સૂદ
છે આરેફોની હિંમતનો, અય એ કે તેજ અંત
છે તલબ કરનારાઓના મતલબનો, અય એ કે
નથી છુપું તેની ઉપર રજકણ પણ દુનિયાનું.

(૧૦૦) હાડકાનો દુઃખાવો દૂર થવા પટે

યા હુંલીમનં લા યઅંજલો યા જવાદન
લા યબ્બંલો યા સોંદેકેનં લા યુબ્બેફો
યા વહાંબનં લાય મલ્લો યા કોંહેરન
લા યુગંલબો યા અંઝીમનં લા યૂસંફો યા
અંદેલનં લા યહીંફો યા ગંનિચન લા
યફેતકેરો યા કબીરનં લા યફેંગોરો યા
હોફેઝંનં લા યગંફોલ

અય એવા સહનશીલ કે ઉતાવળ નથી કરતો,
અય એવા સખી કે બુબ્લ (કંજૂસાઈ) નથી કરતો,
અય એવા વાયદાના સાચા કે ખિલાફ નથી
કરતો, અય એવી બક્ષીશ કરનાર કે કંટાળતો

નથી, અય એવા ઝખરદસ્ત કે હારતો નથી,
 અય એવા બુઝુર્ગ કે જેની તારીફ નથી થઇ
 શકતી, અય એવા આદીલ કે મુલ્મ નથી કરતો,
 અય એવા તવંગર કે મોહતાજ નથી થતો, અય
 એવા મોટા કે નાનો નથી થતો, અય એવા
 રક્ષક કે ગાફીલ નથી થતો.

દુઆએ નુદબા

બિસ્મિલ્લાહિર રહુમાનિર રહીમ

અલહુમ્દો લીલ્લાહે રબ્બિલ આલમીન
 વ સલ્લલ્લાહો અલ્લા સય્યેદેના મોહુમ્મદિન
 નબીયયેહિ વ આલેહિ વ સલ્લમ તસલીમા
 અલ્લાહુમ્મ લકલ હુમ્દો અલ્લા મા જરા
 બેહિ કુંઝાઝાક ફી અવલેયાએકલ અલ્લ

લઝીનસૈ તૈખેલસૈતલુમ લે નફસેક વ દીનેક
 એઝિખૈતરેત લલુમ જઝીલ મા ઈનેદક
 મેનને નઈમિલે મોકીમિલે લંઝી લા ઝવાલ
 લલુ વલઝૈ મિહૈલાલ બંઅદ અને શરતૈત
 અંલયહે મુઝઝોહૈદ ફી દરજાતે હાઝૈહિદૈ
 દુનયદૈ દનીયૈતે વ ઝુખૈરોફેહાવ ઝિખૈરેજેહા
 ફ શરતૈ લક ઝાંલેક વ અંલિમૈત મિનેહોમુલૈ
 વફાઅ બેહિ ફકૈબિલૈતલુમ વ કૈરૈરબૈતલુમ
 વ કૈદૈદમૈત લહોમુઝૈ ઝિંકરૈલ અંલીયૈય
 વસૈસૈનાઅલૈ જલિયૈય વ અહૈબતૈત
 અંલયહેમૈ મલાઅેકતક વ કરૈરમૈતલુમ

બે વહ્યૈક વ રફદૈતહુમં બે ઈલેમેક વ
 જઅલેતહોમુંઝં ઝંરીઅંત એલયેક વલે
 વસીલત એલા રિઝંવાનેક ફ બઅંઝુંન
 અસંકનેતહુ જનેનતક એલા અને અખેરજૈતહુ
 મિનેહા વ બઅંઝુંને હુંમલેતહુ ફી ફુલેકેક
 વ નજૈજયેતહુ વ મને આમન મઅંહુ મેનલે
 હલકતે બે રહુંમતેક વ બઅંઝુંની તખંઝંતહુ
 લે નફસેક ખંલીલને વ સઅલક લેસાન
 સિદૈકિને ફિલે આખેરીન ફ અજબૈતહુ વ
 જઅલેત ઝાંલેક અંલીયેયા વ બઅંઝુંને
 કલેલમતહુ મિને શજરતિને તકલીમને વ

જાંલેત લહુ મિનં અંખીહહે રિદંઅનં વ
 વઝીરા વ બઅંઝુંને અવલદંતહુ મિનં ગંચેરે
 અબિનં વ આતયંતહુલં બચેચેનાતે વ
 અચેચદંતહુ બે રૂહિલં કોદોસે વ કુલંલુન
 શરઅંત લહુ શરીઅંતનં વ નહજંત લહુ
 મિનંહાજા વ તખંચેચરંત લહુ અવેસંચોઅ
 મુસંતહંફેઝંને બઅંદ મુસંતહંફેઝંન મિનં
 મુદંદતિનં એલા મુદંદતિનં એકાંમતનં લે
 દીનેક વ હુંજંજતનં અંલા એબાદેક વ લે
 અલેલા યઝૂલલં હંકંકોં અંને મકંરેરેહિ વ
 યગંલેબલં બાર્તેલો અંલા અહલેહિ વલા

યકુંલો અહુંદુને લવે લા અરેસલેત એલયેના
 રસૂલમે મુનેઝેરને વ અકુંમેત લના અંલમને
 હાદેયને ફનતેતબેઅં આયાતેક મિને કુંબેલે
 અને નઝીલલ વ નખેઝા એલા અનિને તહયેત
 બિલે અમરે એલા હુંબીબેક વ નજીબેક
 મોહુંમમદિને સંલેલલેલાહો અંલયેહે વ
 આલેહિ ફકાન કમને તજબેતહુ સયેયેદ
 મને ખંલકુંતહુ વ સંફેવત મનિસે તંફયેતહુ
 વ અફેઝેલ મનિજે તબયેતહુ વ અકરમ
 મનિઅં તમદેતહુ કુંદમ્મતહુ અંલા અમબેયાએક
 વ બઅંસંતહુ એલસં સંકુંલેયેને મિને એબાદેક

વ અવૃત્તિઅતલુ મશારેકુંક વ મગાંરેબક વ
 સખેખેરેત લહુલે બોરાકું વ અંરજેત બે
 હિ એલા સમાએક વ અવૃદઅંતલુ ઈલમ
 મા કાન વ મા યકૂનો એલને કેઝાંએ ખેલકેક,
 સુંમ્મ નસેરેતલુ બિરેરાંએ બે વ હુંફફેતલુ
 બે જબેરેઈલ વ મીકાઈલ વલે મોસવેવેમીન
 મિને મલાએકતેક વ વઅંદેતલુ અને તુઝાંહેર
 દીનલુ અંલદે દીને કુલેલેહિ વ લવે કરેહલે
 મુશરેકૂન વ ઝાંલેક બઅંદ અને બવેવઅંતલુ
 મોબવેવઅ સિંદેકિને મિને અહલેહિ વ
 જઅંલેત લહુ વ લહુમ અવેવલ બયેતિને

વોઝેઝે લિનેનાસે લલ્લી બેબકત મોબારકને
 વ હોદને લીલ આંલમીન ફીહે આયાતુને
 બયયેનાતુને મકાંમો ઈબરાહીમ વ મને
 દખ્લહુ કાન આમેનને વ કુંલેત ઈનેનમા
 યોરીદુલ્લાહો લે યુઝહેબ અંનેકોમુરે રિજેસ
 અહલલે બયેતે વ યોતંહહેરકુમ તતંહીરા
 સુંમમ જાંલેત અજર મોહુંમમદિને
 સંલવાતોક અંલયહે વ આલેહિ મવદદતહુમે
 ફી કેતાબેક ફ કુંલેત કુલે લા અસેઅલોકુમ
 અંલયહે અજરન ઈલેલલે મવદદત ફિલે
 કુંરેબા વ કુંલેત મા સઅલેતોકુમે મિને અજરે

ફ હોવ લકુમં વ કુંલ્ત મા અસંઅલોકુમં
 અંલયહે મિનં અજરિનં ઈલલા મનં શાઅ
 અંયં યતંતખેઝં એલા રબંબેહિ સબીલનં ફ
 કાનૂ હોમૂસં સબીલ એલયક વલં મસંલક
 એલા રિઝંવાનેક ફ લમંમનં કંઝંતં અયંયામોહુ
 અકાંમ વલીયંયહુ અંલી યબંન અબી
 તાંલેબિનં સંલવાતોક અંલયહેમા વ આલેહેમા
 હાદેયનં ઈઝં કાન હોવલં મુનંઝંર વ લે
 કુલલે કંવંમિનં હાદિનં ફ કાંલ વલં મલઓ
 અમામહુ મનં કુનંતો મવંલાહો ફ અંલીયંયુન
 મવંલાહો અલંલાહુમંમ વાલે મનં વાલાહો

વ આંદે મને આંદાહો વનેસુંરે મને નસુંરહુ
 વેખંઝુંલે મને ખંઝંલહુ વ કોલ મને કુનેતો
 અના નબીયયહુ ફ અંલીયયુને અમીરોહુ
 વ કોલ અના વ અંલીયયુને મિને શજરતિને
 વાહુંદતિને વ સાએરુને નાસે મિને શજરીને
 શતતા વ અહુંલેલહુ મહુંલેલ હારુન મિમ
 મૂસા ફ કોલ લહુ અનેત મિનેની બે મનેઝેલતે
 હારુન મિમ મૂસા ઈલેલા અનેનહુ લા
 નબીયય બઅંદી વ ઝવેવજહુબનેતહુ સયયેદત
 નેસાઈલે આંલમીન વ અહુંલેલ લહુ મિમ
 મસેજેદેહિ મા હુંલેલ લહુ વ સદેદલે અબેવાબ

ઈલેલા બાબલુ સુંમમ અવેદઅંલુ ઈલેમલુ
 વ હિકમતલુ ફ કાંલ અના મદીનતુલ ઈલેમે
 વ અંલીયયુને બાબોહા ફ મને અરાદલ
 મદીનત વલે હિકમત ફલેયઅતેહા મિમ
 બાબેહા સુંમમ કાંલ અનેત અખી વ વસીયેયી
 વ વારેસી લહમોક મિને લહમી વ દમોક
 મિને દમી વ સિલમોક સિલમી વ હરબોક
 હરબી વલે ઈમાનો મોખાંલેતુંને લહમક
 વ દમક કમા ખાંલતે લહમી વ દમી વ
 અનેત ગંદને અંલલે હવેઝે ખંલીફતી વ
 અનેત તકઝી દયેની વ તુનેજેઝો એદાતી

વ શીયેઁતોક ઁલા મનાબેર મિનં નૂરિનં
 મુબેયઁઁતને વોજુહોહુમ હંવેલી ફિલે જનંતે
 વ હુમં જીરાની વ લવં લા અનંત યા ઁલીયેયો
 લમં યુઁરફિલે મુઁમેનૂન બઁઁદી વ કાન
 બઁઁદહૂ હોદમં મેનઁઁ ઁલાલે વ નૂરમં
 મેનલે ઁમા વ હંબેલલેલાહિલે મતીન વ
 સેરાતંહુલે મુસંતકીમં વલા યુસંબકોં બે
 કંરાબતિનં ફી રહંમિનં વલા બે સાબેકંતિનં
 ફી દીનિનં વલા યુલેહંકોં ફી મનંકંબતિનં
 મિમં મનાકંબેહિ યહંઁ હંઁવરે રસૂલે
 સંલલેલાહો ઁલયેહેમા વ ઁલેહેમા વ

યોકાંતેલો અંલત તઅંવીલે વલા તઅખોઝાંહુ
 ફિલલાહે લવમતો લાએમિને કંદે વતર
 ફીહે સંનાદીદલ અંરબે વ કંતલ અખતાંલહુમ
 વ નાવશ ઝુંઅબાનહુમ ફ અવેદઅં કોલૂબહુમ
 અહુંકોંદને બદરીયયતને વ ખંયેબરીયયતને
 વ હોંનયેનીયયતને વ ગંયેર હુનેન ફ
 અઝંબેબતે અંલા અંદાવતેહી વ અકબેબતે
 અંલા મોનાબઝંતેહી હંતેતા કંતલને નાકેસીન
 વલે કાંસેતીને વલે મારેકીને વ લમમા કંઝાં
 નહુંબહુ વ કંતલહુ અશકંલે આખેરીન
 યતેબઓ અશકંલે અવેવલીન લમે યુમેતસંલે

અમરો રસૂલિલલાહે સંલલલલાહો અંલયહે
 વ આલેહી ફિલ હાદીન બઅંદલ હાદીન
 વલ ઉમમતો મોસિરેરતુન અંલા મકતેહિ
 મુજતમેઅંતુન અંલા કંતીઅંતે રહેંમેહિ વ
 ઈકસાંએ વુલદેહી ઈલલલ કંલીલ મિમમન
 વફા લે રેઆંયતિલ હંકકે ફી હિમ ફ કોતેલ
 મનકોતેલ વ સોબેય મન સોબેય વ ઉકસેય
 મન ઉકસેય વ જરલ કંઝાઓ લહુમ બે
 મા યુરજા લહુ હુંસેનુલે મસૂબતે ઈઝં કાનતિલ
 અરઝાં લિલલાહે યૂરેસાંહા મન યશાઓ
 મિન અંબાદેહિ વલ આંકેબતો લિલ મુતેતકીન

વ સુખ્હાંન રબેબેના ઈને કાન વઅંદો રબેબેના
 લ મફેઉલને વ લને યુખેલેફલેલાહો વઅંદહુ
 વ હોવલે અંઝીઝુલે હુંકીમો ફ અંલલે
 અતાંએબે મિને અહલેબયતે મોહમ્મદિને
 વ અંલીયેયીન સંલેલલેલાહો અંલયહેમા
 વ આલેહેમા ફલે યબેકિલે બાકૂન વ
 ઈયેયાહુમ ફલેયનેદોબિને નાદેબૂન વલે
 મિસંલેહિમ ફલે તઝરફિદ દોમૂઓ વલે
 યસંરોબિસં સાંરેખૂન વ યઝિજે જઝંઝાજેજૂન
 વ યઈજેજલે આંજેજૂને અયેનલે હુંસનો
 અયેનલે હુંસયેનો અયેન અબેનાઉલે હુંસયેને

સાંલેહુંમં બઅંદ સાંલેહિને વ સાંદેકુંને બઅંદ
 સાંદેકિને અયેનસં સબીલો બઅંદસં સબીલે
 અયેનલ ખેયરતો બઅંદલ ખેયરતે અયેનશ
 શોમૂસુતે તાંલેઅંતો અયેનલ અકમારૂલ
 મોનીરતો અયેનલ અનજોમુઝ ઝાહેરતો
 અયેન અઅંલામુદ દીને વ કંવાઅંદુલ ઈલેમે
 અયેન બકીયેયતુલેલાહિલ લતી લા તખેલૂ
 મેનલ ઈતેરતિલ હાદેયતે અયેનલ મોઅંદદો
 લે કંતેએ દાબેરિઝે ઝંલમતે અયેનલ મુન્તઝેરો
 લે એકાંમતીલ અમ્તે વલે અવજે અયેનલ
 મુરેતજા લે એઝાલતિલ જવેરે વલે ઉદેવાને

અર્ચનલે મુદ્દેખંરો લે તજ્જેદીદીલે ફરાએઝે
 વસ્સોનને, અર્ચનલે મુતખંયંરો લે એઆંદતિલે
 મિલેલતે વશે શરીઅંતે, અર્ચનલે મોઅમમલો
 લે એહંયાઈલે કેતાબે વ હોદ્દૂદેહિ અર્ચન
 મુહંયી મઆંલેમિદે દીને વ અહલેહિ અર્ચન
 કાંસેમો શવકતિલે મુઅંતદીન અર્ચન હાદેમો
 અબનેયતિશે શિરકે વન નેફાકે અર્ચન
 મોબીદો અહલિલે ફોસૂકે વલે ઈસંયાને
 વતંતુંગંયાને અર્ચન હાંસેદો ફોરૂઈલે ગંયે
 વશે શેકાંકે અર્ચન તાંમેસો આસાંરિઝે ઝયગે
 વલે અહવાએ અર્ચન કાંતેઓ હંબાએલિલે

કિઝંબે વલ ઈફેતેરાએ અયન મોબીદુલ
 ઓતાતે વલ મરદતે અયન મુસતઅસેલો
 અહલિલે એનાદે વતે તઝંલીલે વલ ઈલેહાદે
 અયન મોઈઝંઝુલે અવલેયાએ વ મોઝિલેલુલે
 અઅંદાએ અયન જામેઉલે કલેમતે અંલતે
 તકંવા અયન બાબુલેલાહિલે લઝી મિનેહો
 યુઅતા અયન વજહુલેલાહિલે લઝી એલયહે
 યતવજજહુલે અવલેયાઓ અયનસે સબબુલે
 મુતેતસેલો બયનલે અરેઝે વસે સમાએ અયન
 સાંહેબો યવમિલે ફતહે વ નાશેરો રાયતિલે
 હોદા અયન મોઅલેલેફો શમલિસે સંલાહે

વરેરેઝાં અચનતે તાંલેબો બે ઝાંહૂંલિલ
 અમબેયાએ વ અબનેાઈલ અમબેયાએ
 અચનતે તાંલેબો બે દમિલ મકેતૂલે બે
 કરબલાઅ અચનલે મનસૂરો અંલા
 મનિઅંતદા અંલયેહે વફેતરા અચનલે
 મુઝંતેરેરૂલે લઝાં યોજાબો એઝાં દઝાં અચન
 સંદેરૂલ ખંલાએકે ઝુંલ બિરેરે વતે તકેવા
 અચનબેનુને નબીયેયિલ મુસંતેફા વબંનો
 અંલીયેનીલે મુરેતઝાં વબનો ખંદીજતલે
 ગંરેરાએ વબનો ફાતેમતલે કુબેરા બે અબી
 અનત વ ઉમ્મી વ નફેસી લકલે વેકાંઓ

વલ્લે હુંમા યબ્નેસૌ સાદતિલ્લે મોકુંરેરબીન
 યબ્નેનીને નોજબાઈલ્લે અકુંરમીન યબ્નેલ્લે
 હોદાતિલ્લે મહુંદીયેયીન યબ્નેલ્લે ખેંયરતિલ્લે
 મોહઝંઝબીન યબ્નેલ્લે ગુંતાંરેફતિલ્લે
 અનૈજબીન યબ્નેલ્લે અતાંએબિલ્લે
 મોતુંહુંહરીન યબ્નેલ્લે ખુંઝાંરેમતિલ્લે
 મુનેતજબીન યબ્નેલ્લે કુંમાકુંમતીલ્લે અકુંરમીન
 યબ્નેલ્લે બોદૂરીલ્લે મોનીરતે યબ્નેસૌસોરોજિલ્લે
 મોઝાંઅતે યબ્નેશૌ શોહોબિસૌ સાંકુંબતે
 યબ્નેલ્લે અનૈજોમિઝં ઝાહેરતે યબ્નેસૌ
 સોબોલિલ્લે વાઝુંહુંતે યબ્નેલ્લે અઅંલામિલ્લે

લાએહુંતે યબનલ ઓલૂમિલ કામેલતે યબનસ
 સોનનિલ મશહૂરતે યબનલ મઆંલેમિલ
 મઅસૂરતે યબનલ મુઅંજઝાતિલ મવજૂદતે
 યબનદ દલાએલિલ મશહૂદતે યબનસ
 સેરાતિલ મુસતકીમે યબનન નબઈલ અંઝીમે
 યબન મન હોવ ફી ઉમમિલ કેતાબે લદલલાહે
 અંલીયયુન હુંકીમુન યબનલ આયાતે વલ
 બયયેનાતે યબનદ દલાએલિઝ ઝાહેરાતે
 યબનલ બરાહીનિલ વાઝેહાંતિલ બાહેરાતે
 યબનલ હોજજલ બાલેગાંતે યબનન નેઅંમિસ
 સાબેગાંતે યબન તાંહા વલ મુહુંકમાતે યબન

યાસીન વઝં ઝાંરેયાતે યબેનતે તૂંરે વલ
 આંદેયાતે યબેન મને દના ફતદલેલા ફ
 કાન કાંબ કુંવેસયને અવે અદના દોનૂવને
 વકુંતેરાબમે મેનલે અંલીયેયિલે અઅંલા લયેત
 શેઅંરી અયેનસે તકુંરેરતે બેકને નવા બલે
 અયેયો અરેઝિને તોકિલેલોક અવે સંરા
 અબેરઝંવા અવે ગંયેરેહા અમે ઝીં તોંવા
 અંઝીઝુને અંલયેય અને અરલે ખંલેકું વ
 લા તોરા વ લા અસેમઓ લક હંસીસને વ
 લા નજવા અંઝીઝુને અંલયેય અને તોહીતે
 બેક દૂનેયલે બલેવા વ લા યનાલોક મિનેની

ઝંજીજુને વ લા શકવા બે નફેસી અનંત
 મિમં મોગંયેયબિને લમં યખેલો મિનેના
 બે નફેસી અનંત મિને નાઝેહિને મા નઝહું
 અંનેના બે નફેસી અનંત ઉમનીયેયતો
 શાએકિને યતમનેના મિને મુઅમેનિને વ
 મુઅમેનતિને ઝંકરા ફ હુંનેના બે નફેસી
 અનંત મિને અંકીદે ઈઝ્ઝિને લા યોસામા
 બે નફેસી અનંત મિને અસીલે મજદિને
 લા યોજારા બે નફેસી અનંત મિને તેલાદે
 નેઅંમિને લા તોઝાંહા બે નફેસી અનંત
 મિને નસીફે શરફિને લા યોસાવા એલા

મતા અહોરો ફીક યા મવલાય વ એલા
 મતા વ અયેય ખેતોંબિને અસેફો ફીક વ
 અયેય નજવા અંઝીઝુને અંલયેય અને ઓજાબ
 દુવેનક વ ઓનાગોં, અંઝીઝુને અંલયેય અને
 અબકેયક વ યખેઝોં લકલે વરા અંઝીઝુને
 અંલયેય અને યજરેય અંલયેક દૂનહુમે મા
 જરા હલે મિને મોઈનિને ફ ઓતીલ મઅંહુલ
 અંવીલ વલે બોકાઅ હલે મિને જઝૂઈને ફ
 ઓસાઅંદ જઝઅંહૂ એઝાં ખંલા હલે કંઝેયતે
 અંયેનુને ફ સાઅંદતેહા અંયેની અંલલે કંઝાં
 હલે એલયેક યબેન અહૂંમદ સખીલુને ફ

તુલકોં હલે યત્સોલો યવમોના મીન્ક
 બેએદતીન ફ નહઝોં મતા નરેદો મનાહેલકરે
 રવીયયત ફ નરેવા મતા નન્તફેઓ મીન
 અંઝંબે માએક ફ કંદે તોલસોં સંદા મતા
 નોગોંદીક વ નોરાવેહોંક ફ નોકિરેરો અંયેનને
 મતા તરાના વ નરાક વ કંદે નશરેત લેવાઅને
 નસરે તોરા અતરાના નહુંફેફો બેક વ અન્ત
 તઉમ્મુલે મલઅ વ કંદે મલઅતલે અરેઝં
 અંદેલને વ અઝંકંત અઅંદાઅક હવાનને
 વ એકોંબને વ અબરેતલે ઓતાત વ જહંદતલે
 હુકંકે વ કંતેઅંત દાબેરલે મોતકબેબેરીન

વજૈતસંસંત ઓસૂંલુઝે ઝાંલેમીન વ નહુંનો
 નકૂંલુ અલે હુંમદો લિલેલાહે રબેબિલે
 આંલમીન અલેલાહુમમ અન્ત કશોશાકુલ
 કોરબે વલે બલેવા વ એલયેક અસંતઅંદી
 ફ ઈન્દકલે અંદેવા વ અન્ત રબેબુલે આખેરતે
 વદે દુન્યા ફ અગિસં યા ગેયાસંલે
 મુસંતગીસીન ઓબયેદકલે મુબેતલા વ અરેહિ
 સયેયેદહૂ યા શદીદલે કોવા વ અઝિલે અંનેહો
 બેહિલે અસા વલે જવા વ બરેરિદે ગંલીલહુ
 યા મને અંલલે અંરેશિસે તવા વ મને
 એલયેહીરે રૂજઆં વલે મુનેતહા અલેલાહુમમ

વ નહીંનો અંબીદોકત તોએકૂંન એલા
 વલીયેકલે મોઝંકેકેરે બેક વ બે નબીયેક
 ખંલકેતહદુ લના ઈસંમતને વ મલાઝંને વ
 અકંમતહુ લના કેવામને વ મઆંઝંને વ
 જઅલેતહુ લિલે મુઅમેનીન મિન્ના ઈમામને
 ફ બલેલિગોહો મિન્ના તહીયેયતને વ સલામને
 વ ઝિદના બે ઝાંલેક યા રબેબે ઈકેરામને
 વજેઅંલે મુસતકેરેરહૂ લના મુસતકેરેરન
 વે મોકાંમને વ અતેમિમ નેઅંમતક બે
 તકેદીમેક ઈયેયાહો અમામના હંતેતા તૂરેદના
 જેનાનક વ મોરાફકેતશે શોહદાએ મિને

ખોલસાંએક અલેલાહુમમ સંલ્લે અંલા
 મોહુંમમદિનં વ આલે મોહુંમમદિનં વ સંલ્લે
 અંલા મોહુંમમદિનં જદેદેહિ વ રસૂલેકસં
 સયયોદિલં અકબરે વ અંલા અબીહિસં
 સયયોદિલં અસંગૌરે વ જદેદતેહિસં
 સિદદીકંતિલં કુબરેા ફાતેમત બિન્તે
 મોહુંમમદિનં વ અંલા મનિસં તંફયત મિનં
 આબાએહિલં બરરતે વ અંલયહે અફઝંલ
 વ અકમલ વ અતમમ વ અદવમ વ અકસંર
 વ અવફર મા સંલ્લયત અંલા અહુંદિમં
 મિનં અસંફેયાએક વ ખેયરતેક મિનં ખંલકેક

વ સૈલેલે અંલયેહે સૈલાતને લા ગાંયત લે
 અંદદેહા વલા નેહાયત લે મદદેહા વ લા
 નફાદ લે અમદેહા અલેલાહુમમ વ અકિમ
 બેહિલે હુંકુંકું વ અદેહિઝં બેહિલે બાતેલ
 વ અદિલે બેહી અવલેયાઅક વ અઝં
 લીલે બેહી અઅંદાઅક વ સૈલિલેલાહુમમ
 બયેનના વ બયેનહુ વુસૈલતને તોઅદદેહી
 એલા મરાફકુંતે સલફેહી વજઅંલેના મિમમને
 યઅખોઝાં બે હુંજતેહિમ વ યમકોસાં
 ફી ઝિલેલેહિમ વ અઈનેના અંલા તઅદેયતે
 હોકૂકુંકુંહી એલયેહે વલે ઈજતેહાદે ફી

તાંઅંતેહી વજતેનાબે મઅંસેયતેહી વમનુને
 અંલયના બે રેઝાંહો વ હબં લના રઅંફતહુ
 વ રહંમતહુ વ દોઆંઅહુ વ ખંયરહુ મા
 નનાલો બેહી સઅંતમં મિને રહંમતેક વ
 ફવંઝને ઈનેદક વજઅંલે સંલાતના બેહી
 મકંબૂલતને વ ઝાંનૂબના બેહી મગંફુરતને
 વ દોઆંઅના બેહિ મુસ્તજાબને વજઅંલે
 અરંઝાકંના બેહિ મબંસૂતંતને વ હોમૂમના
 બેહિ મકંફીયંયતને વ હંવાંએજના બેહિ
 મકંઝીયંયતને વ અકંબિલે એલયના બે
 વજહેકલે કરીમે વકંબેલે તકંરેરોબના એલયંક

વનેઝુંર એલયેના નઝુંરતન રહીંમતને
 નસેતકેમેલો બેહલે કરામત ઈંનદક સુંમેમ
 લા તેસંરિફેહા અંનેના બે જૂદેક વસેકેના
 મિને હુંવેઝું જદેદેહિ સંલેલલેલાહો અંલયેહે
 વ આલેહિ બે કઅસેહી વ બે યદેહી રયેયને
 રવીયેયને હનીઅને સાએગંને લા ઝંમઅ
 બઅંદહુ યા અરેહમરે રાહુંમીન.

દુઆએ નુદબા

(ફઝીલત અને ગુજરાતી અનુવાદ)

ઈમામે ઝમાના (અ.સ.)ને ગયબતના ઝમાનામાં યાદ
 કરવા અને આપ (અ.સ.)ની નજદીકી હાંસીલ કરવા
 માટે “દુઆએ નુદબા” એક બેહતરીન વસીલો છે.

ગયબતના ઝમાનામાં મોઅમીનો તકલીફો અને મુસીબતોમાં જીવન વિતાવી રહ્યા છે, ત્યારે પોતાના ઈરાદા ઉપર મક્કમ રહેવા માટે અને પોતાની હાજતો પૂરી કરવા માટે આ દુઆ દર શુક્રવારે (ખાસ કરીને નમાઝે સુબ્હ પછી) પઢવી જોઈએ, કારણ કે જુમ્હાનો દિવસ ઈમામે ઝમાના (અ.સ.) સાથે ખાસ સંબંધિત છે. જુમ્હાના દિવસે આપ (અ.સ.) ઝહૂર ફરમાવશે.

આ દુઆની તિલાવત દરમ્યાન અથવા દુઆ પૂરી થયા પછી પોતાની હાજત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે માંગો, ઈન્શાઅલ્લાહ પૂરી થશે.

સામાન્ય રીતે ઉર્દૂમાં પઢવામાં આવતી દુઆને બધા મોઅમીનો સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. તેથી આ દુઆને ઉર્દૂમાંથી ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને પ્રસિદ્ધ કરવામાં આવે છે. અરબી સારી રીતે વાંચી શકનાર બિરાદરોએ બધી જ દુઆઓ અરબીમાં જ પઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ દુઆનો ભાવાર્થ સમજવાથી વિશેષ મઅરેફત મેળવી શકાય છે.

દુઆએ નુદબા ચાર ઈદોમાં પઢવી મુસ્તહબ છે:

૧. ઈદે ફીત્ર

૨. ઈદે કુરબાન

૩. ઈદે ગદીર

૪. જુમ્હાના દિવસે

દુઆએ નુદબાનો ગુજરાતી ભાવાનુવાદ નીચે મુજબ છે:

દુઆએ નુદબાનો ગુજરાતી ભાવાનુવાદ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રેહમાન અને રહીમ છે.

તમામ પ્રશંસા એ અલ્લાહ માટે છે, જે દુનિયાઓનો પાલનહાર છે. તેના નબી અને અમારા સરદાર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની પવિત્ર આલ ઉપર રહેમત અને એવી સલામ થાય જેવી સલામ થવાનો હક છે.

અય અલ્લાહ! જે હુકમો તેં અલ્લીયા માટે નિશ્ચિત કર્યા છે, તેઓને તારા અને તારા દીન માટે ચૂંટી લીધા છે, તે માટે તું વખાણ કરવાને લાયક છો. તેઓ ઉપર તારી નેઅમતોમાંથી સૌથી ઉચ્ચ કક્ષાની નેઅમત વરસાવી જે

અવિનાશી છે.

અય અલ્લાહ! તું તેઓને ઝલીલ દુનિયા અને તેના આકર્ષણને ન રાખવાનો વાયદો લીધો. (તેઓને પરહેઝગારીનો પોશાક પહેરાવ્યો.) અલબત્ત, તુ એ વાતને સારી રીતે જાણતો જ હતો કે તેઓ એ શરતોનું અચૂકપણે પાલન કરનારા છે. તેથી તેં આ કાર્યોને તેમના માટે જરૂરી બનાવી દીધા. તેના બદલા રૂપે તેં તેઓની પ્રશંસા અને તેઓની યાદને ઉચ્ચતા અર્પી અને તેમના ઉપર તારા મલાએકાઓને નાઝિલ કર્યા અને તેમને તારી વહી વડે માનવંત બનાવ્યા, તેં તારા ઈલ્મ વડે નવાજ્યા, અને તેઓને તારી તરફ આવવાનો તેમજ તારી ખુશ્નુદીને હાંસિલ કરવાનો વસીલો બનાવ્યા. પછી તેમાંથી અમુકને જન્નતના બગીચાઓમાં સ્થાન આપ્યું, ત્યાં સુધી કે તે તેમને તેની બહાર મોકલ્યા. અને તેઓમાંથી અમુકને તેં હોડીમાં સવાર કર્યા અને રહેમત થકી તેં તેમને અને તેમના પર ઈમાન લાવનારાઓને વિનાશથી બચાવી લીધા તેઓમાંથી અમુકને તારા ખલીલ તરીકે ચૂંટી કાઢ્યા. તેઓએ વિનંતી કરી

આખર જમાનામાં સાચી જબાન આપવામાં આવે તેમની ઈચ્છા પૂર્ણ કરી ઉચ્ચ દરજ્જા પર નિયુક્ત કર્યા તેઓમાંથી અમુકની સાથે ઝાડ મારફત વાત કરી તેઓના ભાઈને સાચી અને વઝીર બનાવ્યા તેઓમાંથી અમુકને પિતા વિના પેદા કર્યા અને સ્પષ્ટ નિશાનીઓ આપી રહુલકુદુસ થકી તેમની મદદ કરી દરેક માટે શરીર અત બનાવી દરેક માટે જીવનશૈલી (રસ્તા) નક્કી કર્યા તેઓ માટે વસી ચૂંટી કાઢ્યા, એક મુદ્દતથી બીજી મુદ્દત સુધી કે જેથી તારા બંદાઓ પર હુજ્જત તમામ થાય અને હક પોતાના કેન્દ્રથી હટી ન જાય. સત્ય ઉપર અસત્ય ગાલીબ ન થઈ જાય. આ ઉપરાંત કોઈ એમ પણ કહી ન શકે કે અમારા માટે કોઈ ડરાવનાર પયગંબરને શા માટે ન મોકલ્યા? અમારા માટે માર્ગદર્શનની વ્યવસ્થા શા માટે ન કરી? જો આવી સુવિધા હોત, તો અમે તિરસ્કૃત અન હડધૂત થતા પહેલા તારી નિશાનીઓનું (પયગંબરો અને ઈમામોનું) અનુસરણ કરતે. તારા તરફથી રસૂલો મોકલવાનો ક્રમ ચાલુ રહ્યો, ત્યાં સુધી કે તેં રિસાલતના ક્રમને હઝરત મોહમ્મદ મુસ્તુફા

(સ.અ.વ.)ના આગમન પછી ધર્મને સંપૂર્ણતા સુધી પહોંચાડી દીધો. હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ થાય, તેઓને તેં તારી તમામ સૃષ્ટિના સરદારો તરીકે પસંદ કરી લીધા અને તેઓને તારા પસંદ કરેલા ખાસ નફ્સ ઉપર શ્રેષ્ઠતા આપી. તેં તેઓને તારા તમામ નબીઓ કરતાં મુકદ્દમ (સર્વશ્રેષ્ઠ) કર્યા. તારા બંદાઓમાંથી તેઓને જિન્નાતો અને ઈન્સાનો માટે તારા તરફથી ઉચ્ચ દરજ્જો આપીને મોકલ્યા. તેઓને પૂર્વ અને પશ્ચિમનો પ્રવાસ કરાવ્યો. તેઓની સવારી માટે બોરાક (એ સવારીના પ્રાણીનું નામ જેના ઉપર બેસીને રસૂલ (સ.અ.વ.) આસમાન ઉપર ગયા હતા) મોકલ્યું. તેઓને તારા આસમાન તરફ મેઅરાજ (ઉચ્ચ દરજ્જો) આપી. તેઓને તેં તારી પેદા કરેલી દુન્યાનું અને વિશ્વના બની ચૂકેલા અને ભવિષ્યમાં બનનારા બનાવોનું જ્ઞાન આપ્યું. ત્યાર પછી તેઓને તારા રોઅબો - જલાલ (પ્રભાવ અને હૈબત) થકી મદદ કરી, અને તે તેઓની આજુબાજુમાં જિબ્રઈલ, મિકાઈલ અને બીજા ફરિશ્તાઓ જેમના નામ

નક્કી થયેલા છે - તેમને નીમ્યા.

અય અલ્લાહ! તેં સરવરે આલમ હઝરત મોહમ્મદે મુસ્તુફા (સ.અ.વ.)ને વાયદો આપ્યો કે (તું) તેમના દીન મઝહબે ઈસ્લામને બીજા તમામ મઝહબો ઉપર શ્રેષ્ઠ અને ગાલીબ (અંકુશ મેળવનાર) બનાવીશ, ભલે પછી તેના કારણે મુશ્રિકો નારાજ કેમ ન થાય! આ એ બાદ કર્યું કે તેઓના એહલેબૈત (અ.સ.)માંથી તેઓના વસી નક્કી કર્યા તેમના તથા તેમના એહલેબૈત (અ.મુ.સ.) (નજદીકનું કુટુંબીજનો) માટે તેં પ્રથમ ઘર (કાઅબા) નિશ્ચિત કર્યું. જે ઈન્સાનો માટે બનાવવામાં આવ્યું છે. બેશક આ ઘર તમામ દુનિયાઓ માટે બરકત અને હિદાયતનું સ્થાન છે. તેમાં ખુલ્લી અને ઝગમગતી (સ્પષ્ટ) નિશાનીઓ છે. જેમ કે, મકામે ઈબ્રાહીમ, કે જે કોઈ તેમાં દાખલ થાય તે સુરક્ષિત છે.

તેં ફરમાવ્યું છે:

“બેશક, અય એહલેબૈત (અ.મુ.સ.)! ખુદા એ સિવાય કંઈ નથી ઈચ્છતો કે તમને દરેક નજાસતોથી દૂર રાખે

અને એવી રીતે પવિત્ર રાખે જેવો પવિત્ર રાખવાનો હક છે.”

પછી તારી કિતાબ (કુરઆને શરીફ)માં તેઓની (એહલેબૈતનની) મોહબ્બતને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની રિસાલતના કાર્યોનો બદલો (અજ) ગણાવ્યો.

હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) અને તેમની આલ (સંતાનો) ઉપર રહેમત નાઝિલ થાય. તેં હુકમ આપ્યો છે કે: અય રસૂલ (સ.અ.વ.)! આપ કહી દો કે હું તમારી પાસે, તમારી આલની મોહબ્બત સિવાય બીજો કોઈ બદલો માંગતો નથી.

પછી તેં નસીહત ફરમાવી કે: તમારી પાસે જે માંગવામાં આવ્યું છે તે આપવું તમારા માટે ફરજ છે અને એ બાબતની સ્પષ્ટતા કરી કે મોહમ્મદે મુસ્તુફા (સ.અ.વ.) તેમજ તેમના એહલબૈત (અ.મુ.સ.) અલ્લાહની તરફથી મોહબ્બત અને અલ્લાહની ખુશી મેળવવા માટેનો એક માર્ગ, માધ્યમ તેમજ સાધન છે.

જ્યારે સરવરે આલમ હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)ની રિસાલતનો યુગ પૂર્ણ થયો ત્યારે તે તારા વલી, અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને હિદાયત કરનારા નીમ્યા. એ બંને ઉપર અને તેઓની આલ ઉપર તારી રહેમત નાઝિલ થાય, કારણકે તેઓ ડરાવનાર અને પોતાની કૌમની (શ્રેષ્ઠ) હિદાયત કરનારા હતા.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) એ જાહેર મજમામાં એલાન ફરમાવ્યું છે કે :

જેનો હું મૌલા છું, તેઓના આ અલી (અ.સ.) મૌલા છે.

અય અલ્લાહ! જે કોઈ અલી (અ.સ.)ને દોસ્ત રાખે, તેને તું દોસ્ત રાખ અને જે અલી (અ.સ.)નો દુશ્મન હોય, તેને તું તારો દુશ્મન ગણ. જે કોઈ અલી (અ.સ.)ની મદદ કરે, તું પણ તેની મદદ કર, અને જે અલી (અ.સ.)ને ત્યજી દે તું પણ તેને ત્યજી દે.

અને ફરમાવ્યું : જેનો હું નબી છું, અલી (અ.સ.) તેના અમીર (સરદાર - હાકીમ) છે.

અને ફરમાવ્યું: હું અને અલી (અ.સ.) એક જ ઝાડમાંથી છીએ અને બાકીના તમામ લોકો જુદા-જુદા ઝાડમાંથી છે.

આ ઉપરાંત આપ (સ.અ.વ.)એ અલી (અ.સ.)નો પોતાની સાથેનો સંબંધ હઝરત હાફ્સ (અ.સ.)ના મૂસા (અ.સ.)ના સાથેના સંબંધ સમાન ગણાવ્યો. અને તેથી ફરમાવ્યું: અય અલી (અ.સ.)! તમે મારા માટે એવા છો, જેવા કે હઝરત હાફ્સ (અ.સ.) હઝરત મૂસા (અ.સ.) માટે હતા. સિવાય કે મારા પછી કોઈ નબી નથી.

અને તેઓ (સ.અ.વ.)એ પોતાની પુત્રી, જે દુનિયાઓની સ્ત્રીઓની સરદાર છે - તેની શાદી હઝરત અલી (અ.સ.) સાથે કરી. તેઓ (સ.અ.વ.)એ પોતાના માટે મસ્જુદમાં જે કાર્યો કરવા યોગ્ય હતા, તે બધાજ કાર્યો તેમના (હઝરત અલી (અ.સ.)) માટે યોગ્ય ગણાવ્યા. તેઓ (સ.અ.વ.) એ હઝરત અલી (અ.સ.)ના ઘરના દરવાજા સિવાયના મસ્જુદના તમામ દરવાજાઓ (જે મસ્જિદની અંદરની બાજુએ ખુલતા હતા તેને) બંધ

કરાવી દીધા.

તેઓ (સ.અ.વ.) એ પોતાનું ઈલ્મ અને હિક્મત હઝરત અલી (અ.સ.)ને આપ્યું અને ફરમાવ્યું:

હું ઈલ્મનું શહેર છું અને અલી (અ.સ.) તેના દરવાજા છે. જે કોઈ આ શહેર અને હિક્મતનો ઈરાદો કરે (એટલે કે જે કોઈ ઈલ્મ અને હીકમત મેળવવા ઈચ્છતું હોય) તે આ દરવાજામાંથી દાખલ થાય.

પછી હઝરત અલી (અ.સ.)ને સંબોધીને ફરમાવ્યું:

તમે મારા ભાઈ, મારા પ્રતિનીધી (વસી) અને મારા વારસદાર છો. તમારૂં માંસ મારૂં માંસ છે. તમારૂં લોહી મારૂં લોહી છે. તમારી સુલેહ એ મારી સુલેહ છે. તમારી જંગ એ મારી જંગ છે.

(અને અય અલી અ.સ.) તમારા માંસ અને લોહીમાં, મારા માંસ અને ખૂનની જેમ ઈમાન ભળી ગયેલું છે. (કયામતના) દિવસે હૌઝે કૌસર ઉપર તમે મારા જાનશીન (પ્રતિનીધી) બનશો. તમે મારૂં કરજ અદા કરશો, મારા

વાયદાઓને વફા (પુરા) કરશો. તમારા શિયા ચમકતા ચહેરાઓ સાથે જન્નતમાં મિખ્ખર ઉપર મારી આજુબાજુ હશે, અને તેઓ મારા પાડોશી હશે.

અય અલી (અ.સ.)! જો તમે ન હોત, તો મારી પછી મોઅમીનોને ઓળખવાની કોઈ શક્યતા ન રહેત. મારા પછી તમે (કુફ્રે-નિફાકના) અંધકારમાં માર્ગદર્શન અને માર્ગ ભૂલેલા માટે પ્રકાશ અને દીવાદાંડી સમાન છો. તમે અલ્લાહની મજબૂત રસ્તી અને ખુદાના સીધા રસ્તા છો. અલી (અ.સ.) સિવાય (પોતાના) સગાવહાલાઓમાં કોઈ પયગમ્બર (સ.અ.વ.)ની નજદીક છે અને ન દીનમાં તેમનાથી કોઈ આગળ છે.

એ અલી (અ.સ.)ના પ્રશંસા અને શ્રેષ્ઠતાના દરજ્જા સુધી કોઈ પણ પહોંચી શક્યું નથી. તેઓ (અ.સ.)એ રસૂલે ખુદા (સ.અ.વ.)ની જેમ જીવન ગુજાર્યું. તેઓ બંને (સ.) ઉપર અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ થાય. તેઓએ રાહે ખુદામાં (કુરઆનની) તઅવીલના આધારે જેહાદ કરી. રાહે ખુદામાં (કરવામાં આવતા કાર્યોની)

નીંદાની તેઓને કશીજ અસર ન થઈ. અલ્લાહની રાહમાં તેઓએ અરબના મોટા મોટા લોકોનું લોહી વહાવ્યું અને અરબના મોટા પહેલવાનોના માથા ઘડથી જુદા કરી નાખ્યા. તેમના (રબના) ચોર અને લૂંટારાઓનો ખુરદો બોલાવી દીધો. પરિણામે તેઓના (દીનના દુશ્મનોના) દીલ બદ્દ, ખૈબર અને હોનૈન અને તેના જેવી બીજી લડાઈઓમાં પછડાટ (હાર) ખાધા પછી અદાવતથી ભરાઈ ગયા. તેથી તેઓ બધા હઝરત અલી (અ.સ.)ની દુશ્મનીમાં તેમની વિરુદ્ધ લડવા માટે એકઠા થયા. તો હઝરત અલી (અ.સ.)એ તેમની તાબેદારીનો ભંગ કરનારા, સીતમગરો (અહલે જમલ) અને દીનથી ફરી જનારાઓ (એહલે નહેરવાન) ને જહન્નમ ભેગા કરી દીધા.

જ્યારે તેમનો (હઝરત અલી (અ.સ.)નો) અંતિમ સમય આવી પહોંચ્યો, ત્યારે આખરી દૌરના બદતરીને જુના દૌરના બદતરીનું અનુસરણ કર્યું તેણે અલ્લાહ તેમજ તેના રસૂલ (સ.અ.વ.)ના હુકમની પરવા ન કરી. તે પછી ઉમ્મત માટે તેઓ (એહલબૈત)માંથી એક પછી

એક હાદી (હિદાયત કરનારા) આવતા રહ્યા. (ત્યાર પછી તો એવો યુગ આવ્યો કે) ઉમ્મતે તેઓ સાથે એકધારી દુશ્મનીનો આરંભ કરી દીધો. લોકો તેઓ સાથે કત્થે રહમ (સંબંધ તોડવા) માટે એકઠા થઈ ગયા. અને (એટલું જ નહીં) તેઓને સંતાનોને તેમની પ્રતિષ્ઠાના સ્થાનેથી નીચે ઉતારવા માટેનો હઠાગ્રહ શરૂ કરી દીધો.

પરંતુ તેઓમાંના કેટલાક (મોઅમીનો) એવા હતા જેઓએ રસૂલ (સ.અ.વ.) અને તેઓની આલના હક્કોની સંભાળ લીધી. (તેથી તેમની પરિસ્થિતિ એવી બની કે તેઓમાંથી) અમુકને મારી નાખવામાં આવ્યા, તો અમૂકે કેદી થવાની મુસીબત ઉઠાવી, અમૂકને હદપાર (દેશનિકાલ) કરવામાં આવ્યા. તે માનવંત લોકો માટે મોતની સજાનો હુકમ આપ્યો. હકીકતમાં તેમાં તેઓ માટે (ફલાહે દારૈન) અનંત સફળતા હતી. આ પૃથ્વી પર ખુદાએ તઆલાનું સામ્રાજ્ય છે. તેથી તે જે ચાહે છે, તેને તેનો (પોતાનો) વારસદાર બનાવી લે છે. અને શ્રેષ્ઠ આખેરત મુતકી (પરહેઝગાર) લોકો માટે જ છે.

પરવરદિગારની જાત દરેક પ્રકારની ખામી અને ઉણપથી મુક્ત અને પવિત્ર છે. બેશક ખુદાવંદે તઆલાના વાયદા મુજબ અચૂક બનવાનું છે, કારણ કે અલ્લાહ તઆલા કદી પણ તેના વાયદાને ટાળતો નથી. તે તો ઈજ્જત અને હિક્મતનો માલિક છે. એહલેબૈત (અ.મુ.સ.)માં સૌથી પાકો પાકીઝા હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) અને હઝરત અલી (અ.સ.) છે. તેઓ બંને અને તેઓની આલ ઉપર અલ્લાહની રહેમત નાઝિલ થાય.

રડનારા તેઓની મુસીબત ઉપર રૂદન કરે કારણકે તેઓની મુસીબતો ઉપર રડવું જરૂરી છે. (અતઃ અહીં મોહીબ્બાને એહલેબૈત આંખમાં આંસું લાવી) ફરિયાદ કરે અને કહે કે:

ક્યાં છે હસન (અ.સ.)? ક્યાં છે હુસૈન (અ.સ.)?

ક્યાં છે હુસૈન (અ.સ.)ના ફરઝંદો?

જેઓ સાલેહ પછી સાલેહ અને સત્યનિષ્ઠ પછી સત્યનિષ્ઠ છે?

ક્યાં છે એક પછી એક હિદાયતના માર્ગ?

ક્યાં છે એક પછી એક નેકી કરનારા?

ક્યાં છે ઉગતા સૂર્ય?

ક્યાં છે ઝળહળતા ચાંદ?

ક્યાં છે ઝગમગતા સિતારાઓ?

ક્યાં છે દીનની નિશાનીઓ અને ઈલ્મના સ્તંભ?

ક્યાં છે એ બકીયતુલ્લાહ? જે હાદીઓના વંશમાંથી છે, જેમના વગર કોઈપણ જમીન ક્યારેય ખાલી નથી રહેતી.

ક્યાં છે એ મુલ્મની પૈરવી કરનારાને મિટાવી દેનાર પવિત્ર હસ્તીઓ?

ક્યાં છે એ કે જેઓની કપટી અને દગાખોરોને સીધા દોર કરી દેવા માટે રાહ જોવામાં આવી રહી છે.

ક્યાં છે એ કે જેમની પાસેથી મુલ્મ અને અન્યાયને જડ-મૂળથી ઉખેડી નાખવાની આશા બંધાયેલી છે?

ક્યાં છે વાજિબાત અને સુન્નતને પુનઃજીવીત કરનાર?

ક્યાં છે એ કે જેમને અલ્લાહે શરીઅતને નવું જીવન આપવા માટે પસંદ કરવામાં આવ્યા છે?

ક્યાં છે એ જેમની સાથે કુરઆને મજુદ અને તેના કાનૂનોની પુનઃ જાગૃત થવાની આશા બંધાએલી છે?

ક્યાં છે ઓલુમે દીન અને તેને (લાયક વ્યક્તિઓને) જીવંત કરનાર?

ક્યાં છે ઝાલીમ અને જાબિર (અત્યાચારી - બળવાખોરો)ના પ્રભાવના ચૂરે ચૂરા કરી નાખનાર?

ક્યાં છે શીર્ક અને નીફાક (દંભ)ના પાયાને જડમૂળમાંથી ઉખેડી ફેંકનાર?

ક્યાં છે એ ગુનેહગાર, દૂરાચાર, બદી આચરનાર લોકો અને ઈલાહી હુકમની વિરુદ્ધમાં બંડ પોકારનારને નષ્ટ કરી નાખનાર?

ક્યાં છે ગુમરાહી અને વિરોધના તમામ માર્ગોને બંધ કરી નાખનાર?

ક્યાં છે મનોવાસના અને દુષ્ટ વિચારોનું નામોનિશાન

મિટાવી દેનાર?

ક્યાં છે જૂઠ અને તોહમતની ગાંઠ અને ષડયંત્રોના ટુકડે ટુકડા કરી નાખનાર?

ક્યાં છે બળવાખોરો અને હદ ઓળંગી જનારને શરણે લાવનાર?

ક્યાં છે એ મુલ્હીદો (નાસ્તીકો) અને માર્ગ ભુલેલાઓને જડમૂળથી ઉખાડી ફેંકનાર?

ક્યાં છે મિત્રોને ઈજ્જત આપનાર અને દુશ્મનોને તિરસ્કૃત કરનાર?

ક્યાં છે એ જે સાલેહ બંદાઓને તકવાની બુનિયાદ ઉપર ભેગા કરનાર?

ક્યાં છે એ બાબુલ્લાહ? (અલ્લાહના દ્વાર) જેના માધ્યમથી લોકો પ્રવેશ મેળવશે?

ક્યાં છે એ વજહુલ્લાહ જેના પ્રતિ અલ્લાહના મિત્રો એકાગ્ર થઈ મીટ માંડી રહ્યા છે?

ક્યાં છે એ જે આસમાન અને ઝમીનની કડીનું કારણ

છે?

ક્યાં છે યબ્ને ફત્હ (વિજયના દિવસ)ના માલિક અને હિદાયતનો પરચમ ફરકાવનાર?

ક્યાં છે એ જે અલ્લાહ તઆલાની મોહબ્બત અને મરજુ પ્રમાણે અમલ કરનારને એકઠા કરનાર?

ક્યાં છે એ જે નબીઓ અને તેની અવલાદના ખૂનનો, બદલો લેનાર?

ક્યાં છે શોહદાએ કરબલાનો બદલો લેનાર?

ક્યાં છે મઝલૂમો અને તોહમતનો ભોગ બનેલાઓની મદદ કરનાર?

ક્યાં છે એ મુઝતર કે જ્યારે તે દુઆ કરે, તો તેમની દુઆ કબૂલ થાય છે?

ક્યાં છે નેક બંદાઓ અને પરહેઝગાર ઈન્સાનોના સરદાર?

ક્યાં છે સય્યદુલ મુરસલીન (રસૂલોના સરદાર) હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) અને અલીએ

મુરતઝા (અ.સ.)ના ફરઝંદ? જેઓ તેજસ્વી ચહેરાવાવાળા હઝરતે ખદીજા અને હઝરત ફાતેમા ઝહેરા (સ.અ.)ના ફરઝંદ છે.

અય મારા સચ્ચદો આકા! મારા માં-બાપ અને મારી જાન આપની ઉપર ફીદા થઈ જાય, અમારા દિલો જુગર આપના માટે વકફ છે.

અય અલ્લાહ તબારક વ તઆલાથી અતિ નિકટ સરદારોના પુત્ર! અય ઉચ્ચ મરતબાવાળા (અજોડ-પવિત્ર) કુટુંબના પુત્ર. અય હિદાયતપૂર્ણ માર્ગદર્શકોના ફરઝંદ, અય અતિ પવિત્ર પૂર્વજોના ફરઝંદ, અય સૌથી વધુ શરીફ બુર્જુગોના ફરઝંદ, અય તચ્ચબો તાહેરીન (પાક અને પવિત્ર હસ્તીઓ)ના ફરઝંદ, અય ઈજ્જત, મહેરબાની અને દાનશીલતાવાળાના પવિત્ર ફરઝંદ, અય સાહેબાને ઈજ્જતો કરમના ફરઝંદ, અય નૂરે ઈલાહીના પ્રકાશવાન દીપકના ફરઝંદ, અય એવા ઝગમગતા સિતારાના ફરઝંદ, જેનો પ્રકાશ દિમાગોને પ્રકાશવાન કરી દે છે. અય એવી પવિત્ર હસ્તીઓના ફરઝંદ, જે ખુદાનો સ્પષ્ટ સીધો રસ્તો

દેખાડનાર છે. અય એવા માનવંત લોકોના ફરજંદ જેઓ
 ખુદાની ખુલ્લી નિશાની હતાં (છે). અય સંપૂર્ણ જ્ઞાનના
 માલિક (હસ્તીઓ)ના ફરજંદ, જેમની મારફત લોકો
 (ખુદાની) સુન્નતોનથી વાકીફ થયા છે. અય તે (પવિત્ર
 વ્યક્તિઓ)ના ફરજંદ, જેનો ઉલ્લેખ કિતાબે ઈલાહીમાં
 કરવામાં આવ્યો છે. જેમનું અસ્તિત્વ (ખુદ પોતેજ) એક
 મોઅજિઝો છે. અય ખુદાની સ્પષ્ટ દલીલના ફરજંદ, અય
 સીધો માર્ગ દેખાડનારના ફરજંદ, અય મહાન ખબરોના
 ફરજંદ, જેમનું નામ સાહેબે હિક્મત અલ્લાહની લઘ્હે
 મહેફૂઝ (આસમાન ઉપર એક એવી જગ્યા છે જેમાં
 દુનિયામાં બનનારી તમામ બાબતોનો ઉલ્લેખ છે જેને
 અલ્લાહના ખાસ બંદા સિવાય કોઈ વાંચી શકતું નથી)માં
 નોંધાયેલું છે. અય એ નામવરના ફરજંદ, જેઓ ખુદાની
 નિશાની અને હુજ્જત (દલીલ) છે. અય તેમના ફરજંદ જે
 ખુદાની ખુલ્લી સાબિતી અને પ્રભાવશાળી દલીલ છે. અય
 ખુદાની સંપૂર્ણ નેઅમતના ફરજંદ, અય તાહા અને
 મોહકમાતના ફરજંદ, અય યાસીન અને ઝારેયાતના

ફરઝંદ, અય તૂર અને આદેયાત ના ફરઝંદ, અય તે માનવંત હસ્તીના ફરઝંદ, જે ખુદાએ અલીચ્ચીલ અઅલાની એટલા બધા નજદીક થયા હતા કે બંને વચ્ચે બે કમાન (ધનુષ્ય)થી પણ અંતર રહી ગયું હતું.

અય કાશ! મને એ વાતની જાણ હોત કે આપનું સ્થાન અને અંતર કેટલું દૂર છે!

શું આપનું સ્થાન ‘રઝવા’નો પહાડ અથવા તે કઈ જમીન છે, જે આપના અસ્તિત્વથી સરફરાઝ છે? છે કે ઝી તોવા (ના પર્વત) ઉપર છે? એ વાત મને ભારરૂપ લાગે છે કે હું સૃષ્ટિને તો જોઉં, પણ તમને જોઈ ન શકું અને (આપનો અવાજ) એકાંતમાં કે મોટા અવાજમાં સાંભળી ન શકું. એ વાત મને ઉદાસ બનાવી દે છે કે આપની ગયબતમાં બલાઓ અને મુસીબતો મને ઘેરી લે છે અને મારી તકલીફો અને ફરિયાદ આપના સુધી પહોંચી ન શકે.

મારી (સૌથી વ્હાલી) જાનની કસમ, અય મારા સચ્ચદ અને આકા, આપ અમારી વચ્ચેથી ગાયબ (દૂર) છો પણ

અમારા દિલોથી ગાયબ નથી. અય ગાયબ રહેનાર હું
આપની ઉપર ફીદા (કુરબાન) છું, અમારા દિલ આપના
ખ્યાલથી ખાલી નથી અને ન તો આપનું પવિત્ર હૃદય
અમારા ખ્યાલથી ખાલી છે. આપ એવા પરદાએ ગૈબમાં
છો, જે મોમીનોથી દૂર નથી હોતા... (હું આપની ઉપર
કુરબાન છું.) આપ આપનો ઝિક્ર અને આરઝુ કરનાર
અને તમારી યાદમાં આંસુ વહાવનાર મોઅમીનો અને
મોઅમેનાતની મુન્તહાએ આરઝુ (આશાની અંતિમ સીમા)
છો.

મારી જાન આપના ઉપર ફીદા થાય. આપ એવા
(ગાલીબ) જબરદસ્ત શક્તિશાળી સમૂહમાંથી છો જેની
બરાબરી કરી શકાતી નથી. મારી જાન આપની ઉપર
કુરબાન થાય, આપ એ શ્રેષ્ઠ અને બુઝુર્ગ સરદાર છો
જેની કોઈ જોડ નથી. મારી જાન આપની ઉપર ન્યોછાવર
થઈ જાય આપ એવા બુઝુર્ગ અને સરદાર છો જેની
ઉચ્ચતાની કક્ષા સુધી કોઈ પહોંચી શકતું નથી. આપ ખુદાની
બેમિસાલ નેઅમત છો. આપની બુઝુર્ગી અને શરફ (એવી

ઉત્તમતા) છે, જેની ખરાબરી કોઈ કરી શકતું નથી.

અય સચ્ચદો આકા! અમે આપની જુદાઈમાં ક્યાં સુધી રડીએ? અને તમારૂં ધ્યાન અમારા તરફ આકર્ષવા માટે આપને કેવા ગુણો અને ઈલ્લાખથી સંબોધન કરીએ?!

અય સૈયદો આકા! મારા માટે આ વાત એટલી બધી કષ્ટદાયક છે કે: ગુપ્ત વાતનો જવાબ આપના સિવાય બીજા કોઈ પાસેથી મેળવું?

છે કોઈ મારો મદદગાર, જેની પાસે હું રડી કકળીને ફરિયાદ કરૂં? છે કોઈ એવો એકલો, જે આપની યાદમા મશ્ગૂલ હોય અને હું તેની સાથે જોડાઈને આહો ફરિયાદ કરૂં?

છે કોઈ એવી આંખ જે (આપના વિયોગમાં) રડી રડીને સફેદ થઈ ગઈ હોય અને હું તેનો (રડવામાં) સાથ આપું?

અય ફરજંદે રસૂલ (સ.અ.વ.)! શું આપનો ખાદિમ આપના પવિત્ર અને નૂરાની ચહેરાને જોવા પામે એ શક્ય નથી?

શું અમારો આ દિવસ ઝુહુરના દિવસ સાથે જોડાઈ જશે? અને અમે ખુશ થશું?

શું હું આજે અથવા કાલ આપની પવિત્ર બારગાહમાં આવવાનું સદ્ભાગ્ય મેળવી શકીશ ખરો?

ક્યારે અમે આપના ઝરણાંના મધુર પાણીથી ફાયદો મેળવીશું?

હવે તો આપના ઈન્તેઝારની ઘડીઓ અતિ લાંબી થઈ ચૂકી છે.

અમને એવી સવાર - સાંજ ક્યારે નસીબ થશે? ક્યારે અમે આપના પવિત્ર સૌંદર્યને નિરખીને અમારી આંખોને ઠંડક અને નૂર આપી શકીશું?

જ્યારે દીને ઈસ્લામનો પરચમ રક્ષણ અને મદદ માટે લહેરાતો હશે એ સંજોગોમાં અમે આપને ક્યારે જોઈ શકીશું? અને આપની મુલાકાતનું સદ્ભાગ્ય અમોને ક્યારે મળશે?

અમે એ વાતની કલ્પના કરી રહ્યા છીએ કે ખુલુસ (સચ્ચાઈ-નિખાલસતા), ઈજ્જત અને મોહબ્બતથી અમે

આપને ઘેરી વળ્યા છીએ. આપ એક મોટા સમૂહની ઈમામત કરી રહ્યા છો અને વાસ્તવમાં આપે ઝમીનને ન્યાયથી ભરી દીધી હશે ત્યારે દુશ્મનોને અઝાબની યાતનાનો સ્વાદ ચખાડી દીધો હશે. અને અકડનારાઓને હલાક અને સત્યનો ઈન્કાર કરનારાઓને કરણીના ખદલા (કર્મ દંડ) સુધી પહોંચાડી દીધા હશે. (એટલું જ નહીં.) તેમને અનુસરનાર, તેમના વંશજ, તેમના ટેકેદારો અને દીની બાબતમાં ગર્વ કરનારાઓને ખત્મ કરી નાખ્યા હશે. (એ જોઈને) અમે કહી રહ્યા હશું કે તમામ પ્રસંશા એ ખુદાને માટે છે કે જે તમામ દુનિયાઓ (આલમીન)નો પાલનહાર છે.

અય અલ્લાહ! ગમ, દુઃખ તથા પરેશાની અને બલાને દૂર કરનાર તું જ છે, તારી જ પાસેથી રક્ષણ અને મદદ માગી શકાય છે. તું જ અમારો મોટો આધાર છે અને દરેક પ્રકારે અમારી મદદ કરનાર છે.

તું જ દુનિયા અને આખેરતનો પરવરદિગાર છે. તારા નાયીઝ ગુલામ ગમ અને મુસીબતમાં ફસાયેલા છે.

અય અમારી ફરિયાદોને દૂર કરનાર, અમારી ફરિયાદને દૂર કર.

અય મહાન શક્તિના માલિક, અત્યંત શક્તિશાળી, (તારા) આ બંદાને તેના સચ્ચદો - આકા (ઈમામે ઝમાના અ.સ.)ની ઝિયારતથી મુશર્ફ કર. અને તે આકાના સદકામાં (આ) બંદાના રંજો - ગમને દૂર કરી દે અને તેના દિલની જલનને શીતળતામાં ફેરવી નાખ.

અય આસમાનો ઉપર કાબુ ધરાવનાર, કે જેના તરફ બધાયને પાછા ફરવાનું છે અને તે અંત છે.

અય અલ્લાહ! અમે તારા નાચીઝ બંદા છીએ. અને તારા વલી જે તારા રસૂલ (સ.અ.વ.)ની યાદ તાજુ કરાવે છે - તેની ઝિયારતનો શોખ ધરાવીએ છીએ.

તેં તેઓને (તારા વસીને) અમારૂં રક્ષણ અને અમારા સહારા અને સમગ્ર રીતે અમારા સહાયક બનાવ્યા છે અને (તેં જ તેઓને) દુનિયા અને આખેરતમાં અમારા માટે ટકી રહેવાનું માધ્યમ બનાવ્યા છે, અને અમો મોઅમીનો માટે તેઓને હાદી (હિદાયત કરનારા) મહદી

અને ઈમામ બનાવ્યા છે.

અય અલ્લાહ! અમારા તરફથી તેઓની પવિત્ર ખિદમતમાં દુરુદો સલામ પહોંચાડ અને દુરુદો સલામના કારણે અમારી ઈજ્જતો ઈક્રામ (પ્રતિષ્ઠા અને સન્માન)મા વધારો ફરમાવ.

તેઓની કરારગાહ (સાંત્વન સ્થળ)ને અમારા માટે રહેવાનું સ્થાન નક્કી કર. અમને અમારા એ સૈયદ ઉપર તારી નેઅમતોની સંપૂર્ણતાને વિશેષતા અને અગ્રતા અર્પણ કર. એટલે સુધી કે તું અમને તારી જન્નતુલ ફીરદૌસમાં સ્થાન આપ અને તારા મુખ્લીસ (નિર્મળ ભાવનાવાળા) બંદાઓ-શહીદોની મિત્રતા પામવાનું અહોભાગ્ય આપ.

અય અલ્લાહ! હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.), જે તારા રસૂલ (સ.અ.વ.) અને અમારા આકા (ઈમામ ઝમાના અ.સ.)ના દાદા અને સૈયદે અકબર છે તેમના ઉપર અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ ફરમાવ. અને અમારા આકા (ઈમામે ઝમાના અ.સ.)ના પિતા સૈયદે અસગર હઝરત અલી (અ.સ.) ઉપર અને તેમના દાદી

સીદીકએ કુબરા ફાતેમા બિન્તે મોહમ્મદ (સ.અ.વ.) ઉપર અને તેમના પવિત્ર બુઝુર્ગો ઉપર રહેમત નાઝિલ ફરમાવ, જેઓને તેં શ્રેષ્ઠતા અને ઉચ્ચતા અર્પી છે અને તેઓની પોતાની ઉપર બીજા બંદાઓ અને સૃષ્ટી ઉપર નાઝિલ ફરમાવી હોય તેના કરતા અતિ શ્રેષ્ઠ અને (બધીજ રીતે) સંપૂર્ણ હંમેશા બાકી રહેનારી, સંખ્યાબંધ, અસીમ અને અત્યંત શ્રેષ્ઠ એવી રહેમત નાઝિલ ફરમાવ.

અય અલ્લાહ! તેઓ મારફત અને તેઓ થકી હક (સત્ય)ને કાએમ મજબૂત (સ્થિર) કર અને બાતિલ (અસત્ય)નો નાશ કર, તેઓની મારફત તારા મિત્રોને માર્ગ દેખાડ અને તેઓનાજ હાથે દુશ્મનોને હડધૂત કર.

અય અલ્લાહ! અમારી અને તેઓ (ઈમામે ઝમાના)ની વચ્ચે એવી મોહબ્બત, નિરંતરતા અને માધ્યમ નિર્માણ કર જે અમારા અને તેઓના પવિત્ર પૂર્વજોની મિત્રતા સુધી પહોંચાડી દે.

નિ:સંશય જેમણે તેઓને ઓળખ્યા, તેઓ સફળ અને કામીયાબ થયા. જેઓ તેઓ ઉપર ઈમાન ન લાવ્યા તેઓ

નષ્ટ થઈને કાફીર થઈ ગયા. તેઓને (અમારાથી) રાજી કરીને અમારી ઉપર ઉપકાર કર. અમને તેઓની મહેરબાની અને સાંત્વનાથી ઉપકૃત કર, જેથી અમે તારી રહેમતોની વિશાળતાના ઘેરાવામાં આવી જઈએ. અમારી નમાઝોને તેઓના તુફેલથી (માધ્યમથી) કબૂલ ફરમાવ અને તેઓના તુફેલમાં અમારા ગુનાહોને બક્ષી આપ. અમારી દુઆઓને તેઓની મારફત કબૂલ ફરમાવ. અમારી રોઝીને તેઓના વસીલાથી વિશાળ કરી આપ. અમારા ગમ અને મુસીબતને તેઓના સદકામાં દૂર કર. અમારી હાજતોને (માંગણીઓને) તેઓ (ની ખુશી) માટે પૂરી કર. તારી કૃપાથી અમારી દુઆને કબૂલ ફરમાવ. તારી બારગાહમાં અમને નિકટતા આપ અને અમારી તરફ રહેમતની દ્રષ્ટિ કર. કમાલે મહેરબાની (મહેરબાનીની સંપૂર્ણતા)થી અમને ફાયદો પહોંચાડ. તેઓના માધ્યમથી અમારી ઈચ્છાઓને પુરી કર.

ખુદાવંદા! તું તારા લુલ્હો કરમ (દયા અને મહેરબાની) થકી અમારી તરફ લક્ષ આપીને તેઓ (ઈમામે) અસ્ર

અ.સ.)ના પવિત્ર દાદા (સ.અ.વ.)ના હજો કૌસર ઉપર,
 તેઓ (સ.અ.વ.)ના મુબારક હાથે તેજ પ્યાલામાં એવું
 અમૃત સમાન પીણું પીવરાવ જેનાથી અમે સંપૂર્ણપણે તૃપ્ત
 થઈ જઈએ અને પછી ક્યારેય તરસ્યા ન થઈએ. અય
 રહેમ કરનારાઓમાં શ્રેષ્ઠ રહેમ કરનાર.

નોંધ: આ દુઆ પુરી થયા પછી પોતાની હાજત
 બારગાહે ઈલાહીમાં રજૂ કરવી.

દુઆએ ફરજ

(દુઆએ “ઈલાહી અઝોમલ બલાઅ”)

‘કફઅમી’એ ‘બલદુલ અમીન’માં ફરમાવ્યું કે આ
 દુઆ હઝરત સાહેબુલ અમ્ર (અ.સ.)એ એક શખ્સને
 તઅલીમ ફરમાવી. તે શખ્સ કેદમાં હતો અને આ પટવાથી
 કેદમાંથી છુટી ગયો. તે દુઆ નીચે મુજબ છે:

બિસ્મિલ્લાહિર રહ્માનિર રહીમ

ઈલાહી અઝોમલ બલાઓ વ બરેહુંલે

ખંફાઓ વન્કશફલ ગેતાઓ વન્કેતેઅરે
 રજાઓ વ ઝાંકેતિલે અરેઝો વ
 મોનેઅંતિસ્સમાઓ વ અન્તલે મુસ્તઆંનો
 વ એયેકલે મુશ્તકા, વ અંલયેકલે મુઅંવ્વલો
 ફિશે શિદ્તે વરેરખાંએ. અલ્લાહુમ્મ સંલ્લે
 અંલા મોહુંમ્મદિને વ આલે મોહુંમ્મદિને
 ઉલિલે અમ્મિલ્લહીન ફરઝેતા અંલયેના
 તાંઅંતહુમ વ અંરફેતના બે ઝાંલેક
 મન્ઝેલતહુમ ફ ફરિજે અંન્ના બે હુંકેકેહિમ
 ફરજને આંજેલને કંરીબને કલમ્મિહુંલે બસંરે
 અવે હોવ અકરેબો યા મોહુંમ્મદો યા

અંલીય્યો યા અંલિય્યો યા મોહુંમદો
 ઈકુંકેયાની ફ ઈન્નકોમા કાફેયાને વન્સોરોની
 ફ ઈન્નકોમા નાસોરોને, યા મવેલાના યા
 સાંહેબંઝે ઝમાને! અલે ગોંવ્સં અલે ગોંવ્સં
 અલે ગોંવ્સં અદરિકેની અદરિકેની
 અદરિકેની. અસ્સાઅંત, અસ્સાઅંત,
 અસ્સાઅંત. અલે અંજલ, અલ્અંજલ,
 અલ્અંજલ. યા અરુંમરે રાહેમીન. બેહુંકે
 મોહુંમદિને વ આલેહિતે તોહેરીન.

તરજુમો : અય મારા મઅબૂદ! કસોટી સખત
 અને અઘરી બની ગઈ, છુપાએલ ઐબ જાહેર થઈ
 ગયા, ગુપ્ત રહસ્યો પરથી પડદા હટી ચૂક્યા છે.

બધી આશાઓ પર પાણી ફરી વળ્યું છે. જમીન તંગ થઈ ગઈ છે, આસમાનના દરવાજા બંધ થઈ ગયા છે. માત્ર તું જ મદદ કરી શકે તેમ છે તેથી તારીજ મદદ માંગવામાં આવે છે અને તારીજ બારગાહમાં ફરિયાદ લઈને ઉપસ્થિત થયા છીએ અને મુશ્કેલી અને આસાનીના દિવસોમાં તારીજ ઉપર ભરોસો છે. ખુદાયા! મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (સ.અ.વ.)ની આલે પાક ઉપર રહેમત નાઝિલ ફરમાવ, જેઓ એવા સાહેબાને અમ્ર છે, જેમની ઈતાઅત અને પયરવી તેં અમારા માટે ફરજીયાત કરી છે અને તેમના વસીલાથી તેઓના ઉચ્ચ સ્થાનથી તેં અમોને પરિચિત કરાવ્યા છે તો અય ખુદા! તને તેઓ (અ.મુ.સ.)ના હકનો વાસ્તો આપીએ છીએ અમને વિશાળતા (મુક્તિ) અર્પણ કર, એવી વિશાળતા જે ઝડપી અને નજદીક હોય. જે પલકવાર કે તેથી પણ ઝડપી હોય. અય મોહમ્મદ, અય અલી, અય અલી, અય મોહમ્મદ! અમારાથી

રંજ અને બલને દૂર કરી આપો, નિશંક આપ
બંને રંજ અને બલને દૂર કરવા માટે શક્તિમાન
છો, અને અમારી મદદ કરો, અય અમારા આકા,
અય ઝમાનાના હાકીમ, ફરિયાદ! ફરિયાદ!
ફરિયાદ! અમને સંભાળો, અમને સંભાળો, અમને
સંભાળો! આજ વખતે! આજ વખતે! આજ વખતે!
અત્યારેજ, અત્યારેજ, અત્યારેજ! અય રહેમ
કરનારાઓમાં શ્રેષ્ઠ રહેમ કરનાર, મોહમ્મદ
(સ.અ.વ.) અને તેઓની પાક આલનો વાસ્તો.

ઝિયારતે હઝરત ઈમામે ઝમાના

(અ.ત.ફ.શ.)

બિસ્મિલ્લાહિરે રહુમાનિરે રહીમ

અસ્સલામો અંલયક યા ખંલીફતરે
રહુમાન અસ્સલામો અંલયક યા શરીકલે
કુરઆન અસ્સલામો અંલયક યા ઈમામલે
ઈન્સો વલે જાન્ને અસ્સલામો અંલા
બકીયતિલ્લાહે ફી બેલાદેહી વ હુજજતેહી
અંલા એબાદેહીલે મુન્તહા એલયહે મવારી
સુંલે અમ્બેયાએ વલદયહે મઞ્જુદુને આસાંરુલે
અસ્ફેયાઈલે મોઅતમને અંલ સ્સિરરે વલે

વલીય્યે લિલં અમ્મે અસ્સલામો અલલં
 મહંદીયીલં લઝીં વઅંદલ્લાહો અંઝં વ જલ્લ
 બેહીલં ઓમમ અંયજમઅં બેહીલં કલેમ
 વયલ્લુમ્મ બેહીશશઅંસં વ યમ્લઅ બેહીલં
 અરંઝં ક્રિસ્તંને વ અંદલન વ યોમકકેન લહુ
 વ યુન્જેઝ બેહી વ અંદલં મોઅમેનીન અશહદો
 યા મવેલાય અન્નક વલંઅઈમ્મતો મિનં
 આબાએક અઈમ્મતી વ મવાલીય્ય ફીલં
 હંયાતીદે દુન્યા વ યવ્મ યકુંમુલં અશહાદે
 અસ્અલોક યા મવેલાય અનં તસ્અલલ્લાહ

તબારક વ તઓલા ફી સંલ્લાહો શાઅની વ
કંઝોએ હંવાએજી વ ગુંફેરાને ઝાંનુબી વલ્અખેઝે
બે યદી ફી દીની વ દુન્યાય વ આખેરતી લી
વલે ઈખેવાની વ અખેવાતેયલ મોઅમેનીન
વલે મોઅમેનાતે કાફફતને ઈન્નહુ ગુંફુરે
રહીમ.